

ॐ

नमः सिद्धेभ्य

# સિદ્ધપુદ્દળો માર્વાશ્રોષ બેણા

‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક ૧૪૭, ૧૮૪, ૨૦૦,  
૪૧૧, ૫૬૦ તથા ૮૧૮ ઉપર વિવેચન

વિવેચક

આત્મજ્ઞ પૂજ્ય ‘ભાઈશ્રી’ શશીભાઈ  
ભાવનગર

પ્રકાશક

વીતરાગ સન્તસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ  
ભાવનગર

### પ્રકાશક :

વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ  
૫૮૦, જૂની માણોકવાડી, પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી માર્ગ  
ભાવનગર-૩૬૪૦૦૧

### પ્રાપ્તિસ્થાન :

- વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ  
૫૮૦, જૂની માણોકવાડી, પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી માર્ગ  
ભાવનગર-૩૬૪૦૦૧  
ફોન : ૪૨૩૨૦૭, ૫૧૧૪૫૬
- શ્રી શશીપ્રભુ સાધના સમૃતિ મંદિર  
૧૯૪૨-બી, 'ચાંદની'  
પૂજ્ય શશીપ્રભુ માર્ગ, કૃષ્ણાનગર, ભાવનગર-૩૬૪૦૦૨
- શ્રી સત્કૃત પ્રભાવના ટ્રસ્ટ  
B-૫૦, જ્યોતિ માર્ગ, બાપુનગર  
જયપુર-૩૬૨૦૧૫  
ફોન : ૭૦૧૭૦૭

પ્રથમાવૃત્તિ : ડિસેમ્બર, ૨૦૦૧ (પ્રત-૧૫૦૦)

પૂછ સંખ્યા : ૪૪ + ૧૬૪ = ૨૦૮

પડતર કિંમત : ૨૫/-

### લેસર ટાઈપ સેટિંગ :

પૂજા ઇમ્પ્રોશાન્સ  
સ્લોટ નં. ૧૦૭૫-એ,  
'માતૃધારા', આંબાવાડી  
ભાવનગર-૩૬૪૦૦૧  
ફોન: ૪૨૩૪૭૦

### મુદ્રક :

ભગવતી ઓફસેટ  
૧૫, સી. બંસીધર મિલ  
કમ્પાઉન્ડ, બારડોલપુરા,  
અમદાવાદ-૩૮૦૦૦૪  
ફોન : ૨૧૭૩૪૮૮૨/૨૧૬૭૬૦૩

## પ્રકાશકીય નિવેદન

‘સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય’ નામક આ લઘુકાય ગ્રંથનું પ્રકાશન કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા લિખિત વિભિન્ન પત્રો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા થયેલ પ્રવચનોનું સંકલન છે.

અધ્યાત્મયોગી, શાસન પ્રભાવક પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ અનેક પ્રવચનોમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીને સ્મરણમાં લઈ તેઓશ્રીની મું તકં પ્રશંસા ગાઈ છે, આ વાત સર્વ વિદિત છે. સરળ છતાં ગુઢ ભાષામાં લખાયેલા કૃપાળુદેવના પત્રો ઉપર તથા ‘આત્મસિદ્ધિ’ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચનો આપી, ગ્રંથમાં નિહિત મોક્ષમાર્ગને પ્રસિદ્ધ કર્યા છે. કૃપાળુદેવ જેવા મહાજ્ઞાની પુરુષનું પૂજ્ય ગુરુદેવશ્રીના હદ્યમાં શું સ્થાન હતું ! તે ભાગ્યે જ દર્શાવવાની જરૂર છે.

એ જ પ્રમાણે પ્રશમ્મૂર્તિ પૂજ્ય ભગવતી માતા ચંપાબહેન પણ જ્ઞાનદશાની પ્રાપ્તિ પૂર્વ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથનો નિયમિત સ્વાધ્યાય કરતાં હતા. પ્રશ્ચચર્ચામાં પણ તેઓશ્રીને પૂછાયેલા પ્રશ્નોમાં તેમણે કૃપાળુદેવના ભાવોને સ્પષ્ટ કરી મુમુક્ષુ જીવો ઉપર ઉપકાર કર્યો છે.

તથાપિ એકાવતારી પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્રજી સોગાનીજી સ્વયંની જીવનયાત્રાના અંત સમયે ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથનું અધ્યયન કરતાં હતા. પરમ નિશ્ચયનયના ધારક ! પ્રખર દ્રવ્યદૃષ્ટિના ધારક ! જીવંત પુરુષાર્થના ધડી ! પૂજ્ય સોગાનીજી જેવા મહાજ્ઞાની પણ આ જ ગ્રંથનું અધ્યયન કરતાં જોવા મળે છે.

આ જ ગ્રંથ થકી જેમનું જીવન પરિવર્તન થયું એવા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા થયેલા વિભિન્ન પત્રો ઉપરના પ્રવચનો આ પુસ્તકમાં પ્રકાશિત કરતાં અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથ મુમુક્ષુ જીવ માટે પરમ પ્રયોજનભૂત વિષયથી સંકલિત હોવાથી અવશ્ય અધ્યયન કરવા યોગ્ય છે. પૂજ્ય ભાઈશ્રીની હદ્યસ્પર્શી વાણી, કૃપાળુદેવના હદ્યને ખોલતી હોય અને મુમુક્ષુજીવને દિવ્ય માર્ગદર્શન આપતી હોય ! એવો અનુભવ આ પુસ્તકના વાંચનથી પ્રત્યેક મુમુક્ષુને

થશે, એવો વિશ્વાસ છે.

દસ પ્રવચનોમાં સંકલિત થયેલાં આ પુસ્તકના પ્રવચનોને સૌપ્રથમ અક્ષરશઃ ઉતારી લેવામાં આવે છે. ત્યારબાદ સંકલન કરતી વખતે વાક્ય રચનાને પૂર્ણ કરવા અર્થે કૌંસ ભરવામાં આવ્યા છે. આ સંકલન પણ કેસેટ સાંભળતા-સાંભળતા કરવામાં આવે છે. ત્યારબાદ પૂર્ણ રીડિંગ થયા પછી ફીરીથી કેસેટ સાથે સાંભળીને મેળવી લેવામાં આવે છે. તેમ છતાં સંકલન કાર્યમાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો દેવ, શાસ્ત્ર, ગુરુની શુદ્ધ અંતઃકરણ પૂર્વક ક્ષમા યાચીએ છીએ. પાઠકવર્ગને પણ વિનંતી કરવામાં આવે છે કે એવી કોઈ ભૂલ લક્ષગોચર થાય તો અવશ્ય જાણ કરે. જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય.

આ ગ્રંથના પ્રવચનો લખી આપવા બદલ શ્રી કનુભાઈ શાહ, અમદાવાદ-શ્રી જ્યેન્દ્રભાઈ શાહ, કું. નીતાબહેન શાહ, ભાવનગરનો હદ્યપૂર્વક આભાર માનવામાં આવે છે. ગ્રંથના પૂર્ણ રીડિંગ માટે જે મુમુક્ષુઓએ સહકાર આપ્યો છે તેમનો પણ આભાર માનવામાં આવે છે. આ ગ્રંથના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશિ અન્યત્ર આપવામાં આવી છે.

આ ગ્રંથના સુંદર ટાઈપ સેટોંગ માટે પૂજા ઇમ્પ્રેશન્સ, ભાવનગરનો તથા સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ મે. ભગવતી ઓફસેટ, અમદાવાદનો પણ આભાર માનવામાં આવે છે.

અંતતઃ: પૂજ્ય ભાઈશ્રી શશીભાઈની ૬૮ મી જન્મ જયંતીના માંગલિક પ્રસંગે આ પુસ્તકનું પ્રકાશન કરતાં પ્રત્યેક જ્ઞાની પુરુષના ચરણમાં વંદન કરીએ છીએ. અને સર્વ જીવો ‘સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાય’ ને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે અત્ર વિરમીએ છીએ.

ભાવનગર

કાર્તિકી પૂર્ણિમા,

વીર સંવત-૨૫૨૮

(૩૦-૧૧-૨૦૦૧)

ખ.

દ્રસ્તીગણ

વીતરાગ સત્ત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ

## વિષય પ્રવેશ

પ્રવર્તમાન જિનશાસન મહાવીર ભગવાનના નામથી પ્રસિદ્ધ છે. મહાવીર સ્વામીના નિર્વાજ બાદ અનેક કેવળીઓ, શુતકેવળીઓ તથા જ્ઞાની ધર્માત્માઓથી આ ભરતભૂમિ સુશોભીત રહી છે. આચાર્ય શિરોમણી, દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા ગણધર ભગવાન દ્વારા ૧૨ અંગ તથા ૧૪ પૂર્વની રચના થઈ. આ શુતજ્ઞાન પરંપરાએ આચાર્ય ભગવંતોને પ્રાપ્ત થયું અને સર્વ સમર્થ આચાર્યો દ્વારા આ જિનશાસનનું અખંડિતપણું અવિરતપણે ચાલુ રહ્યું. કાળકમે અનેક જ્ઞાની ધર્માત્માઓ થયા અને તેમણે પરમ ગંભીર શાસ્ત્રોના રહસ્યોને સ્વાનુભવથી ઉકેલી જિનશાસનને જીવંત રાખ્યું.

સમસ્ત જિનાગમનો મૂળ હેતુ પરિભ્રમણ કરી રહેલા સંસારી જીવોને દુઃખથી મુશ્કેલી કરાવી સાચિ અનંત કાળ પર્યત શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવાનો છે. જિનાગમને વિષે, સંસાર પરિભ્રમણના મૂળ કારણો અને તેનાથી મુશ્કેલી વિધિનો વિષય સૂક્ષ્મ રીતે પ્રતિપાદિત થયેલો છે. પોતાના મૂળ સ્વરૂપથી અજાણ એવો જીવ સ્વ મતિકલ્યનાથી અનેક ધર્મસાધન કરતો આવ્યો છે, છતાં પરિભ્રમણ અને પરિભ્રમણના કારણો પ્રત્યક્ષપણે ચાલુ રહ્યાં છે, એ વાત નિઃસંદેહ છે. પોતાના મૂળ સ્વરૂપને વિષે તથા તેની પ્રાપ્તિની વિધિના વિષયમાં જીવ કલ્યના કરતો આવ્યો છે અને અંતઃ દુઃખથી મુશ્કેલી વિષે તથા નથી. આ એક સર્વમાન્ય પ્રસિદ્ધ તથ્ય છે.

સમવસરણમાં બિરાજમાન પ્રત્યક્ષ જિનેન્દ્ર ભગવાન અને પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્માઓનો યોગ પણ જીવને અનંતકાળમાં અનંત વાર થઈ ચુક્યો છે. અનેક વાર પ્રત્યક્ષ સત્પુરુષના ચરણ સાનિધ્યમાં રહેવાનો યોગ પણ પ્રાપ્ત થયો છે અને અનેક વાર શાસ્ત્રાધ્યયન પણ કર્યું છે. જિનેન્દ્ર ભગવાનની મહિં રત્નોના દીવાથી પૂજા-ભર્ત ત પણ કરી છે. છતાં પણ પરિભ્રમણથી મુશ્કેલી વિષે તથા નથી થવાયું? શામાટે પોતે મૂળ સ્વરૂપની પ્રાપ્તિથી વંચિત રહ્યો છે? એવી કર્દી વાત બાકી રહી ગઈ કે રહી જાય છે, કે જેના કારણે જન્મ-મરણનો એક ફેરો પણ ઓછો નથી થયો? આ વાત સ્વલ્પને ગંભીર ઉપયોગથી વિચારવા યોગ્ય છે.

સમીપ સમયવર્તી આત્મજ્ઞ સત્પુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજયંદ્રજીએ સ્વયંના આત્મ અનુભવથી અનેક પત્રોમાં આ વાતને પ્રસિદ્ધ કરી છે. જીવને પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો યોગ થવા છતાં પણ તેમની ઓળખાજા થઈ નથી અને

ઓળખાણ પૂર્વક સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યકું પ્રતીતિ આવ્યાં નથી. તથા તેમના વચનોને રૂડા પ્રકારે – યથાર્થ પ્રકારે ઉપાસ્યા નથી. જીવે પ્રત્યક્ષ સમાગમ યોગને આજ્ઞાંકિતપણે ઉપાસ્યો નથી. આજ્ઞામાં એકતાન થવાના પુરુષાર્થથી વંચિત રહ્યો છે. એકમાત્ર આ કારણના સદ્ગ્ભાવને લીધે જીવે, યોગને પણ અયોગ થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. ફલતઃ પરિભ્રમણ ચાલુ રહ્યું છે.

ઉપરો ત વિષયને અનેક પત્રોમાં પ્રકાશિત કરી પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાંપ્રત મુમુક્ષુ સમાજ ઉપર પરમ ઉપકાર કર્યો છે. જીવની અયોગ્યતા તથા મહિન અંતઃકરણને કારણે આ વાત લક્ષ ઉપર આવી નથી. કૃપાળુદેવ ૧૮૪ પત્રમાં લખે છે : “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રચ્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યકુપ્રતીતિ આવ્યા વિના સત્ત્વવૃપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવાં છે, તેની દશાને પામે છે. . . . જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી.” આમ સ્વયંના અનુભવથી વાતને સ્પષ્ટપણે કહી છે. તદુપરાંત પત્રાંક-૫૧૧ માં આ વાતને સિદ્ધાંતરૂપે સ્થાપીને લખે છે : “જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.”

આમ અનેક પત્રોમાં આ વિષય ઉપર પ્રકાશ પાડી મુમુક્ષુજીવની બીજભૂત ભૂલને દર્શાવી છે. આ પણ એક સત્ય વાત પ્રકાશી છે કે, “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો જ્ઞાનીના હદ્યમાં રહ્યો છે.” ઉ ત વચનાનુસાર કૃપાળુદેવની આ બધી ગૂઢ વાતોને, પ્રત્યક્ષ ઉપકારી સૌમ્યમૂર્તિ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈએ સરળ ભાષામાં અનેક પ્રવચનો કરી, જીવના લક્ષ ઉપર આડી છે. જ્ઞાનીપુરુષનું હદ્ય ખોલવા માટે તથા તેનો મર્મ-રહસ્ય ખોલવા અર્થે જ્ઞાનીપુરુષ જ જોઈએ. અન્યથા સામાન્ય જીવોથી જ્ઞાનીપુરુષના હદ્ય સુધી પહોંચી શકતું નથી. તેમ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈએ કૃપાળુદેવના હદ્ય પર્યત પહોંચી તેમના આશયને-મર્મને ખોલીને મુમુક્ષુજીવો પર પરમ પરમ ઉપકાર કર્યો છે.

અંતતઃ જ્ઞાનીપુરુષની આજ્ઞામાં રહી સિદ્ધપદની પ્રાપ્તિની ભાવના ભાવીએ છીએ. જેથી દુઃખથી મું ત થઈ શાશ્વત સુખમાં બિરાજમાન થવાય. પ્રસ્તુત વિષય - સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાયને સર્વ જીવો પ્રાપ્ત થાય, એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.

---

પરમ કૃપાળુદેવાય નમઃ

## પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો આધ્યાત્મિક જીવન પરિચય

શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સંવત ૧૮૨૪ કાર્તિક પૂર્ણિમા રવિવાર વવાણિયા ગામે (ગુજરાત) થયો હતો. તેઓ બાળવયથી જાતિસ્મરણ તથા અનેક જ્ઞાનના ધર્ષણી હતા.

શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેત્તાઓમાંના એક છે. શ્રીમદ્ રાજચંદ્ર એટલે અધ્યાત્મગાગનમાં જળકી રહેલી અદ્ભૂત જ્ઞાનજ્યોતિ ! માત્ર ભારતની જ નહિ પણ વિશ્વની એક વિરલ વિભૂતિ ! અમૃત્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના જળહળતા પ્રકાશથી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉઘોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવની તલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ !

શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તો આપણને અનેક મળે પણ જેમનું જીવન જ સત્થાસ્ત્રનું પ્રતીક બની રહે એવો વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તો જળહળતા આત્મજ્ઞાનમય ઉજ્જવળ જીવનનો અંતરંગ પ્રકાશ હતો એટલે જ એમને અદ્ભૂત અમૃતવાળીની સહજ સ્કુરણા હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લખે છે : “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદ્ મારા ઉપર ડી અસર કરી છે. ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિ-શ્રી (શ્રીમદ્ રાજચંદ્ર) ના જીવનમાંથી છે.

પરમ કૃપાળુદેવની વિશેષતાઓને ત્રણ વિભાગમાં જોઈ શકાય, તેમ છે.

યથા :-

1. તેઓશ્રીની આભ્યંતર અધ્યાત્મદશાની વિશેષતાઓ;

૨. તે અધ્યાત્મદશાની સાથે સાથે પ્રવર્તિત ઉચ્ચ/આદર્શ વ્યવહારપરિણામની વિશેષતાઓ; અને

૩. તીર્થકરદેવનો મૂળમાર્ગ પ્રકાશવાની શરીર તરૂપ વિશેષતાઓ.

— આ ગ્રંથ પ્રકારની વિશેષતાઓનો ઉલ્લેખ, તેઓશ્રીના જ વર્તન અને વચનામૃતો દ્વારા, કરવા યોગ્ય છે; અને તે વડે તે પ્રતીત કરવા યોગ્ય છે, ભરી ત કરવા યોગ્ય છે.

**□ પરમ નિઃસ્પૃહતા :** પરિપૂર્ણ આત્મસ્વરૂપના અવલંબનપૂર્વક સર્વ બાધ્ય પદાર્�ો પ્રત્યેની અપેક્ષાબુદ્ધિ વિલય પામે છે; જગતના કોઈ પણ પદાર્થની સ્પૃહતા રહેતી નથી. એટલું જ નહિ, સ્વસ્વરૂપદૃષ્ટિની મસ્તીમાં તો ભાવી મોક્ષપર્યાયની પણ અપેક્ષા નથી હોતી. તેવા આશયને પ્રકાશતું તેઓશ્રીનું વચન પત્રાંક-૧૬પમાં છે કે : “એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણાને કાંઈ જરૂર નથી.”

**□ અદ્ભુત વિદેહીદશા :** જ્ઞાનદશાના પ્રારંભથી જ તેઓશ્રીની પરિણતિમાં સ્વરૂપમાં સમાઈ જવાની લય લાગેલી હતી. અને તેઓશ્રીએ બાધ્ય ધર્મ-પ્રભાવનાના પરિણામોને ગૌણ કરી, નિશ્ચયધર્મની પ્રધાનતા કરી, તે સ્પષ્ટ જોવામાં આવે છે. આ સંદર્ભમાં સ્પષ્ટ ઉલ્લેખ પત્રાંક ૧૭૬માં ઉપલબ્ધ છે : “એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે, અને એક બાજુથી અલખ ‘લો’માં સમાઈ જવું એમ રહે છે....અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધું થયા છીએ;” આ ઉપરાંત તેઓશ્રીએ પત્રાંક-૨૫પમાં સ્વયંની અંતરંગદશા આ શર્ષદોથી પ્રકાશી છે : “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાહીએ છીએ;... સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી;...હદ્ય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રમેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે

વર્તે છે;....” વગેરે વચનો, તેઓશ્રીની અદ્ભુત વિદેહી દશાને પ્રકાશે છે. વળી તેઓશ્રીના ચિત્તની આત્માકાર સ્થિતિનો ઉલ્લેખ પત્રાંક-૭૮૮માં પણ જોવા મળે છે : “આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ધાણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદવાને યોગ્ય નથી,.....”

□ અપૂર્વ વીતરાગતા : મોક્ષમાર્ગના પ્રારંભમાં જે તેઓશ્રીની સાધનામાં અપૂર્વ વીતરાગતા પ્રગટ થયેલી તેનો ઉલ્લેખ પત્રાંક-૩૧૭માં આ પ્રકારે છે : “કોઈ એવા પ્રકારનો ઉદ્ય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન કયાંય વિરામ પામતું નથી,... ચિત્તનો પણ જાણો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણાવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે.” આ ઉપરાંત, તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૩૧૭માં આ પ્રમાણે છે : “ચિત્ત ધાણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુ તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે... જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ.” ...વગેરે.

□ અલૌકિક સ્વરૂપ-જાગૃતિ : ગૃહસ્થદશા અને અનેક પ્રકારના વ્યાવસાયિક પ્રસંગોની વચ્ચે પણ તેઓશ્રીની અલૌકિક સ્વરૂપ-જાગૃતિ સ્પષ્ટ ઉપસી આવે છે. તે જાગૃતિને વશ સ્વયંના સૂક્ષ્મ પરિણામોનું અવલોકન થઈ, તે વિષય તેઓશ્રીએ અનેક પત્રોમાં અસાધારણપણે વ્યક્ત કર્યો છે. તેવી જાગૃતિનો ઉલ્લેખ, આરાધક પુરુષોના પુરુષાર્થને સ્મરણમાં લઈ, તેઓશ્રીએ પત્રાંક-૭૮૮માં આ પ્રમાણે કર્યો છે : “અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદ્ય વત્ત્યા છતાં જે પુરુષો તે ઉદ્યથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વર્ધમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષોના ભીષ્મપ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ.”

□ અદ્ભુત પુરુષાર્થ : કૃપાળુદેવના જીવનની-પરિણામનની આ કોઈ અસાધારણ વિલક્ષણતા હતી જે તેઓશ્રીના પ્રબળ પુરુષાર્થને પ્રકાશે છે. તેઓશ્રીએ લગભગ દશ વર્ષના સાધકજીવનમાં જ અદ્ભુત પુરુષાર્થ વડે સંસારને માત્ર એક ભવ પૂરતો સંક્ષેપ કરી નિર્વાણ-પદની સમીપતા સંપ્રાપ્ત કરી. જેનો ઉલ્લેખ, તેઓશ્રીએ પોતાની આભ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧/૮૮માં આ શબ્દોથી કર્યો છે : “વૈશ્યવેષે અને નિર્ભ્રથભાવે વસતાં કોટી કોટી વિચાર

થયા કરે છે... નિર્ગ્રથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિર્ગ્રથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે,... તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્ય કર્યા વિના નિર્ગ્રથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી... તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિણીક કર્યો છે, અને હજુ પણ તે જ પરિણાતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત (-આત્મપુરુષભાર્થ) વિશ્રાંતિ પામે એમ જણાતું નથી...”

તેઓશ્રીનો પુરુણભાર્થ તો વર્તમાન ભવમાં જ પૂર્ણ દશા પ્રાપ્ત કરવાનો હતો; અને તે અંગેનો પુરુણભાર્થ પણ તેમને ઉપાડચો હતો. જેનો ઉલ્લેખ તેઓશ્રીના અંતિમ વચ્ચનામૃત પત્રાંક-૮૫૧માં જોવા મળે છે : “ઘણી તરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો (પૂર્વકર્મનો) રહ્યો હતો તે આત્મવીર્ય કરી (- તીવ્ર પુરુણભાર્થ કરી) જેમ અલ્ય કાળો વેદી લેવાય તેમ પ્રઘટના (યોજના) કરતાં પગે નિકાયિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે (વસ્તુ)-સ્વરૂપ છે તે અન્યથા થતું નથી.” આ અને આવા અનેક તીવ્ર પુરુણભાર્થ-ઘોતક ભાવોનાં દર્શન તેઓશ્રીના વચ્ચનામૃતોમાં થાય છે. અને તેઓશ્રીનો કરડો પુરુણભાર્થ જોઈ સહજ જ મસ્તક નમી જાય છે.

### □ સમ્યક્ ઔદાસીન્ય વૃત્તિ : જ્ઞાનદશાની સાથે અવિનાભાવીપણે

પજતો વૈરાગ્ય તેઓશ્રીની આરાધકદશાની પૂર્વ જ અને ત્યાર પછી પણ પ્રબળ હતો. તેના દર્શન તેઓશ્રીના અનેક પત્રોમાં થાય છે. તેઓશ્રી પત્રાંક-૪૧૪માં લખે છે કે : “ગૃહસ્થ પ્રત્યાયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં ‘સર્વથા’ અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાનીપુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજુએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે.” પત્રાંક-૫૦૮માં તેઓશ્રી દ્વારા વ્યક્ત

ઉદ્ગારો મુમુક્ષુજીવે હૃદયંગમ કરવા યોગ્ય છે : “આ સંસારને વિષે કોઈ પ્રકાર સ્થિયોગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે;... વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ગ્રાસ વર્ત છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; ...બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણો સ્થિતિ છે.” વળી, તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૨૧૪માં દ્રષ્ટવ્ય છે : “અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્ત છે; તે સાવ સોનાનું થાય તો અમને તૃણવત્ત છે;” કૃપાળુદેવની અંતર ભાવનાના દર્શન પત્રાંક-૨૧૭માં થાય છે – તેઓશ્રી લખે છે કે : “વારંવાર વનવાસની છચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી,... વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ’ વનમાં જઈએ એમ થઈ આવે છે.”

□ અદીન વૃત્તિ : જ્ઞાનદશામાં નિજ પરમેશ્વર પદનું અવલંબન રહેતું હોવાથી જ્ઞાનીપુરુષને કયાંય કોઈ પ્રસંગમાં દીનતા સહજ જ થતી નથી. તેમ જ ઉદ્ય પ્રત્યે ઉપેક્ષા અને અસાવધાની રહેવા છતાં ભવિષ્યની કોઈ ચિંતા થતી નથી. તે જ્ઞાનદશાની વિલક્ષણાતા છે; કારણ કે સર્વ અજ્ઞાની જીવોને ભવિષ્યની ચિંતા આડ વર્તમાનમાં આત્મહિતનો પુરુણાર્થ ઉપડતો જ નથી. આ સંદર્ભમાં તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૨૧૭માં આ પ્રમાણો છે જે મુમુક્ષુજીવે અવધારવા યોગ્ય છે : “ઉદ્યકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણાનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી.”

□ સમદર્શિતા : તેઓશ્રીના વિચારોમાં પ્રથમથી જ સર્વ આત્માઓ પ્રત્યે સમદૃષ્ટિ રાખવાનો અભિપ્રાય હતો. તેના દર્શન ૧૭માં વર્ષ રચેલાં ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ કાવ્યમાં થાય છે : “સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્વો આ વચનને હદ્યે લખો.” તે ઉપરાંત તેઓશ્રી પત્રાંક-૪૬૮માં લખે છે કે : “જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે... જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છાએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છાએ છીએ જે જે આ આત્મા માટે ઈચ્છાએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઈચ્છાએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ.” એ વગેરે પ્રકારે આ પત્રમાં તેઓશ્રીના સમદર્શિત્વ ગુણને

વ્યક્ત કરતા અનેક પાસાઓ પ્રકાશિત થયા છે. જે જૈનદર્શનની વિશાળતાને દર્શાવે છે.

**□ પ્રશભ દશા :** તેઓશ્રીની પ્રશભ મુદ્રાના પ્રત્યક્ષ દર્શન જે મુમુક્ષુઓએ કર્યા હશે, તેઓ તો ખરેખર સૌભાગ્યવંત ગણવા જોઈએ. પરંતુ તેઓશ્રીની છવિમાં (જે મહાનુ સદ્ગ્ભાગ્યે ઉપલબ્ધ છે તેમાં) પણ આજે તેઓશ્રીની પ્રશભતા અભિવ્ય ત થાય છે. આ પ્રકારની પ્રશભતા જ્ઞાનીપુરુષની બાધ્યાભ્યંતરદરશાનું એક પ્રગટ લક્ષણ છે. અને તે પ્રયોગાત્મક રીતે જ્ઞાનદરશાનું બોધ કરાવનાર છે. કૃપાળુદેવની પ્રશભદશા તો ખરેખર અભિવંદનીય છે.

**□ જિતેન્દ્રિયતા :** વર્તમાન કાળના આયુર્ઘના ધોરણનો વિચાર કરતાં કુમાર અવસ્થા, યુવાવસ્થાનો પ્રારંભ કાળ અને યુવાવસ્થાની મધ્યમ સ્થિતિમાંથી તેઓશ્રીના જીવનનું અવલોકન કરતાં અસાધારણ જિતેન્દ્રિયપણાનું આપણાને દર્શન થાય છે. પંચેન્દ્રિયના વિષયો પ્રત્યે તેઓશ્રીના વિચારો જોતાં ‘અપ્રતિમ વૈરાગ્ય’ તેઓશ્રીના વચ્ચનોમાં ઠામઠામ જોવા મળે છે. જીવનના ઉત્તરાર્ધમાં તો તેઓશ્રીએ જાણે કે ભર યુવાનીમાં સર્વસંગપરિત્યાગ કરી આહાર આદિનો સંક્ષેપ પણ કરી નાખ્યો હતો. તેઓશ્રીને કોઈ પણ ઇન્ડ્રિયના વિષયોએ આકર્ષણ હોય તેવું શોધવાનો જો પ્રયાસ કરવામાં આવે તો પણ તે શોધી શકાય તેમ નથી. ટૂંકમાં તેમ અવશ્ય કહી શકાય છે કે, તેઓ ગૃહસ્થવેષમાં પણ એક મહા યોગીરાજ હતા.

**□ સહજતા :** સહજ આત્મસ્વરૂપ સાથે અભેદભાવે વર્તતી જ્ઞાનીપુરુષોની દશામાં સહજતા ઉત્પત્ત થઈ આવે છે, જે જ્ઞાનદરશાના અનેક મુખ્ય લક્ષણો માંથેનું એક મુખ્ય લક્ષણ છે. કૃપાળુદેવની દશામાં પણ સહજતા ઠામઠામ જોવા મળે છે. તેનો ઉલ્લેખ તેઓશ્રીએ પત્રાંક-૬૧૮માં કર્યો છે : “જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણાતિ રહે છે;” એટલે કે તેવી પરિણાતિમાં સહજતા કરવી પડતી નથી પણ આરાધકદરશાને લીધે આવી સહજતા પણે છે.

**□ લોકોત્તર સરળતા :** તેઓશ્રીની સરળતાનો પ્રકાર તો ખરેખર વંદ્નીય છે. મુમુક્ષુઓ કરતાં અત્યંત ઉચ્ચ કોટિની જ્ઞાનદરશાને સંપ્રાપ્ત હોવા છતાં, તેઓશ્રીએ પોતાના પરિણામોનું નિવેદન (અસ્થિરતાને લીધે અલ્ય

દોષયું ત હોય તે પણ) અનેક પત્રોમાં અત્યંત સરળભાવે કર્યું છે. જેને અનુસરીને મુમુક્ષુજીવોએ પણ કૃપાળુટેવના જીવનને સ્વયં બોધસ્વરૂપ જાણીને પોતાના દોષોનું નિવેદન કરવાની સરળતા પ્રાપ્ત કરી હતી. શિષ્ય જો જ્ઞાની સદ્ગુરુ પ્રત્યે પોતાના દોષોનું નિવેદન કરે તો તે તો ઉચિત જ છે. પરંતુ જ્ઞાની પોતાના દોષેનું નિવેદન કરે તે તો લોકોત્તર સરળતા છે. કૃપાળુટેવનાં વચનામૃતોમાં આવી અલૌકિક સરળતાના દર્શન ઠામઠામ થાય છે.

**□ મધ્યસ્થતા :** કૃપાળુટેવની મધ્યસ્થતા અસાધારણ હતી. જેને લીધે આજે પણ તેઓશ્રીના અક્ષરદેહરૂપ વચનામૃતોથી આકર્ષિત થઈને ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાંથી અનેક પાત્ર જીવો સંપ્રદાયબુદ્ધિનો ત્યાગ કરી, મૂળમાર્ગને સ્વીકારતા થયાં છે. જેન સિવાયના અન્ય મત સંબંધી તેઓશ્રીનો પત્ર વ્યવહાર સમકાળીન પ્રભ્યાત વિદ્વાન શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અને શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી) સાથે થયેલ, તેમાં તેઓશ્રીએ અત્યંત મધ્યસ્થતાપૂર્વક તેઓના પત્રોના પ્રત્યુત્તર આપેલ છે, તે મધ્યસ્થતા કેળવવા અર્થે મુમુક્ષુજીવે વારંવાર અનુપ્રેક્ષણીય છે. આજે અનેકાનેક જૈનેતર લાયક મુમુક્ષોઓને કૃપાળુટેવનાં વચનામૃત પ્રત્યે જે બહુમાન અને ભર્તી ત સ્કુરે છે તે તેઓશ્રીની મધ્યસ્થતાનો પ્રબળ અને જીવંત પુરાવો છે. તેઓશ્રીનું પંદર વર્ષની ઊંમરે લખાયેલું આ વચનામૃત (પુષ્પમાળા-૧૫) અત્યંત પ્રસિદ્ધ છે : “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભર્તી ત, તે ધર્મ અને તે સદાચારને તું સેવજો.” આમ મધ્યસ્થભાવે કોઈ પણ ધર્મની ચર્ચા કરવા છિતાં તેઓ અસાધારણ વિચક્ષણતાથી મૂળમાર્ગ (-શ્રી તીર્થકરદેવના માર્ગાની) ઉત્કૃષ્ટતા પ્રતિપાદન/સ્થાપન કરવાનું ચૂં યા નથી; અને અનેક જીવોને સન્માર્ગ વાય્યા છે. જે બદલ તેઓશ્રીના ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓધા પડે છે.

**□ ગુડા ગંભીરતા :** દુર્લભ અને મહાન જ્ઞાનદશા પ્રાપ્ત હોવા છિતાં તેઓશ્રી અપ્રેગટ-ગુપ્ત રહેવા છચ્છતા હતા કે જેથી બાબ્ય પ્રસિદ્ધ કે જે મોક્ષમાર્ગને સ્યાત્ર પ્રતિકૂળ છે, તેનાથી બચી શકાય. તેનો નિર્દેષ પત્રાંક-૧૮૨માં મળે છે : “માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે.” તેમ જ પત્રાંક-૧૭૦માં આ વચનો જોવા મળે છે : “આટલા

માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અકશરે એ વિષયે વાત કરવા હચ્છા થતી નથી.... સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની હચ્છા બાંધી રાખી છે.”

□ પરેચ્છાચારિતા : આત્મપરિણાતિનું અખંડપણું રહેવા અર્થે એટલે કે બાધ ન પામે તે અર્થે તેઓશ્રીએ બાદ્ય પ્રવૃત્તિમાં બહુભાગ બીજાની હચ્છાને અનુસરવાની નીતિ અપનાવી હતી. આ પ્રકારની વિચક્ષણતા તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૩૭૬માં જોવા મળે છે : “હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ.” તેમ જ પત્રાંક-૩૧૭માં પણ આ વચનો દ્રષ્ટવ્ય છે : “ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુ તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશોષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ.”

□ સમ્યક્ આચરણા : પરમ કૃપાળુદેવ બાદ્ય સંયોગોની અપેક્ષાએ સામાન્ય મનુષ્યોની જેમ જ સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરતા દેખાવા છતાં, અંતરંગમાં એકદમ અસંગવૃત્તિએ રહી શકતા હતા. કારણ કે તેઓશ્રીને કોઈ સંયોગમાં સ્વપણું અનુભવાતું ન હતું. (જુઓ પત્રાંક-૨૨૮). તે ઉપરાંત પરાનુકૂપા અર્થે પણ ઉદ્ય વેદવાનું તેઓશ્રીથી બન્યું છે જેનો ઉલ્લેખ તેઓશ્રીએ પત્રાંક-૪૦૮માં આ પ્રકારે કર્યો છે : “તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની હચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણો-કારણપણો પ્રવર્તવાની હચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વ કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદ્યજેણ છે, એમ જાણી વચિત્ર ખેદ પામીએ છીએ, કવચિત્ર વિશોષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તે પરાનુકૂપારૂપ જણાય છે.” પત્રાંક-૩૭૮માં વ્યાવહારિક પ્રવૃત્તિ સંબંધી તેઓશ્રીના વચનામૃતો લક્ષ્યમાં લેવા યોગ્ય છે : “હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાદ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. વચિત્ર પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વ નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મા નિવત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે. થોડા કાળમાં ભોગવી લેવાને

અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થ સેવીએ છીએ.” આવું વ્યાવહારિક કાર્ય કરતા પણ તેઓશ્રીના પરિણામની સ્થિતિ કેવા પ્રકારની વર્તતી હતી, તે પત્રાંક-૩૪૭માં દર્શિત થાય છે : “જાહીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણો વર્તે છે..... હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચોંટનું નથી. પોતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારુપે રહે છે.” આમ પ્રારબ્ધની નિવૃત્તિઅર્થે તેઓશ્રી ઉદ્યને સમ્યક્ પ્રકારે વેદતા હતા. તેઓશ્રીની એવી સમયક્ આચરણા હતી. તે સંબંધમાં, તેઓશ્રીની આત્મશરીર ત બળવાન હોવાથી ઉદ્યકણ વિશેષ પુર્ણપાર્થ દ્વારા પૂર્વ કર્મની વિશેષ નિર્જરા અર્થે ઉપાધિ યોગનો ત્યાગ કરવાને બદલે સમ્યક્ પ્રકારે પૂર્વ કર્મનો ભોગવટો તેઓશ્રી કરતા હતા. આ એક રહસ્યભૂત વિષય તેઓશ્રીની અધ્યાત્મદશાનું અવલોકન કરતા સમજાય છે. આ વિષે સ્પષ્ટ ઉલ્લેખ પત્રાંક-૩૮૮માં છે : “હાલ જે ઉપાધિજોગ પ્રાપ્તપણો વર્તે છે, તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે; તથાપિ તે ઉપાધિજોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી છથા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે, એમ જાહીએ છીએ.” આમ હોવા છતાં, અંતરંગ પારમાર્થિક નિવૃત્ત દશાને બાધ્ય ઉપાધિ વ્યવહારે અનુકૂળ નથી. તેથી તેઓશ્રીને ઉપાધિથી છૂટવાની તીવ્ર વૃત્તિ રહ્યા કરતી હતી. જેનો ઉલ્લેખ તેઓશ્રીએ પત્રાંક-૫૬૮માં કર્યો છે : “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કર્યી પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે કયારેય બુદ્ધિ થતી નથી... નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” એવા પ્રકારે વર્તતી તેઓશ્રીની સમ્યક્ આચરણા નિઃસંદેહ અભિવંદનીય છે, અનુકરણીય છે.

॥ ઉપાધિમાં સમાધિ : તેઓશ્રીનું વ્યવહાર-ઉપાધિમાં રહેવું પૂર્વ પ્રારબ્ધયોગે થતું હતું, જે આરાધકદશાથી પ્રતિકૂળ હોવા છતાં, તેઓશ્રી અંતરંગ

સમાધિભાવમાં નિરંતર રહેતા હતા. તેનો ઉલ્લેખ તેઓશ્રીના અનેક પત્રોમાં જોવા મળે છે તેનો નમૂનો પત્રાંક-૨૪૭માં આ પ્રમાણે છે : “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે; જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિષછા (-ભવિતવ્ય) સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ.” અર્થાત્ સમ્યજ્ઞાનમાં ચારે પડખેથી સર્વ પ્રકારના સંયોગ-વિયોગમાં અસમાધાન ઉત્પત્ત થતું નથી; પરંતુ સહજ સમાધિભાવ રહે છે. જે તેઓશ્રીએ અવારનવાર પત્ર દ્વારા જણાયું છે. પત્રાંક-૪૦૮ અને ૭૧૦ના વચનામૃતો, (ઉદ્ય-પ્રવત્તિમાં ખેદ છતાં સમ્યક્ પ્રકારે સમતાભાવે વેદવામાં આવે છે,) તેના ઉદાહરણરૂપે છે.

તેઓશ્રીની આરાધનાની સહવર્તી બીજી અનેકવિધ વિશેષતાઓ પણ ઉલ્લેખનીય છે. અંતર્ આરાધનાની સાથે સાથે તેને અનુરૂપ અને અનુકૂળ એવા બાધ્ય પરિણામનમાં અનેકવિધ પ્રકારે તેઓશ્રીના અનેક ગુણો પણ મુમુક્ષુજીવને અવલોકનમાત્રથી ઉપકારી થાય તેવા છે. જેનું યત્કિંચિત્ વર્ણન આ પ્રમાણે છે :-

**□ સાતિશય જ્ઞાન-યોગ :** પરમ કૃપાળુદેવને ચિત્તમાં કોઈ પણ વાતની સ્ફુરણા થતી તેમાં ઘણા નયયું ત તે તે વાત ગતિ, એટલે કે કોઈ એક વાતના સમર્થનમાં અનેક નયોની સંધિ તેઓશ્રીના જ્ઞાનમાં સ્ફુરિત થઈ જતી, તેવો ઉલ્લેખ તેઓશ્રીએ પોતાના શબ્દોમાં પત્રાંક-૨૨૭માં કરેલો છે : “લેખનશરી ત શૂન્યતા પાચ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ગેલી વાત ઘણા નયયું ત હોય છે, અને તે લેખમાં આવી શકતી નથી (સંભવિત નથી).” તદુપરાંત તેઓશ્રીના ઉપયોગની તીક્ષ્ણતા-તીવ્રતા-વિશાળતાનો ઉલ્લેખ પત્રાંક-૮૧૭માં જોવા મળે છે : “એક શ્લોક વાંચતાં અમને હજરો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.”

**□ વિવેકદ્વિષ્ટ :** પરમ કૃપાળુદેવની વિવેકદ્વિષ્ટને વિચારતાં, કોઈ પણ વિચારવાન જીવનું મસ્તક નમી પડે તેમ છે. કોઈ પણ લૌકિક કે પારમાર્થિક વ્યવહાર સંબંધિત મુદ્દો ઉપસ્થિત થાય અને તે તેમની સમક્ષ આવે ત્યારે તેઓશ્રીનો ઉપયોગ ચારેય પડાયે ફરી વળતો દેખાય છે. આ વિષયમાં તેઓશ્રીના પત્રોમાં વિભન્ન કોટિના મુમુક્ષુઓને જે માર્ગદર્શન આપ્યું છે તેનું જો વર્ણન કરવામાં આવે તો આ વિષયક એક પુસ્તક જેટલું કદ થઈ જાય

તેમ છે. પરંતુ સંકોપમાં એટલું અવશ્ય કહી શકાય છે કે સમ્યગ્જ્ઞાન સહિત જ્ઞાનનું યથાર્થપણું તેઓશ્રીના અનેક પ્રકારના માર્ગદર્શનમાં પ્રતીત થાય છે, અર્થાત્ તેઓશ્રીની જ્ઞાનદર્શાની પ્રતીતિ કરાવે છે, અને તે દ્વારા તેઓશ્રી પ્રત્યે ભર્તી ત પજવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે.

□ ગુણ-પ્રમોદ : આ વિષયમાં તેઓશ્રીનું ગુણ-આહકપણું અથવા ગુણ પ્રાપ્તિની દખ્ખિ ઘણી તીક્ષણ હતી, તેમ સમજાય છે. તેઓશ્રી ચારેય અનુયોગોમાંથી સર્વત્ર આત્મગુણ પ્રગટાવવાનો આશય ખેંચી કાઢતા હતા. એટલું જ નહિ, અન્ય મતમાં જન્મેલા માર્ગાનુસારી મહાત્માઓના વચનો પણ આત્મગુણ પ્રગટવામાં કેવી રીતે પ્રેરક છે, તેવો આશય ખેંચીને વ્યતીત કરવામાં તેઓશ્રીના વચનો વર્તમાન સાહિત્યમાં કદાચ બેજોડ છે. તે ઉપરાંત તેઓશ્રી કોઈ પણ વ્યતીત તના દોષોને ગૌણ કરીને, તેના ગુણના અલ્ય અંશને પણ મુખ્ય કરતા. જેના સંદર્ભમાં તેઓશ્રીની એક પંચ ત અત્ર ઉદ્ધરણ કરવા યોગ્ય છે : “ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ.” જૈનદર્શનનાં અનુયોગના સંદર્ભમાં પ્રવાહિત થયેલું આ પદ્ય ગુણ-પ્રમોદની ફળશુદ્ધિને અંતર્મુખતામાં અભિવ્યક્ત કરતું પ્રવાહિત થયું છે. જે આપણને તેઓશ્રીની ગુણ-પ્રમોદતાના દર્શન કરાવે છે.

□ વાત્સલ્ય અને પ્રભાવના : પોતાની આત્મદર્શા વડે જેમણે ‘નિશ્ચયપ્રભાવના’ પ્રગટ કરી છે, તેવા ધર્માત્માઓની એવી નીતિ હોય છે કે ‘બ્યવહારપ્રભાવના’ પ્રસંગે જે જીવ તેઓની સમીપમાં-સાન્નિધ્યમાં આવે છે તેનું સ્થિતિકરણ તેઓ અત્યંત વિચક્ષણતાપૂર્વક કરે છે, અને વાત્સલ્ય કરે છે. આ બ્યવહારપ્રભાવનાના મુખ્ય અંગો છે. મહાન્ જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને તેઓશ્રીની સમીપમાં આવનાર મુમુક્ષુજીવો વચ્ચેનાં પત્ર બ્યવહારને જો આ દખ્ખિકોણથી ગવેષવામાં આવે તો આ વિષયમાં તેઓશ્રીની અસાધારણ વિચક્ષણતા અને પ્રજ્ઞાના દર્શન થાય છે. ગમે તે અન્ય મત-પંથમાંથી આવનાર સામાન્ય જીવને તેઓશ્રી પ્રથમ ભો રાખી, મૂઢુ ભાષાથી આવકાર આપે છે તથા વાત્સલ્યતા, મધ્યસ્થતા અને સરળતાપૂર્વક તેની સાથે યથોચિત બ્યવહાર / વર્તન / ઉપચાર / માર્ગદર્શન કરે છે કે જેથી આવનાર મુમુક્ષુ, જ્ઞાનીથી કદાપિ દૂર ન થઈ જાય. તેમાં પણ શ્રી સૌભાગ્યભાઈ જેવા અનેક મુમુક્ષુઓને તો જાણે કે સંસારસમુદ્રમાંથી હાથ જાલીને બહાર કાઢતા હોય-બચાવી લેતા હોય –

તેવી પરિસ્થિતિ સ્પષ્ટ માલૂમ પડે છે.

□ નિષ્કારણ કારુણ્યવૃત્તિ : જ્ઞાનદશાને અનુરૂપ ઉ ત અનેક વિશેષતાઓ સિવાય, તેઓશ્રીની અન્ય મુમુક્ષુજીવો પ્રત્યે નિષ્કારણ અભિગ્રાહાવે કારુણ્યવૃત્તિ પણ અસાધારણ હતી. આ વિષયમાં તેઓશ્રીના વચ્ચનો પત્રાંક-૧૮૮માં દૃષ્ટવ્ય છે : “અમારી વૃત્તિ જે કરવા હશે છે, તે નિષ્કારણ પરમાર્થ છે.” તેમજ તેઓશ્રી પત્રાંક-૩૮૮માં જ્ઞાવે છે કે : “આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હદ્યને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કરી પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સળ્ખાવન થાય અને કોઈ પણ જીવોને – ઘણા જીવોને – પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે;” તેમ જ તેઓશ્રી પત્રાંક-૫૨૮માં પણ જ્ઞાવે છે કે : “અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે.”

□ અલૌકિક વિનમ્રતા : કૃપાળુદેવના જીવનમાં જે પ્રકારની વિનમ્રતા જોવા મળે છે તેવું બીજું દૃષ્ટાંત કર્યાંય પણ જોવા મળતું નથી. તેવી અજોડ વિનમ્રતાના દર્શન તેઓશ્રીના વચ્ચનામૃતોમાં અનેક પ્રકારે થાય છે. તેઓશ્રી પત્રાંક-૨૧૦માં લખે છે કે : “અમારા ઉપર તમારી ગમે તેવી ભર્તી ત હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.” કૃપાળુદેવના ચિત્તની અધ્યાત્મમય દશાને લીધે, મુમુક્ષુજીવોને પ્રત્યુત્તર મોડા લખવા અથવા પ્રત્યુત્તર નહિ લખી શકવા બદલ તેઓશ્રીએ અનેક પત્રોમાં ક્ષમા માંગી છે. જોકે તેમ થવાનું કારણ તેઓશ્રીની મહાન્ન અધ્યાત્મપરિણાતિ છે; તેથી તેઓશ્રી ક્ષમા માગવાને યોગ્ય નથી. તેમ ઇતાં પણ, તેઓશ્રીએ અનેકવાર તેમ થવા માટે મુમુક્ષુજીવોની ક્ષમા માંગી છે. તે પ્રકાર તેઓશ્રીની આલૌકિક/અસાધારણ વિનમ્રતાને પ્રકાશિત કરે છે. તે સિવાય પત્રાંક-૫૨૯ તેઓશ્રીના અંતરંગને પ્રદર્શિત કરે છે : “બાબુ માહાત્મ્યની ઇચ્છા

આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ ભાવ માહાત્મ્ય ઘણું કરી છચ્છતી જગ્યાતી નથી.” તેઓશ્રીની સ્મૃતિ અસાધારણ હોવાને લીધે શતાવધાન આદિ પ્રયોગ દ્વારા તેઓશ્રીની ઘ્યાતિ વધેલી, તેમ છતાં, ૨૩મે વર્ષ લખેલી ‘સમુચ્ચયવવયચર્યા’માં તેઓશ્રીના નમતા સૂચક વચ્નો આ મુજબ છે : “સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ ડેણવળી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ઘ્યાતિ ભોગવે છે, તેટલી ઘ્યાતિ ભોગવવાથી તે કંઈ અપરાધી થઈ છે.” તે ઉપરાંત પત્રાંક-૭૦૮માં તેઓશ્રીના નિજાવલોકનપૂર્વકના વચ્નો આ પ્રમાણે છે : “ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહથી પણ વખતે આવી વૃત્તિ (ધર્મ સ્થાપવાની) રહે, પણ આત્માને ઘણીવાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે.” આ વચ્નામૃત એમ સૂચવે છે કે તેઓશ્રીએ અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક માન કષાય ઉપર વિજય મેળવ્યો હતો. જે મુમુક્ષુજીવે અનુસરણ થવા અર્થે ઉપકારી છે અને ખરેખર ભર્તી ત કરવા યોગ્ય છે.

□ નિર્ગ્રથતાની ભાવના : તેઓશ્રીના પરિણામનાનું નોંધનીય પાસું એક એ પણ છે કે તેઓશ્રીને પૂર્ણતાના ધ્યેયને લીધે યથાર્થ પુરુણાર્થની ઉગ્રતા વર્તતી હતી અને તે કારણથી તેઓશ્રીને યુવાનવયમાં જ સર્વસંગપરિત્યાગ કરી બાધ્યાભ્યંતર નિર્ગ્રથ થવાની ઉત્કટ ભાવના વર્તતી હતી. આ વિષયમાં તેઓશ્રીએ સ્વયંની અંતર્ભાવનાને હાથનોંધ-૧(૪૫)માં વ્ય ત કરી છે : “હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર !... ખભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.” વળી તેઓશ્રીનાં હૃદયમાં રહેલી આ ભાવના પત્રાંક-૪૫૮માં પણ આ શબ્દોમાં સ્ફુરિત થઈ છે : “મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્યકાળમાં આ ઉપાધિયોગ મટી બાધ્યાભ્યંતર નિર્ગ્રથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્યકાળમાં બને એવું સૂજતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી.” એ જ પ્રકારની ભાવના તેઓશ્રીએ પત્રાંક-૫૬૦માં દર્શાવી છે : “...તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદ્ય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેધો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂજાંયાં કર્યું છે.” આ ઉપરાંત તેઓશ્રીની બાધ્યાભ્યંતર નિર્ગ્રથતાની ભાવનાને અભિવ્યક્ત કરતું “અપૂર્વ અવસર” કાચ્ય તો જગ પ્રસિદ્ધ છે જ. ધન્ય છે તેઓશ્રીની આરાધના !

□ કથન-અવિરુદ્ધતા : જેમનાં અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં નિજાત્મસ્વરૂપ અનુભવ ગોચર થયું હોય, તેવા કોઈ પણ જ્ઞાનીપુરુષનાં વચનમાં પૂર્વાપર વચન-વિરુદ્ધતા કયાંય પણ હોતી જ નથી. તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. આત્મપદાર્થમાં કેટલાક પરસ્પર વિરુદ્ધ ધર્મો છે, અને તે એક જ પદાર્થ-સત્તામાં રહેલાં હોવાથી તેની અવિરોધપણે અભિવ્યિ ત, સ્વાનુભવ-વિભૂષિત પુરુષનાં જ વચનોમાં આવી શકે તેમ છે. બીજાં જીવોને કે જેમને સ્વાનુભવ નથી પરંતુ શાસ્ત્રનું પઠન-પાઠન છે તેવા જીવોને પદાર્થદર્શન નહિ હોવાને લીધે – પૂર્વાપર વિરોધપણું આવ્યા વિના રહેતું નથી. જ્ઞાનીપુરુષનાં વચનોનું પૂર્વાપર અવિરોધપણું તે ખાસ પ્રકારનું - વિલક્ષણ સ્વરૂપ છે; અને તે જેને સમજાય/ઓળખાય છે, તેને તો તે જ્ઞાની પ્રત્યે અત્યંત અહોમાવ સહજ સ્ફુરે છે. એવી કથન-અવિરુદ્ધતા પરમ કૃપાળુદેવનાં વચનોમાં રહેલી છે.

□ વિધિ-દર્શકતા : બાર અંગના સારભૂત સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષય અંતર્ભૂખ થઈને સ્વસ્વરૂપ પ્રાપ્તિની વિધિ/કાર્યપદ્ધતિનો છે, અને તે સ્વાનુભવી જ્ઞાનીપુરુષની વાણી સિવાય કયાંય પણ પ્રાપ્ત થવો સંભવિત નથી. સ્વરૂપ-પ્રાપ્તિની વિધિની સૂક્ષ્મતા અને અંતર્દ્ર ધ્વનિની અભિવ્યિ ત એક માત્ર જ્ઞાનીપુરુષની વાણીમાં જ હોય છે, તેવી વસ્તુસ્થિતિ છે. કૃપાળુદેવે આ વિષયમાં (જ્ઞાનીપુરુષની વાણી વિષેના) કેટલાક લક્ષણો પત્રાંક-૬૭૮માં પ્રસિદ્ધ કર્યા છે : તેમાં આત્મભાન કરવાનો આશય, પદાર્થદર્શનને લીધે વિરુદ્ધ સ્વભાવોનું પણ અવિરુદ્ધ નિરૂપણ, આત્માર્થ ઉપદેશકપણું, અપૂર્વ સ્વભાવના અપૂર્વ અર્થનું નિરૂપણ, આત્મજાગૃતિને લીધે સતત જાગૃત કરનાર, શુષ્ણતા રહિત અધ્યાત્મ નિરૂપણ, વાસ્તવિક અને યથાસ્થિત પદાર્થ-નિરૂપણ વગેરે લક્ષણો કૃપાળુદેવે પોતાના સ્વાનુભવમાંથી દર્શાવ્યા છે અને તેથી વર્તમાન નિકૃષ્ટ કાળમાં પણ અખંડ મોકશમાર્ગ જીવંત રહેવા પાય્યો છે.

□ ધર્મ-પ્રવૃત્તિમાં વિચક્ષણતા : શ્રી તીર્થકરદેવનો માર્ગ પ્રકાશવાની શરીર તનું હોવાપણું એટલે કે સામર્થ્ય હોવા છતાં (પત્રાંક-૭૦૮) બીજા જીવોને અંદેશો ઉપજે તેવો બહારમાં પૂર્વ પ્રારબ્ધયોગ હોવાથી તેઓશ્રીએ મૂળમાર્ગનો ઉપદેશ ન કરવો - તેવું અનેક પડખાઓથી વિચારેલું. આ વિષયમાં લખાયેલા પત્રાંક-૫૦૦ અને ૫૮૨ વિશેષ ગવેષણીય છે. પત્રાંક-૬૨૧માં તો લોકોને નુકસાન ન થાય તે દૃષ્ટિકોણથી પણ કૃપાળુદેવે સમાજની વચ્ચે

(— સમજિતપણે) ધર્મ-પ્રકાશકપણે પ્રવૃત્તિ કરી નથી; તેવો ઉલ્લેખ તેઓશ્રીના શઠોમાં આ પ્રમાણે છે : “આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદ્ય હોવાથી ગુણવ્ય તત્ત્વ હોય તોપણ લોકોને ભાસ્યમાન થવું કઠળ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમજ પૂર્વ મહાપુરુષના (નિર્ગ્રથના) અનુકમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય.” તેઓશ્રીની આ વિષયમાં અનેક પડખાઓથી ઘણી સૂક્ષ્મ વિચારણા ચાલી હતી તેનો પુરાવો તેઓશ્રીની હાથનોંધ-૧ (૭૩)માં મળે છે : “એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાકમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાકમ ઘટે છે. તથારૂપ શરીર ત થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી,...” — તથારૂપ શરીર ત પોતામાં હતી, છતાં પણ અનેકવિધ કારણોસર તેઓ ગુપ્ત રહ્યાં હતા. તે માંદેની એક સૂક્ષ્મ વાત, અતિ ગૂઢ વચનોમાં આ જ હાથનોંધ (૧/૭૩)માં જોવા મળે છે : “દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્ત એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્ત તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જો જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની (દર્શનની) રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠળ છે. દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે.”

ઉપરો ત પ્રકારે તેઓશ્રીને માર્ગ-પ્રવર્તનની રીતિ-નીતિના વિષયમાં ઘણા સૂક્ષ્મ ને ગહન વિચારો આવ્યાં છે; અને પરસ્પર વિરોધી પડખાઓનો ડો વિચાર ચાલ્યો છે; તેવું તેઓશ્રીના ઉક્ત વચનોથી સમજાય તેમ છે. તે સર્વના નિષ્કર્ષરૂપે તેઓશ્રીએ સ્વયંની આરાધનાને મુખ્ય કરીને, ગૌણપણે જે જે પાત્ર જીવો જણાયા તેમની વચ્ચે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને, માર્ગ-પ્રવર્તવવાની પ્રવૃત્તિ યથાર્થપણે અને યોગ્યરીતે કરી છે, તેમ સમજાય છે.

સ્વયંના ઉદ્યમાવ અને ઔદ્યિક સંયોગોની પરિસ્થિતિ જોઈને, શાસન પ્રવર્તવવાના અંતરંગ ગુણો હોવા છતાં, શાસનનાયક અથવા ઉપદેશકના સ્થાને રહીને તેઓશ્રીએ ધર્મ-પ્રવૃત્તિ કરી નથી; તે આ વિષયમાં તેઓશ્રીની ડો

વિચારણા અને દીર્ઘદર્શિતા પ્રદર્શિત કરે છે.

“પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ;  
જેણો આપ્યું ભાન નિઃ, તેને સદા પ્રષામ.”

ગુજરાતી સંકીર્તન

— શક્રેય પૂજય ‘માઈશ્રી’ શશીમાઈ



## સૌભ્યમૂર્તિ પૂ. ભાઈશ્રી શશીભાઈનો આધ્યાત્મિક જીવન પરિચય

સામાન્યતઃ કોઈપણ સાધારણ મનુષ્યનો ઇતિહાસ કે જીવનચરિત્ર લખાતું નથી પરંતુ જે સ્વયંના પુરુષાર્થથી સ્વયંનો ઇતિહાસ બનાવે છે અર્થાત્ જન્મ-મરણનો છેદ કરીને જીવનમું ત થાય છે, તેનું જીવન ચરિત્ર લખાય છે અને તેની યશગાથા સમસ્ત લોકમાં પ્રસરે છે. એવા જ એક પુરુષાર્થવંત આત્માનું અર્થાત્ ‘પૂ. ભાઈશ્રી’ નું જીવનચરિત્ર અત્ર પ્રસ્તુત છે.

જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં અનેક તીર્થકરો, આચાર્યો તથા જ્ઞાની ભગવંતો થતા આવ્યા છે. આ કારણથી આ ભૂમિ હમેશા પવિત્ર

રહી છે.  
અનાદિકાળથી  
પરિભ્રમણ કરતા  
અનેક જીવો આ  
ક્ષેત્રથી સાધના  
સાધીને મોક્ષમાં  
પદ્ધાર્યા છે. એવા  
આ ભારત દેશના  
૨૧૩૨૧૭૮-૧૧  
સુરેન્દ્રનગર  
નામના એક  
નાનકડા ગામમાં,  
સંવત ૧૮૮૮ના



જન્મધામ - સુરેન્દ્રનગર (મોસાળ)

માગશાર સુદુર આઠમ, તા-૨૪-૧૧-૧૮૮૮ના મંગલ દિવસે પ્રમાણિક સદ્ગૃહસ્થ શ્રી મનસુખલાલ લઘરચંદ શેઠને ત્યાં આવા જ કોઈ પવિત્ર

આત્માનું આગમન થયું. માતુશ્રી રેવાબહેનની કુખ દીપી ઠી. પ્રભાવશાળી પુરુષના પુનિત આગમનથી કોને હર્ષ ન થાય? અર્થાત્ સર્વને હર્ષ થાય.

વાતાવરણ પ્રકૃતિલિત અને અનેરા પ્રકારના આનંદોલ્વાસથી હર્ષવિભોર થઈ છ્યું છે. ભરત ભૂમિ ફરી એકવાર ગૌરવવંતી બનીને ધન્યતાનો અનુભવ કરી રહી છે. માતા-પિતાના હર્ષનો પાર નથી. બાળકની શાંત અને સૌભ્ય મુખમુદ્રા દેખી તૃપ્તિ થતી નથી. સૌ કોઈ આ આત્માને જોઈને અનેરી શાંતિ અનુભવે છે. અનંત તીર્થકરો જે માર્ગ ચાલ્યા એ માર્ગ ચાલવા આ શૂરવીર આત્માએ આગમન કર્યું છે. અહો! ધન્ય છે આ ભૂમિને! અને ધન્ય છે આ માતા-પિતાને! ફરીથી જન્મ ધારણા ન કરવો પડે એ અર્થે જેણે જન્મ ધારણા કર્યો છે. ચંદ્રની ચાંદની જેમ શીતળતા રેલાવે છે અને ભૂમિને શેત કરે છે, તેમ ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુળ થઈને જાંઝવાના જણને લેવા દોડતા લેખિત આત્માઓને શીતળતા પ્રાપ્ત કરાવનાર અને દોષોની કાલિમાને ધોઈ પવિત્ર અને શેત દશા પ્રાપ્ત કરાવનાર આ બાળકનું નામ ‘શશીકાંત’ રાખવામાં આવ્યું.

### (૧) બાળપણા :

મૂળ વતન રાણપુરમાં બાળકુમાર શશીકાંતની નયનરથ્ય ચેષ્ટાથી સૌ કોઈ મનોમન મલકાઈ રહ્યાં છે. સ્વયંની નિર્દોષ ચેષ્ટાથી લોકોના મન હરનાર બાળકુમારનું જીવન આનંદી વ્યતીત થઈ રહ્યું છે. અત્યારથી જ આ બાળકુમાર નીડર, પાપભીરુ, ગુણગ્રાહી, સ્વતંત્ર વિચારક તથા આદર્શ વિચારધારા ધરાવે છે. પ્રથમથી જ અસાધારણ બુદ્ધિમતાને કારણે શાળામાં પ્રાય: પ્રથમ અથવા



રાણપુરનું ધર જ્યાં બાળપણ વ્યતીત થયું

દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ૮-૧૦ વર્ષની વયે તેમના દાદાજી દ્વારા તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. વૈશ્વ કુટુંભમાં જન્મ થયો હોવાને કારણો રામાયણ, ગીતા, મહાભારત, ભાગવત વગેરે ગ્રંથો વાંચે છે. પાણીના પુરની જેમ ચાલી રહેલી સ્મરણ શર્ટ તના કારણો જોતજોતામાં શ્રીમદ્ ભાગવત ગીતાના બે-ત્રણ અધ્યાયોના સંસ્કૃત શલોકો કંઠસ્થ કરી લીધાં છે. બાળકુમાર પ્રત્યેક કાર્ય ચુસ્તતાથી તથા દૃઢ મનોબળથી કરે છે. આ તો અલૌકિક આત્મા, આત્માની સાધના સાધનારા છે તે સાધારણ બાળકોની કોટિમાં કઈ રીતે આવી શકે ? બાળકુમારની ચુસ્તતા તથા દૃઢ મનોબળના દર્શન આપણે નિઝનલિખિત પ્રસંગ ઉપરથી જોઈએ.

ઉનાળાના દિવસો છે, કાળજાળ ગરભી રેલાવતો સૂર્ય આકાશમાં તપી રહ્યો છે. આવા અતિશય પ્રખર તાપમાં નિશાળમાં આર. એસ. એસ. પરેડ ચાલી રહી છે. પરેડ દરમ્યાન અત્યંત તૃધાને કારણો કંઠ સુકાઈ રહ્યો છે છતાં નિયમોનું પાલન ચુસ્તપણો કરવાનું હોવાથી બાળકુમાર કંઈપણ બોલતા નથી. એકબાજુ ધોમધખભતો તાપ, બીજી બાજુ કડકપણો ચાલી રહેલી પરેડ, સુકાઈ ગયેલો કંઠ જાણો કે પાણીના બિંદુ માટે પોકાર કરી રહ્યો છે, તેવામાં પરેડ પુરી થવાની જ્યાં તૈયારી થાય છે ત્યાં બાળકુમાર ચક્કર ખાઈને નીચે પડી જાય છે. જુઓ ! બાળકુમારની ચુસ્તતા અને દૃઢ મનોબળ !!

કુમાર શશીકાંતની સ્વતંત્ર વિચારધારા તથા અનુભવ પ્રધાનતાના દર્શન પણ અત્ર કરવા યોગ્ય છે. ૧૪ વર્ષની ઉમર છે, યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી જેવા મહાપ્રતાપી સત્પુરુષ રાણપુરમાં પદ્ધાર્યા છે. કુમાર શશીકાંતને આત્મકલ્યાણકારી મંગળ પ્રવચનનો સાંભળવાની ઉત્કંઠા થાય છે અને પ્રવચન સાંભળવા જાય છે. પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી ફરમાવી રહ્યાં છે, ‘જુઓ ! આત્મામાં જ્ઞાન



બાળકુમાર શશીકાંત (ઉમર વર્ષ-૧૪)

સ્વયં થઈ રહ્યું છે. આ જ્ઞાન વાણીથી ઉત્પત્ત થતું નથી કે ગુરુથી પણ ઉત્પત્ત થતું નથી. આપમેળે જ ઉત્પત્ત થયા કરે છે'. આ વાત સાંભળતી વખતે 'જુઓ' શબ્દનો પ્રયોગ થયો હોવાથી, કુમાર શરીકાંત અંદર જુએ છે અને તેને પણ એમ લાગે છે કે 'ખરેખર, મારું જ્ઞાન પણ સ્વયં સહજ ઉત્પત્ત થઈ રહ્યું છે'. જુઓ ! પૂર્વ સંસ્કારને કારણો અનુભવ પદ્ધતિ કેવી રીતે જાગૃત થાય છે ! આવા-આવા અનેક સદ્ગુણો ધરાવનાર કુમાર યૌવન અવસ્થામાં પ્રવેશ કરે છે.

## (૨) યુવાવસ્થા :

અસાધારણ બુદ્ધિમત્તાને કારણો ખૂબ-ખૂબ ભાગવાના વિચારો આવે છે અને એફ. આર. સી. એસ. (લંડન) ડૉ. ટૃ થવાની બળવાન મહત્વાકાંક્ષા સેવાય છે. પરંતુ પ્રારબ્ધ કંઈક જુદુ જ હોવાને કારણો અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાને કારણે યુવાવયમાં પ્રવેશ થતાં મેટ્રોકનો અભ્યાસ પૂર્ણ કરી પિતાજીના વ્યવસાયમાં જોડાવું પડે છે. તેની કાર્યકુશળતા, બુદ્ધિમત્તા અને પ્રમાણિકતા જોઈને તેમના એક સ્નેહીએ મુંબઈ જેવા મોટા ક્ષેત્રમાં જવાની પ્રેરણા આપી અને મુંબઈમાં એક મોટા કમીશન એજન્ટને તાં નોકરીએ રહી જાય છે.

આ અરસામાં મુંબઈમાં નોકરી દરમ્યાન વિરમગામના શ્રી દોશી ક્રીરચંદ લક્ષ્મીચંદના પુત્રી, ચંદ્રાવતી સાથે સગપણ થયું. આ દિવસોમાં જ પાંડુરંગ શાસ્ત્રીજીને સાંભળવાનો પ્રસંગ પણ થાય છે અને તત્વજ્ઞાન સંબંધીનો રસ જાગૃત થયો. મહાત્મા નિશ્ચલદાસજી કૃત શ્રી વિચારસાગર ગ્રંથ વાંચવાનું બન્યું. આ વાંચનથી તત્વવિચાર તથા મંથન તીવ્રતાથી ચાલવા લાગ્યું. આવી અંતરંગ પરિસ્થિતિમાં સમ્યકજ્ઞાનને અનુસરતો એક દાઢિકોણ સાધ્ય કરવાનો અભિપ્રાય થાય છે કે 'કોઈપણ પ્રસંગે મારી તે પરિસ્થિતિ અંગેનો નિર્ણય યથાર્થ પ્રકારે લેવાય તેવો દાઢિકોણ મારે પ્રાપ્ત કરવો જોઈએ' આ વિષય ઉપર નિરંતર ચિંતન તથા મંથન ચાલ્યા કરે છે.


પ્રથમથી જ આદર્શની મુખ્યતારૂપ વિચારધારા, તત્વજ્ઞાનનો રસ, કુળધર્મનો અપક્ષપાત, મધ્યસ્થતા, સાંપ્રદાયિક ધર્મ પ્રત્યેના આકર્ષણનો તથા

અંધશ્રદ્ધાના અભાવરૂપ સદ્ગુણો સાથે જૈન દર્શન પરતવે યા પ્રકારે આકર્ષણાથ્યું તે પણ અત્ર હષ્ટવ્ય છે.

એક વખત મુંબઈમાં પેઢી ઉપર બેઠા છે, તેવામાં સાથે કામ કરવાવાળા એક સદ્ગૃહસ્થ આવી, હાથ જોઈને ક્ષમા માગે છે. ત્યારે આશર્ય સાથે ક્ષમા માંગવાનું કારણ પુછે છે અને ત્યારે જાણવા મળે છે કે જૈન ધર્મમાં આ પ્રકારે આખા વર્ષ દરમ્યાન જો કોઈપણ પ્રકારે એક-બીજા પ્રત્યે દોષ થયો હોય તો તેની ક્ષમા માંગવામાં આવે છે. આનંદાશર્ય સાથે જૈનદર્શન પ્રત્યે અહોમાવ જાગે છે અને આકર્ષણાથાય છે અને રાણપુરના બાળપણનો દિવસ યાદ આવે છે; ત્યાં

પણ જૈન ધર્મના ધરમાં કેવા પ્રકારની રીતિ-નીતિ હોય છે તે તાદૃશ્ય થાય છે. અગાઉ રાણપુરમાં એક દિવસ એક જૈન ધર્મના ધરમાં જવાનો પ્રસંગ

ભો થયો હતો. ત્યાં છાણા ભેગા કરેલા હતા તેમાંથી રસોઈના કામ અર્થે છાણા કાઢવામાં આવે છે અને તાપણાંમાં મુક્તા પહેલા ખંખેરીને જુઓ છે કે કોઈ જીવાત આદિ તો નથી ? આ જોઈને એમ થયું હતું કે જૈન દર્શનમાં નાનામાં નાના જીવની હિંસા ન થાય તેની પણ કેટલી કાળજી રાખવામાં આવે છે !! અહો ! પુત્રના લક્ષણ પારણાંમાંથી એ કહેવત અનુસાર જેમના થકી સમસ્ત જિનશાસનની પ્રભાવના થવાની છે એવા આ પવિત્ર આત્માને ગુણ પ્રત્યે પ્રમોદ આવે છે. આમ જૈનદર્શન અને કુળધર્મને તુલનાત્મક દર્શિકોણથી જોવાનું સહજ બને છે. મુંબઈમાં અતિશય કામકાજનું દબાણ તથા સખત પરિશ્રમના કારણો સ્વાસ્થ્ય કથળે છે અને મુંબઈ છોડી દઈ ભાવનગર આવે છે અને ભાવનગરમાં એક સબંધીની પેઢીમાં નોકરીએ રહી જાય છે.



ઉભર વર્ષ - ૧૯

પરંતુ ભાવનગરમાં તત્ત્વજ્ઞાનના રસને પોષણ નહીં મળતું હોવાને કારણો તેની ક્ષતિ લાગ્યા કરે છે. કોઈ સત્તસંગ નથી મળતો, કોઈ તત્ત્વજ્ઞાનની વાત કરવાવાળું પણ નથી દેખાતું તે કારણો મન ઉદાસ રહ્યા કરે છે. પરંતુ જેનો આત્મા ખરેખર આ પરિભ્રમણથી છૂટી જવાનો છે તેનાથી સત્ય કેટલા દિવસ દૂર રહી શકે ? શું ભાવના સાથે કુદરત બંધાયેલી નથી ? અવશ્ય બંધાયેલી છે.

### (૩) દિશાબોધ :

સત્તસંગનો અભાવ, સ્વયંના તત્ત્વજ્ઞાનના રસને નહીં મળતું પોષણ, સત્યની શોધ અને સુખથી વંચિત અંતરંગ અતૃપત પરિણાતિ, આવી અંતરંગ પરિસ્થિતિ વચ્ચે, વિધિની કોઈ ધન્ય પળ આવે છે. એક દિવસ પેઢી ઉપર બેસીને કામ કરી રહ્યાં છે. ત્યાં બાજુમાં પડેલા એક ગ્રંથ ઉપર નજર જાય છે અને ગ્રંથનું નામ વાંચે છે - 'શ્રીમદ્ રાજચંદ્'. જૈન દર્શનમાં પ્રવેશ થવાનું પહેલું નિમિત્ત કારણ બની ગયું. મું ત થવાની દિશાના મંડાણનો પ્રથમ મંગલ પ્રસંગ બન્યો. જિજાસા સાથે ગ્રંથના પાના ફેરવી જોતાં લાગ્યું કે કોઈ તત્ત્વજ્ઞાન વિષયક ગ્રંથ છે. ગ્રંથનો વિશેષ અભ્યાસ કરતાં લખનાર એવા કુ. દેવ શ્રીમદ્ રાજચંદ્ના વચ્ચનામૃતોથી પોતે પ્રમાણિત થાય છે. તેમની મધ્યસ્થતા જોઈને હદ્ય પ્રકુલ્પિત થઈ ઉઠ્યું. તત્ત્વજ્ઞાનના રસને પોષણ મળ્યું, અંતરંગ અતૃપત પરિણાતિને જાણો કે વિશ્રાંતિનું સ્થાન મળ્યું !!

આ ગ્રંથ વાંચતા એવી પ્રતીતિ થાય છે કે જૈન દર્શનમાં જીવ અને જડ પરમાણુનું વિજ્ઞાન છે અને બત્તે પદાર્થોમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધે જે અસર ઉત્પત્ત થાય છે તેનાથી જીવમાં સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી જાય તો હંમેશાને માટે બહુ મોટું કામ થઈ જાય. આ અપેક્ષાથી જૈન દર્શનમાં ડા ઉત્તરવાનો અન્યાન્ય રસ ઉત્પત્ત થયો. ગુણ-દોષની ચર્ચા, પદાર્થની વैજ્ઞાનિક દાખિયોજાથી નાય, પ્રમાણાની પદ્ધતિથી સુલ્યવસ્થિત પ્રતિપાદન કરવાની પદ્ધતિ જોઈને જૈન દર્શનની સર્વोત્કૃષ્ટતા હદ્યમાં અંકિત થઈ ગઈ. અનંત કાળથી ચાલી રહેલા જન્મ-મરણ અને તે દરમ્યાન થતાં દુઃખ અને લેશથી છૂટવાનો એકમાત્ર ઉપાય

આત્મજ્ઞાન છે, આ વાત ઉપર ધ્યાન જાય છે. આ કારણથી ગમે તેમ કરીને કોઈપણ આત્મજ્ઞાનીના સાત્ત્વિક્યમાં રહીને પોતાના પ્રત્યેક પરિણામોનું નિવેદન કરીને માર્ગદર્શન મેળવવું એવો સૌ પ્રથમ મંગલ વિચાર ઉદ્ભવે છે. કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સત્સંગના મહત્વ અંગેના વિચારો યથાર્થ પ્રકારે સમજાયાથી સત્સંગ અર્થે તીવ્ર ભાવના રહ્યા કરે છે અને ‘જ્યાં ચાહ છે ત્યાં રાહ છે’ એ અનુસાર ભાવના ફળો છે અને ભાવનગરમાં એક ધર્મપ્રેર્ણી મુમુક્ષુને ત્યાં સત્સંગની સુમંગલ શરૂઆત થાય છે.

#### (૪) નિજ પરમાત્માના વિયોગની વેદના તથા જુરણા :

કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અત્યંત ગાહન અવગાહન ચાલે છે અને સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી શકે એમ છે તેમ દેખાતાં હદ્ય પ્રતિદિન આ સમસ્યાને ઉકેલવા માટે તે- તે ઉત્તરવા લાગ્યું. સત્ય સુખ


યાં છે ? દુઃખની નિવૃત્તિ કેમ થાય ? સર્વ પ્રકારના દોષથી કઈ રીતે નિવૃત્ત થવાય ? જન્મ-મરણ શા માટે ? જન્મ-મરણનો આત્યંતિક વિયોગ

યા પ્રકારે થાય ? આવા-આવા અનેક પ્રકારના પ્રશ્નો માનસપટ પર છવાયેલા રહે છે. આવી અંતરંગ પરિસ્થિતિ

વચ્ચે સત્સંગની શરૂઆત થઈ અને રોજ પરોઢિયે ચાર વાગે સત્સંગ અર્થે જવાનું શરૂ થયું. એક બાજુ કૃ. દેવના ગ્રંથનું અધ્યયન અને બીજી બાજુ અંતરંગમાં આવી પરિણામોની સ્થિતિ !

સવારે ૪ વાગે એકાંતનો સમય છે. કડકડતી ઠંડીમાં જ્યાં સમસ્ત વિશ્વ ભાવનિક્રાન અને દ્રવ્યનિક્રામાં પોઢી રહ્યું છે ત્યાં જન્મ-મરણનો ઉકેલ શોધવા નીકળેલો આ આત્મા ધીર, ગંભીર અને ધીમી ચાલથી ચાલતાં-ચાલતાં સત્સંગમાં જઈ રહ્યો છે.

બાજુના ગામડામાંથી અડધી રાત્રે રવાના થઈ એક ખેડુત ગાડુ લઈને ઉકરડો



નિજ સ્વરૂપના વિયોગવશ

ઉદાસીનતા

(ભાતર) ભેગો કરવા માટે ચાલ્યો આવે છે. આ જોઈને વિચાર આવે છે કે આવી તુચ્છ વસ્તુ માટે પણ આ ખેડુત કેટલી પ્રતિકુળતા અને પરિશ્રમ વેઠે છે તો પછી હું તો જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય કરવા નિકળ્યો છું; તે માટે આથી વધુ કોઈપણ કિમત ચુકવવી પડે તો તેમાં શું વિશેષતા છે ? બસ ! પછી તો આવી મંગલ વિચારધારા વચ્ચે આંખમાંથી ચોધાર આંસુની ધારા વહી રહી છે કોઈ રોકવા ચાહે તો રોકી શકાય નહિ એવી હદ્ય દ્રાવક વેદના વચ્ચે અંતરંગ શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલે છે. હદ્યમાંથી તીવ્ર વેદના સહિત ધ્વનિ નીકળી રહ્યો છે,

“હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ,  
હું તો દોષ અનંતનું, ભાજન છું કરેકાળ  
અનંત કાળથી આથડચો, વિના ભાન ભગવાન  
સોવ્યા નહિ ગુરુ સંતનો, મૂકવું નહિ અભિમાન  
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંચા  
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંચા ?”

નિજ દોષનો અત્યંત પશ્ચાતાપ થયા વિના પવિત્રતાની શરૂઆત થતી નથી. એ સિદ્ધાંત અનુસાર અનંત કાળથી ચાલ્યા આવતા નિજ દોષનો અત્યંત તીવ્ર પશ્ચાતાપ અને નિજ પરમાત્મ સ્વરૂપના વિયોગની વેદનાથી આ આત્માનું હદ્ય હમેશા રહ્યા કરે છે. સંસારની ઉપાસનાના અભિપ્રાયથી મલિન રહેતું અંતઃકરણ આ વેદનાથી શુદ્ધ થાય છે.

#### (૫) પૂર્ણાતાનું લક્ષ :

ઉપરો ત વેદનાને કારણે ઉત્પત્ત થયેલી ઉદાસીનતાથી યાંય રસ નથી આવતો. જીવન રસવિહીન થઈ ગયું. એકમાત્ર આત્મકલ્યાણ કેમ થાય ? બસ ! એક જ વાતના પાયા શોધાઈ રહ્યા છે. અંદરમાં અનેક પ્રકારની લૌકિક મહત્વકાંક્ષાઓ અને બાહારમાં નબળી આર્થિક કૌટુંબિક પરિસ્થિતિ વચ્ચે સૌ પ્રથમ ભૌતિક જીવનની સર્વ મહત્વકાંક્ષાઓનો હદ્યમાંથી ત્યાગ કરે છે. એક પણ માટે સામે આવતા ભવિષ્યના વિચારને જોરથી લાત

મારી, ફગાવી દઈ શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ કરી લેવાનો દઈ નિર્ધાર જન્મ લે છે અને અંતરંગમાં આવા મહાન કાર્યના પુરુષાર્થમાં આ આત્મા પરોવાઈ જાય છે. અહો ! કેવો અદ્ભુત સંવેગ પ્રગટ થયો છે !! જેમ વાદળા જોઈને સૂર્ય પાછો ફરતો નથી અને નદીનું જળ, વચ્ચે પડેલા પત્થરને બેઢી આગળ વધે છે, પાછુ જતું નથી. તેમ ધસમસતા પ્રગટ થતાં નિર્ધાર સહિતના આ પરિણામોને હવે વિશ્વની કોઈ તાકાત રોકી શકે ખરી ?

જીવન સમક્ષ ઈ ત એક જ લક્ષ / ધ્યેય અને સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના કરવા જતાં ભલે અનેક પ્રકારની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે તો પણ આત્મકલ્યાણ કરી જ લેવું છે. એમ વારંવાર આવ્યા કરે છે. અસાધારણ નિશ્ચય શર્ટ ત અને પરમાર્થને પ્રતિકૂળ પ્રિયજનોનાં અભિપ્રાય સામે અડગ રહેવાની અને જગ્યુમવાની તાકાત અંદરથી સ્હુરાયમાન થઈ રહી છે. નાહિંમત નહિ થવાની લોખંડી વજ જેવી હિંમત અને છતાં નિર્દોષ વૃત્તિ સાથે અનાદિ અજ્ઞાન અંધકારને ભેદવા માર્ગની શોધ ચાલી રહી છે. આવા અસાધારણ નિશ્ચય સાથે આગળ વધતો આ આત્મા મૂંજવણથી મૂંજાતો પણ નથી અને પ્રમાદ પણ નથી થવા દેતો. અત્યંત ધીરજ અને ગંભીરતા સાથે માર્ગને ગ્રહણ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.

જુઓ ! કેવા અસાધારણ ગુણો પ્રગટ થયા છે ! મુમુક્ષુતા દૈદીઘ્યમાન થઈને જળકી રહી છે. જેને છૂટવું જ છે તેને બાંધનાર કોઈ નથી. ! એ સિદ્ધાંત અનુસાર આ આત્માના આવા અદ્ભુત ગુણો જોઈને હદ્ય નમી પડે છે. અનંતકાળમાં જે સત્પાત્રતા પ્રાપ્ત થઈ નહોતી તે સત્પાત્રતા પ્રગટ થઈ. સમ્યાદર્શનને રાખવાનું પાત્ર તૈયાર થઈ ગયું !!


#### (૬) નિજ દોષનું અપક્ષપાતપણો અવલોકન :

નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબુલાત છે'. એ સિદ્ધાંત અનુસાર અડોલ વજ જેવી હિંમત સાથે નિર્દોષ થવા નિકણેલો આ આત્મા સ્વયંના દોષોનું અપક્ષપાતપણો અવલોકન કરે છે અને તે દોષને ટાળવા અર્થે અમલીકરણ પણ કરે છે. કૃ. દેવના ગ્રંથનું ગહન ચિંતન તથા મંથન ચાલી રહ્યું છે. જે તે વાતનો નિશ્ચય કરવા અર્થે પરિણામના

અવલોકનપૂર્વક પ્રયોગ પદ્ધતિથી કાર્ય કરવાનું શરૂ થયું. જુઓ ! કેવી આત્મહિતની સૂજ આવી છે ! અંદરથી જ અનુભવપદ્ધતિથી કાર્ય કરવાની આવી સૂજ મોકાથીને જ આવી શકે. બહારમાં કૃ. દેવના ગ્રંથ દારા મળતું માર્ગદર્શન અને અંદરમાં પ્રયોગ પદ્ધતિથી અનેક પ્રકારના પૂર્વગ્રહ તથા વિપર્યાસો મોળા પડવા લાગ્યા. આમ સતત અપક્ષપાતપણે દોષોનું અવલોકન ચાલતાં અંદરમાં જ્ઞાનની નિર્મળતા વધતી ચાલી.

### (૭) સત્પુરુષમાં પરમેશ્વરભૂષિ :

તારણાહાર કૃ. દેવના આત્મકલ્યાણના હેતુભૂત માર્ગદર્શનનું મૂલ્યાંકન અતીશયપણે વધતું ચાલ્યું. ઉપકારી શ્રીગુરુની છબીમાં પરમાત્માના દર્શન થતાં તેમના ભૌતિક દેહની છબીમાં મનુષ્યાકૃતિની આકૃતિ ગૌણ થઈને ભાવાત્મક પરમાત્માના દર્શન થતાં હદ્ય અશ્રુભિનું થઈ ઠ છે. અનંતકાળથી રજણપાટ કરતાં આ



ભૌતિક દેહની છબીમાં મનુષ્યાકૃતિની આકૃતિ ગૌણ થઈને ભાવાત્મક પરમાત્માના દર્શન થતાં હદ્ય અશ્રુભિનું થઈ ઠ છે. અનંતકાળથી રજણપાટ કરતાં આ

આત્માને તારવા અર્થે જ જાણો કે આ ગ્રંથની રચના થઈ હોય તેમ વારંવાર લાગી આવે છે. આમ કૃ. દેવને માત્ર એક સત્પુરુષની નજરે નહીં જોતા એક તારણાહાર પરમાત્માની નજરે જોઈ રહે છે. હદ્યમાંથી ધ્વનિ સરી પડે છે અહો ! આ પુરુષ આવા વિષમકાળમાં મારે માટે પરમ શાંતિના ધામરૂપ અને કલ્પવૃક્ષ સમાન છે. અહો ! મારે માટે તો આ બીજા શ્રીરામ અને મહાવીર છે. આમ કૃ. દેવની ભર્તા તમાં લીન થઈને તેમના લક્ષણોનું ચિંતન ચાલે છે અને તેઓશ્રીની મુખાકૃતિનું હદ્યથી અવલોકન કરે છે. અહો ! જ્ઞાનીઓએ હદ્યમાં રાખેલું અને નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય પરમ રહસ્યને પ્રાપ્ત થાય છે.

એક મરણથી બચાવે તેના પ્રત્યેનો ઉપકાર પણ વિસ્મૃત થતો નથી

તો પછી જે અનંત જન્મ-મરણથી બચાવે તેના પ્રત્યે શું પરમેશ્વરબુદ્ધિ ન આવે ? અર્થાત્ પરમેશ્વરબુદ્ધિ આવે જ. સર્વ શાસ્ત્રોનો અને સર્વ સંતોના હદ્યના મર્મરૂપ બીજની પ્રાપ્તિ થઈ અર્થાત્ પ્રથમ સમકિત પ્રાપ્ત થયું. આવા પ્રકારના પરિણામોથી જ્ઞાનમાં નિર્મળતા આવવા લાગી, આત્મરૂપિ તીવ્ર થતી ગઈ અને અંદરથી આત્માને અનંતકાળમાં નહીં આવેલી તેવી અપૂર્વ જાગૃતિ આવી. આ જાગૃતિ અપૂર્વ છે એવી ચોક્કસ પ્રકારની પ્રતીતિ આવે છે.

#### (૮) અંતર ખોજ :

ઉપરો ત પ્રકારના નિર્મળ પરિણામોની સાથે-સાથે આત્મરૂપિ તીવ્ર થતી જાય છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા વશ ઉત્પત્ત વૈરાગ્ય એક નવા તબક્કામાં પ્રવેશ કરે છે. નિજ પરમાત્મસ્વરૂપની અંતર ખોજમાં આ આત્મા એટલો બધો ખોવાયેલો રહે છે કે બહારના વ્યવહારમાં તથા ખાવા-પીવા ઇત્યાદિ નિત્યકમમાં ઘ્યાલ પણ રહેતો નથી. વૈરાગ્યને કારણો ઉદાસીનતા એટલી બધી આવી ગઈ છે કે જમતી વખતે શું જમે છે ? તેનો ઘ્યાલ નથી રહેતો. જમવામાં કઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે ? તેનો પણ ઘ્યાલ નથી રહેતો. પહેરવશ અને બીજી રહેણી-કરણીમાં એટલી બધી સાદાઈ આવી ગઈ છે કે ધરના લોકોને એવી દહેશત થાય છે કે આ જૈન ધર્મની દીક્ષા લઈ લેશે કે શું ? અહો ! ધન્ય છે તે ઉદાસીનતાને !

આત્મ સાધના કરવા નીકળેલા આવા આત્માને સંસારમાં શું રૂચે ? જેમ હંસને મોતીના ચારામાં જ રસ હોય છે તેમ આવા સાધક આત્માને નિજ સ્વરૂપ સિવાય બીજે યાંય રસ નથી આવતો. સુખની સહેલી અને અધ્યાત્મની જનેતા જ્યાં છે ત્યાં સત્ય સુખ અને આત્માનુભવ કેટલા હિવસ દૂર રહી શકે ? અર્થાત્ એ તો હવે પ્રગટ થવાના જ છે.

#### (૯) સ્વરૂપ નિશ્ચય :

અહો ! જેના આધારે અનંત કાળનું સુખ પ્રાપ્ત થવાનું છે, જેના આધારે અનંત કાળથી ચાલી આવતી જન્મ-મરણની શુંખલા તુટવાની છે, જેના આધારે અતૃપ્ત આત્મા પરિતૃપ્તતાને પામવાનો છે એવા નિજ સ્વરૂપ

પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવશ ઉત્પત્ત વૈરાગ્ય તથા ઉદાસીનતાથી આ આસત્ર ભવ્ય જીવના જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. જ્ઞાનમાં સ્વભાવ તથા વિભાવ જીતિની પરખ કરવાની ક્ષમતા પ્રગટ થઈ છે. સર્વ પ્રકારના વિભાવભાવ આકુળતારૂપ, મહિનતારૂપ અને વિપરીત સ્વરૂપે ભાસે છે. ચાલતા જ્ઞાન સાથે વિભાવભાવની વારંવાર મિંઠવડી ચાલે છે અને આ પ્રકારે મિંઠવડી ચાલતાં જ્ઞાન તદ્દન અનાકુળ, પવિત્ર અને અવિપરીત સ્વભાવે ભાસે છે. આમ અંતર ખોજ સાથે ચાલતા અવલોકનથી જીતિની પરખ આવવી શરૂ થાય છે. ત્યાં તો, કૃ. દેવ શ્રીમદ્ રાજયંકળના સાતિશય વચન યોગને ઉજમાળ કરતો એ ધન્ય દિવસ આવી પહોંચ્યો ! કે જે દિવસે નિજ પરમાત્માનો અંતરંગમાં સ્પષ્ટપણે પતો લાગી ગયો. ચાલતા જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન સામાન્ય / વેદનના આધારે અખંડ એકરૂપ અનંત જ્ઞાન અને અનંત સુખના સામર્થ્યરૂપ સહજ સ્વરૂપનું ભાવભાસન આવ્યું. લૌકિક સમુક્રને તો તળિયું હોય છે પરંતુ આ તળિયા વગરના નિજ સુખ સમુક્રને જોતાં અને અનંત ગુણ રત્નોની નિધિને જોતાં પુરુષાર્થે ઉછાળો ખાયો. નિજ સિદ્ધપદનું સાક્ષાત અસ્તિત્વ ગ્રહણ થવાથી નિજ સ્વરૂપનો અપૂર્વ મહિમા ચાલુ થઈ ગયો અને ગુણ નિધાનની અનન્ય રુચિનો ઉછાળો સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થપૂર્વક આવવા લાગ્યો. જેના કારણો ઉદ્યમાવમાં જતો ઉપયોગ વારંવાર છટકી-છટકીને સ્વરૂપ ભણી આવવા લાગ્યો.

આ પ્રક્રિયા દિન-પ્રતિદિન વેગ પકડે છે. સંવેગ તથા નિર્વેદ બતે પ્રકારના પરિણામના અપ્રતિમ જોરના કારણે, સ્વરૂપલક્ષના પરિણામપૂર્વક નિજ પરમાત્મપદની ધૂન ચરી ગઈ અને પુરુષાર્થનો વેગ ફાટફાટ થવા લાગ્યો. જાણો કે અંદરથી પુરુષાર્થનો બંબો ન ફાટ્યો હોય ! અનંત કાળથી સુખને અર્થે બહારમાં ભટકતા ઉપયોગને વિશ્રાંતિનું સ્થાન મળી ગયું. જન્મ-મરણની જટીલ સમસ્યાનો ઉકેલ આવી ગયો. પછી તો વિશ્વની એવી કોઈ શર્ત ત નથી કે જે આવા પુરુષાર્થને રોકી શકે કે ઉપયોગને નિજ પરમાત્માથી અન્ય રાખી શકે. નિજ સ્વરૂપથી અન્ય - જુદી નહિ રહી શકવાને કારણો વર્તમાન પર્યાયે સ્વરૂપ સાથે અનન્ય થવા અર્થે પુરી શર્ત તથી પુરુષાર્થ

---

ઉપાડ્યો.

### (૧૦) આત્મ સાક્ષાત્કાર :

આજ અરસામાં શ્રી દીપચંદજી કાસલીવાળ કૃત ‘અનુભવ પ્રકાશ’ ગ્રંથ હાથ આવે છે. તેમના લખાયેલા વચન અનુસાર સ્વરૂપ લક્ષ સહિત ભેદજ્ઞાનનો પ્રયોગ ચાલી રહ્યો છે. ‘અનુભવ પ્રકાશ’ ગ્રંથના ગણન અભ્યાસપૂર્વકનું રસાસ્વાદન કરી જેમ એક પાણીદાર અશ્ચ તેના માલિકના ઓક જ ઇશારાથી પવનવેગે દોડવા લાગે છે તેમ આ પૂર્વ સંરક્ષારી આત્માને અંતરંગ પરિણામનમાં અપ્રતિહતભાવે પુરુષાર્થની ધારા શરૂ થઈ ગઈ છે.

૨૧ વર્ષની ઉમર છે. બહારમાં સાવ સામાન્ય ટેખાવ હોવા છતાં અંદરમાં આ આત્માને નિજ પરમાત્મ પદનો પતો લાગી ગયો છે તે કોઈથી કણી શકતુ નથી. ૧૦૦ રૂ. ના પગારની નોકરી કરતા આ આત્માને એમ લાગતું કે હું પરમેશ્વર છું અને ત્રણ લોકનો નાથ છું. અંતરંગ પરિણાતિ પલટી ગઈ. સ્વરૂપ સંમુખતાના પુરુષાર્થ પૂર્વક ભેદજ્ઞાન ધારાવાહીરૂપે ચાલી રહ્યું છે.

પૂર્વ કર્મ અનુસાર શુભાશુભ ભાવ અને કમશા: ઉદ્ય પ્રસંગ છે; તે સર્વથી હું જ્ઞાનમયપણે હોવાને લીધે બિનન છું. તેમ સમભાવે - સ્વને જ્ઞાનરૂપે વેદવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. ક્ષણો-ક્ષણો, પ્રસંગો-પ્રસંગો આ પ્રકારનો અભ્યાસ ચાલી રહ્યો છે. જ્ઞાનમાં સ્વ અસ્તિત્વનું ગ્રહણ વેદનથી થતાં ચિદ્રસ ઉત્પત્ત થાય છે. આ ચિદ્રસ પરિણાતિમાં સહેજે જઈને ભણે છે. પરિણાતિ ઉપયોગને વારંવાર પોતા તરફ ખેંચી લાવે છે. આ પ્રકારના વારંવારના ભેદજ્ઞાનના અભ્યાસથી નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ઉત્પત્ત થયો અને આત્માના પ્રદેશો-પ્રદેશેથી સ્વસંવેદનજ્ઞાન અને અપૂર્વ આનંદનો અનુભવ થયો. જન્મ-મરણની શુંખલા તૂટી ગઈ, પરિણાતિમાં આનંદના પૂર ઉમટ્યા અને અનાદિકાળથી કર્તૃત્વના બોજ નીચે દબાયેલી પરિણાતિ મુશ્કેલી નીચે અનુભવ કરવા લાગી. અનુપમ અમૃત આસ્વાદથી પરિણાતિ તૃપ્ત થઈ.

અહો ! ધન્ય છે આ અજોડ પુરુષાર્થને !

ધન્ય છે આ પવિત્ર સાધનાને !

(૧૧) યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી તથા અન્ય ધર્માત્માઓનો સમાગમ :

સુવર્ણપુરી - સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી દારા ઉપાદિષ્ટ પ્રવચનોનું સંકલન કરતા માસિક 'આત્મધર્મ' ના ૪-૫ અંકો એક મુમુક્ષુ ભાઈ પાસેથી મળતાં તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો સાંભળવાનો પ્રથમ પ્રસંગ બને છે ત્યારે સાથે રહેલા મુમુક્ષુ દારા તેમની વૈશ્વ તરીકેની ઓળખાણ આપવામાં આવે છે. આ સાંભળી પૂ. ગુરુદેવશ્રી બોલ્યા 'અહીંયા તો અમારે કોઈ જૈન કે વૈશ્વ નથી. અમારી દાખિલાં તો બધા જ આત્માઓ છે' તેઓશ્રીના સમદાચિત્ભર્યા વચ્ચનોથી આકર્ષણ થયું અને ત્યાર પછી તો અવાર-નવાર પૂ. ગુરુદેવશ્રીને સાંભળવાનો પ્રસંગ ચાલુ રહ્યો. પ્રથમ ૪-૫ પ્રવચનો પરિક્ષાદાષ્ટિ અને ચિકિત્સાવૃત્તિથી સાંભળીને એવા નિર્ણય પર આવ્યા કે 'આ તો કોઇનુર હીરો છે'. તેઓશ્રીને આત્મજ્ઞાની તરીકે સ્વીકારીને વધુમાં વધુ સત્તસંગ મળે એવી ભાવના રહે છે. પૂ. ગુરુદેવશ્રીનો જિનમાર્ગ પ્રભાવનાનો ઉદ્ય જોઈને માર્ગ પ્રભાવના માટે અભિપ્રાયપૂર્વક એવા ભાવ થાય છે કે આ અલૌકિક જગત ડિતકારક માર્ગની પ્રભાવના થતી હોય તો તે પ્રભાવના પેટે પાટા બાંધીને પડા કરવી જોઈએ. જુઓ ! કેવી અદ્ભુત માર્ગ ભી ત પ્રગટ થઈ છે !!

પૂ. ગુરુદેવશ્રી સાથે આત્મીયતા વધી ગઈ છે અને સ્વયંની પરિણાતિના રસનું પોષણ થતું હોવાને કારણે તેઓશ્રીની સાથે અવાર-નવાર એકાંતમાં ચર્ચાનો પ્રસંગ બને છે. બે જ્ઞાની પુરુષોની જ્ઞાનગોષ્ઠી કેવી હશે !! જાહેર પ્રવચનમાં વારંવાર થતું પ્રેમાણ સંબોધન,



પરમ પ્રેમપૂર્ણ સાન્નિધ્ય

ખાસ સૂક્ષ્મ વિષય ચાલે ત્યારે એક-બીજાનું સ્મરણ એક અદ્વિતીય પ્રેમને સૂચવે છે. એક પ્રભાવશાળી પુરુષના પ્રેમ સાન્નિધ્યમાં રહેવાનો સુદીર્ઘ કાલીન યોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળવા જેવું બન્યું.

પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની દિવ્ય વાડીનો પ્રથમ ચમત્કારિક રૂપર્શ થતાં જ જેમને વિશ્વની ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ એવા પુરુષાર્થમૂર્તિ પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજના સમાગમમાં આવવાનું બને છે. પાંચ વર્ષ સુધી સતત તેઓશ્રીના પરિયયમાં રહે છે તે વખતે તેઓશ્રીની ઉગ્ર અધ્યાત્મ પરિણાતિના નિકટતાથી દર્શન કરે છે. તે જોઈને તેમના પોતાના પરિણામો વિશેષ ભળવાન થાય છે. આ દૃષ્ટિકોણથી તેમનો અસીમ ઉપકાર ભાસે છે. પૂ. સોગાનીજની ચિરવિદાય બાદ તેઓશ્રીના પત્રો અને તત્ત્વચર્ચાનું સંકલન કરી 'દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ' જેવા અધ્યાત્મના ઉચ્ચ કોટિના ગ્રંથનું પ્રકાશન કરે છે. આ રીતે, પૂ. સોગાનીજ જેવા એકાવતારી, અદ્વિતીય મહાપુરુષના અક્ષરદેહ દ્વારા તેમની તીવ્ર જ્ઞાનદશાના મુમુક્ષુ સમાજને દર્શન કરાવી મુમુક્ષુ સમાજ ઉપર ઉપકાર કરે છે.

પૂ. ગુરુદેવશ્રીની સભાના ધર્મશોભારૂપ પૂ. બહેનશ્રીના સાન્નિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પણ સંપ્રાપ્ત થયું. પૂ. બહેનશ્રી પ્રયે સેવા, ભ્રી ત તથા સમર્પણનો અપૂર્વ લાભ પણ તેઓશ્રીને પ્રાપ્ત થયો. આમ આવા દુષ્મકાળમાં જ્યાં એક ધર્માત્મા મળવા પણ દુર્લભ છે ત્યાં ઉ-ઉ મહાપુરુષનો સમાગમ એ કોઈ અલૌકિક ભાવનાનું ફળ છે. આમ સમગ્ર જીવન પ્રગાઢ સત્સંગ યુ ત બન્યું.

### (૧૨) પ્રભાવના યોગ :

પૂ. ગુરુદેવશ્રીના પ્રભાવના યોગને જોઈને સ્વયંને પ્રભાવના કરવા સંબંધી જે ભાવના હતી તેને સર્વપ્રકારે તેઓશ્રીએ સાકાર કરી. જેમાં મુખ્યત: શ્રી સીમંધર સ્વામી જિનમંદિર-ભાવનગર, શ્રી પરમાગમ મંદિર-સોનગઢ, શ્રી નંદિશ્વર જિનાલય-સોનગઢ જેવા જિનમંદિરોનાં નિર્માણ કાર્યમાં ગુપ્ત રહી અપૂર્વ ભ્રી ત પૂર્વક સમર્પણ કર્યું. તદુપરાંત પૂ. ગુરુદેવશ્રીની ભાવિ પર્યાય - સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપના ગામ-ગામ કરાવીને પૂ. બહેનશ્રીની

ભાવનાને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું.

વળી, તેઓશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવશ્રીની સંમતિપૂર્વક શાસ્ત્ર પ્રકાશનાર્થે 'શ્રી વીતરાગ સત્ત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ'ની સ્થાપના થઈ. જેમાં લાખ્યો ગ્રંથ પ્રકાશિત થયા અને વર્તમાનમાં પણ પ્રકાશિત થઈ રહ્યાં છે.

વળી, તેઓશ્રીએ વિવિધ આચાર્યાં અને જ્ઞાનીઓ દ્વારા લિખિત સોએક શાસ્ત્રો જેવા કે શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પરમાત્મપ્રકાશ, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી સમયસાર કળશટીકા, શ્રી



પ્રવચનામૃત પીરસત્તા પૂ. ભાઈશ્રી

અનુભવપ્રકાશ, શ્રી અષ્ટપાણુડ, શ્રી પંચાધ્યાયી, શ્રી ચિદ્વિલાસ, શ્રી સમ્યક્ષાન ટીપિકા, શ્રી નાટક સમયસાર, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત અને પુરાણો ઇત્યાદિકનો ગણ અભ્યાસ કરી તેના રહસ્યને તથા હાર્દને સ્વયંની મૌલિક અને સરળ શૈલીથી પ્રવચનો દ્વારા

મુમુક્ષુઓને અમૃતપાન કરાવ્યું. નિષ્કારણ કરુણાથી ઉપ વર્ષ તેઓશ્રીએ સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાણુડ, કળશટીકા, શ્રીમદ્ રાજચંદ્ર, અનુભવ પ્રકાશ, ચિદ્વિલાસ, બહેનશ્રીના વચનામૃત, ગુરુદેવશ્રીના વચનામૃત, પરમાગમસાર, સ્વાનુભૂતિદર્શન, ઇત્યાદિક અનેક ગ્રંથો પર જાહેર સ્વાધ્યાય આપ્યો. આ સ્વાધ્યાયમાં માર્ગની વિધિ, ભેદજ્ઞાન, સત્પુરુષ અને સત્સંગનું માહાત્મ્ય, સત્પુરુષ પ્રત્યેની ભર્ત ત, ભાવના ઇત્યાદિ અનેક વિષયો ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો. તદ્દઉપરાંત સાતિશય જ્ઞાનયોગ તથા વચનયોગના પ્રતાપે મુમુક્ષુ જીવોને વર્તમાન ભૂમિકાથી આગળ વધી મોક્ષમાર્ગ પર્યત પહોંચવાના કમનું, સ્વયંની મૌલિક શૈલીમાં સુવ્યવસ્થિત પ્રતિપાદન કરીને સમસ્ત મુમુક્ષુ જગત ઉપર અવિસ્મરણિય ઉપકાર કર્યો છે. વર્તમાનમાં જેની

૪૫૦૦ ઓડીયો કેસેટો ભાવનગરમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેમજ વિદેશમાં પણ જિનમાર્ગની પ્રભાવનાનું કાર્ય તેઓશ્રી કરેલ છે.

તદ્દુરૂપરાંત, સ્વયંની અનોખી પ્રાયોગિક શૈલીમાં ‘નિષ્ઠ્રાત દર્શનની કેરી’, ‘પ્રયોજન સિદ્ધિ’, ‘તત્ત્વાનુશીલન ભાગ-૧-૨-૩’, ‘મુમુક્ષુતા આરોહણ ક્રમ’, ‘સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત છ પદનો - અમૃત પત્ર’, ‘પરિભ્રમણના પ્રત્યાખ્યાન’, ‘આત્મયોગ’ અને ‘અનુભવ સંજીવની’ કે જેમાં સ્વયંના અંતર મંથનમાંથી સુદૂરિત વચનામૃતોની સમર્થ રચના દ્વારા જન્મ-મરણની જટિલ સમસ્યાને હલ કરવા અતિ ઉપકારી માર્ગદર્શન આપ્યું છે. વળી, તેઓશ્રીએ ‘જ્ઞાનામૃત’, ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’, ‘પરમાગમસાર’, ‘પથ પ્રકાશ’, ‘ભગવાન આત્મા’, ‘વિધિ વિજ્ઞાન’, ‘બીજું કાંઈ શોધમાં’, ‘ધન્ય આરાધના’, ‘અધ્યાત્મ પરાગ’, ‘જિણ સાસણ સવ્વ, ઈત્યાદિ અનેક ગ્રંથોને સંકલન તથા વિવેચનરૂપે પ્રકાશિત કર્યા.

અધ્યાત્મમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પંચ પરમાગમ તથા અન્ય પરમાગમો ઉપરના વિશિષ્ટ પ્રવચનો ધ્વનિમુદ્રિત કેસેટો ઉપરથી અક્ષરશઃ પુસ્તકાકારરૂપે પ્રકાશિત થાય તેવી તેઓશ્રીની વિચારધારા અને ભાવનાના ફળસ્વરૂપે ‘પ્રવચન રત્નાકર’ ભાગ ૧ થી ૧૧ પ્રકાશિત કરવામાં તેઓશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન તથા યોગદાન રહ્યું છે.

તદ્દુરૂપરાંત પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સાધનાના દોહનના ફળસ્વરૂપ, માખડા સ્વરૂપ ૧૪૩ પ્રવચનો પ્રકાશિત થવામાં વિલંબ થયો હોવા છીતાં તેઓશ્રીના નિર્દેશન તળે ‘પ્રવચન નવનીત’ ભાગ ૧-૨-૩ પ્રકાશિત થયા અને ટુંક સમયમાં ભાગ ૪ પણ પ્રકાશિત થશે. પૂ. ગુરુદેવશ્રીના અન્ય પરમાગમો ઉપરના પ્રવચનો પ્રકાશિત થાય તેવી તેઓશ્રીની ભાવના હતી અને તે પણ કમશઃ પ્રકાશિત કરવામાં આવશે.

### (૧૩) શ્રુત ભર્ત ત :


મહાન દિગંબર આચાર્યો રચિત અનેક પ્રાચીન પરમાગમો જે ઉપલબ્ધ નથી તેની શોધ અર્થે શ્રી કુંદનુંદ કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ નામક ટ્રસ્ટમાં તેઓશ્રીએ તામિલનાડુ તથા કર્ણાટક પ્રાંતમાં શાસ્ત્રની શોધ ચલાવેલ.

જર્મન યૂનિવર્સિટી સાથે આ પ્રાચીન શાસ્ત્ર-શોધ અર્થે પ્રયાસ કરી રહ્યાં હતા. તેમજ ઇંગ્લેન્ડ, ફાંસ, જર્મની વગેરે સ્થળોની પ્રસિદ્ધ લાયબ્રેરીઓની મુલાકાત પણ લીધેલ. ભારતમાં આવેલી અન્ય સંસ્થાઓ સાથે મળીને પણ

આ પ્રાચીન શાસ્ત્ર શોધનું કાર્ય કરી રહ્યાં હતા અને વર્તમાનમાં પણ તેઓશ્રીની ભાવના અનુસાર આ કાર્ય ચાલી રહ્યું છે.

‘શ્રી સત્યશુદ્ધ પ્રભાવના ટ્રસ્ટ’માં હિન્દી તથા ગુજરાતીમાં પ્રકાશિત થતી માસિક આધ્યાત્મિક પત્રિકા ‘સ્વાનુભૂતિપ્રકાશ’ને અપૂર્વ નિર્દેશન આપી રહ્યાં હતાં. આ પત્રિકા દ્વારા સમાજ પર્યાત અધ્યાત્મ તત્ત્વ પહોંચે તેવી ભાવનાથી આ પત્રિકાનું નિઃશુલ્ક વિતરણ પણ તેઓશ્રીના અનુગ્રહથી ચાલી રહ્યું છે.

**પ્રાચીન તાડપત્રીનું નિરીક્ષણ કરી રહ્યાં છે**  
(મૂડબિંડી - વર્ષ - ૧૯૮૭)




તત્ત્વ પહોંચે તેવી ભાવનાથી આ પત્રિકાનું નિઃશુલ્ક વિતરણ પણ તેઓશ્રીના અનુગ્રહથી ચાલી રહ્યું છે.

#### (૧૪) મહાપ્રયાણ :

તા.૨૧-૩-૮૮, ચૈત્ર સુદ ચોથ, રોજંદા કમ પ્રમાણો સાંજના સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. કુદરતની કોઈ અકળ ગતિ આવી પહોંચી. રાત્રિના ૧:૩૦ વાગે હદ્યમાં દુખાવો શરૂ થયો. વેદના વધતી જતી હતી તેમ છતાં કોઈ અણસાર આવવા દીધો નહીં. પોતે પોતાના પુરુષાર્થમાં લાગેલા રહ્યાં. તેમના નાના દિકરા પંકજભાઈ સાથે પૂ. બહેનશ્રીની તથા પૂ. ગુરુદુદેવશ્રીની વાતો કરવા લાગ્યા. અંદરમાં આત્મસ્વરૂપ પ્રત્યેની પુરુષાર્થની ભીંસ વધતી ગઈ, બહારમાં ઉપકારી શ્રી ગુરુના સ્મરણો વાગોળતા ગયા. અશાતા વેદની ગૌણ થઈ ગઈ અને આત્મિક પુરુષાર્થ બળ પકડવા લાગ્યો. ડૉ ટરોની સૂચના પ્રમાણો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ગયા ત્યારે શારિરીક પરિસ્થિતિ કાંઈક વધારે કથળી અને અંતરમાં અણસાર આવી ગયો કે હવે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છૂટવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેથી

પોતે તીવ્ર વેદના હોવા છતાં ધ્યાનમાં બેસી ગયા. આજીવન સાધેલી અખંડ આત્મ સાધના છેલ્લી ઘડીએ આવિર્ભૂત થઈ. અશાત્તા વેદનીને અત્યંત ગૌણ કરી, ઉપેક્ષા કરી ઉપયોગો અંતર્મુખ થવાનો પુરુષાર્થ આદ્યો. સામાન્ય જ્ઞાનવેદન આવિર્ભૂત થઈ પ્રદેશો-પ્રદેશો સ્વસંવેદનનું રસાસ્વાદન થયું, પુરુષાર્થે બીસ લગાવી નિજ સ્વરૂપનું અવલંબન લીધું, ઉપયોગ સર્વથી છૂટો પડી નિજ સ્વરૂપમાં રમવા લાગ્યો. અનંતા કર્મોની નિર્જરા થઈ. બહારમાં ડો ટરો એમનું કામ કરતા રહ્યાં, મુમુક્ષુઓ અસહાય બની સ્વયંના બાલા શ્રીગુરુની સ્થિતિ જોતા રહ્યાં અને પંચમકાળ પોતાનું કામ કરતો રહ્યો. દેહ અને આત્મા જુદા છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરી પોતે જીવન સફળ બનાવ્યું. ચૈત્ર સુદ-૫, તા-૨૨-૩-૮૮, પરોઢીયે ૪:૧૫ કલાકે એક ભવ ઓછો કર્યો અને ધ્યેયની સમીપ પહોંચ્યા. ન જોઈતી, નહિ છચ્છેલી પરિસ્થિતિ આવીને ખડી થઈ ગઈ. અંદરમાં દેહ અને આત્માનની ભિન્નતાનો અનુભવ અને બહારમાં પણ દેહ અને આત્માની ભિન્નતાની વાસ્તવિકતા ખડી થઈ ગઈ.

## વિશ્વવિભૂતિનું મહાપ્રયાણ



મુમુક્ષુઓના જીવન આધાર, મુમુક્ષુઓને નિઃસહાય, અનાથ મુક્તિને ચાલ્યા ગયા. શું કુદરતને આ પરિસ્થિતિ મંજુર નથી કે આવા દિવ્ય પુરુષો શાશ્વત આ ધરાતલ પર બિરાજમાન રહે ? શું કુદરત આટલી હદે નિષ્ઠુર થઈ શકે છે ? શું કાળને કોઈપણ પ્રકારની દયા ન આવી અને સર્વ મુમુક્ષુઓના બાલસોયા પરમેશ્વરને છીનવી લીધા ? આવા-આવા અનેક પ્રશ્નોના અસમાધાન વચ્ચે મુમુક્ષુઓ ચોધાર આંસુએ જોતા રહ્યા. એક વિરાટ

વ્યાત તત્ત્વનો વિયોગ - મુમુક્ષુઓ માટે એક વજાપાત સમાન નિવડચો. મુમુક્ષુઓ અવાયક નેત્રોથી સ્વયંના શ્રીગુરુની વસમી વિદાય જોઈ રહ્યાં. દૂર-દૂર સુધી ફેલાયેલી અમાપ કિતિજોમાં સ્વયંની આભા ફેલાવી આ વિશ્વવિભૂતિનું મહાપ્રયાણ થયું.

- ઉપકૃત મુમુક્ષુવૃદ્ધ



## વિષયાનુક્રમણિકા

પ્રવચન ૦૧	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૧૪૭ . . . . .	૦૧
પ્રવચન ૦૨	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૧૮૪ . . . . .	૧૭
પ્રવચન ૦૩	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૧૮૪ . . . . .	૩૭
પ્રવચન ૦૪	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૨૦૦ . . . . .	૫૫
પ્રવચન ૦૫	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૨૦૦ . . . . .	૭૧
પ્રવચન ૦૬	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૨૦૦ . . . . .	૮૮
પ્રવચન ૦૭	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૨૦૦ . . . . .	૧૦૮
પ્રવચન ૦૮	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૫૧૧ . . . . .	૧૧૪
પ્રવચન ૦૯	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૫૬૦ . . . . .	૧૩૧
પ્રવચન ૧૦	શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૮૧૮ . . . . .	૧૪૩

## આ પુસ્તકની કિંમત ઘટાડવા માટે અને નિઃશુલ્ક વિતરણ માટે પ્રાપ્ત થયેલ દાનરાશિ

શ્રી જમનાદાસ હેમચંદ હેમાણી ચેરીટેબલ ટ્રસ્ટ, કલકત્તા	૨૦,૦૦૦/-
શ્રીમતી વિમલાદેવી હીરાલાલ જૈન, ભાવનગર	૨૫૦૦/-
શ્રી નગીનભાઈ ચુનીભાઈ ભાયાણી, કલકત્તા	૨૫૦૦/-
સ્વ. ન્યાલચંદ વીરચંદ વોરા પરિવાર, ભાવનગર	૨૦૦૦/-
શ્રીમતિ ચંદ્રિકાબહેન શશીકાંતભાઈ શેઠ, ભાવનગર	૫૦૦/-
સ્વ. કસ્તુરબહેન લક્ષ્મીચંદ શાહના સ્મરણાર્થ	
ક. કનુભાઈ શાહ, અમદાવાદ	૫૦૦/-
શ્રીમતિ સ્વરાજબહેન ઘોખાલ, કલકત્તા	૨૫૦/-
શ્રીમતિ સ્નેહલતાબહેન શાહ, ભાવનગર	૨૫૦/-

## હું જ્ઞાનમાત્ર છું.

□

સુખધામ અનંત સુસંત ચહી,  
દિનરાત્ર રહે તદ્વિદ્યાન મહી;  
પ્રશાંતિ અનંત સુધામય જે,  
પ્રણમું પદ તે વરતે જ્ય તે.

□

પાવન મધુર અદ્ભુત અહો ! ગુરુવદનથી અમૃત જર્યા,  
શ્રવણો મળ્યાં સદ્ગ્રામયથી નિત્યે અહો ! ચિદ્રસ ભર્યા.  
ગુરુદેવ તારણાહારથી આત્માર્થી ભવસાગર તર્યા,  
ગુણમૂર્તિના ગુણગુણતણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.

□

હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;  
કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે.

□

**સહજાત્મસ્વરૂપ**

**સર્વજ્ઞદેવ**

**પરમગુરુ**

□

ॐ

नमः सिद्धेभ्य

‘श्रीમद् राजचंद्र’

पत्रांक - १४७

વવाणिया, આસો સુદ્ધ દ, રવિ, ૧૯૪૬

સુજા ભાઈ ખીમજી,

આજી પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું.

આજીમાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ  
બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.

એને માટે તમે શું ઉપાય કરશો ? અથવા ધાર્યો છે ?  
અધિક શું ? અત્યારે આટલુંય ઘણું છે.

વિ. રાયચંદ્રના યથા.



પ્રવચન — ૧

‘શ્રીમદ્ રાજયંત્ર’ પત્રાંક-૧૪૭

તા. ૨૪/૦૮/૧૯૯૫ – મુંબઈ

---

---

શ્રીમદ્ રાજયંત્ર વચનામૃત. પત્રાંક-૧૪૭, પાનું-૨૩૦. એક પોસ્ટકાર્ડની અંદર મુમુક્ષુ ખીમજીભાઈ પ્રત્યે લખાયેલો આ પત્ર છે. પત્રમાં બે વચનામૃત - બે વા યો અત્યંત માર્ગિક છે.

‘સુખ ભાઈ ખીમજી, આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું.’ ખીમજીભાઈનો એક પત્ર (કૃપાળુદેવને મળ્યો છે) કે, જેમાં એમણે કૃપાળુદેવની આજ્ઞા અને કૃપા સંબંધી ઉલ્લેખ કરેલો છે. અને એ પત્ર મળતાં કૃપાળુદેવને સંતોષ થયો છે. આ વચનમાં પત્રની પહોંચ છે અને પત્ર લખનારે જે વિષય આવ્યો છે, તેનો સંક્ષેપથી નિર્દેશ છે અને પોતાને (પત્ર વાંચીને) જે લાગાશી ઉત્પત્ત થઈ તેનો પણ ઉલ્લેખ છે.

પત્રનો વિષય જે સ્વાધ્યાય કરવા યોગ્ય છે - એમાં બે વચનો લખેલા છે. ‘આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.’ શું કહે છે ? કે મુમુક્ષુજીવ જ્ઞાનીપુરુષની આજ્ઞામાં એકતાન ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણનો જે પારમાર્થિક માર્ગ છે, તેની પ્રાપ્તિ ઘણી જ કઠિન છે. અસુલભ છે એટલે ઘણી જ કઠિન છે. વિષય એમ છે કે, આ જગ્યાએ જીવ ભૂત્યો છે. ધર્મના ક્ષેત્રમાં આવીને અનેક પ્રકારનાં ધર્મ સાધન કરેલા છે. તેમ છતાં, જે કરવા યોગ્ય છે એ નહીં કર્યું, તેથી પરમાર્થ માર્ગની પ્રાપ્તિ નથી થઈ.

‘થમ નિયમ સંયમ આપ કિયો’ એ પદ કૃપાળુદેવે લખ્યું છે. ‘વહ સાધન બાર અનંત કિયો’ એવા દૂર્ધર સાધનો અનંતવાર કરવા છતાં, ‘તદપિ કછુ હાથ હજુ ન પર્યો’ - (અર્થાત્) કાંઈપણ હાથમાં ન આવ્યું. અનું કારણ શું ? કે જીવ જ્ઞાનીપુરુષની આજ્ઞામાં આવ્યો નથી. થોડો ઘણો આવ્યો છે તો એકતાન થઈને આવ્યો નથી. આ વિષયનું પરમાર્થ માર્ગમાં બહુ મોટુ મહત્વ છે.

એક જ વા ચની અંદર, સિદ્ધાલયમાં જે સિદ્ધપદ છે અનું Foundation - એનો પાયો આ જગ્યાએ છે. કૃપાળુટેવે ૭૫૧ નંબરનો જે પત્ર લખેલો છે. અમાં આપણુંખના વચનની પ્રતીતિ, આજ્ઞા રુચિ અને સ્વચ્છંદનિરોધ ભર્તી તને પ્રથમ સમકિત કર્યું છે. ‘મોક્ષનું મૂળ સમ્યગર્દર્શન છે.’ - એ વાત જૈનર્દ્શનની પ્રસિદ્ધ વાત છે. આ વાત સંપ્રદાયમાં ખુલ્લી છે કે, ‘મોક્ષનું મૂળ સમ્યગર્દર્શન છે.’ પણ એ મૂળ ચા બીજમાંથી ઉત્પત્ત થયું ? એ વાત બહુ ઓછા જાણે છે અથવા સમ્યગર્દર્શનરૂપી મોક્ષનું મૂળ છે અનું બીજ ચાં પડ્યું છે ? કેવું છે ? એ વાત કૃપાળુટેવે પોતાના વચનોમાં ઠામ-ઠામ કરેલી છે. એવી એક વાત આ જગ્યાએ પણ કરેલી છે.

તેઓશ્રીએ મુમુક્ષુ જીવ માટે પરમાર્થમાર્ગની સુલભતા થાય એવી પરમકૃપા કરી છે અને એ કૃપા આપણા ઉપર કરી છે, એવું આપણને લાગવું જોઈએ. એવું આપણને ભાસ્યમાન થવું જોઈએ. જ્ઞાનીપુરુષની આજ્ઞામાં એકતાન થવું. સર્વાર્પણબુદ્ધિથી સર્વભાવ અર્પણ કરી દઈ, જો સત્પુરુષની આજ્ઞામાં રહેવાય તો આ જીવને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અત્યંત સુલભ છે. નહીંતો ઘણી જ અસુલભ છે - ઘણી જ દુર્લભ છે. ભલે વાત સંક્ષેપમાં કરેલી છે, ટૂંકાણમાં કરેલી છે પણ એ વાતનું મહત્વ ઘણું છે. અનંતકાળમાં આ જ જગ્યાએ જીવ ભૂલેલો છે. આ જ સ્થળે ભૂલેલો છે.

તીર્થકરદેવની દિવ્યધનિમાં આ વાત બહુ જોર-શોરથી આવેલી અને કૃપાળુટેવની દિવ્ય-ધનિમાં પણ આ વાત જોર-શોરથી આવી છે. ગુરુઆજ્ઞા, ગુરુપૂજા અને ગુરુનું મહત્વ બીજા અનેક સંપ્રદાયોમાં છે. જૈન શાસ્ત્રોમાં પણ છે, જૈન સંપ્રદાયમાં પણ છે. પણ એનું કારણ શું ? એનું મહત્વ કેમ છે ? શા માટે છે ? એ વાત, જ્યાં સુધી એ માર્ગ પુરુષાર્થ કરનારને અનુભવગોચર ન થાય ત્યાં સુધી ઓધસંજ્ઞાએ સમજાય છે.

વાત સમજવા જેવી છે; સમજવા જેવી છે - એટલે કઈ રીતે સમજવા જેવી છે ? એ મહત્વનો વિષય છે. આ વાત બુદ્ધિગોચરપણે સમજવી એ એટલી અધરી નથી. કેમકે આપણે સૌ એટલી બુદ્ધિ ધરાવીએ છીએ. આપણી પાસે એટલી બુદ્ધિ છે. આપણે બૌદ્ધિક સરર પર આ વાત ન સમજી શકીએ, એવું નથી. પરંતુ અનુભવગોચરપણે સમજવું - એ સમજણની ખરી પદ્ધતિ છે. પરમાર્થનો માર્ગ એટલેકે આત્મકલ્યાણનો માર્ગ - મોક્ષનો માર્ગ અનુભવ

પ્રધાન છે. જ્યારે માર્ગ જ અનુભવ પ્રધાન છે તો એની સમજણા પણ અનુભવપદ્ધતિથી થવા યોગ્ય છે - હોવા યોગ્ય છે. (એટલે) આ વચનામૃતને પણ અનુભવગોચરપણે સમજવું, તો જ એનું રહસ્ય સમજાય અથવા એનું ખરું મહત્વ સમજાય. નહીંતર એ વાત માત્ર બુદ્ધિના સ્તર પર બરાબર લાગે, છતાં પણ એમાં ‘યथાર્થતા’નો અભાવ હોય છે.

શાસ્ત્રની કોઈપણ વાત (હોય) અને સત્પુરુષના કોઈપણ વચનો હોય - એ વચનોને બુદ્ધિગોચરપણે સમજવા એટલા અધરા નથી, એટલા કઠિન નથી. પણ અનુભવગોચરપણે સમજવામાં માર્ગ પ્રાપ્તિ છે, માર્ગ સુધી પહોંચી શકાય છે અને તેથી તે પદ્ધતિથી તે સમજવા યોગ્ય છે. એટલે આ વચનામૃતને સમજવા માટે આપણો માત્ર બુદ્ધિને લાગુ કરવી - બુદ્ધિને Apply કરવી, એટલું પર્યાપ્ત નથી - એટલું પૂરતું નથી. એના માટે પ્રયત્ન કરવો જોઈએ કે, ગુરુઆજામાં રહેવું એટલે શું ? અને ગુરુ આજાથી બહાર જવું એટલે શું ? આ વાત એ માર્ગ ચાલવાના પ્રયત્ન વિના કેમ સમજાય ? અને ગુરુ ચરણના સાનિધ્ય વિના કેમ સમજાય ? બે વાત સાથે જોઈએ. ગુરુ ચરણનું સાનિધ્ય સંપ્રાપ્ત થવું જોઈએ અને એમની આજા ઉપાસવી (એ વાત પણ સાથે હોવી જોઈએ).

ખરેખર તો એમની આજા ઉપાસવી - એ એમની આજા ઉપાસવી એમ નથી પણ એ ભૂમિકામાં એ આત્માની જ ઉપાસના છે. મુમુક્ષુની ભૂમિકામાં, ગુરુ આજાની ઉપાસના - તે, તે ભૂમિકાની આત્મ ઉપાસના છે. એ તો કથન નિભિત્ત પ્રધાન છે. (પરંતુ) વિષય ઉપાદાન પ્રધાન છે. કેમકે તેવી યોગ્યતા ઉપાદાનમાં જોઈએ. નિભિત્ત પરક વચન હોય એટલે એ નિભિત્તાધીન વાત છે - એવી સમજણની ભૂલ કરવા યોગ્ય નથી.

અહીંયા એક પ્રસંગનું ચિત્ર દોરવા જેવું લાગે છે. કોઈ એક કૃપાળુદેવ જેવા મહાપુરુષની - સદગુરુની - સત્પુરુષની સમીપમાં, એમનાં ચરણ સાનિધ્યમાં રહેવાનો કોઈ મહાપુરુષ યોગ હોય. જ્યારે ભીમજીભાઈ ઉપર આ પત્ર લખાડો હશે ત્યારે એ ભાગ્યશાળી મુમુક્ષુને ધન્યવાદ દેવા જોઈએ. (કેમકે) આવી એક બહુ મૂલ્ય વાત ફ ત એક પોસ્ટકાર્ડમાં લખી મોકલી છે. એ વખતે પોસ્ટકાર્ડની કિમત એક પૈસો હતી ! એક આનાનો ચોથો ભાગ. Quarter ana કૃપાળુદેવના હસ્તાક્ષરના અસલ પોસ્ટકાર્ડ જોયા હશે. ઈડરમાં ઈડરના આશ્રમમાં ઘણા

પોસ્ટકાર્ડ છે. એક પૈસાના પોસ્ટકાર્ડમાં કરોડો-અબજો (રૂપિયા) શું - જેનું મૂલ્ય જ ન થાય, જેની કિંમત આંકવા માટે કોઈ Term નથી - કોઈ Terminology નથી - એવી વાત લખી મોકલી છે. જો કોઈ જીવ સત્પુરુષની આજ્ઞામાં એકતાન થઈને રહે તો અંતે એ સિદ્ધપદને પામે. સિદ્ધપદને પામે એટલે - એ કેટલા દુઃખના નુકસાનથી બચે, એનો જો વિસ્તાર કરવો હોય તો ચારે ગતિના જન્મના, મરણના, અનંત જન્મના-અનંત મરણના દુઃખોથી છૂટે અને ચારે ગતિમાં પાપના ઉદ્યે જેટલાં-જેટલાં દુઃખો ઉત્પત્ત થાય છે એ દુઃખોથી બચે. એ ઉપરાંત અજ્ઞાન અને અસમાધાનને લઈને જે મૂંજવણ થાય છે - આપણે જેને Tension કહીએ છીએ - તણાવ કહીએ છીએ - જે સૌથી મોટું દુઃખ છે. જેના વશ માણસ આપધાત કરી બેસે છે. એ તમામ પ્રકારના સર્વ દુઃખ અને સર્વ લેશથી છૂટે અને સાચિ અનંત-અનંત સમાધિ સુખમાં, અનંત જ્ઞાન-અનંત દર્શન સહિત સિદ્ધપદમાં બિરાજમાન થાય - એનું મૂલ્ય જગતના ચા પદાર્થથી થઈ શકે ? કે કોઈ પદાર્થથી થઈ શકે નહીં. એવા સિદ્ધપદનું મૂળ, એ મૂળનું જે બીજ - એ બીજભૂત વાત ફૂપાળુંટેવે આ જગ્યાએ કરી છે.

ખરેખર તો કોઈ મુમુક્ષુ જીવ આત્મકલ્યાણના પુરુષાર્થમાં - આત્મકલ્યાણના પ્રયત્નમાં - પ્રયાસમાં લાગે ત્યારે એ માર્ગ ચઢતાં પહેલાં એને કેટલી-કેટલી તકલીફો ભી થાય છે ! તકલીફો એટલે અહીંયા કોઈ સંયોગોની પ્રતિકૂળતા નથી કહેવી. પણ માર્ગ હાથમાં ન આવે અને માર્ગ સમજાય તો પણ પુરુષાર્થ ઉપરે નહીં, પુરુષાર્થ ઉપરે તો પ્રકૃતિના ઉદ્યમમાં પરિણામો પછાડ ખાય, એ પછાડના માર લાગે, પરિણામની ચડ-ઉત્તરમાં મનુષ્ય આયુષ્યનો કિંમતી સમય વ્યતીત થઈ જાય, ખોવાઈ જાય - ખોઈ બેસવો પડે, એ બધાં પ્રકારમાંથી બચવાનો કોઈ એક ઉપાય હોય, કોઈ એક ઉત્તમ ઉપાય હોય, કોઈ એક સુગમમાં સુગમ ઉત્તમ ઉપાય હોય તો તે આ એક ઉપાય છે કે - આજ્ઞામાં એકતાન થનું.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! આ વાતનું એકદમ સ્પષ્ટીકરણ કરો. આજ્ઞાનું આરાધન સાચી રીતે કરી ભૂમિકામાં થાય છે ?

પૂજ્ય ભાઈશ્રી :- ઠીક છે, બહુ સરસ પ્રશ્ન છે. જ્ઞાનીપુરુષના સમાગમના યોગે સૌ પ્રથમ આ જીવે પોતાની યોગ્યતા સમજવી આવશ્યક છે. જો જીવને પોતાની યોગ્યતા ન સમજાય એટલેકે એ પોતે ચાં ભો છે એ જ એને

ખબર ન હોય, તો એને પોતાના કર્તવ્યની કેમ સમજ પડે ? કે મારે પહેલું કદમ કઈ દિશામાં, કઈ જગ્યાએ મૂકવાનું છે ? જ્યારે એ વાતની સમજ આવે ત્યારે સત્ત્સમાગમ યોગે જ્ઞાનીપુરુષના જે-જે ઉપદેશરૂપ દિવ્યધ્વનિનો શ્રવણયોગ પ્રાપ્ત હોય, ત્યારે પોતાને પ્રયોજનભૂત-વર્તમાન ભૂમિકાને પ્રયોજનભૂત એવી વાત મને શું કહી ? એવું એને ભાસ્યમાન થાય છે. ‘આ વાત મને શ્રી ગુરુ કહે છે, આ વાત મને લાગુ પડે છે.’ નહીંતર આ વાત જો મને ન સમજાણી હોત તો હું આ જગ્યાએ ભૂલ કરી બેઠો હોત. એ વાત સ્પષ્ટ સમજમાં આવે છે. પોતાની ભૂલ થાત, કેમ થાત, કેવી રીતની થાત, એ પણ સમજાય અને શ્રીગુરુનો અનંત ઉપકાર પણ સમજાય કે મને મારી ભૂમિકામાં આ ઉપદેશ આપે છે અને આ એમનું વચન - આ એમનો વિકલ્પ એક સામાન્ય વાત નથી પણ મારા માટે શિરોધાર્ય કરવારૂપ એક આજા છે.

કૃપાળુદેવ ૨૦૦ (નંબરના પત્રમાં) વચનાવલીમાં લખે છે. ‘સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશયો છે.’ એમ ૨૦૧ (પત્રમાં) એમણે કહ્યું. (૨૦૦ પત્રમાં) પાંચમું વચન છે. ‘જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની છચ્છાયે, એટલે આજાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાની નિવૃત્તિ થવી સંભવતી નથી.’ (યોથી વચનામૃતમાં) એક વચન લખાઈ ગયું છે, કે ‘પોતાની છચ્છાયે પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.’ (આગળ ૧૨માં વચનમાં લખે છે) ‘શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.’ અને પ્રત્યક્ષ આજ્ઞા આરાધવા માટે જ્ઞાની પ્રત્યક્ષ જોઈએ. પ્રત્યક્ષ (જ્ઞાની) ન હોય તો આશ્રય ભાવના જોઈએ. આશ્રય ભાવના હોય તો ભાવના ફળીને, કાળે કરીને આશ્રય પ્રાપ્ત થાય.

એ જીવને ત્યાં (અને ત્યારે) સમજાય છે કે, મારા પ્રયાસમાં, મારા પ્રયત્નની અંદર પરિણામોની ચડ-ઉત્તર થાય છે, એનું કારણ શું ? મુમુક્ષુ જીવ છે, આત્મકલ્યાણની ભાવનાવાળો જીવ છે (તેના) પરિણામ કચારેક ઠીક કામ કરે છે, ચારેક આત્મરૂપિ સારી કામ કરે છે, ચારેક પરિણામ બરાબર કામ કરતાં નથી. એવો સર્વ સાધારણપણે બધાં મુમુક્ષુને અનુભવ થાય છે. આમ થવાનું કારણ શું ? આમ કેમ થાય છે ? આ એક મૂંજવતો પ્રશ્ન છે. એ મૂંજવણનો ઉકેલ કૃપાળુદેવે આ જગ્યાએ આપ્યો છે કે, તું આજામાં એકતાન થા. કાંઈ તકલીફ નહીં થાય. તારા પરિણામની ચડ-ઉત્તર બંધ થઈ જશે. અરે...!

એટલું જ નહીં. કોઈ મુમુક્ષુ જીવ - કોઈ આત્માર્થી જીવ એવો એક દૃઢ નિર્ધાર કરે કે, આજથી ગુરુઆજ્ઞામાં જીવન સમર્પણ કરવું છે, ગુરુઆજ્ઞામાં જ રહેવું છે અને અંશમાત્ર પણ આજ્ઞા બહાર પગ મૂકવો નથી. આજ્ઞા બહાર પગ મૂકું તો બહુ મોટો અપરાધ છે અથવા તેઓશ્રીનો ઉપકાર ઓળવવા જેવું મહા પાપ છે. એવી ગંભીરતાથી આજ્ઞામાં એકતાન થવાનો નિશ્ચય કરે - નિર્ધાર કરે, તો એ નિર્ધાર અને નિશ્ચય માત્રમાં એ ભૂમિકાની નિર્મળતા પ્રગટચા વિના ન રહે. તત્કાળ નિર્મળતા પ્રગટે. પાત્રતાની ભૂમિકાનું આ એક સુખ છે, એક સગવડ છે, એક સુવિધા છે કે પાત્રતા - નિર્મળતા આવતાં વાર લાગતી નથી અને એ આવવા માટે કોઈ Pre-condition નથી - કોઈ પૂર્વ શરત નથી.

મોક્ષમાર્ગની અને મોક્ષમાર્ગની ઉપર-ઉપરની બધી જ દશાઓમાં પૂર્વ શરત રહેલી છે. જેમકે, સિદ્ધપદ છે એ અરિહંતપદની પ્રાપ્તિ વિના ન થાય. (એમાં) શરત છે કે પહેલાં અરિહંતપદ આવે તો જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય અને અરિહંતપદ છે - કેવળજ્ઞાનાદિની ઉત્પત્તિ છે એ ક્ષપકશ્રેષ્ઠીના પરિજ્ઞામો થયા વિના કદ્દી ઉત્પત્ત ન થાય. ક્ષપકશ્રેષ્ઠીમાં શુક્લ ધ્યાન તારે જ ઉત્પત્ત થાય કે છહે-સાતમે ગુણસ્થાને અંતર્ભાવ્ય નિર્ગ્રથ દશા પ્રગટ થાય, ભાવલિંગી મુનિદશા પ્રગટ થાય, ત્યારે જ એને ક્ષપકશ્રેષ્ઠીનું એકાગ્રતારૂપ શુક્લધ્યાન લાગે. એ પહેલાં ગૃહસ્થદશામાં જ્ઞાનીપુરુષને ધર્મધ્યાન હોઈ શકે (છે) પણ શુક્લધ્યાન ન હોઈ શકે અને એવી નિર્ગ્રથદશા - ભાવલિંગી મુનિદશા સમ્યંદર્શન વગર કોઈને ઉત્પત્ત ન થાય. એની અંદર સમ્યંદર્શનની પૂર્વ શરત છે. એવું જે સમ્યંદર્શન છે (કે) જે મુનિદશાનું મૂળ કારણ છે, અનન્ય કારણ છે, અંગભૂત કારણ છે એ સ્વરૂપની ઓળખાજ વિના, સ્વરૂપના નિશ્ચય વિના, સ્વરૂપના ભાવભાસન વિના, સ્વરૂપના લક્ષ વિના કોઈને ઉત્પત્ત ન થાય. એવું જે સ્વરૂપની ઓળખાજરૂપ બીજું સમકિત જે ૭૫૧ પત્રમાં કહ્યું, તે સત્પુરુષની ઓળખાજ વિના ન થાય (કે) જેને ૭૫૧(પત્રમાં) પહેલું સમકિત કહ્યું છે. આ બધી પૂર્વ શરતો છે. ઉપર-ઉપરની દશા (આવવા) માટે નીચેની દશા આવી હોવી જ જોઈએ, તો જ (ઉપરની દશા પ્રગટ) થાય અને એ સત્પુરુષની ઓળખાજ આજ્ઞામાં એકતાન થવાના નિર્ધાર વિના - નિશ્ચય વિના ન થાય. કેમ ? (કેમકે) જ્ઞાની પુરુષ છે - સત્પુરુષ છે એ નિર્માણી પુરુષ છે. ‘દર્શનમોહ

યતીત થઈ ઉપજ્યો બોધ જે' - દર્શનમોહનો જેમણે અભાવ કર્યો છે. અનંત જન્મ-મરણાના કારણભૂત સંસારનું મૂળ જેમણે છેધ્યું છે, એવું આત્મજ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે. જેમનો આત્મા દર્શનમોહના અભાવથી નિર્મળ થયો છે. એ પુરુષની ઓળખાણ આત્માની નિર્મળતામાં આવ્યા વિના થતી નથી.

હીરાને બરાબર જોવા માટે, હીરાનું મૂલ્યાંકન બરાબર કરવા માટે આંખ પણ ચોખ્યી જોઈએ. (એમાં) આંખના રોગવાળાનું કામ નથી કે એનું એ મૂલ્યાંકન કરી શકે. એની આંખ પણ ચોખ્યી જોઈએ. એમ જ્ઞાનીપુરુષની ઓળખાણ થવારૂપ પ્રથમ સમકિત છે કે જે ઓળખાણથી આજ્ઞા રુચિ પ્રગટ થાય, એના માટે જે નિર્મળતા જોઈએ, એ આજ્ઞામાં એકતાન થવા માટેનો નિર્ધાર માગે છે - નિર્જય માગે છે - નિશ્ચય માગે છે. કેમકે એ સિવાય પરમાર્થમાર્ગની પ્રાપ્તિ બીજા કોઈ પ્રકારે, કોઈ કાળે, કોઈને થઈ નથી, થઈ શકવા યોગ્ય પણ નથી. અસુલભ છે - એટલે બીજું ગમે તે કરે (તો પણ માર્ગ પ્રાપ્તિ ન થાય).

કૃપાળુદેવે ૧૯૪ પત્રમાં તો આ વાતનો પુરાવો પોતાના આત્મ સાક્ષાત્કારતાથી આપેલો છે. લખે છે, 'ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિથરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્તસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી... જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી.' ભૂતકાળમાં ગતભવમાં પોતાને જ્ઞાનપ્રાપ્તિ થયેલી, તેનું જ્ઞાતિસ્મરણજ્ઞાન પોતાને વર્તમાનમાં વર્તતું હતું. 'વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગતકાળે પણ જ્ઞાનીપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે.' બધાં જ શાસ્ત્રો આ જ વાતને Point-out કરે છે, એમ કહે છે. 'બોધ લક્ષ છે' એમ કહીને (એમ કહેવા માગે છે કે) આ જીવાએ બધાં શાસ્ત્રોનું વજન છે. કેમકે તીર્થકરદેવની દિવ્યધ્વનિમાંથી એ શાસ્ત્રો ઉત્પત્ત થયા અને ત્યાં પણ તે જ વાત આવેલી.

કેટલાક અન્ય મતોએ એ વાત બહુ જોરથી પદકાળી છે. ખાસ કરીને પંજાબ અને સિંધ બાજુ ગુરુ આજ્ઞાનું બહુ મહત્વ છે. 'વાહે ગુરુ'- એ લોકો ગુરુને ભગવાન કરતાં પણ વિશેષ મહત્વ આપે છે. અને એનું કારણ એ વાત દિવ્યધ્વનિમાં આવેલી (અને) એ સંપ્રદાયમાં મુખ્ય થઈ ગઈ. પણ આ (વાત) યથાર્થ છે અને એ વિના બીજો કોઈ ઉપાય નથી.

આપણા સ્વાધ્યાયમાં (જ) ભૂળ વિષય ચાલતો હતો એના ઉપર આવીએ. મુમુક્ષુની પાત્રતા એટલે નિર્મળતા - એ નિર્મળતા સહજમાત્રમાં કોઈપણ શરત વિના, સીધે સીધી આવે તો ચાંથી આવે ? કે ગુરુ આજ્ઞામાં રહેવાની પોતાની તૈયારી હોય તો. આગળ એક ૧૦૫ નંબરનો પત્ર પાત્રતા વિષે આવી ગયો. (એ પત્રમાં) પાત્રતાના જે વચનો કહ્યાં એમાં મુખ્ય અને પહેલું વચન એ લીધું છે - સત્પુરુષના ચરણનો છચ્છુક. એમાં પહેલા જેવું એકેય નથી. દસમાંથી પહેલા જેવું એકેય સાધન નથી (એમ કહ્યું છે). એમણે ધામ-ધામ આ વાત કરી છે. આટલી બધી ઉપસાવી-ઉપસાવીને વાત કરી છે ! છતાં જો ધ્યાન ન ખેંચાય અથવા જીવ એ રીતે તૈયાર ન થાય (તો એનો બીજો કોઈ ઉપાય નથી). ફરજ ત પરિણામથી તૈયાર થવાનું છે. નિર્ણયથી તૈયાર થવાનું છે. ત્યાં પછી જો જીવ પોતે દિશામૂઢ રહેવા છચ્છે છે તો બીજો કોઈ ઉપાય નથી. ત્યાં તો પછી બીજો કોઈ ઉપાય જ નથી.

‘આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.’ આ વાત પ્રયત્ન કરનારને સમજાય એવી છે. પ્રયત્ન ન કરે તો માત્ર બુદ્ધિગોચર (પણે) સમજાય અને પ્રયત્ન કરે તો અનુભવગોચરપણે સમજાય કે ચાં- ચાં આંટી-ધૂંટી છે ? પરમાર્થ માર્ગ - ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષમાર્ગः’ - ત્યાં સુધી પહોંચવામાં વિટંબણા ઘડી છે. માર્ગ પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાનીપુરુષને ઉપરના ગુણસ્થાન ચડવા માટે એટલી વિટંબણા નથી. કેમકે પોતાનું નિજ સ્વરૂપ જોયું છે - અનુભવ્યું છે અને નિજસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય અનુભવગોચર પણ થયો છે એટલે માર્ગ પણ જોયો છે. એમને એટલી વિટંબણા નથી. એ સ્થિતિમાં આવ્યા પછી અસંખ્ય સમયમાં સિદ્ધપદની - મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. એવો નિયમ છે. પણ એ પહેલા અનંતકાળ સંસારમાં જાય છે.

એકવાર પણ યથાર્થ મુમુક્ષુતા આવી નથી - બરી મુમુક્ષુતા આવી નથી. ફૂપાળુંદેવે એવો ઉલ્લેખ અન્ય વચનામૃતોમાં કરેલો છે. એ (મુમુક્ષુતા) આવવામાં વિટંબણા ઘડી છે. એ બધી વિટંબણાનો ઉકેલ આ એક વચનામૃતમાં છે કે, આજ્ઞામાં એકતાન થવું.

જો કે, ‘એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.’ બીજું વચનામૃત આ પ્રકાશયું છે. એકતાન થવું બહુ જ અસુલભ છે - એમ કેમ કહ્યું ? ઉપલક

દૃષ્ટિએ જાડો આ તો સીધું - સાંહું નાનું કામ હોય એવું લાગે. એમાં શું ? આપણે સત્પુરુષના સમાગમયોગે એમની આજ્ઞામાં રહી જઈએ. એમાં શું વાંધો ? વાંધો એ પડે છે કે, આ જીવને કેટલા પ્રતિબંધો છે, અને કેટલો સ્વચ્છંદ છે - એ આજ્ઞામાં આવવાનો (જે) પ્રયાસ કરે છે, આજ્ઞામાં રહેવા માટેની તૈયારી કરે છે, એ પરિણામમાં આવવા માગે છે - ત્યારે (એને) એ સમજાય છે. ત્યાં સુધી એને સમજાતું નથી.

કૃપાળુદેવે સંસાર પરિભ્રમણના મુખ્ય બે કારણો પ્રકાશ્યા છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે પોતાની મતિ કલ્પનાએ ચાલવું. સ્વચ્છંદ શર્બના બે પ્રકારે અર્થ જોવામાં આવે છે. એક તો સ્વચ્છંદ એ છે કે વિષય કખાયની નિરર્ગળ પ્રવૃત્તિ કરવામાં આવે, તીવ્ર રસે કરીને પ્રવૃત્તિ થાય, એને પણ જ્ઞાનીઓએ સ્વચ્છંદ કર્યો છે. પોતાની મતિ કલ્પનાએ ધર્મ સાધન કરવું તે સ્વચ્છંદ છે. જીવ કરે છે ધર્મ સાધન - માને છે ધર્મ સાધન. અને સંપ્રદાયમાં સૌ કોઈ કરે પણ છે, પણ તે જ્ઞાનીની આજ્ઞાએ કરતો નથી - એટલે એને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરી છે. પોતે (માર્ગથી) અજાણ્યો છે. માર્ગનો અજાણ્યો હોવા છતાં ધર્મ સાધનનો નિર્ણય પોતે પોતાની મતિ કલ્પનાથી કરે છે અને જ્ઞાનીની આજ્ઞાને અનુસરતો નથી, જ્ઞાનીની આજ્ઞામાં રહેતો નથી, એ જ જીવનો સ્વચ્છંદ છે.

એ સ્વચ્છંદ નિષ્પક્ષપણે પોતાના દોષના અવલોકનમાં જીવ આવે ત્યારે એને સમજાય છે અને એ સ્વચ્છંદ હાનિ પામે એવી કોઈ પરિસ્થિતિ ઉત્પત્ત થાય છે. એ પરિભ્રમણનું મુખ્ય એક કારણ છે.

બીજું કારણ છે - પ્રતિબંધ. કૃપાળુદેવે ચાર પ્રકારના પ્રતિબંધ કર્યાં (છે). (૧) સમાજ પ્રતિબંધ (૨) કુટુંબ પ્રતિબંધ (૩) શરીર પ્રતિબંધ અને (૪) સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. (કોઈપણ જીવ) જ્ઞાનીની આજ્ઞામાં રહેવા જાય ત્યાં સમાજ પ્રતિબંધ નડે. એ જમાનામાં પણ કૃપાળુદેવ પાસે જે કોઈ મુમુક્ષુઓ - સુપાત્ર જીવો આવેલા તો સમાજમાં એને તકલીફો ભી થતી. સમાજમાં વિરોધ થતો. સંપ્રદાયને અનુસરનારાઓ એમ કહે કે, તમે કેમ ત્યાં જાઓ છો ? એ તો આવા છે ને તેવા છે, ફલાણાં છે ને ઢીકણાં છે. જ્ઞાનીપુરુષની અનેક પ્રકારે નીંદા પણ કરે. એ વચ્ચનો પણ સહન કરવા પડે, સાંભળવા પડે. પણ જેને આત્મકલ્યાણ કરવું જ છે એ દૃઢ નિર્ધારથી સત્પુરુષના ચરણને વળગીને રહે

છે. કોઈપણ પરિસ્થિતિમાં એ (સત્પુરુષને) છોડવા માગતો નથી. ચારેક તો મોટો સામાજિક વિરોધ પણ ભો થાય, એ બધી સંભાવનાઓ હોય છે. એની તૈયારી રાખે કે ગમે તે પરિસ્થિતિમાં (રહેવું છે). પરિભ્રમણના દુઃખી કોઈ સમાજ છોડવવા આવવાનો નથી અને મારે પરિભ્રમણથી મું ત થવું હોય તો જ્ઞાનીપુરુષની આજ્ઞામાં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. જેણે માર્ગ જોયો છે એ માર્ગ દર્શાવી શકે; કલ્યાન પ્રાપ્ત પુરુષ માર્ગને બતાવી ન શકે, (કેમકે) જે માર્ગને પામેલા નથી એ (માર્ગને) કેમ બતાવી શકે? એટલે સમાજની દરકાર કર્યા વિના, પહેલા દરકાર છોડવામાં બળ જોઈએ - પરિણામમાં બળ જોઈએ. આવડો મોટો સમાજ, એ સંપ્રદાયનો ત્યાગી વર્ગ (પણ) હોય છે, એ બધાંનો (ત્યાગ કરીને) સામે ચાલીને જ્ઞાનીપુરુષના ચરણમાં જવાનું થાય છે. અત્યારે એટલી તકલીફ નથી, જેટલી સો વર્ષ પહેલા તકલીફ હતી. કેમકે અત્યારે થોડી ધર્મ ચુસ્તતા ઘટી છે અને Rigidity ઘટી છે. સમાજ વ્યવસ્થામાં પણ ઘણો ફેર પડ્યો છે. Inter cast marraige થવા લાગ્યા છે. એટલે સામાજિક બંધનો બહુ ઢીલા થઈ ગયા છે. નહીંતર જીવને સમાજ પ્રતિબંધ બહુ નડે છે. ધર્મના ક્ષેત્રમાં એનો સામનો કરવો પડે છે.

ત્યાર પછી રહ્યો - કુટુંબ પ્રતિબંધ. કુટુંબમાં બધાં એક મતના હોતાં નથી. એટલે પરમાર્થમાર્ગ પ્રત્યે જ્યારે કોઈ જીવ વળવા માટે તૈયાર થાય છે, સંસારથી છૂટવાનો પ્રથમ પ્રયત્ન કરે છે, જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનો (પ્રયત્ન કરે છે) ત્યારે એના જ કરેલા પૂર્વકર્મો સામે આવીને ભા રહે છે અને એમાં નજીકના નિમિત્તો હોય છે - કુટુંબના સત્યો. એ લોકો નારાજ થાય છે. એ સંસારથી બહાર નીકળવાવાળાને સંસારમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે. (એ કુટુંબીજનો એમ કહે છે) ‘હજુ આપણે ઘણાં કામ બાકી છે, હજુ તારી ઊંમર નથી.’ નાની ઊંમર હોય તો ઊંમરનો બાધ આવે. અને બધાંને (બધાં) કામ બાકી જ હોય છે. કોઈને કોઈ કામ બાકી નથી હોતા, એવો કોઈ સંસારી ગૃહસ્થ નથી. બધાંને બધાં કામ બાકી જ દેખાય છે. એટલે (એમ કહે કે) ‘પહેલા આ કર, પહેલા આ કર ! પછી (આત્મકલ્યાણ) કરવાનું (ખરું) પણ પહેલા આ કરવાનું. (સંસારના કામ કરતાં-કરતાં) સાથે-સાથે તું કર એનો વાંધો નથી પણ પહેલા આ કર !’ (આમ) સંસાર છે એ Top priorityમાં રહે છે અને આત્મકલ્યાણ Last priority માં રહે છે અને અત્યાર સુધી એમ

જ ચાલ્યું છે. આત્મકલ્યાણને Top priority માં મૂળ યા વિના અને સંસારના કાર્યોને અને આખા સંસારને Last priority માં રાખ્યા વિના, કદી આત્મકલ્યાણની દિશામાં પ્રગતિનું એક કદમ પણ ભરી શકાય, એવી વસ્તુસ્થિતિ નથી. કેમકે એનું (આત્મકલ્યાણનું) એટલું મૂલ્ય છે, એટલું મૂલ્યાંકન આવવું જોઈએ, એટલું મૂલ્યાંકન આંક્રાય વિના, કદી એ દિશામાં પદાર્પણ થતું નથી. એટલે (આમ) એકતાન થવું પણ સુલભ નથી - ઘણું હુલ્લબ છે. પ્રાય: આવું બને છે. ભાગ્યેજ કોઈના કુટુંબમાં બધાં એક મતના હોય છે કે, જેથી કોઈ ધર્મ સાધન (આત્મકલ્યાણ) કરવા તૈયાર થાય તો બધાં જ અનુકૂળ થાય કે 'કાંઈ વાંધો નહીં' - તારે જે કરવું હોય તે કર. અમે બધાં બાકીનું સંભાળી લઈશું. જો તું આત્મકલ્યાણ કરતો હોય તો અમારા બધાંની અનુમોદના છે.' એવું હજારો કુટુંબમાંથી કોઈ એક કુટુંબ નીકળે પણ ખરું. તો પણ અહીંયા એક લાલબજી મૂકવા જેવી છે અને તે એ કે - અનુકૂળતા છે માટે હું ધર્મ સાધન કરી શકીશ - એવો જે અભિપ્રાય; એ પ્રતિકૂળતા હોય તો હું ધર્મ સાધન ન કરી શકું - એવા અભિપ્રાયના સિક્કાની બીજી બાજુ છે. જે પ્રતિકૂળતાથી ગભરાય છે અને આત્મકલ્યાણના માર્ગ અને અવરોધ સમજે છે - એ અનુકૂળતામાં ફસાયા વિના રહી શકે નહીં. અનુકૂળતામાં ફસાય તે આત્મકલ્યાણ કરી શકે નહીં. કેમકે તે પ્રતિકૂળતાથી ગભરાયેલો જ છે. એ ભય એને અંદરમાં ભોજ છે. એ ભયથી ગ્રસિત જ છે. આત્મકલ્યાણનો માર્ગ અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પર છે. એનું Level જુદું છે (અને) આત્મકલ્યાણના પરિણામનું Level જુદું છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાને ગણકાર્ય વિના જે આગળ વધવા માગે છે, એનું કાર્યક્રમ છે એ - આત્મકલ્યાણ છે. એટલે પ્રતિબંધ છે એ પોતાના પરિણામો છે, કુટુંબ નથી. કહેવાય કુટુંબ પ્રતિબંધ પણ કુટુંબ પ્રત્યેના પોતાના જે લાગણી ભરેલા પરિણામો - તેનું નામ કુટુંબ પ્રતિબંધ છે. પછી એ કુટુંબના સભ્યો નારાજ થાય તો એની લાગણી સાથે સ્પર્શ થાય છે અને રાજી થાય તો પણ એની લાગણી સાથે જ સ્પર્શ થાય છે. બજેમાં વાત તો એક જ છે. એ લાગણીથી પર થવું પડે છે ત્યારે જીવ કુટુંબ પ્રતિબંધથી ધૂટે. 'એ મારાં નથી.' (એમ લાગવું જોઈએ).

કૃપાળુદેવે ૫૩૭ પત્રમાં આ મૂળ વાત કરી છે. ૫૩૭ પત્ર જોઈએ આપડો - કૃપાળુદેવના પોતાના શબ્દોમાં જોઈએ તો - ૪૩૬ પાને પહેલા

પેરેગ્રાફની વચ્ચે લીટી છે, ‘...અજ્ઞાનદર્શરૂપ સ્વભરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે...’ એટલે કુટુંબાદિમાં (રહેલા) આત્માઓને વિષે. ‘...સ્વપણો માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે,...’ પિતા-પુત્ર કહીને કુટુંબની વાત લઈ લીધી છે. જ્યાં બીજા આત્માઓ વિષે કોઈપણ સંબંધ - ખરો સંબંધ છે એમ માન્યું, કહેવા માત્ર વ્યવહારિક સંબંધ છે એ વાત જુદી છે, પણ ખરો સંબંધ (છે) એમ માન્યું એટલે નરક નિગોદાદિ ગતિનો હેતુ તે જ છે. અને પ્રતિબંધરૂપ સંસારનું કારણ કહ્યું. એ (પરિજ્ઞામ હોય તારે) ગુરુઆજ્ઞા ઉપાસવામાં - (એમાં) એકતાન થવામાં તકલીફ પડે છે. કેમકે એક જગ્યાએ એકતાન થાય તો બધી જગ્યાએથી ઢી જવું પડે, ત્યારે એકતાન થાય. બધી જગ્યાએથી ઢી જવ એટલે બધી (જગ્યાએથી) લાગણી ધૂટી જાય.

(કૃપાળુટેવ) સૌભાગ્યભાઈને લખે છે કે, ‘તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થાઓ. એવી ગાંડી શિખામણ આ સ્થળે લખી છે.’ ગાંડી શિખામણ કેમ કહ્યું ? કેમકે જગતમાં તો એ વાત ગાંડપણવાળી ગણાય, (અને એમ લાગે) ‘પોતાના કુટુંબનો સ્નેહ છોડી દેવો ? આ તે કાંઈ રીત છે ? તો (પછી) કોની સાથે સ્નેહ કરવો ?’ (અહીંયા એમ કહે છે) જો સ્નેહ કરવો હોય તો શ્રીગુરુ સાથે કરવો, જ્ઞાનીપુરુષ સાથે કરવો, તો સંસારથી ધૂટી જવાશે. એ સ્નેહ એવો કરવો કે (એમાં) એકતાન થવું ! નહીંતો બાકીનો સ્નેહ તો ચારગતિમાં રખડવા માટે અત્યાર સુધી અનંતવાર કર્યો છે અને હજુ જો ચાલુ રાખે તો એ જ પરિસ્થિતિ છે, એ જ વિટંબણાઓ છે, એ જ દુઃખ અને દુઃખના કારણો ભા છે. એટલે (આજ્ઞામાં) એકતાન થવું એ સુલભ નથી - ઘણું કઠણ છે (અને) એમાં અનેક વિટંબણાઓ આવે છે. એ લાગણીઓથી પર થવું એ બળ માગે છે. એનું બળવાનપણું જોઈએ. ખરેખર જેને આત્મકલ્યાણ કરવું હોય તેને જ એ બળ આવે, બીજાને એ બળ ન આવે.

અહીંયા પણ એક મૂળની વાત, એક તપાસવા જેવી વાત એ છે, જીવને પોતાને પોતાના આત્મામાં એક પ્રશ્ન પૂછવા જેવો છે કે, ખરેખર આત્મકલ્યાણ કરવું છે ? શુદ્ધ અંતકરણથી આ વાત (આવી) છે ? પૂરી પ્રમાણિકતાથી

આ વાત છે ? કે હજુ કાઈક ખૂણો-ખાંચરે પણ સંસાર ઉપાસવો છે ? કે આ જગતના સુખની અલ્ય પણ છચ્છા અભિપ્રાયબુદ્ધિએ રહી છે ? કેમકે ચારિત્રમોહની વાત જુદી છે. ત્યાં સુધી આત્મા ઉપાસવો છે કે ગુરુઆજ્ઞામાં એકતાન થવું છે, એ વાત સંભવિત નથી, (એ વાત) બની શકતી નથી. એટલે અહીંથા એને એમ કહ્યું કે, અસુલભ છે - (આજ્ઞામાં) એકતાન થવું પણ અસુલભ છે. કેમકે જીવ આત્મકલ્યાણની ભાવના રાખે છે એને એ ભાવનાના ક્ષેત્રમાં આવેલા સંઘાંધ જીવોમાં કોઈ એક વિરલ જીવ એવો હોય છે કે જેને આ જગતમાંથી આબરુ, કીર્તિ, માન-સન્માન, કે કોઈપણ પદાર્થ, કોઈપણ સંયોગની કાઈપણ છચ્છા નથી. માત્ર એક આત્મકલ્યાણ જ પૂરી પ્રમાણિકતાથી, પૂરી ઈમાનદારીથી કરવું છે. એવા શુદ્ધ અંત:કરણવાળા જીવને આજ્ઞામાં એકતાન થવું સુલભ છે.

કોઈ એક અપેક્ષાએ, જે ધારું જ અસુલભ છે એ સુલભ પણ છે. ધારું જ અસુલભ છે એમ કહીને કોઈ નાસીપાસ થવાની વાત કરતા નથી કે, કોઈ Depression માં આવવાની વાત નથી. સુલભ પણ છે (અને) એ સુલભ

ચારે છે ? કે શુદ્ધ અંત:કરણથી આત્મકલ્યાણની ભાવના હોય, જિજાસા હોય, તો સુલભ પણ છે. પણ એવું લગભગ - પ્રાય: જોવામાં આવતું નથી. એથી એમ લખ્યું કે, ‘બહુ અસુલભ છે.’ કેમકે જીવ ખાસ કરીને પ્રકૃતિના ઉદ્યમાં બેંચાય છે, જોડાય છે એને ત્યાં માર ખાય છે - પછાડ ખાય છે. આજ્ઞામાં (કોઈ) જીવ એકતાન થઈ ગયો હોય તો એ એકતાન થઈ ગયેલા જીવને પ્રકૃતિના ઉદ્યમાં પણ વિજય મેળવવો સુલભ પડે છે. કેમકે એને માર્ગ પ્રાપ્તિ સુલભ છે. એકતાન થયા વિના અસુલભ છે તો એકતાન થાય તેને સુલભ છે. એ વાત એમાંથી અનર્પિતપણે નીકળે છે.

કુટુંબ પ્રતિબંધ પછી શરીર પ્રતિબંધમાં - શરીરની અનુકૂળ સંયોગની પરિસ્થિતિ, પ્રતિકૂળ સંયોગની પરિસ્થિતિ, શાતા-અશાતાની મુખ્યતા - એ મુખ્યતામાં આત્મકલ્યાણને ગૌણ કરવામાં આવે અથવા આત્મકલ્યાણના નિભિત્તભૂત એવા યથાર્થ સત્સંગને અને સત્પુરુષના યોગને - સમાગમને ગૌણ કરવામાં આવે છે, ત્યારે એને શરીર પ્રતિબંધ છે. શરીર પ્રત્યેની લાગડી નરે છે એને (આજ્ઞામાં) એકતાન થવા દેતી નથી. (કૃપાળુટેવે) ૬૦૮ પત્રમાં બહુ સ્પષ્ટ હું કે, દેહત્યાગ થવા જેવો પ્રસંગ આવે તો પણ સત્સંગને ગૌણ

કરવો નહીં. કેમકે આત્મકલ્યાણના હેતુભૂત એવું, ‘સત્સંગ’ જેવું બીજું કોઈ સાધન નથી. પ્રાણથી પણ અધિક સત્સંગનું મૂલ્યાંકન થવું જોઈએ. મારે જમ્યા વિના ચાલશે, પાણી પીધા વિના ચાલશે, અરે...! શાસોશ્વાસ વિના પણ ચાલશે ! પણ સત્સંગ વિના નહીં ચાલે ! શાસોશ્વાસ પ્રાણ છે, પણ શરીરના પ્રાણ છે. સત્સંગ મારા આત્માનો પ્રાણ છે. આમ તો જ્ઞાન અને દર્શન આત્માનો પ્રાણ છે.

સમયસારની ૪૭ શર્ટ તમાં - જીવત્વશર્ટ તમાં એ શર્ષદ વાપર્યો છે કે, જ્ઞાન અને દર્શન આત્માના પ્રાણ છે. પણ મુમુક્ષુની ભૂમિકામાં ‘સત્સંગ’ એ અનો પ્રાણ છે અને તે શરીરના પ્રાણથી (પણ) અધિક મૂલ્યવાન છે. એટલું જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આજ્ઞામાં એકતાન થવાની વાત ભૂલી જવા જેવી છે. કેમકે એ ગુરુઆજ્ઞા છે. ‘દેહત્યાગના પ્રસંગને પણ સ્વીકારવો’ એવા શર્ષદો (૬૦૮ પત્રમાં) લખ્યા છે. એ આજ્ઞા છે. સર્વ મુમુક્ષુ જીવ માટે એ આજ્ઞા છે.

૧૯૫ (પત્રમાં) કહ્યું, પરિભ્રમણની વેદનામાં આવવું, જુરણામાં આવવું. (એ ચિંતનામાં) દૃઢ થઈને જ્યોર્યા વિના માર્ગની દિશાનું અલ્ય પણ ભાન થવું, એ બની શકવા યોગ્ય નથી. એ આજ્ઞા છે. ‘તમારે સઘળાએ એ જ શોધવાનું છે.’ (એમ લખીને) બધાં મુમુક્ષુને આજ્ઞા કરી છે. જો (આ પરિભ્રમણની) વેદનામાં ન આવે (તો) અનો અર્થ એ કે (એ જીવ) સંસારની - જડની - અનાત્માની ચિંતામાં ઘેરાયેલો છે. ત્યાંથી હજી બહાર નીકળ્યો નથી (અને) આજ્ઞામાં આવ્યો નથી. આ આજ્ઞામાં એકતાન થવાનો એક સામાન્ય નિયમ ૧૯૫મો પત્ર છે કે, ‘તમારે સઘળાએ’ (એમ કહીને) બધાંને આજ્ઞા કરી છે. ‘તમારે સઘળાએ એ જ શોધવાનું છે.’ (પોતે) તપાસી લેવું કે એ વેદનામાં (અને) જુરણામાં જીવ ચારે આવ્યો ? કેટલો આવ્યો ? અને એના ફળસ્વરૂપે નિર્મજના કેટલી આવી ? કેમકે ત્યારપછી જ બીજું શું કરવું તે સમજાય છે. તો સમજાયું (ખરું) ? જુરણામાં આવ્યા વિના એ સમજાય નહીં.

એમ અનેક પ્રકારે જ્ઞાનીપુરુષની જે આજ્ઞા છે, (એમાં) પોતાને કરી આજ્ઞા અત્યારે લાગુ પડે છે - એ વાત જ્યાં સુધી સમજામાં ન આવે અને એમાં પૂરા પ્રયત્નથી એકતાન થઈને લાગે નહીં. ત્યાં સુધી આ જીવ જ્ઞાનીની આજ્ઞાને અનુસરવા માગતો નથી, સ્વચ્છંટે વર્તવા માગે છે, અને ત્યાં સુધી કોઈ કાળે

પણ આત્મકલ્યાણના માર્ગની પ્રાપ્તિ નથી.

કૃપાળુંદેવે તો અહીંયા ખીમજ્જમાઈને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘એને માટે તમે શું ઉપાય કરશો?’ એકતાન થવા માટે શું ઉપાય કરશો? ‘અથવા (કરવા) ધાર્યો છે?’ આથી વધારે શું? ‘અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે’ એમ કહીને પત્ર સમાપ્ત કર્યો છે. પણ પત્રની અંદર અનંતકાળમાં થયેલી અનંત ભૂલો આ જગ્યાએ થઈ છે, એને સુધારવા માટે એક High light મૂકી છે. એ વાત આપડી સમજમાં આવે તો કામ થવાનું સુલભ છે. સમય થયો છે.



“સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ (કહેવાઈ) હોય તોપણ, તેનો પરમાર્થ, સત્પુરુષનો સત્સંગ જેને આજાંકિતપણે થયો નથી, તેને સમજવો દુર્લભ થાય છે.”—શ્રીમદ્ભૂ.

સત્પુરુષની વાણીમાં ‘જ્ઞાનદશા’નો વિષય સ્વાનુભવપૂર્વક વ્યત્યાય છે, તેમાં જે પરમાર્થમાર્ગમાં પોતાનું નિર્ગમન થઈ રહ્યું છે તે માર્ગના અપૂર્વ ભાવોની અભિવ્યક્તિ ત, તેમજ ઉદ્યમભાવો અને તે અંગોની ચેષ્ટાએ વરતતાં, પર-અપર ભાવોની વિલક્ષણતા સમજવા અર્થે, યોગ્યતાની અપેક્ષા રહે છે; જે પ્રકારની યોગ્યતાની અપેક્ષા છે, તે પ્રાય: આજાંકિતપણમાં સંપ્રાપ્ત હોય છે. તેથી ઉત્તે વચ્ચેનામૃતની ગંભીરતા અને આજાંકિતપણે સત્સંગનું મૂલ્યાંકન, મુમુક્ષુજીવને થતાં, પરમાર્થની પ્રાપ્તિનો અવકાશ થાય, તે પરમહિત થવાનું બીજ છે. તેથી એક લક્ષે જ્ઞાનોપુરુષની વિલક્ષણતા સમજતા, તેમના પ્રત્યે અનન્ય ભર્તી ત / પ્રેમનું કારણ થાય છે.

— પૂજ્ય ભાઈશ્રી  
(અનુભવ સંજીવની - ૫૩૮)

ॐ

‘શ્રીમદ્ રાજચંદ્ર’

પત્રાંક - ૧૯૪

મુંબઈ, પોષ, ૧૯૪૭

જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ?

એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.

હાલ વિશેષ લખી શકવાની કે જ્ઞાનવવાની દશા નથી, તોપડા એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે.

અમને લાગે છે કે માર્ગ સરળ છે, પડા પ્રાપ્તિ યોગ મળવો દુર્લભ છે.

સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભર્ત તથે નમોનમઃ

ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પડા જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પડા પ્રાઇસી છૂટવા છય્યે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે આનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી, (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષચ્યા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે.

જોકે તેણો જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણો કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.

સૂયગડાંગસૂત્રમાં ધમદેવજી ભગવાને જ્યાં અહ્ષાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગ ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :

હે આયુષ્યમનો ! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચ્ચન, તેનો ઉપદેશ તે સાંબળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.

સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશો છે કે જગત આખાનું જેણો દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણો આમ અમને કહ્યું છે :- ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.

એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળો અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.

આણાએ ધર્મો આણાએ તવો ।

આજાનું આરાધન એ જ ધર્મ અને આજાનું આરાધન એ જ તપ.

(આચારાંગ સૂત્ર)

સર્વ સ્થળો એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણો સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગ જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશો. ઉપશમ મળે અને જેની આજાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો.

બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય.

પ્રવચન - ૨

‘શ્રીમદ્ રાજચંદ્’ પત્રાંક-૧૯૮

તા. ૦૮/૦૬/૧૯૮૮૪ - ભાવનગર

---

---

શ્રીમદ્ રાજચંદ્ વચનામૃત. પત્રાંક ૧૯૮, પાનું ૨૫૮. લલ્લુજી મુનિ ઉપરનો પત્ર છે. પત્રનો મુખ્ય વિષય નીચેના Paragraph થી શરૂ થાય છે. એ પહેલાં થોડી પ્રારંભિક સૂચના કરી છે. પહેલું જ વચન પ્રશ્નાર્થમાં મૂં યું છે.

‘જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ?’ શું પ્રશ્ન ચો છે ? કે આ જીવે અનંતકાળમાં સંસારથી મું ત થવા માટે ધર્મના ક્ષેત્રમાં ઘણી પ્રવૃત્તિ કરી છે. ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે એમાં સંસારઅર્થે પ્રવૃત્તિ કરી છે. ખરેખર મું ત થવા અર્થે પ્રવૃત્તિ કરી નથી. કોઈ વખત અથવા અનેકવાર તો સ્પષ્ટ સંસારના પદાર્થોની વાંછા રાખી છે અને કોઈવાર મોક્ષની વાંછા રાખી છે, પણ એ ઉપર ઉપરથી, યથાર્થપણે ધ્યયને બદલીને નહીં, ધ્યયને બદલ્યા વગર રાખી છે એટલે મોક્ષ પામવાને બદલે સંસાર ફળેલો છે.

જન્મ-મરણથી મું ત થવારૂપ જે મોક્ષ છે અથવા નિર્ઝર્મ દશારૂપ જે મોક્ષ છે, શાસ્ત્ર-ભાષામાં એને નિર્ઝર્મ દશારૂપ મોક્ષ કહેવામાં આવે છે, એ કર્મનું ફળ જન્મ-મરણ છે અને એનો નાશ થવારૂપ જે મોક્ષ છે, એના ઉપાયને અહીંયા માર્ગ કહે છે. એવી દશાએ પહોંચવાનો જે ઉપાય છે એને અહીંયા માર્ગ કહે છે. એ ઉપાય નહીં જડવાનું કારણ શું ? એમણે પ્રયોજનભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે.

લલ્લુજી મુનિ તો દીક્ષાધારી હતા. તે પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા લીધેલી. એ જમાનામાં એવું હતું, કે કોઈ સ્ત્રીને સંતાન ન થાય તો એ સ્ત્રી પોતે (પોતાના પતિને) બીજી સ્ત્રી પરણવા (માટે) રજા આપી દે. કાયદા-કાનૂન પણ એવાં નહોતાં. બીજી (સ્ત્રીને પુત્ર) ન થાય તો ત્રીજાને પરણવાની પણ છૂટ આપે. એવી રીતે એમને ત્રણેક સ્ત્રીઓનો યોગ હતો, અને એક ગંભીર

માંદગીમાં આવી ગયા પછી, હળુકર્મા આત્મા હતા, એટલે વિચાર આખ્યો કે જો આ માંદગીમાંથી બચી જાઉં તો સંસાર ત્યાગ કરી દેવો છે. એટલેકે ગૃહસ્થીનો ત્યાગ કરી દેવો છે. એટલે સ્થાનકવાસી સંપ્રદાયમાં - મુહૂરતિમાં દીક્ષા લઈ લીધેલી. છતાં માર્ગ નથી મળ્યો અનું શું કારણ? ઘર તો છોડ્યું. વ્યાપાર કે જે કંઈ વ્યવસાય હશે એ પણ છોડ્યો. અહીંયા આપણે રસ્તામાં આવે છે ને? વટામણ, વટામણ કરીને ગામ આવે છે. અહીંથી ખંભાત બાજુ જતાં તારાપુર પહેલાં વટામણ ચોકી આવે છે ને, એ વટામણના હતાં. ત્યાં ફૂપાળુદેવનું આશ્રમ જેવું સ્થાન રાખ્યું છે.

(માર્ગ નથી મળ્યો અનું) શું કારણ છે? શાસ્ત્રો ભાષ્યો, યમ-નિયમ-સંયમ પાલ્યા, ઘણું કર્યું (છતાં) માર્ગ નહીં મળવાનું શું કારણ છે? ઉપાય નહીં જડવાનું શું કારણ છે? આ એક મુદ્દા ઉપર જ આખો પત્ર છે કે, માર્ગ નહીં મળવાનું શું કારણ? જીવને માર્ગ મળ્યો નથી (એમાં) અનંતકાળ (શબ્દ) અધ્યાહર છે. અનંતકાળમાં, અનંતપ્રકારના પ્રયત્નો કરવાં છતાં; અનંતવાર, અનંત પ્રકારે, અનંતકાળમાં પ્રયત્નો કર્યા છતાં પણ મોક્ષનો ઉપાય ન મળ્યો અનું શું કારણ છે? એમણે આ પ્રશ્ન કર્યો છે.

‘એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.’ એનો ઉત્તર અહીંયા સાથેના પત્રમાં છે. નીચે જે Paragraph થી શરૂ થાય છે, એમાં એનો ઉત્તર છે. ‘એ વારંવાર વિચારી યોગ્ય લાગે...’ યોગ્ય લાગે એટલે જિજાસા બરાબર પરિપક્વ થાય ત્યારે સાથેનું પત્ર વાંચજો.

‘હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી...’ ૨૪મું વર્ષ છે. હજુ સમ્યક્કદર્શન થયાં ત્રણોક મહિના થયા છે. પોષ મહિનાનો (પત્ર છે). પોતાની દશાનો ઉલ્લેખ કર્યો છે કે લાંબુ-લાંબુ લખવાની કે જણાવવાની અમારી દશા નથી. (એટલેકે) વિકલ્પ એટલાં ચાલતા નથી. ‘તોપણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે...’ અવસરે એટલે આ વખતે - આ પ્રસંગે, ‘યોગ્ય લાગ્યું તે લખ્યું છે.’ લખે છે તો વખત જોઈને લખે છે કે, આ જીવની યોગ્યતા અત્યારે કેવી છે? એ બરાબર માપીને લખે છે. અનું નામ ‘અવસરે લખ્યું છે.’ (એમ થાય છે). ‘...લખી શકવાની કે જણાવવાની દશા નથી...’ (અર્થાતું) જણાવવાની પરિસ્થિતિ નથી. ‘તોપણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે...’ (એટલેકે) તમારી માગડી

છે (કે) કંઈક આ પામરને માર્ગદર્શન આપો, આ પામરને કંઈક બોધ આપો. એ તો બહુ નમતાવાળા હતા. એકદમ ભી તવાન અને નમતાવાળા હતા. તો (કહે છે) એક તમારી વૃત્તિ દુભાતી અટકે એટલા માટે આ લખ્યું છે. આખો પત્ર લખ્યો છે.

(આગળ લખે છે) ‘અમને લાગે છે કે માર્ગ સરળ છે.....’ મોક્ષ પામવાનો ઉપાય સરળ છે - કઠણ નથી, એમ કહે છે. ઠીક ! સરળ છે એટલે કઠણ નથી, એનું નામ અહીંયા સરળ છે. ‘પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.’ આ ‘યોગ’ (શબ્દ) છે એ એમણે ગંભીર શબ્દ લીધો છે. તે માર્ગ પ્રાપ્તિનો યોગ મળવો, એટલેકે પ્રત્યક્ષ સત્પુરુષ મળવા દુર્લભ છે અને પ્રત્યક્ષ સત્પુરુષ મળે ત્યારે તથાપ્રકારની પોતાની યોગ્યતા હોવી દુર્લભ છે. નહીંતર અનંતકાળમાં અનંતવાર સત્પુરુષ મળ્યા છે, નથી મળ્યા એવું કંઈ નથી. પણ યોગ મળવો દુર્લભ છે એટલે યોગાનુયોગ થઈ જવો, આ બાજુ યોગ્યતા તૈયાર થાય અને આ બાજુ સત્પુરુષ મળે. આવો જો મેળ થઈ જાય (તો) એનો ધૂટકો થઈ જાય. બે સાથે હોવું (અર્થાત्) ઉપાદાન અને નિમિત્ત - બે સાથે થાય એટલે કાર્યસિદ્ધ ન થાય એવું બને નહીં. નહીંતર નિમિત્ત, નિમિત્ત નથી ખરેખર તો. નહીંતર જે નિમિત્ત મળ્યું એ ખરેખર એને માટે નિમિત્ત નથી. આત્મકલ્યાણનું નિમિત્ત એને માટે નિમિત્ત ન રહ્યું. પછી થોડાંક પુછ્ય બાંધ્યા હોય (એ) ચપટી રાખ જેવી વાત છે. એ તો આગળ જતાં બળી જાવાના. ‘અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.

‘સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભી તએ નમોનમઃ’ હવે જે પત્ર શરૂ કર્યો છે એનું મથાળું બાંધ્યું છે. ‘સત્સ્વરૂપ’ એવું જે પોતાનું આત્મસ્વરૂપ એને ‘અભેદભાવે’ એટલે નિર્વિકલ્પ અભેદ અનુભવથી ‘અનન્ય ભી તએ’ (એટલે) બહુમાનથી. એ (બહુમાન) વગર તો એવી દશા આવે નહીં. (સ્વરૂપનો) અપૂર્વ મહિમા આવે ત્યારે એના ફળ સ્વરૂપે, નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ દશા થાય. એને (અહીંયા) અનન્ય ભી ત કહી છે. અન્ય પરિણામ ન રહે એવી ભી ત (તેને અનન્ય ભી ત કહેવાય છે). વિકલ્પમાં વિકલ્પરૂપ પરિણામ - ભી તના વિકલ્પરૂપ પરિણામ અન્ય રહે છે અને આત્મા અન્ય રહે છે. કેમકે વિકલ્પમાં રાગ છે (જ્યારે) આત્મા વીતરાગ સ્વરૂપ છે. રાગ અને વીતરાગતા સાથે થતાં નથી. અન્ય-અન્ય રહે છે, ભિન્ન-ભિન્ન રહે છે.

જ્યારે વીતરાગી સ્વરૂપ અને વીતરાગ ભાવ અનન્ય થઈ જાય છે. વીતરાગ સ્વરૂપના અવલંબને અભેદભાવ થતાં, ભી ત પણ અનન્ય થઈ જાય છે, એટલે અભેદભાવ લીધો. ભી ત અન્ય વિકલ્પરૂપ રહેતી નથી.

એ પ્રકારનો અમારા આત્માને અમારો નમસ્કાર છે. ઠીક ! અમારા આત્માને અમારો નમસ્કાર છે. એક જગ્યાએ લીધું છે, ‘નમસ્કાર કરવા યોગ્ય એવો હું.’ કોણ ? નમસ્કાર કરવા યોગ્ય એવો હું મને પોતાને જ નમસ્કાર કરું છું. એવું મારું સ્વરૂપ છે.

મુમુક્ષુ :- ગુરુદેવશ્રીએ નિયમસારના પ્રવચનમાં સત્પુરુષને અંતરંગ નિમિત્ત કહ્યા છે.

પૂજ્ય ભાઈશ્રી :- હા, સત્પુરુષને અંતરંગ નિમિત્ત કહ્યા છે, બરાબર છે. એ બહુ ગૂઢ વાત છે. એ (સત્પુરુષ) અંતર સુધી પહોંચે છે - મુમુક્ષુના અંતરંગ સુધી પહોંચી જાય છે. એની દશાને માપે છે કે આ જીવને અત્યારે કઈ વાત કરવી જોઈએ ! તેને જે કાંઈ દવા આપવી છે, ઔષધ આપવું છું, એ કઈ માત્રાનું અને ચા ટાણે આપવું ? કેટલી માત્રામાં આપવું ? ચારે-

ચારે આપવું ? કેટલું આપવું ? એના અંતરંગ સુધી પહોંચે છે અને યોગ્યતાવાન મુમુક્ષુ પણ સત્પુરુષના અંતર સુધી પહોંચે છે. એ તો આપણે હમણાં ૨૧૩ (પત્ર) માં લીધું. જુઓ ! ભૂલાઈ ગયું હોય તો જરા પાકું થઈ જશે. ચોથો Paragraph (છે).

‘એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સત્પુરુષનાં અંત:કરણ,...’ અહીં અંત:કરણ સુધી કોણ પહોંચ્યું ? મુમુક્ષુ પહોંચ્યો. ‘...એવાં સત્પુરુષનાં અંત:કરણ, તે જોઈ અમે પરમાશર્ય પામીને નમીએ છીએ.’ એટલે એ અંતરંગ નિમિત્ત છે. એકબીજાના અંતર સુધી પહોંચે છે. પરિણામમાં અંતરંગરૂપ જે પરિણાતિ છે, એ અંતરંગમાં પહોંચનારા હોવાથી પરસ્પરને અંતરંગ નિમિત્ત કહેવામાં આવ્યા છે.

કૃપાળુદેવ સોભાગભાઈનો સત્ત્વસમાગમ શું કરવા હયતા હતાં ? (કેમકે) એ એમના અંતરંગ નિમિત્ત હતાં. ઠીક ! એ એમના અંતરંગ નિમિત્ત હતાં. એમના સમાગમમાં પોતાનો આત્મા અંદરથી ખીલી ઉઠતો હતો, કોળી ઉઠતો હતો. અંદરથી રહસ્યમાંથી તત્ત્વ બહાર આવતું હતું. (કૃપાળુદેવ) એમના

(સોભાગભાઈના) અંતરંગ સુધી પહોંચતા (અને) સોભાગભાઈ કૃપાળુદેવના અંતરંગ સુધી પહોંચે. એટલા માટે અને અંતરંગ નિમિત્ત કહેવામાં આવ્યું છે. નહીંતર નિમિત્ત તો બહાર છે. સ્થૂળ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો નિમિત્ત તો બાબુ પદાર્થ છે. અહીંયા નિમિત્તને બાબુ પદાર્થ કહેવામાં આવતો નથી. ઠીક ! અથવા જો આવા નિમિત્તને બાબુ નિમિત્ત કહેવામાં આવે તો એ સરાસર અપમાન છે. એ નિમિત્તનું અપમાન છે. ઠીક ! અને એ સરાસર અન્યાય છે.

મુમુક્ષુ :- એવો જે ભેટ પાડતો હોય અને માટે માર્ગ જ વિકટ છે.

પૂજ્ય ભાઈશ્રી :- હા, અને માર્ગ વિકટ છે. અને બાબુ નિમિત્ત કીધું એટલે એ ચ ન રહ્યું. જે ૨૨૭ (પત્ર) માં આપણે વાંચ્યું. (સત્પુરુષને) બાબુ નિમિત્ત ગણે તો અને એ ચ ન રહ્યું, અને જો એ ચ ન રહ્યું, તો અને તો માર્ગની પ્રાપ્તિ અતિ વિકટ છે. અને તો ઘણી વિકટ છે.

‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે...’ ત્યાં અસંગ અંતઃકરણ લીધું. ૨૧૩ (પત્ર)માં શુદ્ધ અંતઃકરણને અસંગમાં લીધું. અહીંયા અપ્રતિબદ્ધ લીધું. અપ્રતિબદ્ધ કહો, અસંગ કહો, નિર્લોપ કહો. અથવા શુદ્ધ અંતઃકરણ કહો. (બધું એકાર્થ છે).

‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષ...’ કેવાં જ્ઞાનીપુરુષને અહીંયા લીધા છે ? કે જેને કોઈ પ્રકારે ‘ભાવ’માં પ્રતિબંધ નથી. ક્ષેત્રથી ભલે હો, દ્રવ્યથી ભલે હો. દ્રવ્યે હજુ અવિરત હોવાથી બધા પ્રકારનો પ્રતિબંધ દેખાય. કપડાં પહેરે છે, કુટુંબ-પરિવાર છે, વ્યવસાય આદિ કરે છે, (છતાં) ભાવે પ્રતિબંધ નથી. અંદરથી ભાવે ધૂટા છે. એ બધાં જ સંયોગો વર્ચ્યે અંદરથી ભાવે અપ્રતિબદ્ધ - ધૂટા છે. અપ્રતિબદ્ધ છે એટલે ધૂટા છે.

‘નિરંતર વિચરે છે’ (એટલે) ધ્યાન લગાવીને બેઠાં નથી. ‘નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના...’ પહેલો શબ્દ પ્રેમનો લીધો છે. એક સત્પુરુષને જ શોધ, એ કહી ગયાને આગળ ? કોઈ (સત્પુરુષને) શોધે, ખોજે, અને અને મળે તો અનન્ય પ્રેમ આવ્યા વિના રહે નહીં. અનન્ય કહો કે અચળ કહો. અચળ એટલા માટે (કિદ્યું) કે કોઈપણ સંજોગોમાં વિચલિત ન થાય એવો (અચળ). કોઈપણ પ્રસંગોમાં વિચલિત ન થાય એવો. ‘અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીનિ આવ્યા વિના...’ આ

ઓળખાણ છે. પ્રતીતિ એટલે ખાતરી. આ સત્પુરુષ જ છે એવી ઓળખાણથી ખાતરી. (આવવી). (અ) ‘આવ્યા વિના સત્સ્વરૂપની,...’ એટલે પોતાના આત્મસ્વરૂપની ‘પ્રાપ્તિ થતી નથી,...’ પ્રાપ્તિ નામ અનુભવ થતો નથી. ત્યો ! આ અનુભવ થવા માટે કચો માર્ગ મેળવવો ? ચા માર્ગ જાવું ? એનો ચોખ્ખો ઉલ્લેખ છે.

મંદિરમાં દાખલ થતાં એમ વિચાર આવ્યો હતો કે આમાંથી (ગ્રંથમાંથી) પ્રત્યક્ષ સત્પુરુષના વિષયમાં કેવાં-કેવાં વચનો એમણે લખ્યા છે ? એક જ �Subject (તારવો). જેમકે દૃષ્ટાંત તરીકે ૧૮૮ (પત્ર) માં આપણે એક Paragraph લઈ શકીએ કે, ‘કોઈપણ પ્રકારે જીવ પોતાની કલ્યાનાએ કરી સત્તને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જે સત્ત પ્રાપ્ત થાય છે,...’ સજીવનમૂર્તિ એટલે પ્રત્યક્ષ. પરોક્ષને સજીવનમૂર્તિ કહેવામાં આવતાં નથી. ‘સત્ત સમજાય છે, સત્તનો માર્ગ મળે છે, સત્ત પર લક્ષ આવે છે. સજીવમૂર્તિના લક્ષ વગર,...’ એટલે પહેલાં સજીવનમૂર્તિ જોઈએ, પછી બધું શું કરવું ? ન કરવું ? કર્તવ્ય-અકર્તવ્યની સમજ પડે. એવા લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે,...’: ધૂટવાનો ઉપાય નથી. ગમે એ કરે નહીં. એને બંધન (થાય) છે. (અ) ધૂટવાનો ઉપાય નથી. ‘આ અમારું હદ્ય છે.’ અમારા હદ્યમાં ધૂટવા માટેની જીવને મું ત થવા માટેની મુખ્ય વાત કોઈ પડેલી હોય તો આ એક જ છે. ફેરવી-ફેરવીને કેટ - કેટલી જગ્યાએ કેવી કેવી શૈલીથી વાત કરી છે ! આ એક તારવવા જેવું (છે).

એ નિમિત્તે એ જ વિષયનો સ્વાધ્યાય થઈ જાય. પોતાને થાય અને પછી બીજાને પણ થઈ જાય. કારણકે હવે તો ‘આત્મ-જાગૃતિ’નું સાધન થઈ ગયું છે. (એટલે) સમાજને કોઈ વાત સંકલિત કરીને કોઈ ઢબથી, કોઈ શૈલીથી મૂકવી હોય (તો મૂકી શકાય).

(અહીંયા) કહે છે કે, એ (અચળ પ્રેમ આવ્યા) વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ત્રણોકાળે હોં ! ‘...અને આવ્યેથી...’ એવો અચળ પ્રેમ આવે અને એવી સમ્યક્પ્રતીતિ આવ્યેથી ‘...અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે.’ (અર્થાત્) એવી જ દશાને પામે છે. એમ કહેવું છે. ત્યો ! આ જ્ઞાની થવાનો સહેલામાં સહેલો ઉપાય ! એમ ન હું કે ફલાણું શાસ્ત્ર વાંચજો, તો તમને જ્ઞાન થશે. કેમકે જ્ઞાન થવા માટે જ્ઞાનાભ્યાસ

જોઈએને ! જ્ઞાન થવા માટે શું જોઈએ ? જ્ઞાનાભ્યાસ કરવો જોઈએને ! આ તો એક સામાન્ય માણસને ઘ્યાલ આવે છે એટલે પૂછે, મારે ચું પુસ્તક વાંચવું ? હવે અત્યારે મારે ચું પુસ્તક વાંચવું ? મારે જ્ઞાન મેળવવું છે માટે ( ચું પુસ્તક વાંચવું) તો અહીંયા એ કાંઈ વાત નથી કરી. નથી ઉપવાસ કરવાની વાત કરી, નથી પૂજા કરવાની વાત કરી, નથી દાન દેવાની વાત કરી કે નથી શાસ્ત્ર વાંચવાની વાત કરી. જુઓ ! કઈ વાત કરી છે ? કે એ (સમ્યક્) પ્રતીતિ અને (અચળ) પ્રેમ થતાં, જે મુમુક્ષુએ, જે જ્ઞાનીપુરુષનાં ચરણાવિંદ સેવ્યાં છે, તેની દશાને પામે છે. તે દશાને એ પામે છે. તે દશાએ એ પહોંચી જાય છે. પછી એ પૂર્ણતાને પહોંચે છે એ કહેવાની જરૂર નથી. ‘ગુરુ રવ્યા છભસ્થ’ ગુરુ છભસ્થ રહી જાય ને શિષ્ય આગળ નીકળી જાય ! પછી કાંઈ વાંધો નથી. પછી એને ગુરુને માટે રોકાવું પડતું નથી. એકવાર એ દશાને પામી જાય તો આગળ પણ નીકળી જાય.

(હવે કહે છે) ‘આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે.’ ત્રણેકાળના જે-જે જ્ઞાનીઓ થયા તે આ માર્ગ થયા. ભૂતકાળમાં થયા, અત્યારે થઈ રવ્યાં છે અને ભવિષ્યમાં પણ આ જ માર્ગ થશે. ‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ બીજા માર્ગ (જ્ઞાની) નહીં થાય, એમ કહે છે. કેમકે પહેલો પણ ઠાંયો છે કે, ‘જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ?’ (તો કહે છે) એને સત્પુરુષના ચરણારવિંદમાં અચળ પ્રેમ થયો નથી અને એને સત્પુરુષની સમ્યક્પ્રતીતિ આવી નથી. એટલે આ માર્ગ નથી મળ્યો. બીજો કાંઈ વાંધો નથી. એટલું કરે તો બીજું કોઈ શાસ્ત્ર વાંચવાની એને જરૂર નથી, જાઓ !

કેમકે સત્પુરુષ પોતે જ સાક્ષાત જીવંત આગમ છે. કેવાં છે ? સત્પુરુષ સાક્ષાત પોતે જ જીવંત આગમ છે. શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન ન થાય તે જ્ઞાન સત્પુરુષની અંતર પરિણતિથી થઈ જાય છે. એ (જ્ઞાન) તો સીધું જ થાય. સત્પુરુષની પરિણતિની એ જ વાત શાસ્ત્રમાં લખી હોય. જેવી સત્પુરુષની અંતરંગ પરિણતિ હોય તેવી દશાની વાત શાસ્ત્રમાં લખી હોય અને એ વાંચતાં જ્ઞાન ન થાય અને જો પરિણતિ જોવે તો જ્ઞાન થઈ જાય, લ્યો ! ઠીક ! કેમ એમ થતું હશે ? ચાલો, આ પ્રશ્ન છે.

કરીથી. સત્પુરુષની અંતરંગ શુદ્ધદશા-આત્મદશા વાંચીને જ્ઞાન ન પણ થાય. ન જ થાય એવું નહીં, ન પણ થાય. કોઈ યોગ્યતાવાનને - સંસ્કારીજીવને

થઈ જાય એની બીજી વાત છે. યોગ્યતા(વાનને) એટલે સંસ્કારીજીવને, બીજાને ન થાય. અને અત્યારે જે રહી ગયા છે એના સંસ્કારનો વિચાર કરવાની જરૂર નથી. એટલે આ તો વર્તમાન અપેક્ષાથી વાત છે કે એ (શાસ્ત્ર) વાંચીને (આત્મજ્ઞાન) ન થાય અને પરિણતિ જોવે તો થયા વિના રહે નહીં. કારણ શું ? ચાલો ! પ્રત્યક્ષતા. આ મુદ્રા છે. (શાસ્ત્રમાં) જે દશા લખી છે એમાં એ દશાનું વર્ણન પરોક્ષપણે ચાલી રહ્યું છે, અને જે દશા દેખાય છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. (અને જો) ઓળખાય તો પછી ઐ ચપણું થઈ જાય. અચળ પ્રેમ આવે તો ઐ ચપણું થઈ જાય. બસ ! આમ છે. તો ઐ ચપણું થઈ જાય.

ગુરુદેવ (બિરાજતા) હતા ત્યારે એ વિચાર આવતો હતો કે (એમના) અંતેવાસી થઈને રહેવું જોઈએ. મુમુક્ષુએ તો આવાં જ્ઞાનીપુરુષના અંતેવાસી થઈને રહેવું જોઈએ. દૂર ન રહેવું જોઈએ, આવે ન રહેવું જોઈએ, છેટે ન રહેવું જોઈએ (કે) ઠીક છે, આપણે વ્યાખ્યાન સાંભળીને જતા રહો, બહુ સારું વ્યાખ્યાન કરે છે ! બહુ સારું વ્યાખ્યાન આવે છે ! એમ આવે રહીને લેવું નહીં. અંતેવાસી થવું જોઈએ. એ વખતે બધાં વિચારો એવી રીતે ચાલતાં હતાં.

(અહીંયા કહે છે) ‘જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી,...’ અમને પણ જ્ઞાનપ્રાપ્તિ એવાં પ્રકારે જ થઈ છે. તો (કોઈ) કહે પણ આપને તો કોઈ ગુરુ મણ્યા હોય એવું અમારા જ્ઞાનવામાં તો નથી. કૃપાળુદેવને આ ભવમાં કોઈ ગુરુ મણ્યા હોય એવું તો જોવામાં આવતું નથી, અને મણ્યા હોય તો એનો ઉત્ત્વેખ કર્યા વિના (રહે નહીં). (એમના કથનમાં) ગુરુભ્રિત ત આવ્યા વિના રહે નહીં અને કેવી ગુરુભ્રિત ત આવે, એ ‘ગુરુ-ગુણ સંભારણા’માં વાંચી લેજો. મહિના-બે મહિનામાં બહાર આવી જશે. સૌના હાથમાં આવી જશે, બહુ ધૂટથી મળશે. ૫,૦૦૦ નકલ છપાવવાનો નિર્ણય લીધો છે, એટલે બધાંને ધૂટથી મળશે. ૧૫ રૂપિયાનું પુસ્તક ૫ રૂપિયામાં ધૂટથી મણ્યા કરશે અને આપણા મંડળમાં તો બધાંને ભેટ મળવાનું જ છે, એમાં કાંઈ પ્રશ્ન નથી.

શું કહે છે ? કે ‘જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી,...’ પોતાના જતિસ્મરણજ્ઞાન છે. પૂર્વભવમાં પણ જ્ઞાનપ્રાપ્તિ એકવાર થઈ ગયેલી છે અને તે નજીકના ભવમાં જ થયેલી છે, બહુ દૂરવર્તી ભવમાં નથી થયેલી. સમીપના ભવમાં (એટલે) કદાચ આ પહેલાના ભવમાં થઈ હોય તો ના નહીં. પણ કોઈ જ્ઞાનીપુરુષ એમને (ચોક્કસ) મણ્યા છે. તેમના ચરણારવિંદ પ્રત્યે એમને

અચળ પ્રેમ થયેલો, તેની સમ્યક્પ્રતીતિ આવેલી, અને પોતાને પણ એથી જ્ઞાનપ્રાપ્તિ થયેલી.

જો કે કૃપાળુદેવની તો પૂર્વભવની દ્રવ્યશુતની ઉપાસના પણ ઘડી જ હોવી જોઈએ, એવું લાગે છે. નાની ઉમરમાં જે એમનો ઉધાડ છે, જે પ્રકારનો અને જેટલો જેવડો એમનો ઉધાડ છે, તે (પૂર્વભવના) શુતની ઉપાસનાને સૂચવે છે. દ્રવ્યશુતની, જ્ઞાનીપુરુષોના વચનોની, શાસ્ત્રોની, આગમની ઉપાસના ઘડી કરી હોય, એ નવા ભવમાં પણ કેટલીક એ જાતની ક્ષયોપશમની મૂડી લઈને આવે, બીજી જાતનો ઉધાડ તો ઘડાંને હોય. પણ આ જાતનો ઉધાડ લઈને આવે, પરમાર્થિક ઉધાડ લઈને આવે (એવા કોઈક જ હોય). જ્ઞાન ન થયું હોય તોપણ એમ કહે કે, ‘સ્વદ્વયના રક્ષક ત્વરાથી થાઓ.’ ‘સ્વદ્વયના ગ્રાહક ત્વરાથી થાઓ.’ ૧૭માં વર્ષ પહેલાં (આવું લાગે છે). ચાંથી લાવ્યા (આ) ? એ (પૂર્વભવની) મૂડી લઈને આવ્યા હતા. (કોઈ અત્યારે તર્ક કરે છે કે) પણ એ (૨૪માં વર્ષ પહેલા) જ્ઞાની નહોતા ને, અજ્ઞાની હતાં ને ? (તો) કહે (છે) ચાલ, ચાલ. તારું કામ નથી એ સમજવાનું ! લોકો ચર્ચા કરે છે ને ! કે ૨૪માં વર્ષ પહેલાંના વચનો તો અજ્ઞાનપણાના હોયને ? એ Judgment લેવાનો તારો અધિકાર નથી. એ જ્ઞાનીનો અધિકાર છે અને ગુરુદેવે એ (દસ વચનો ઉપર) પ્રવચન કરતાં એમ કહું કે, બાર અંગનો સાર છે ! આ વચનો છે એ બાર અંગનો સાર છે ! તો બાર અંગના સારની મૂડી લઈને આવ્યા હતા. માટે એની અજ્ઞાનદશાને બીજા અજ્ઞાનીઓ સાથે માપી શકાય નહીં (અને) માપે તો ભૂલો પડી જાય. ભૂલો પડી જાય એટલે વિરાધનામાં આવે ! ભૂલો પડી જાય એટલે થોડું નુકસાન નથી. સીધી સત્ત્વની વિરાધનામાં આવે ! અને અનું ફળ બહુ ભયંકર છે, અનું ફળ બહુ ભયંકર છે ! માટે જરા પણ ડોઢાયા થવા જેવું નથી.

શું કહે છે અહીંયા ? કે ‘જ્ઞાની પ્રાપ્તિ એથી અમને થઈ હતી,...’ ભૂતકાળ નાખ્યો છે. ‘થઈ છે’ એમ ન કહું. આ ભવમાં થઈ છે એમ ન કહું. ભૂતકાળમાં થઈ હતી, એમ કીધું છે. પોતાને ચોખ્યું યાદ છે. કોનો સત્સંગ કર્યો હતો ? મારા ગુરુ કેવાં અને ચા હતાં ? એ વખતે મારા પરિણામ કેવાં થયાં હતાં ? મુમુક્ષુતા કેવી આવી હતી ? જ્ઞાનપ્રાપ્તિ કઈ રીતે થઈ હતી ? બધી ખબર છે. એટલે એ પોતાના - સ્વયંના અનુભવની વાત કરી રહ્યા છે. આ પત્રમાં

એ પોતાના-સ્વયંના અનુભવની જ વાત કરી રહ્યા છે. ખાલી લખવા ખાતર લલ્લુજી મુનિને પત્ર લખ્યો છે, એમ વાત નથી. પોતાનો અનુભવ લખી રહ્યા છે કે અમને પણ આમ થયું હતું.

(આગળ કહે છે) ‘વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળો...’ એટલે ભવિષ્યના કાળો, જે કાળ ન આવ્યો હોય અને અન-આગત કહેવામાં આવે છે. આવ્યો નથી. (અર્થાતું) આગત એટલે આવ્યો, ‘અન’ એટલે નથી. ‘અનાગત કાળો પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે.’ એટલે અત્યારે પણ એ જ માર્ગ છે, ભૂતકાળમાં એ જ માર્ગ હતો, ભવિષ્યમાં પણ એ જ માર્ગ છે અને બીજા માર્ગ કોઈને (જ્ઞાનપ્રાપ્તિ) થવાની નથી, જાઓ !

‘અનાગત કાળો પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે.’ લ્યો ! ટીક ! એટલેકે સર્વ શાસ્ત્રના બોધનો સાર, અનું માખણ, મુમુક્ષુ માટેનું તત્ત્વ ! લ્યો ! ટીક ! માખણ કરતાં પણ મુમુક્ષુ માટેનું તત્ત્વ જોવાં જોઈએ, તો એ જ છે કે મુમુક્ષુએ સત્પુરુષને ઓળખીને અચળ પ્રેમથી એમના ચરણારવિંદ સેવતાં એને સત્તની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. Guaranteed થાય. ન થાય કે થાય ? થાય કે ન થાય ? (એમાં) અનિશ્ચિત વાત નથી. થાય જ. થાય જ થાય અને બીજી રીતે કોઈ પ્રકારે ન થાય. ‘એ જ છે.’ એનો અર્થ એ છે, પણ એમે શાસ્ત્રો વાંચીએ તો ? ‘સમયસાર’ જેવાં મહાન પરમાગમને વાંચીએ તો ? તો કહે, તું ગમે તે કર નહીં. ન થાય એટલે ન જ થાય. આમ છે. ‘એ જ છે’ એનો અર્થ એ છે. એ અનેકાંત કર્યું છે. એ જ છે અને બીજો કોઈ નથી. અસ્તિ-નાસ્તિથી અનેકાંત કર્યું છે. કોઈને એમ લાગે કે અનેકાંત કર્યું છે. ‘એ જ છે’ (શબ્દમાં) ‘જ’ વાપર્યો છે ને ? તો કહે એકાંત કર્યું છે. એકાંત નથી. કર્યું અનેકાંત કર્યું છે. એ જ છે અને બીજું નથી.

‘સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવાં જતાં...’ એટલે આ વાતને અનુલક્ષીને બધા શાસ્ત્રોમાં બોધ પ્રવત્યો છે. શું કહેવું છે ? ‘બોધ લક્ષ’નો અર્થ શું ? કે આ પ્રકારના આ લક્ષથી બોધની પ્રવૃત્તિ થઈ છે. એવા બોધને બોધ લક્ષ કહેવામાં આવ્યો છે. ચા લક્ષે બોધ કર્યો છે ? કે સત્પુરુષ સુધી પહોંચાડવાના લક્ષે બોધ કર્યો છે. ટીક !

‘સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં...’ આ (વા ચ) સંયોજન પણ એમનું

સ્વતંત્ર છે. બીજા શાસ્ત્રોમાં એવું મળે નહીં. એમણે જે કેટલાંક શબ્દપ્રયોગ કર્યા છે, એ શબ્દ-સંયોજન (દ્વારા) પોતાના ભાવની અભિવ્યક્તિ તને અસાધારણ રીતે વ્ય ત કરી છે.

બધાં શાસ્ત્રોનો સાર અને બધાં મુમુક્ષુ માટેનું ખરું તત્ત્વ એ જ છે. મુમુક્ષુ માટે ભીજું તત્ત્વ જ નથી, એમ કહે છે. આ એક જ તત્ત્વ છે. (સત્પુરુષ પ્રત્યે) એ વ્ય થતાં એ પરમ તત્ત્વ થઈ ગયું. કેમકે અહીંયા પણ પરમ તત્ત્વ છે ને (સામે સત્પુરુષમાં પણ પરમ તત્ત્વ છે. એટલે) એ અને આ જુદું ન રહ્યું. માટે એ પરમ તત્ત્વ થઈ ગયું. બે ન રહ્યાં. (એટલે કે બે પણાનો લેદ ન રહ્યો). માટે એ તત્ત્વ થઈ ગયું. પરમ તત્ત્વ થઈ ગયું.

‘અને જે કોઈ પ્રાણી ધૂટવા ઈચ્છે છે...’ (અર્થાત્) જેને સંસારનાં સર્વ દુઃખોથી ખરેખર ધૂટવું હોય, ધૂટવું હોય નહીં ‘ખરેખર’ ધૂટવું હોય, (અર્થાત્) જેને સંસારનાં સર્વ દુઃખોથી ખરેખર ધૂટવું હોય, ધૂટવું હોય નહીં, ‘ખરેખર’ ધૂટવું હોય, ‘તેણે અખંડ વૃત્તિથી...’ (એટલે) આમાં ખંડ પાડવો નહીં. (મુમુક્ષુને એમ ન થાય કે) અમને (પહેલા) ઘણું બહુમાન હતું પણ વળી પાછું ઓછું થઈ ગયું, વળી પાછું વધ્યું ને પાછું ઓછું થઈ ગયું. પહેલાં બહુ સોનગઢ જાતા હતાં, પાછું ઓછું કરી નાખ્યું. પાછા વળી જવા મંડયા, વળી પાછું ઓછું થઈ ગયું. એ ખંડિત વૃત્તિ છે. (અહીંયા) અખંડ વૃત્તિથી (કહેવા માર્ગે છે). ‘જે કોઈ પણ પ્રાણી ધૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો.’ બીજા માર્ગને નહીં આરાધતાં એ જ માર્ગને આરાધવો.

બહુ પ્રયોજનભૂત વાત કરી છે. લલ્યુજુ સ્વામી જેવા એક યોગ્યતાવાન મુમુક્ષુ (સામે હતા) ત્યારે આ વાત નીકળીને ? નહીંતર ચાંથી નીકળત ? જો યોગ્યતા ન હોત તો આ વાત નીકળત ચાંથી ? માટે જે જે મુમુક્ષુના પત્રોમાં કૃપાળુદેવનો આવો પારમાર્થિક ઉપદેશ નીકળ્યો છે (તેમાં એમ) સમજવું કે સામે યોગ્યતાવાન જીવ હોવો જોઈએ. યોગ્યતાવાન ન હોય તો આવી વાત એમના શ્રીમુખેથી બહાર ન આવે. યોગ્યતા હોય તો જ બહાર આવે, એ નક્કી થાય છે.

મુમુક્ષુ :- સત્પુરુષ ક્ષેત્રથી આધા હોય તો શું કરવું ?

પૂજ્ય ભાઈશ્રી :- અહીં તો વૃત્તિનો જ સવાલ છે ને, ક્ષેત્રનો પ્રશ્ન જ કયાં કર્યા છે ? ક્ષેત્રનો પ્રશ્ન નથી કર્યો અને ક્ષેત્રથી તો નિરંતર કોઈ સાથે

રહી શકે જ નહીં. દરેકના ઉદ્ય જુદા જુદા હોય. ચારેક કોઈને ક્યાંય જવું પડે, ચારેક કોઈને ક્યાંય જવું પડે, ચારેક કોઈ સાજા હોય, (ક્યારેક માંદા હોય), ક્યારેક કોઈ સાજા-માંદા હોય કે ન હોય ? એટલે ક્ષેત્રનો તો કોઈ નિયમ જ નથી. ક્ષેત્ર અખંડ રહેવાનો કોઈ નિયમ નથી. કેવળીના સમવસરણ પણ અન્ય અન્ય ક્ષેત્રે થાય છે. યોગ્યતાવાન જીવો ત્યાં પહોંચે છે. એમ તો ગુરુદેવનો વિહાર થતો હતો (ત્યારે) લોકો જતાં હતાં. જ્યાં જ્યાં વિહાર થાય ત્યાં પણ જતાં હતાં. (કોઈ) ક્યાંક ન પણ પહોંચી શકે. શરીર પ્રતિબંધ હોય (તો ન પણ પહોંચી શકે). પૂજ્ય બહેનશ્રી લખે છે, ગુરુદેવ મુંબઈ Hospital માં હતાં અને સમાચાર આવતાં (કે) તબિયત નરમ છે, તો એકદમ જવાનું મન થઈ જતું (એમ) કહે. એવો વિકલ્પ ઉપદેને, કે જલ્દી જાઉ, ગાડીમાં જાઉ, Plane માં જાઉ, અરે ! તીને જાઉ ! એવું લઘું છે ! ઠીક ! પાંખ આવે તો તીને જાઉ. એટલો બધો વિકલ્પ ચાલતો હતો, (એમ) કહેતા. પણ જુઓને, કેવું શરીર થઈ ગયું છે ! એમ બોલ્યા છે. પછી લખી નાયું છે - (એ) બહેનોએ લઘું છે. જુઓને ! કેવું શરીર થઈ ગયું છે ! બંધન થઈ ગયું છે. શરીર નબળું પડી ગયું અને માંદગીનું બંધન થઈ ગયું છે. આવો વિકલ્પ થાય છે. ગુરુચરણમાં વૃત્તિ અખંડ છે. ક્ષેત્રમાં અખંડતા જળવાય, એ કુદરતને આધીન છે, એ કોઈ મનુષ્યને આધીન નથી. એ વિકલ્પને આધીન નથી.

(હવે કહે છે) ‘તેણો અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.’ માર્ગ નથી મળ્યો અનું કારણ કે આ માર્ગ નથી ચાલ્યો. જન્મ-મરણ ટખ્યાં નથી અને પરિભ્રમણ ચાલુ રહ્યું છે અનું કારણ કે આ માર્ગ ચાલ્યો નથી. બાકી તો ઘણું કર્યું. ફૂપાળુદેવ એ લખે છે કે બધું કરવા છિતાં આ એક જ સત્પુરુષના વિષયમાં ભૂલ્યો છે. એ જગ્યાએ એણે ભૂલ ખાધી છે. અનંતકાળમાં અનંતવાર ભૂલ ખાધી છે. ‘એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.’

‘જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે,...’ (અર્થાતું) એ માર્ગ આરાધ્યો નહીં તો બીજું તો આરાધ્યું ને ? તો કહે હા, બીજું આરાધ્યું તો ખરું. (તો) શા કારણથી આરાધ્યું ? (કે) સ્વચ્છંદને લઈને આરાધ્યું. જ્ઞાનીની આજ્ઞાએ ન ચાલ્યો. (જીવને એમ થાય છે કે) ‘મને એમ લાગે છે કે મારે અત્યારે આમ કરવું જોઈએ, મને એમ લાગે છે કે મારે અત્યારે આમ કરવું જોઈએ.’

બસ ! ખલાસ ! એ સ્વચ્છંદરૂપી અંધત્વ છે. ‘જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી.’ એટલેકે જ્ઞાનીના માર્ગ ચાલવું જોઈએ, એ માર્ગ કેવા પ્રકારનો છે, એનું એને દર્શન થતું નથી. કોઈને તો સ્વચ્છંદને લઈને જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું જોઈએ, એ પ્રકાર જ આવતો નથી. એ પોતાની મેળે યમ-નિયમ કરે, પોતાની મેળે ઠીક પડે એ શાસ્ત્રો વાંચે, પોતાની મેળે પૂજા-ભર્ત ત કરે, પોતાની મેળે યાત્રાને દ્યા-દાન કરે, જ્યાં-તપ આદિ જે કરવું હોય એ કરે. એને તો જ્ઞાનીને માર્ગ ચાલવું છે, એવો બહુભાગ જીવને તો વિકલ્પ જ નથી. કોઈને એ જ્ઞાની મારફત સમજાય તો પણ એ માર્ગ કેવો છે કે જે માર્ગ ચાલીએ, એનું દર્શન થતું નથી. એ માર્ગ દેખાતો નથી. દેખાતો નથી એનું કારણ સ્વચ્છંદરૂપી અંધત્વ છે, એમ કહે છે. કોને ન દેખાય ? કે આંધળો હોય એને ન દેખાય. ચંકું હોય એને તો દેખાય જ. ચંકું ન હોય એને ન દેખાય. તો એ સ્વચ્છંદ છે એ અંધત્વ છે. એ આંધળો થઈ ગયો છે. સોભાગભાઈ જેવા જીવંત પાત્ર સ્વયં જ એ માર્ગનું દર્શન કરાવે છે. ઠીક ! એ સ્વયં જ એ માર્ગનું દર્શન કરાવે છે. છતાં પણ જો જીવને ન દેખાય તો એ સ્વચ્છંદરૂપી અંધત્વ છે.

‘જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી.’ (માર્ગ) દેખાતો નથી. ‘(અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો;...’ જુઓ ! પોતે ચાંક ચાંક કૌંસ ભરે છે હોં ! કોઈક જગ્યાએ (કૌંસ ભરે છે). ‘(અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો;...’ કે આ

ચા પ્રકારનો માર્ગ હશે ? મારામાં જે માર્ગ ઉત્પત્ત નથી થયો તો એ માર્ગ ચા પ્રકારનો હશે ? આનો વિચાર કરવો. એટલે એની જિજ્ઞાસા કરવી, એની ખોજ કરવી, એની ભાવના કરવી. અને છતાં પણ ન મળે તો ‘...દૃઢ મોક્ષેચ્છા કરવી;...’ જુઓ ! પછી શું લઘ્યું છે ? દૃઢ મોક્ષેચ્છા કહો કે પૂર્ણતાનું લક્ષ કહો (એક જ વાત છે). પૂર્ણતાનું લક્ષ કરશે એ સત્પુરુષને ઓળખવાના અને એના પ્રત્યે અચળ પ્રેમ કરવાના માર્ગમાં આવી જશે, (પરંતુ) દૃઢ મોક્ષેચ્છા હશે તો. દૃઢ મોક્ષેચ્છા કરવી - પૂર્ણતાનું લક્ષ કરવું. મોક્ષ એટલે પૂર્ણતા અને છચ્છા એટલે અહીંયા લક્ષ લેવું. છચ્છા એટલે અહીંયા રાગ નહીં, વિકલ્પ નહીં પણ લક્ષ લેવું.

‘(અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો;...’ વિચાર કરવાનો

અર્થ અહીંયા એ (છે કે) વિચારવામાં તર્ક-વિતર્ક લગાડવા એમ નહીં. ખોજ કરવી, શોધ કરવી, કે આ માર્ગ કેવો હશે ? એમ વાત છે કેમકે એ માર્ગ માત્ર વૈચારિક ભૂમિકા નથી, એ માર્ગ છે એ એક પરિણમનની ભૂમિકા છે. એટલે ત્યાં અચળ પ્રેમ અને અનન્ય ભર્તિ ત એવાં બે શર્ષદ વર્ણિયાં છે. અચળ પ્રેમ એ વિચારનો વિષય નથી - એ પરિણમનનો વિષય છે. અનન્ય ભર્તિ ત એ વિચારનો વિષય નથી - પરિણમનનો વિષય છે. એટલે એ માર્ગ પરિણમનરૂપ છે. કેવો છે એ માર્ગ ? પરિણમનરૂપ છે. તો એ કેવું પરિણમન છે ? એનો વિચાર કરવો.

અત્યારે તો આવું સાહિત્ય જે ઉપલબ્ધ છે, એમાં જીવંત (ઉદાહરણ) જોવા મળશે. લ્યો ! એક તો અહીંયા સોભાગભાઈની ભર્તિ ત જોવા મળે છે. હવે પૂજ્ય બહેનશ્રીની ભર્તિ ત જોવા મળશે. સોગાનીછની ભર્તિ ત તો બધાંએ જોઈ, એમની તો જોઈ છે. એમણે તો પોતાના પત્રોમાં પણ લખી છે અને ચર્ચામાં પણ આવી છે. એટલે આવી વસ્તુ તો (અત્યારે સાહિત્યમાં) મળે છે, નથી મળતી એવું કાંઈ નથી. વિચાર કરવા માટે સમજવાનું સ્થાન છે. પણ માત્ર સમજયે પાર નહીં આવે, પરિણામ્યે પાર આવશે. એ જાતનું પરિણમન આવવું જોઈએ. કોઈ એમ કહે કે, એ (અચળ પ્રેમ) સમજાવોને. એ વાત સમજાવોને. એમ કહે તો ? પ્રશ્ન નીકળે કે ન નીકળે ? પણ એ સમજવા-સમજાવવાનો વિષય નથી. એ પરિણમવાનો વિષય છે. સમજવું હોય તો આટલી વાત ઉઘાડી પડી છે. આ ત્રણ-ત્રણ મહાત્માઓની વાત તો ખુલ્લી પડી છે. સમજવું હોય તો સમજવાની જગ્યા નથી એવું કાંઈ નથી. પછી શું સમજાવાનું રહે છે ? પરિણમન સાક્ષાત જોવા મળે છે પછી શું સમજાવાની વાત રહે છે ? પણ યોગ્યતા આવે એમાં પ્રવેશ થાય છે. યોગ્યતા અને પાત્રતા વિના તથાપ્રકારના માર્ગમાં પ્રવેશ થતો નથી. બાકી (બધી) યોગ્યતા, એ યોગ્યતા નામમાત્ર છે. અહીંથી ખરી યોગ્યતા શરૂ થાય છે.

મુમુક્ષુ :- ૧૨૮ નંબરના પત્રમાં પણ લીધું છે કે, જો નેપથ્યમાંથી પ્રશ્ન ઠે છે તો ઉત્તર પણ ત્યાંથી મળે છે.

પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો કહેવું એમ છે કે, જિજ્ઞાસા જો અંતરંગથી થઈ હોય, તો તમારે શાસ્ત્ર નહીં ગોતવું પડે. અંદરથી જ ઉત્તર મળશે. ફૂપાળુદેવને પોતાને રડ માં વર્ષમાં - મુમુક્ષુની ભૂમિકામાં, આવાં બધા ધૂટવા

માટેના પ્રશ્નો થયાં હતાં. એ ૧૨૮માં પત્રનો આપણે પહેલાં સ્વાધ્યાય થઈ ગયો.

(૨૨૨ નંબરના પાને છે) કે ‘એમ કરવું જો’ આ દઢ મોક્ષેચા છે. ‘ગમે તેમ હો,...’ કરીને (જે પેરેગાફ) છે ને ? એ દઢ મોક્ષેચાનું સ્વરૂપ છે કે આ કરવું જ. ગમે તે સ્થિતિમાં કરવું. એક સમયનું આયુષ્ય બાકી હોય તોપણ કરવું. ‘ત્યાં સુધી હે જીવ ! ધૂટકો નથી.’ ઉપર બધાં પ્રશ્નો લખ્યાં છે. ‘આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે,...’ એ ઉત્તર આવી ગયો છે. દઢ મોક્ષેચા એ ઉત્તર છે. એ પહેલાં આ પ્રશ્નો ઉઠ્યા છે. દઢ મોક્ષેચા એનો ઉત્તર છે, અને એ નેપથ્યમાંથી આવેલો ઉત્તર છે. ચાંથી આવ્યો ઉત્તર ? કે અંદર આત્મામાંથી આવ્યો. આત્મા તો હજુ સમ્યક્દર્શનને પામ્યો નથી, એટલે નેપથ્ય શબ્દ વાપર્યો. ઠીક ! જે અગમ-અગોચર છે ત્યાંથી (ઉત્તર) આવ્યો. નેપથ્ય એટલે અગમ-અગોચરથી. ચાંથી આવ્યો એ ખબર ન પડે. કોઈ આકાશવાણી થઈ એમ કહેવાય. આકાશવાણી (આકાશના) ચા ઠેકાણેથી થઈ ? ઉપરથી થઈ ? બાજુમાંથી થઈ ? નીચેથી થઈ ? ઉગમણેથી થઈ ? આથમણેથી થઈ ? ચાંથી થઈ ? તો કહે એ નેપથ્યમાંથી આવ્યો. એની ખબર પડે નહીં. એ દિશા ન જડે. અંદરથી આવ્યો એ વાત સાચી.

ગુરુદેવને ઓમધ્વનિ આવ્યો હતો. ગુરુદેવને ત્રણ-ત્રણવાર ઓમધ્વનિ આવ્યો હતો. ઓમધ્વનિ સાંભળીને આવ્યા હતા માટે ઓમધ્વનિ આવ્યો હતો, એમ નહીં. આ ગુરુ-ગુણ-સંભારણામાં પૂજ્ય બહેનશ્રીએ ચર્ચા કરતાં-કરતાં એ વાત લીધી છે કે, સીમંઘર ભગવાનનો ઓમકાર-ધ્વનિ સાંભળીને આવ્યા હતા માટે અહીંયા ઓમધ્વનિ સંભળાતો હતો, એમ નહીં. અલ્યકાળમાં કેવળજ્ઞાની થઈને પોતાને ઓમધ્વનિ ધૂટવાનો હતો. તીર્થકર (દ્રવ્ય) હતુંને ? માટે અંદરથી ઓમધ્વનિ આવ્યો હતો. એમણે અંદરથી અર્થ એમ કાઢ્યો છે. એવી રીતે ઓમધ્વનિ આવ્યો છે. ત્રણ વખત આવ્યો છે. એક વખત વિંધીયામાં આવ્યા, ગામ બહાર વિંધીયાના વડલા નીચે (આવ્યો). ગામ બહાર શાસ્ત્ર લઈને સ્વાધ્યાય કરવા નીકળી જતા હતા. ઉપવાસ કરે - તે દિવસે આહાર ન લ્યે, એટલે ગામમાં આવવાની માથાફૂટ નહીં, જમવા-જમાડવાની માથાફૂટ નહીં. ઉપવાસ કરીને શાસ્ત્ર લઈને જતા રહે, એકાંતમાં વડલા નીચે જતા રહેતા. વડનું જાડ હતું ત્યાં એકાંતમાં ઓમધ્વનિ સાંભળ્યો. એક વખત વાંકાનેરનાં

ઉપાશ્રયમાં (આવ્યો હતો). અમે વાંકાનેર ગયા ત્યારે ઉપાશ્રય બતાડ્યો હતો. આ ઉપાશ્રયમાં ગુરુદૈવને ઓમ-ધ્વનિ આવેલો. (એટલે) એ બધું નેપથ્યમાંથી આવે છે, એમ કહેવું છે. ચાંથી આવે છે ? અંદરમાંથી - નેપથ્યમાંથી આવે છે.

‘અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો;...’ એટલે ખોજ કરવી, ‘દઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત રહેવું,...’ એટલે જ્યાં સુધી એનું સમાધાન ન થાય એટલે પરિણમન ન આવે, ત્યાં સુધી બીજા ઉદ્યમાં ખોવાઈ જવું નહીં. અપ્રમત રહેવું એટલે શું ? કે એને ચારેય પડતું મૂકવું નહીં. એની પાછળ પડી જવું ! પૂરેપૂરી શર્ત તથી એની પાછળ પડી જવું. ‘તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે,...’ (આમ થવાથી) સ્વચ્છંદ ટળે છે અને માર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે ઉપાય મળે છે. ‘એ નિઃશંક માનજો.’ જો એ પ્રકારમાં આવો અને માર્ગની પ્રાપ્તિ થાય કે ન થાય એની શંકા કરવાની તમારે જરૂર નથી.

કૃપાળુદૈવનો પોતાનો અનુભવ એમ બોલે છે કે અમને આ રીતે માર્ગ પ્રાપ્તિ થઈ, (અને) આ રીતનું પરિણમન થાય તો પછી કોઈપણ જીવને (માર્ગ પ્રાપ્તિ) ન થાય, એ અવકાશ દેખાતો નથી. આ પ્રકારના પરિણામ થાય એટલે માર્ગની પ્રાપ્તિ થાય જ. અમને થઈ ગઈ હતી માટે બધાંને થઈ જાય. જીવ તો બધાં એક જ જાતના છે ને ! એટલે નિઃશંકતાની વાત લીધી છે. પોતાના સ્વાનુભવને કારણે નિઃશંકતાની વાત લીધી છે. જે પરિણામથી પોતે સફળતાને પ્રાપ્ત થયા છે તેવાં જ પરિણામ કોઈપણ જીવને થાય, તો તે પરિણામ નિષ્ફળ કરી રીતે જાય ? (અનુભવને) તપાસતા એમ માલૂમ પડે છે કે નિષ્ફળ કોઈ રીતે જાય નહીં. જાઓ ! માટે એમ કહું કે જાઓ ! નિઃશંક (માર્ગની પ્રાપ્તિ) થાશે, થાય, થાયને થાય જ.

‘એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે.’ લ્યો ! ઢીક. સરખાઈનો ઠપકો આખ્યો છે. પણ પ્રભુ ! અમે શાસ્ત્રો વાંચ્યા છે, નથી વાંચ્યા એવું નથી કાંઈ. ગણધરના - આચાર્ય શિરોમણીના રચેલા શાસ્ત્રો વાંચ્યા હોય હોં ! ગણધર એટલે આચાર્ય શિરોમણી કહેવાય. બધા આચાર્યોમાં સર્વોત્કૃષ્ટ આચાર્ય ગણધર છે. એ વખતે બીજા આચાર્યો હોય પણ સર્વોત્કૃષ્ટ આચાર્ય છે એ ગણધર છે. તેમનો સીધો ઉપદેશ (હોય) એવાં શાસ્ત્રો વાંચ્યા

હોય, તો એને અવળે માર્ગ ચાલ્યો એમ કહેવાય ? (તો કહે છે કે) જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કર્યા વિના વાંચ્યા હોય તો તે અવળે માર્ગ ચાલ્યો છે.

જીવને પોતાના પ્રયોજનની વાત પણ લક્ષમાં આવતી નથી એનું કારણ એ છે કે આજ્ઞાંકિતપણે સત્પુરુષના યોગમાં સત્તસંગને ઉપાસ્યો નથી. આ વાત એક પત્રમાં લખી છે કે, આજ્ઞાંકિતપણે સત્તસંગ નથી ઉપાસ્યો. (એટલે) એના પ્રયોજનની વાત એને ધ્યાન ઉપર આવતી નથી - લક્ષ ઉપર નથી આવતી. અથવા ત્યાં એવી પણ વાત લીધી છે કે પ્રગટ આત્મ-સ્વરૂપને દર્શાવનારા એવા વચનો મળવાં છીતાં જીવને એની અસર નહીં થવાનું કારણ શું ? અથવા એ આત્માનું દર્શન નહીં થવાનું કારણ શું ? પ્રગટ આત્મસ્વરૂપને દર્શાવનારા વચનો છે. એવો Tone ને એવી શૈલીથી (વચનો) આવ્યા હોય, કારણકે સત્તસંગ ઉપાસ્યો નથી. (સત્તસંગ) ઉપાસ્યો નથી એ કઈ રીતે ? કે આજ્ઞાંકિતપણે ઉપાસ્યો નથી. સ્વચ્છંદે તો ઉપાસ્યો છે - આજ્ઞાંકિતપણે ઉપાસ્યો નથી.

એટલે કહ્યું કે, ‘અનાદિ કાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે. જોકે તેણે જ્ય, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી;...’ કે જે અવશ્ય કરવા યોગ્ય હતું. ‘જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.’ (અર્થાત્) જ્ઞાનીપુરુષના ચરણારવિદ પરમ પ્રેમે અને અનન્ય ભર્ત તથે સેવ્યાં નથી. બસ ! આ જે અમે પ્રથમ કહ્યું એ એણો કર્યું નથી. બાકી બધું કરી ધૂટ્યો છે અને એથી નવું બંધન કર્યું છે. કલ્પના કરે ને ? પછી માર્ગની કલ્પના કરે, કે આ ઉપાય છે. (અને) ઉપાય ખરેખર એને જડ્યો નથી. કોઈક બીજા ઉપાયને ઉપાય માન્યો છે એટલે ગૃહીત-મિથ્યાત્વ થયું છે, એટલે બંધન થયું છે. ઉઘાડ વધ્યો, કષાય મંદ થયો અને ગૃહીત-મિથ્યાત્વ વળગ્યું (એ) નફામાં. ઠીક ! આમ થાય લ્યો ! અહીં આટલું વજન આપ્યું છે.

પછી (નીચેના પેરેગાફમાં) એના માટેના દૃષ્ટાંતો (આપ્યા છે).

ખભદ્દેવ ભગવાનથી માંડીને ઠેઠ જંબુસ્વામી - છેલ્લા કેવળી થયા ત્યાં સુધી આમ જ વાત ચાલી છે, એમ કહે છે. ખભદ્દેવ ભગવાનથી માંડીને મહાવીર

સ્વામી ન લીધા, અંતિમ કેવળી જંબુસ્વામી લીધા. કે જેમને સુધર્મસ્વામીએ બોધ આપ્યો હતો. અંતિમ કેવળી જંબુસ્વામી મથુરામાંથી (મોક્ષ) ગયા છે. અહીં સુધી રાખીએ.



ધર્મ પામવાની આશાથી, જીવ અનેક પ્રકારે કલ્પિત ભાવ્ય સાધનરૂપ ધર્મ-પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેથી કાંઈ ધર્મ-સાધના થતી નથી, ઉલટું સાધન કર્યાનું દુષ્ટ અભિમાન થાય છે, જે જીવને સત્ત-સાધનથી વંચિત રાખે છે, - અથવા સત્ત-સાધન સૂઝવા દેતું નથી તેથી આત્મ-કલ્યાણનો 'અપૂર્વવિચાર' આવ્યા વિના, કલ્પિત સાધન મટવા અર્થે, 'અપૂર્વજ્ઞાનીપુરુષ'ની આજાએ વર્તવાનો દૃઢ નિશ્ચય થાય, ત્યારથી જ જીવને આત્માર્થની શરૂઆત થાય છે. અને જેણે 'માર્ગ' જોયો છે, તેવા જ્ઞાનીપુરુષ વિદ્યમાન, બિરાજમાન હોય તો તેના ચરણ સેવે છે અને અવિદ્યમાન હોય તો તીવ્ર આશ્રય-ભાવનાએ વર્તે છે. સિદ્ધાંત એમ છે કે, 'અપૂર્વ આત્મવિચારે' જ્ઞાનીપુરુષની આજાનું આરાધન જ માર્ગ પ્રાપ્તિનું સર્વ શ્રેષ્ઠ કારણ છે.

— પૂજ્ય ભાઈશ્રી  
(અનુભવ સંજીવની - ૫૪૦)

પ્રવચન - ૩

‘શ્રીમદ્ રાજચંદ્’ પત્રાંક-૧૯૮

તા. ૧૦/૦૬/૧૯૮૮૪ - ભાવનગર

શ્રીમદ્ રાજચંદ્ (વચનામૃત) પત્રાંક - ૧૯૮ ચાલે છે. પહેલો પેરેગાફ જે ચાલી ગયો તેમાં એ વાત આવી કે, કોઈપણ જીવને મોક્ષમાર્ગમાં આવતા પહેલા જ્ઞાનીપુરુષની ઓળખાણ હોવી જોઈએ. જ્ઞાનીપુરુષની ઓળખાણ થવી જોઈએ. ઓળખાણપૂર્વક પૂરો વિશ્વાસ આવવો જોઈએ. ‘સમ્યક્પ્રતીતિ’નો અર્થ એ જ છે. યથાર્થ ઓળખાણપૂર્વક ઉત્પત્ત થયેલો પૂર્ણ વિશ્વાસ. કારણકે અહીં પ્રતીતિ એટલે શ્રદ્ધા. જ્ઞાનીની શ્રદ્ધા એમ કહીએ, પરંતુ ઓળખાણ થવી તે જ્ઞાનની પર્યાય છે. વિશ્વાસ આવે તો તે શ્રદ્ધાપ્રધાન જ્ઞાનની પર્યાય છે. કારણકે દૃષ્ટિ-શ્રદ્ધા તો હજુ સુલટી નથી, ઉલટી છે. માટે અહીં શ્રદ્ધાનું પરિણામન કાર્યકારી નથી. (ફરીથી લઈએ).

આ પેરેગાફ એક પ્રશ્નના ઉત્તરદ્વારે ચાલી રહ્યો છે. ફૂપાળુદેવે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ‘જીવને માર્ગ મળ્યો નથી અનું શું કારણ ?’ આ પ્રશ્નને વિશેષપણે સમજાવવામાં આવે તો અનંતકાળથી અત્યાર સુધી - અનાદિથી અત્યાર સુધી અનંતકાળ વીત્યો. કેટલો (કાળ વીત્યો) ? (અનંતકાળ વીતી ગયો). આ અનંતકાળમાં ધર્મના ક્ષેત્રમાં બધાં પ્રકારની - વ્રત, સંયમની કિયા કરવા છતાં અને અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં (માર્ગ પ્રાપ્ત થયો નથી). કરોડો પ્રયત્ન કર્યા. કરોડો શું ? અનંત પ્રયત્નો કર્યા છે છતાં પણ જીવને માર્ગ નથી મળ્યો તેનું શું કારણ ? એવી તો કઈ એક વાત રહી ગઈ છે કે, જેને કારણ માર્ગ મળ્યો નથી ? એક જ કારણ છે કે તેને સત્પુરુષની ઓળખાણ થઈ નથી. (ફૂપાળુદેવ) અહીંયા જ્ઞાનીપુરુષ - સત્પુરુષ એટલું જ ન કહેતાં, બહુમાનથી એમ કહે છે કે, ‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવાં...’ (અર્થાત્) જે અન્ય પદાર્થમાં પ્રતિબદ્ધ હોય, તે જ્ઞાની ન હોય શકે. કારણકે જ્ઞાની તો (પરપદાર્થથી) ભિન્નત્વ થતાં થયા છે. અનાદિથી ભિન્ન

પદાર્થો સાથે અભિમતવનો અનુભવ કર્યો હતો, તે જ્ઞાનીપુરુષને છૂટી ગયો અને તેઓ ભિન્ન પદાર્થ (છે તેનો) ભિન્નપણે અનુભવ કરે છે. તેથી તેમને ભાવ પ્રતિબંધ નથી. ભાવ પ્રતિબંધ ન હોવાનું આ જ કારણ છે.

**મુખુકુ :-** આ જ વાત સત્પુરુષની ઓળખાણમાં ઉપકારી થાય છે ?

**પૂજ્ય ભાઈશ્રી :-** (હા), ઉપકારી થાય છે. તેઓ પ્રતિબદ્ધતાને પામે છે કે પ્રતિબદ્ધતાને પ્રાપ્ત નથી થતાં ? (એ જોવાનું છે).

શૈતાભરમાં તો ત્યાં સુધી કથા આવે છે કે, ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તો ગૌતમ સ્વામી રડવા લાગ્યા. અરે...! જ્ઞાનીપુરુષને પણ પ્રતિબદ્ધતા હોતી નથી તો ગણધરદેવને તો ચંથી હોય ? તેઓશ્રીને ચારિત્રમોહનો થોડો - અલ્ય અનુરાગ હતો. કેટલો (અનુરાગ હતો) ? બહુ જ થોડો (અનુરાગ હતો). તે પણ છૂટી ગયો. ભગવાન નિર્વાણ પધારતા તે પણ છૂટી ગયો. એકદમ વિર ત પરિણામ થતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તે જ દિવસે ૨૪ કલાકમાં કેવળજ્ઞાન લઈ લીધું. ચોવીસ કલાક પણ

ચાં લાગ્યા છે ? પછી તરત જ લીધું છે. આ બાજુ ભગવાન નિર્વાણ પધાર્યા (અને આ બાજુ ગૌતમસ્વામી) કેવળજ્ઞાનેનો પ્રાપ્ત થયા. તરત જ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા. પછી એટલો પણ ઉપયોગ બહાર જવાનું (કોઈ) સ્થાન તેમને ન રહ્યું.

**મુખુકુ :-** ત્રણ કણાયની ચોકડી બાકી છે માટે હજુ પ્રતિબદ્ધતા છે, એવો કરણાનુયોગનો સિદ્ધાંત અહીં કામમાં ન આવે ?

**પૂજ્ય ભાઈશ્રી :-** નહીં, અનંતાનુબંધી અને દર્શનમોહનીય ગયા તો બાકી ત્રણ ચોકડીનો કોઈ હિસાબ નથી. અહીં ૨૫% અને ૭૫% એમ ગણાતુનથી. સૈન્યમાં કોઈ રાજને મારી નાખે તો પછી સૈન્યમાં કેટલા માણસો બાકી છે ? એમ જોવામાં નથી આવતું. રાજને મારી નાખ્યો તો આખુંય સૈન્ય શરણાગતિ સ્વીકારી લેશો. તે તો શરણાગતિમાં આવી જશે અને કહેશે ‘તમે રાજને મારી નાખ્યો છે હવે અમારું શું ગજું છે ? અમારે ભરવું નથી. અમને જીવતા રહેવા દો અમે તમારા શરણો આવી જશું.’

(અહીં કહે છે) ‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ,...’ અહીં માત્ર જ્ઞાનીપુરુષ પ્રત્યે એમ ન લીધું.

‘જ્ઞાનીપુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે...’ (એમ લીધું છે). જુઓ ! (મુમુક્ષુ) ચાં બેસે છે ? જ્ઞાનીપુરુષ પ્રત્યે પ્રેમ આવ્યો એમ નહીં કહેતાં, ‘ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યકૃપતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી,...’ (સત્સ્વરૂપની એટલે) પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પોતાના આત્મસ્વરૂપનો અનુભવ કોઈને થતો નથી. ત્રણેય કાળે આ વાત છે, આગળ એમ કહે છે ‘અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે.’ શું વાત કહી ?

(જેને) જ્ઞાનીપુરુષ મળ્યા છે, તો તેને અવશ્ય સત્સ્વરૂપની પ્રાપ્તિ - સ્વાનુભવ થાય જ છે. જ્ઞાનીપુરુષ મળવા છતાં પણ (જો સત્સ્વરૂપની) પ્રાપ્તિ ન થઈ, તો માનવું પડશે - માનવું જ રહ્યું કે તેણે (જ્ઞાનીપુરુષની) ઓળખાણ નથી કરી અને તેને અચળ પ્રેમ પણ આવ્યો નથી અને તમેના ચરણારવિંદને સેવ્યાં પણ નથી.

ભલે આપણે ગુરુદેવશ્રીને આહારદાન આપતી વખતે તેમના ચરણ ધોતા હતા (તો પણ અચળ પ્રેમ થયો ન હતો.) જેટલી વખત આહારદાન આપ્યું હશે તેટલી વખત તો ચરણ ધોયા હશે ! નમસ્કાર કરતી વખતે પણ ચરણને સ્પર્શ કરીએ છીએ ! ચરણ સ્પર્શ કરીએ છીએ કે નથી કરતા ? તેમ છતાં તેમના ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ નહોતો થયો અને સાચી ઓળખાણ નહોતી થઈ. એ વાત નક્કી છે. (જો ઓળખાણ) થઈ તો, અવશ્ય તેને (સત્સ્વરૂપની) પ્રાપ્તિ થશે, થશે અને થશે જ. સભ્યકૃપતીતિ આવી, અચળ પ્રેમ થયો તો સ્વાનુભવ થશે કે નહીં થાય ? એવો (પ્રશ્ન) રહેતો (જ) નથી. (જો સત્સ્વરૂપની પ્રાપ્તિ) નથી થઈ તો સમજ લેવું કે ઓળખાણ નથી થઈ. કારણ (પ્રગટ) નથી થયું તો કાર્ય (પ્રગટ) નથી થતું. કારણ (પ્રગટ) થશે તો કાર્ય થશે, થશે અને થશે જ. આ વાત નિયમબદ્ધ છે.

મુમુક્ષુ :- અહીં ચરણારવિંદ શબ્દ લાખ્યો છે. શરીરના બીજા અવયવો નથી લીધા, તો ચરણારવિંદ લાખ્યુ એનો અર્થ શું છે ?

પૂજ્ય ભાઈશ્રી :- એમાં એવું છે કે આખાય શરીરમાં મસ્તક છે તે ઉત્કૃષ્ટ અંગ છે અને પગ છે તે નિફૃષ્ટ અંગ છે. (મસ્તક) ઉપર રહે છે અને પગ જમીન સાથે - ધૂળ સાથે અદેલાં નીચે રહે છે; ગંદા પણ થાય

છે, તો એને એટલી ગરજ છે, તો મુમુક્ષુને - આત્માર્થીને એટલી ગરજ છે - કે, ભલે પગ ગંદા હોય - તેમની ચરણ રજ મારા મસ્તક પર ચડવી જોઈએ. મારું ઉત્કૃષ્ટ અંગ અને તેમનું નિકૃષ્ટ અંગ ! ઠીક ! જ્ઞાનીનું નિકૃષ્ટ અંગ અને પોતાનું ઉત્કૃષ્ટ અંગ ! મુમુક્ષુ તેમની ચરણરજને માથે ચડાવે છે, એમ વાત છે, ઠીક !

**મુમુક્ષુ :-** વાળીની ઉપાસનાની વાત તો આવે છે પરંતુ અહીં ચરણની ઉપાસનાની વાત કરી છે.

**પૂજ્ય ભાઈશ્રી :-** અહીં તો ચરણની ઉપાસના લીધી છે. ચરણારવિંદ - ચરણકમલ. ચરણને પણ કમળનું વિશેખણ આયું. અરવિંદ એટલે કમળ. 'ચરણકમલ' એમ કહે છે. ચરણકમલ પણ કહે છે અને ચરણારવિંદ પણ કહે છે. બજે રીતે કહેવાય છે.

**મુમુક્ષુ :-** ગુરુદેવના સાનિધ્યમાં રહ્યાં, ચરણમાં રહ્યાં, તો પણ ઓળખાણ ન થઈ અને કામ ન થયું.

**પૂજ્ય ભાઈશ્રી :-** ઓળખાણ ન થઈ માટે (સ્વરૂપપ્રાપ્તિ) નથી થતી. ઓળખાણ થવા માટે તો યોગ્યતા જોઈએ. ક્ષેત્રથી નજીક રહેવાથી ઓળખાણ થઈ જાય, એવું પણ નથી. ક્ષેત્રથી નજીક રહેવાથી કોઈ ઓળખાણ થઈ જાય છે, એમ પણ નથી અથવા વધુ સમય સમીપમાં રહેવાથી ઓળખાણ થઈ જાય છે, એવું પણ નથી.

સોગાનીજીને એક જ કલાકમાં ઓળખાણ થઈ ગઈ ! એક દિવસમાં (પણ) નહીં ! એક દિવસમાં તો અનુભવ થઈ ગયો હતો. જ્યારે ઓળખાણ તો એક જ કલાકમાં થઈ છે - પહેલા એક કલાકમાં થઈ છે. પહેલા પ્રવચનમાં થઈ છે. જુઓ ! શું કારણ છે ? જ્યારે યોગ્યતા પ્રાપ્ત હોય છે ત્યારે ઓળખાણ થાય છે. સાથે રહેવાનું પછી ભલે એક કલાક થયું હોય કે ૫૦ વર્ષ હોય ! ૫૦ વર્ષ ગુરુદેવની સાથે રહેનારા પણ હશે ! પરંતુ ઓળખાણ ન થઈ તો ન જ થઈ. તેનું કારણ તો એ જ છે કે, પોતાની ઓળખવાની યોગ્યતા નથી.

**મુમુક્ષુ :-** અમારી યોગ્યતા નથી એટલે ઓળખાણ નથી, એમ સંકોચ કરીને શું બેસી રહેવું ?

પૂજ્ય ભાઈશ્રી :- આ વાતની ચર્ચા તો એટલે માટે જ ચાલી રહી છે કે, પોતાની યોગ્યતા ન હોય તો પોતે યોગ્યતામાં કેવી રીતે આવે ? તે હેતુથી આ વાત છે. આ વાત પોતાની ઉપરથી કાઢી નાખવા માટે નથી. પોતા ઉપર લેવા માટે છે, કાઢી નાખવા માટે નથી. સંતોષ કરવા માટે પણ નથી. અને તેને Neglect - ગૌણ કરવા માટે પણ નથી કે, ચાલો ભાઈ ! આપણો યોગ્યતા નથી, શું કરીએ ? ખાઈ-પીને આરામથી સૂર્ય જવ ! ઘ બરાબર આવી જશે ! (આ વાત) નિશ્ચિંત થઈ જવા માટે કાંઈ નથી, ચિંતિત થવા માટે આ વાત છે. આપણો આ વાત ચર્ચામાં શા માટે લઈએ છીએ ? કે જો આપણો આ વિષયમાં ચિંતિત ન હોઈએ, તો ચિંતિત થઈ જવું જોઈએ. ચિંતિત હશું તો યોગ્યતા આવશે. જો તેની ચિંતા નહીં થાય તો યોગ્યતા પણ નહીં આવે.

મુમુક્ષુ :- કોઈ મુમુક્ષુ એમ પણ કહે છે કે, શું કરીએ અમારી પ્રકૃતિ એવી છે !

પૂજ્ય ભાઈશ્રી :- એમ પણ ન ચાલો. પ્રકૃતિ તો દુશ્મન છે. પોતાની પ્રકૃતિ એટલે પોતાનો દુશ્મન કે જેને આપણે ગળે લગાડીએ છીએ - ભેટીએ છીએ, એમ લેવું છે શું ? (પ્રકૃતિ) તો મારશે. માટે એમ નથી ચાલતું. (આ વિષયમાં) ચિંતિત થવું જોઈએ, બહુ જ બેદ અને બહુ જ દુઃખ થવું જોઈએ. ગમે તેટલું રડવું કેમ ન આવે ? પરંતુ એક વખત તો એમ થવું જ જોઈએ, અવશ્ય થવું જ જોઈએ. સ્વાનુભવ અને સમ્યક્દર્શન માટે આ સીધી સાદી વાત છે. સ્વરૂપપ્રાપ્તિ માટે સીધી-સાદી વાત છે કે, મારે શું કરવું ? મારે શાસ્ત્ર વાંચવું ? કચુ શાસ્ત્ર વાંચવું ? સમયસાર વાંચવું ? ચા મહાત્માના વચનામૃતને વાંચવા ? એવી કોઈ વાત નથી કરી. ઉપવાસ કરવો, પ્રત, નિયમ, સંયમ કરવા - એ વાત પણ નથી કરી. અને દયા, દાન, યાત્રા કરવાની વાત પણ નથી કરી. પંચપરમેષ્ઠી મંત્રનો જાપ કરવો ! જ્યારે (આ) મંત્ર તો ઉત્કૃષ્ટ છે તો પણ એમ નથી કહ્યું. પરંતુ જ્ઞાનીપુરુષના ચરણારવિદનું સેવન કરવું, બસ ! આટલું જ કહ્યું. આટલું કરવાથી અવશ્ય (સફળતા) મળે છે.

(હવે આગળ કહે છે). : આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે

અને સેવશો.' (અત્યાર સુધીમાં) જેટલાં પણ જ્ઞાની થયાં, તેમણે એમ જ કર્યું હતું. જે (વર્તમાનમાં) થઈ રહ્યા છે તેઓ પણ આમ જ કરી રહ્યાં છે, જે (ભવિષ્યમાં) થશે, તેઓ પણ એમ જ કરશે. જો આમ નહીં કરે તો તેમને જ્ઞાન નહીં થાય, એમ કહે છે, ઠીક ! સીધી વાત છે.

(કહે છે) 'જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી,...' આ સાથે પોતાનો પુરાવો આપે છે કે, એમે એનો પુરાવો છીએ કે, આ પ્રકારે અમને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. એટલે વિશ્વમાં જો કોઈને (જ્ઞાનપ્રાપ્તિ) થશે કે થઈ હશે તો આ જ પ્રકારે થશે. બીજા પ્રકારે ન થઈ શકે અને આ જ વાસ્તવિકતા છે. કારણ જે અનાદિથી અજ્ઞાયો છે, એવો અંતર્મુખ થવાનો ઉપાય, તે કોઈને પોતાની જાતે ખબર ન પડે. પોતાની મેળે કોઈને પતો લાગતો નથી અને જો એમ જ પતો લાગી જતો હોત તો, ધર્મક્ષેત્રમાં કિયાકંડ કરવામાં તો કોઈ કસર નથી રાખી, શાસ્ત્ર વાંચવામાં પણ કોઈ કસર નથી રાખી, તો (માર્ગ) મળી ગયો હોત, પરંતુ એ રીતે મળતો નથી. ધ્યાનની પ્રેક્ટીસ કરે તો ? પણ શેનું ધ્યાન કરશો ? તે ધ્યાન, ધ્યાન નથી (પરંતુ) અનેક પ્રકારના તરંગરૂપ ધ્યાન છે. 'સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.' (૧૨૮-પત્રાંકમાં) આવ્યું કે નહીં ?

મુમુક્ષુ :- મોટા ભાગો તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું જ ધ્યાન કરશે !

પૂજ્ય ભાઈશ્રી :-હા, એ તો ચાલે જ છે. ચતુર્થ ગુણસ્થાન પહેલાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બે જ ધ્યાન છે, ત્રીજું ધર્મધ્યાન ત્યાં નથી. શુક્લધ્યાનનો તો વિચાર કરવાની પણ જગ્યા નથી.

'વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે.' (આ જ એક માર્ગ છે) એમ લેવું. જ્યારે આ વાત આપણે સામે સ્પષ્ટ રીતે આવે છે, તો પછી આપણે બીજો વિકલ્પ કે શંકા ઉઠાવવી જોઈએ નહીં. જ્યારે કૃપાળુદેવ આપણી સામે આ વાત પોતાની અનુભવથી પ્રસ્તુત કરી રહ્યાં છે, તો આપણે બીજો યો વિકલ્પ કરવાની આવશ્યકતા છે ? આપણે કોઈ બીજો વિકલ્પ ન કરવો જોઈએ. આ જ કમ છે. આ જ એકમાત્ર ઉપાય છે. બીજો ઉપાય છે જ નહીં. જ્યારે બીજો ઉપાય છે જ નહીં તો પછી એ વિષયમાં વિચાર શા માટે કરવો ? અને 'સર્વ શાસ્ત્રોનો

બોધલક્ષ જોવા જતાં એ જ છે.' અમારો અનુભવ પણ એમ જ કહે છે અને બધાં જ્ઞાનીઓના શાસ્ત્ર પણ એમ જ કહે છે. એટલેકે હું એકલો બોલું હું, (એમ નથી). બધાં જ્ઞાની એમ જ કહે છે, એમ જ કહી રહ્યાં છે. નિયમસારની પત મી ગાથામાં આવ્યું ને ! તે ગાથામાં સત્પુરુષને (સમ્યકૃત્વ પરિણામના) અંતરંગ નિમિત્ત કહ્યાં છે. નિયમસાર જેવાં શાસ્ત્રમાં (એવું કહ્યું છે). ! (જ્યારે નિયમસાર) તો ત્રિકાળી કારણ પરમાત્માની ભાવનાનો ગ્રંથ છે. ત્યાં સત્પુરુષને અંતરંગ નિમિત્ત લીધાં છે, જુઓ !

'અને જે કોઈ પણ પ્રાણી છૂટવા છયે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો.' આ માર્ગનું જે આરાધન કરતા નથી, તે છૂટવા પણ માંગતા નથી. અહીંથી એ વાત અનર્પિતપણે નીકળે છે. જે છૂટવા માંગતો હોય તે આ જ માર્ગનું સેવન કરે - એમાંથી અનર્પિતપણે નીકળે છે કે, જે આ માર્ગનું સેવન નથી કરતો, તે છૂટવા માંગતો પણ નથી. તેને હજુ બંધનમાં પડવું છે, છૂટવું નથી. - એ વાત નક્કી છે.

'એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.' બધાં જ પડખાંથી વાતને સ્પષ્ટ કરે છે કે, એ જ માર્ગનું આરાધન કર્યા વિના જ જીવનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે. જો આટલું કરી લીધું હોત તો તેનું પરિભ્રમણ ચાલુ ન રહેત. 'જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે....' આ વાત એટલે માટે લ્યે છે કે, બીજાં-બીજાં (ધર્મસાધન) કર્યા તેનું શું ? તો કહે છે કે, બધું સ્વચ્છંદ કર્યું છે. જ્ઞાનીની આજ્ઞામાં રહીને કાંઈ નથી કર્યું. (માટે) જે પણ કિયા કરવી હોય, જ્ઞાનીની આજ્ઞામાં કરો ! કહેવાનો મતલબ એ છે. નહીંતર સ્વચ્છંદ થઈ જશે. પોતાની મેળે કરવા જશો તો સ્વચ્છંદ થઈ જશે.

'જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી.' આ વાત પણ બહુ જ સુદર કરી છે કે, જેને આવી સૂજ આવતી નથી કે, મારે જ્ઞાનીના માર્ગ ચાલવું જોઈએ, મારા અભિપ્રાયથી, મારી મનમાનાનીથી ન ચાલવું જોઈએ, જેને એવી સૂજ નથી તેઓ સ્વચ્છંદમાં પડવાં છે. ચાં પડજાં છે ? સ્વચ્છંદમાં પડજાં છે અને એટલે જ આ માર્ગની સૂજ નથી આવતી. 'દર્શન થતું નથી.' એટલે સૂજ નથી આવતી. જુઓ ! યોગ્યતા

શું કામ કરે છે ? આ વાત હજારો-લાખો જીવો વાંચે છે કે નથી વાંચતાં ? આજે પણ હજારો લોકો વાંચે છે. પરંતુ જેનું આ વાત ઉપર ધ્યાન જાય છે તે યોગ્યતાવાન છે. જેનું ધ્યાન નથી જતું તેની યોગ્યતા નથી. તે લોકો વાંચતાં જ રહેશે, આને આ જ વાંચ્યા કરશે.

જેમકે ફૃપાળુટેવે એક Slogan આપ્યું - મંત્ર આય્યો કે, ‘આત્મ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે !’ એક વા ય કહ્યું. હવે જો આપણે આત્મભાવના તો ભાવીએ નહીં અને તુ ત પંિ તની જ ધૂન લગાવીએ તો ! બે-બે કલાક, ત્રણ-ત્રણ કલાક બોલ્યા જ કરીએ. આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે... આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે ! તો કેવળજ્ઞાન લેશે શું ? આવી ધૂન લગાડવી તે જ કાર્યની વિધિ-પદ્ધતિ છે, એમ કરતા (માનવાથી) તો ગૃહીત મિથ્યાત્વ થશે. શું થશે ? ગૃહીત મિથ્યાત્વ થશે. (એવું માનવાથી) સાધનની ભૂલ થશે - કાર્યપદ્ધતિની ભૂલ થશે. ગૃહીત મિથ્યાત્વ થઈ જશે. બોલશે ફૃપાળુટેવનું જ વચન અને કરશે શું ? મિથ્યાત્વને દૃઢ !! આવી ગડબડ થાય છે.

તેથી આ પત્ર તો વાંચશે, એકવાર વાંચશે, દસ વાર વાંચશે, સો વખત વાંચશે, હજાર વખત વાંચશે પરંતુ વાંચવામાં જે ઉપદેશ આવ્યો તેનું અનુસરણ કર્યું નથી. ઉપદેશ વાંચ્યો તો ખરો ! સાંભળ્યો ખરો પણ અમલીકરણ ન કર્યું. વાંચતો જ રહ્યો ! વાંચતો જ રહ્યો ! શા માટે વાંચે છે ? કે વાંચવા ખાતર વાંચે છે. વારંવાર વાંચવું જોઈએ એટલે વાંચે છે. જે વાંચનનો વિષય છે તેને દૃઢ કરવા વાંચે છે. પણ અમલ કરવામાં ? કાંઈ નહીં. તો એ બધું વાંચવું નિરર્થક છે. એ તો પેલી ધૂન લગાવવા જેવી વાત થઈ ગઈ. તેને માર્ગનું દર્શન પણ થતું નથી.

‘અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો,...’ હવે સ્વચ્છં દ દૂર કરવા માટે શું કરવું ? એ કહે છે. આ માર્ગનો વિચાર કરવો કે, કેવી રીતે સત્પુરુષને ઓળખવા ? કે જેથી પોતાને એમના પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના રહે નહીં. કેવી રીતે ઓળખવાં તેનો વિચાર કરવો અને આ વિચાર કરવામાં જો કોઈ સહાયક છે તો તે - ‘પૂર્ણતાનું લક્ષ’ છે. ‘દૃઢ મોક્ષેચ્છા કરવી;...’ (અર્થાતુ) કોઈપણ કિંમતે મારે છૂટવું જ છે. ગમે તે થઈ જાય.

ગમે તેટલાં ઉપસર્ગ આવી જાય, પરિષહ આવી જાય, આધિ-વાધિ-ઉપાધિ આવી જાય, એવું ૧૨૮ પત્રમાં લીધું કે ન લીધું ? ભલે આયુષ્ય એક સમય બાકી હોય, તે પણ દુનિભિત હોય, કાંઈ પણ હોય ! એમ કરવું જ છે - છૂટવું જ છે. - પરિભ્રમણથી મું ત થવું જ છે. એવી 'દઢ મોક્ષેચ્છા કરવી;...'

(એવી) દઢ મોક્ષેચ્છા કરવાથી ઓળખાણની યોગ્યતા આવી જશે, ઠીક ! (માર્ગ પ્રાપ્તિના) કમના પ્રારંભમાં પહેલું પગલું ભરતાં જ (જ્ઞાનીપુરુષને) ઓળખવાની યોગ્યતા આવી જશે. એમ વાત છે. એ તો ૨૫૪ પત્રાંકમાં લીધું જ છે કે, જે મોક્ષને માટે પ્રયાસ કરે છે, તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિની બહુ ભાવના હોય છે, તીવ્ર ભાવના હોય છે, તે ભાવનાને વશ તેનું નિરંતર અવલોકન ચાલે છે, અવલોકનથી પોતાના દોષ દેખવામાં આવે છે અને સંસારના પદાર્થોમાં ચાંચ અલ્ય પણ સુખની છચ્છા નથી રહેતી અને જ્ઞાનીની ઓળખાણ થઈ તેમનામાં પરમેશ્વરબુદ્ધિ થઈ જાય છે. ૨૫૪ - પત્રમાં એવો કુમ લીધો છે કે નહીં ? બસ ! તે રીતે વહેલે - મોક્ષ ઓળખાણ થઈ જશે. આટલી Process થશે તો ઓળખાણ થઈ જશે. દઢ મોક્ષેચ્છા એટલે પૂર્ણતાના લક્ષ પછી આટલી Process થયા બાદ ઓળખાણ થશે. જો ઓળખાણ ન થઈ હોય તો ઓળખવા માટેની તીવ્ર જિજ્ઞાસામાં રહેવું, એમ પણ ત્યાં લીધું છે. તેમ છતાં પણ જો ઓળખાણ ન થાય તો શું કરવું ? કે તીવ્ર જિજ્ઞાસામાં રહેવાથી ઓળખાણ થયા વિના નહીં રહે.

પૂજ્ય સોગાનીળનું જીવનચરિત્ર જોઈએ તો, એમને સીધી આ વાત નહોતી મળી કે, તારે સત્પુરુષના ચરણમાં જવું જોઈએ. એવું કોઈ સંભળાવનાર મળ્યું ન હતું, ન કોઈ કહેનાર મળ્યું હતું, કે ન તો આ વાત વાંચવામાં

ચાંચ આવી હતી. પરંતુ છૂટવાની ભાવના તીવ્ર થઈ ગઈ હતી. એટલી બધી તીવ્ર થઈ ગઈ ! એટલી બધી તીવ્ર થઈ ગઈ કે, એક વિકલ્પને પણ સહન કરી શકતા નહોતા. એક વિકલ્પ પણ ગળામાં ફાંસી (જેવો) લાગતો હતો. એટલું તીવ્ર દુઃખ વિકલ્પમાં લાગવા માંડચું હતું અને કોઈ પ્રતિબંધ રહ્યો નહોતો. સમાજ પ્રતિબંધ અને કુટુંબ પ્રતિબંધ તો કચારના છૂટી ગયા હતા. વિકલ્પ પ્રતિબંધ ચાલુ હતો અને તે પણ તેઓ સહન નહોતા કરી શકતા. (એમને એમ લાગતું હતું કે) કાં તો વિકલ્પ છૂટી જશે ને કાં તો

મારા પ્રાણ છૂટી જશે. એ ભૂમિકામાં યોગ્યતાની ચરમસીમા એ આવી ગયા હતા. એટલામાં ‘આત્મધર્મ’ (પત્રિકા) મળી. (વાંચ્યા પછી) એવું અનુમાન થયું કે આ માર્ગને દર્શાવનારા કોઈ છે ખરા, અને ૬૦૦ માર્દિલની સફર કરી નાખી. ૬૦૦ માર્દિલ એટલે ? ૧૦૦૦ કિલોમિટર થઈ જાય. ૧૦૦૦ કિલોમિટરની મુસાફરી કરી નાખી. કોઈ ઓળખાણ-પિછાણ નહીં, ભાષા સમજે નહીં, કાંઈ નહોતું. (તેમ છતાં) પણ તેમને શીખવવું નથી પડ્યું કે, તમારે સત્પુરુષના ચરણમાં જવું જોઈએ. એવો કોઈએ ઉપદેશ નથી આપ્યો. એનો અર્થ એ થાય છે કે, આ વાત શીખવવી પડતી નથી.

જેને પાણીની તરસ લાગે છે અને એવી તરસ લાગે કે, પ્રાણ છૂટી જાય તેમ હોય, તેને શું પાણી ગોતવાનું શીખવવું પડે શું ? કે, તમે પાણી ગોતો, નહીંતર મરી જશો ! કાંઈ શીખવવું પડતું નથી. એ તો સારી વાત છે કે, આપણને શીખવનાર મળ્યાં છે ! તેમને તો વગર શીખવાને જ અનુકરણ - અનુસરણ થઈ ગયું અને અહીં શીખવાનાર મળવા છતાં પણ અનુકરણ અને અનુસરણ નથી થતું - તો આ યોગ્યતાની (જ) બલિહારી છે ! બીજું કાંઈ નથી. એ તો યોગ્યતાનું જ કારણ છે. દરેક જગ્યાએ યોગ્યતાનું સામાજય છે - જેની જેવી યોગ્યતા - બસ !

**મુમુક્ષુ :-** તેની યોગ્યતા ઓછી છે માટે શીખવવાવાળા મળે છે ?

**પૂજ્ય ભાઈશ્રી :-** યોગ્યતા ઓછી હોય કે વધારે, એનાથી કોઈ મતલબ નથી. જ્ઞાની (પોતાના માર્ગ) ચાલ્યા જાય છે અને માર્ગ દર્શાવતા જાય છે. કોઈના ભાગ્યમાં તેમનો યોગ હોય તો તે (માર્ગ) જોઈ લ્યે છે અને જો કોઈની યોગ્યતા નથી હોતી તો - દેખાડનાર મળવા છતાં પણ જોતો નથી. એવું નથી કે બધાં જ નથી જોતાં, (અને) એવું પણ નથી કે બધાં જોઈ લ્યે છે. એવું પણ નથી. માટે એનો કોઈ નિયમ નથી.

‘આ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે, જ્યાં સુધી જીવને સ્વચ્છાદરૂપી અંધત્વ છે. ...દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું,...’ અપ્રમત્ત રહેવું એટલે કે પાછળ પડી જવું. પૂરેપૂરું પાછળ પડી જવું. એ પહેલા મગજમાં કોઈ બીજી વાત આવે નહીં. ‘તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળો છે. એ નિઃશંક માનજો.’ અંધત્વ અવશ્ય દૂર થશે,

સ્વચ્છંદ મટશે જ, માર્ગની પ્રાપ્તિ થશે જ, એમાં શંકા કરવાનો કોઈ અવકાશ નથી. કોઈ શંકાને અવકાશ નથી. એકદમ અનુભવસિદ્ધ વાત છે. કેવી વાત છે ? અનુભવસિદ્ધ વાત છે.

‘અનાદિ કાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે.’ આ (માર્ગને) છોડી જે પણ માર્ગ પસંદ કર્યો, તે બધાં વિપરીત છે. તે માર્ગ નથી પરંતુ ઉન્માર્ગ છે. શું છે ? માર્ગ નથી પરંતુ ઉન્માર્ગ છે અને અંધત્વ વધ્યું છે. ઉન્માર્ગ ઉપર ચાલતાં વધુ દૂર ગયો છે. એ જ ધંધો કર્યો છે. ‘જો કે તેણો જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે;...’ કરોડોવાર નહીં (પરંતુ) અનંતવાર કર્યા છે. ‘તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણો કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.’ અમે ઉપરના વચનોમાં એ જ બતાવ્યું છે. તે જ નથી કર્યું, બાકી બધું કરી લીધું છે. આપણું જીવન જોવાથી એ ખબર પડી જશે કે, આપણે પણ જે કંઈ કર્યું તેમાં આ બાકી રહી ગયું છે (કે) ઓળખાણ થઈ નથી, યોગ્યતા આવી નથી. બાકી તો શાસ્ત્ર અધ્યયન કરે છે, થોડી પૂજા-ભૂજ ત પણ કરે છે, થોડાં દ્યા-દાન પણ કરે છે; (એ રીતે) જે કંઈ પણ મુમુક્ષુને યોગ્ય પરિણામ છે તે કરે છે. પરંતુ જીવન ચાલ્યુ જાય છે અને કાર્ય થતું નથી અનું શું કારણ છે ? કે આ (કહ્યું) જે તે થયું નથી. માત્ર આ જીવન જ નહીં પણ આવી તો અનંત જુંદગી આ રીતે ચાલી ગઈ.

હવે આ વાતના પુરાવા આપે છે. બે પુરાવા આખ્યાં છે. એક સત્યુગના પ્રારંભનો અને એક સત્યુગના અંતનો કારણકે ચોથો આરો છે એમાં ધર્મ ઘણો થયો, અનેક જીવોએ ધર્મની પ્રાપ્તિ કરી. બહુ મોટી સંખ્યામાં, બહુ મોટી માત્રામાં ધર્મની પ્રભાવના થઈ હતી. (સત્તા)યુગના પ્રારંભના પણ આ જ કારણથી ધર્મ થયો અને અંતમાં પણ આ જ કારણથી ધર્મ થયો. બે પુરાવા આખ્યા છે.

પહેલો પુરાવો આપે છે. ‘સૂયગડાંગસૂત્રમાં ધમદેવજી ભગવાને જ્યાં અહ્ંકારું પુત્રોને ઉપદેશ્યા છે,...’ એ અહ્ંકારું પુત્રો મોક્ષે ગયા છે. ધત્તદેવ ભગવાનના કેટલાં પુત્રો હતાં ? ૧૦૦ પુત્રો હતા. એમ જોઈએ તો, સો એ સો મોક્ષે ગયા છે. પરંતુ ઈતિહાસ માત્ર ભરત-બાહુબલીજીનો મળે છે.

બાકીના અહ્ંકારું પુત્રોનો એટલો હતિહાસ નથી મળતો. કારણકે તેઓ તુરંત (મોક્ષમાં) ચાલ્યા ગયા. એમાં કોઈ ઘટના ઘટી જ નથી. ભરત મહારાજાની તો ચક્રવર્તીપદની (વાતો આવે છે) અને બાહુબલીજી ને ભરતજી સાથે યુદ્ધની ઘટના બની છે. પરંતુ આ લોકોને તો કોઈ ઘટના જ નથી ઘટી. તેઓ બોલતા ન હતાં. સમવસરણમાં ભગવાનનો ઉપદેશ સાંભળતા હતા. બોલતા ન હોવાથી કોઈને શંકા ગઈ કે આવા મહાપુરુષના પુત્રો કાંઈ મૂંગા થોડા હોય શકે ? તેઓ બોલ્યા નહોતા. એટલું પુણ્ય લઈને આવ્યાં હતાં - તીર્થકરના પુત્રો મૂંગા થોડા હોય ? આ બોલતા કેમ નથી. ઉપદેશ જ સાંભળતા હતા. સાંભળતા હતાં અને અંદરમાં ઉતારતા હતાં. શું કરતા હતાં ? બહાર નહોતાં બોલવા માંડતા. અત્યારે તો થોડું સાંભળ્યું, થોડું વાંચ્યું કે બહાર બોલવા માંડે છે. અંદરમાં ન જાય તો બહાર બોલવા લાગી જાય. (ઉપદેશને) અંતરમાં ઉતારતા હતા. જ્યારે પહેલું-વહેલું બોલ્યા તો એટલું જ બોલ્યા કે ‘અમારે ભગવતી પ્રવર્જયા ગ્રહણ કરવી છે. અમારે સંસારમાં ચાંચ કાંઈપણ કરવું નથી. આપની જે આજ્ઞા છે તેને અમે શિરોધાર્ય કરી છે. અમે તો આપના ચરણમાં બેસી ગયા છીએ, હવે ઉઠવાના નથી.’ જાઓ ! (એમ કહીને) દીક્ષા લઈ લીધી. બધાં જ ભાવલિંગી સંત થઈ ગયા. (અને) તે જ ભવમાં મોક્ષમાં -નિર્વાણપદમાં ચાલ્યા ગયા. નિગોદમાંથી આવ્યા હતા. તેઓને ચોરાસી લાખ ધોનિમાં જન્મ-મરણ જ ન કરવા પડ્યાં. મનુષ્ય થઈને નિર્વાણપદમાં ચાલ્યા ગયા. પભદેવ ભગવાને જે એવા ચરમશરીરી, મોક્ષગામી અહ્ંકારું પુત્રોને ઉપદેશ આપ્યો હતો અને ‘મોક્ષમાર્ણ ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે.’ - ત્યાં કેવો ઉપદેશ આપ્યો છે, તેને ત્રણ પંચ તમાં લખે છે.

‘હે આયુષ્મનો !...’ તમે મનુષ્ય આયુષ્ય ભોગવી રહ્યાં છો, નિર્વાણપદના અધિકારી છો. ‘આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચ્ચ, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી...’ શું આપણે પણ (ઉપદેશ) નથી સાંભળ્યો ? (અહીંયા કહે છે કે) સાંભળ્યો નથી જાઓ ! સાંભળ્યાં પછી તેનું અમલીકરણ ન થયું તો સાંભળ્યું જ નથી, ઉપરથી કાઢી નાખ્યું. એક કાનથી સાંભળ્યું ને બીજા કાનથી કાઢી નાખ્યું.

‘અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી.’ એટલે કે ગ્રહણ કર્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.’ સત્પુરુષના ઉપદેશને ગ્રહણ કરવો તે જ સામાયિક છે. એક કલાક બેસી જવું તે સામાયિક નથી. સામાયિકના પાઠ બોલી જેવા તે પણ સામાયિક નથી. (અત્યાર સુધી જે સામાયિક) કરી તે સામાયિક હતી કે કેમ? બિલકુલ સામાયિક નહોતી. તે સામાયિકના વિષયમાં એક ભાંતિ હતી. તે ભાંતિને છોડી દીધી. આ કરવા લાયક નથી. સામાયિક તો એ છે કે, જે સત્પુરુષના ઉપદેશને ગ્રહણ કરી અંતરના ઉતારી લ્યે, તે જ સામાયિક છે. અહીં મુનિઓની સામાયિક સાથે સરખામણી કરી છે, જુઓ! આ વાત સૂયગડાંગસૂત્રમાં આવી છે. ખભદેવ ભગવાને અહૃણું પુત્રોને માર્ગ ચઢાવ્યા છે. ઉપદેશ આખ્યો છે, આ રીતે ઉપદેશ આખ્યો છે, આ રીતે માર્ગ પર ચઢાવ્યા છે. જ્યારે સત્પુરુષનો પ્રારંભ હતો, અને આવા પાત્ર જીવો તેમના સમવસરણમાં હતા, ત્યાં પણ ઉપદેશ એ જ આખ્યો કે, સત્પુરુષના વચનનું અનુસરણ કરી અંતરમાં ઉતારી લ્યો. જે સત્પુરુષના વચન છે - તે જ શ્રીગુરુના વચન છે - તે જ પરમગુરુ તીર્થકરના વચન છે. એમાં કાંઈ ફરક નથી. આખા ચતુર્થ કાળમાં આવો જ ઉપદેશ ચાલ્યો અને જે ભાગ્યવંતોએ આ ઉપદેશનું અનુસરણ કર્યું, તેઓ ધર્મ પામીને પોતાનું કલ્યાણ કરવા લાગી ગયા. (ચતુર્થ કાળના) છેલ્લા સમયમાં શું થયું? અંતમાં બે કેવળી રહી ગયા. સુધર્માસ્વામી અને જંબુસ્વામી. જંબુસ્વામી છે તે અંતિમ કેવળી છે. પહેલા ગૌતમસ્વામી ગયા, પછી સુધર્માસ્વામી ગયા એ પછી મથુરાથી જંબુસ્વામી (મોક્ષમાં) ગયા.

મથુરા-ચોરાસી કહે છે ને? ત્યાં ચર્ચા ચાલી હતી કે, આને ચોરાસી કેમ કહેવાય છે? કારણકે આજુબાજુમાં ચોવીસ કોસમાં ધર્મ પ્રભાવના થઈ હતી. મોક્ષની (પ્રભાવના થઈ હતી) માટે તેને મથુરા-ચોરાસી કહેવાય છે.

‘સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશો છે કે જગત આખાનું જેણો દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણો આમ અમને કહ્યું છે -’ ભગવાન મહાવીર આપણાં પરમ ગુરુ હતા. સુધર્માસ્વામી જંબુસ્વામીને શું કહે છે? કે, ભગવાન મહાવીર જે આપણાં ગુરુ હતા, તેઓ કેવા હતાં? કે સર્વજ્ઞ

હતા. આજા જગતનું દર્શન કરી લીધું હતું. કોઈપણ વાતથી અજાણ્યા નહોતા - અનન્ભિજ્ઞ નહોતા. તેમણે અમને આ પ્રકારે કદ્યું હતું. અમારા ગુરુએ તો અમને આમ કદ્યું હતું જેથી અમે મોક્ષમાં જશું. તમે પણ સાંભળો અને મોક્ષમાં ચાલ્યા જાવ. 'ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.' ગુરુને આધીન થઈને રહ્યાં તેમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો. જે ગુરુને આધીન થઈને ન રહ્યાં તેણે મોક્ષને પ્રાપ્ત ન કર્યા. ક્ષેત્રથી (ગુરુને) આધીન રહ્યાં, એ વાત નથી. ક્ષેત્રથી તો નજીક રહે (પરંતુ) ભાવ ધા ચાલે - તે ગુરુને આધીન નથી. ક્ષેત્રથી દૂર હોય કે સમીપ હોય, પરંતુ તેમની આજ્ઞામાં રહેવાનો જેનો નિશ્ચય છે તે તરી જશે.

**મુમુક્ષુ :-** ઉપદેશને અંદર ઉતારવો તે જ ચરણકમલની ઉપાસના છે ?

**પૂજ્ય ભાઈશ્રી :-** તે જ વાસ્તવિક ચરણકમળની ઉપાસના છે. એટલે એમાં (એક) બીજી વાત રહેલી છે. ઠીક (પ્રશ્ન) છે. જેને શ્રીગુરુનો - સત્પુરુષનો ઉપદેશ મળે છે અને પોતાના અંતરંગમાં - ભર્મસ્થાનમાં પહોંચે છે (અર્થાત્) તેની અસર આવે છે અને જે તેનું અમલીકરણ કરવા લાગી જાય છે, તેને ખબર પડી જાય છે કે હવે, મારું કલ્યાણ થશે. થશે અને અવશ્ય થશે. તેને તેમની (શ્રીગુરુની) ચરણરજ માથે ચડાવવાનો ભાવ આવે છે. પોતાના ઉપકારી (શ્રીગુરુ) પ્રત્યે એટલી બધી ઉપકારબુદ્ધિ આવે છે કે, તેમની ચરણરજ તે માથે લગાડે છે. એટલી ઉપકારબુદ્ધિ તેને આવે છે. પછી થયું શું ? કોઈકને ખરેખર આવું બન્યું એટલે તેણે તો એમ કર્યું, પણ તેની નકલ કરી લેવાથી કાંઈ ઉપકાર નથી થઈ જતો. પછી એવી Tradition થઈ ગઈ કે, ચાલો ! ગુરુના ચરણસ્પર્શ કરો ! તેમની ચરણરજને માથે લગાડો ! પણ અહીં એવી વાત નથી.

**મુમુક્ષુ :-** પછી માથા ઉપર વાસ્કેપ નખાવે છે.

**પૂજ્ય ભાઈશ્રી :-** વાસ્કેપ તો કંઈક સારી રજ હશે. સુખડ વગેરેનો પાવડર હશે. પણ આ તો ચરણરજ-ધૂળ છે. જેને આપણે મેલાપણું કહીએ છીએ. શું કહીએ છીએ ? (મેલાપણું કહીએ છીએ). પાણીમાં નાખે તો પાણી મેલું થાય કે ન થાય ? (થાય.) તો એ રીતે, એટલી ઉપકારબુદ્ધિ આવે છે અને એવી ઉપકારબુદ્ધિ આવવાથી બહારમાં એવી પ્રક્રિયા પણ થાય છે. પરંતુ

પછી જેને ઉપકાર ન થયો હોય એ પણ નકલ કરવા લાગી જાય છે. તેથી કાંઈ કામ થતું નથી. મૂળમાં એ વાત હોય છે અથવા હતી એટલેકે હોય છે. એમ વાત છે. એવું બને છે. પછી જે નથી સમજતા તે પણ એવું કરી લ્યે છે. જે સમજને કરે છે તેની તો વાસ્તવિક વાત છે. જે સમજયાં વગર કરે છે, તે ઓધસંઝામાં કરે છે. બનેને (બહારની પ્રક્રિયા તો) હોય છે.

**મુમુક્ષુ :- ભર્ત ત તો અંતરંગથી ઉઠે છે.**

**પૂજ્ય ભાઈશ્રી :-** એ તો ઠીક છે. ઓળખાણ થશે તો અંતરંગથી (ભર્ત ત) આવ્યા વિના રહેશે નહીં. એ વાત બહુ જ સ્વાભાવિક છે. બહુ જ સ્વાભાવિક છે. પરંતુ એમ નહીં થવું એ અસ્વાભાવિક છે. શું ? એમ નહીં થવું તે અસ્વાભાવિક છે અને એમ થવું તે એકદમ સ્વાભાવિક છે.

બહારમાં દિલ્હીના Secretariat માં એક કામ કઠાવવા જઈએ ને ! (તો પણ કેટલી ગરજ કરીએ છીએ ?) મંત્રી પાસેથી કોઈ લાયસન્સ લેવું હોય તો પહેલાં તેના પણ્ણવાળાથી માંડીને, સેકેટરી પાસે થઈને ત્યાં પહોંચવું પડે છે અને બધાંને રાજી રાખવા પડે છે અને એ પણ્ણવાળો ઢેઢ - ભંગી હો કે ચમાર હો અથવા તે પ્રધાન પણ ભંગી કે ચમાર (જાતિનો હોય તો પણ), ત્યાં કેટલી ગરજ કરવી પડે છે ? સાહેબ... સાહેબ... સાહેબ... કરીને, પોતે કરોડપતિ હોય તોપણ પૂછ્યી હલાવવા લાગે છે કે નહીં ? કેમ ? કેમકે, તેની ગરજ છે. એક કામ કઠાવવું છે તો એટલી ગરજ હોય છે ! (તો) અહીં અનંત જન્મ-મરણ મટાડવાં માટે કેટલી ગરજ થતી હશે !! તેનો હિસાબ કરી જોજો, બસ ! વાત સમજય જશે !

ભાવનગરમાં એક ભાઈ આવ્યા હતા. તે કૃપાળુદેવની બહુ ભર્ત ત કરતા હતા. તેને બધે કૃપાળુદેવ જ દેખાતા હતા. (તે કહેતા હતા) હું ભાવનગર આવ્યો ત્યારે બસમાંથી વાદળા જોયા તો વાદળાં ઉપર કૃપાળુદેવને બેઠેલાં મેં જોયા. સ્કુટર ચલાવું છું તો એવું લાગે કે મારી આગળ ચાલી રહ્યા છે અથવા મારી પાછળ બેસી ગયા છે. બધી જગ્યાએ એ જ દેખાય છે. તો શું કૃપાળુદેવ સર્વવ્યાપક થઈ ગયા હતા કાંઈ ? કે તેની નજરમાં તો સર્વવ્યાપક થઈ ગયા ! આ વાત પરથી ભગવાનને સર્વવ્યાપક કહેવામાં આવે છે. વાસ્તવમાં ભગવાન સર્વવ્યાપક નથી. પરંતુ જ્યાં-જ્યાં નજર પડે છે, ત્યાં-

ત્યાં પોતાના ઉપકારીના દર્શન થાય છે. તેને સર્વવ્યાપકતા થઈ ગઈ, એમ કહેવામાં આવે છે. આવું બને છે. (આવું) પણ બને છે. આ વાત સહજ-સ્વાભાવિક હોય છે. તે કરવું પડતું નથી કે શીખવું પણ પડતું નથી. આ શીખડાવવામાં નથી આવતું. એ થઈ જાય છે.

‘એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળો અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.’ અહીં લક્ષ એટલે હરાદો. દરેક સ્થળે, બધા શાસ્ત્રમાં આ જ વાત કહેવાનો હરાદો છે. તેનું સૂત્ર છે. - ‘આણાએ ધર્મો આણાએ તવો’ ‘આજાનું આરાધન એ જ ધર્મ અને આજાનું આરાધન એ જ તપ.’ બહારમાં તો જે લોકો તપ કરે છે ને ! જેમકે ઉપવાસ આદિ કરે છે; ન ગમતી પરિસ્થિતિને સહન કરીને પણ તપ કરે છે. પરંતુ ગુરુઆજ્ઞા ન ગમે, એવું

ચારેય બનતું નથી. પોતાની પસંદગી-નાપસંદગીની એમાં કોઈ પરિસ્થિતિ નથી હોતી કે, મને આ પસંદ છે કે નહીં ? એ વાત ત્યાં રહેતી નથી. કહે છે ને ? No choice, No voice. તેની સામે કોઈ અવાજ નહીં. બસ ! જે આજ્ઞા છે તેને ઉઠાવી લીધી. તેમાં કાંઈ સહન કરવાં - નહીં કરવાનો પ્રશ્ન જ અસ્થાને છે. તેને જ તપ કહેવામાં આવું છે. અને તપ પરમ પ્રેમથી ઉપાસનીય હોય છે. આર્તધ્યાનના પરિણામથી જે તપ કરવામાં આવે છે તે તપ છે જ નહીં.

**મુમુક્ષુ :-** આમાં નિભિત્તનું ઘૂંટણ બહુ ચાલે છે.

**પૂજ્ય ભાઈશ્રી :-** આખો દિવસ નિભિત્તનું ઘૂંટણ ચાલે છે ત્યારે કેમ પ્રશ્ન ઉઠતો નથી ? ભૂખ લાગે એટલે ખાવા બેસી જઈએ, બહુ ભૂખ લાગી હોય તો ઝપટ મારે ! તરસ લાગી હોય તો ફટાફટ પાણી પી લઈએ છીએ, ત્યાં તો નિભિત્ત સૂઝતું નથી ! અને આખો દિવસ - ચોવીસ કલાક કર્મના ઉદ્યમાં - નિભિત્તમાં જોડાઈને કામ કરે છે. એક સમય એવો બતાવી છ્યો કે, તમારા ચોવીસ કલાકમાંથી એક સમય પણ તમે નિભિત્તાધિન થયા વગર પ્રવૃત્તિ કરતા હો ? (બસ !) એક સમય બતાવી છ્યો ! માટે અહીં, પહેલાં નિભિત્ત બદલો. આ રીતે પહેલા (નિભિત્ત) બદલો. જ્યારે તું નિભિત્તાધિન થયેલો જ છો અને બીજો કોઈ બચવાનો ઉપાય નથી તો એક વખત નિભિત્તને બદલો. પછી ઉપાદાનમાં (આપો આપ) આવી જશો. નિભિત્ત બદલ્યા વગર

ચારેય ઉપાદાનમાં નહીં આવી શકે. ઘડો ઘો છે તે આડો થશે પછી સીધો થશે. એક પણ ઘડો આડો થયા વગર સીધો થયો હોય તે અસંભવ છે - અશે ય છે. ચારેય ન બની શકે, તો પહેલાં આડા તો થઈ જાવ ! એમ કહે છે. જ્યારે આડા થવાનું કહેવાય છે તો આ કહે છે કે, આડા નહીં સીધા થવું છે. તો કહે છે કે, તારે સીધા થવું જ નથી. એમ વાત છે. અહીં નિમિત્તાધીન દૃષ્ટિ થઈ જાય છે, એવો વિચાર જેને આવે છે તેઓ બહુ દુભર્જી છે ! બહુ મોટો દુભર્જી છે ! કારણકે અહીં પણ તેની સરળતા ન રહી. - આડોડાઈમાં રહ્યો.

આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ્ય - આ આચારાંગસૂત્ર યાંથી નીકળ્યું ? ભગવાનની વાણી અને ગાણધર ગૌતમસ્વામીના માધ્યમથી આ આચારાંગસૂત્ર લખાયું છે. આ મૂળ સૂત્ર છે. ‘જો એવં જાણહિ સો સવં જાણહિ’ (આ પણ) મૂળ સૂત્ર છે. ‘આણાએ ધર્મો આણાએ તવો’ ! - આ મૂળ સૂત્ર છે. બાકી પછી Adulteration (ભેળસેળ) થઈ હોય, તે અલગ વાત છે. બાકી કેટલાંક મૂળ સૂત્રો એમનેમ રહ્યાં છે. આ ભગવાનનું મૂળ સૂત્ર છે. શું ભગવાનને ઉપાદાનની ખબર નહીં હોય ? ભગવાનને ઉપાદાનનો ઉપદેશ દેતાં નહોતું આવડતું કે જેથી આવું સૂત્ર લખી નાયું ? તો પછી ભગવાનની ભૂલ થઈ ગઈ કે શું !! અમે તો ઉપાદાનવાળા ! ભગવાનની પણ ભૂલ કાઢી શકીએ છીએ. !! (અરે !) આ જ સ્વચ્છંદ છે, બીજું કાંઈ નથી. આનું નામ જ સ્વચ્છંદ છે.

‘સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે.’ સર્વ મહાપુરુષોનો આ જ કહેવાનો હરાદો છે. ‘એ લક્ષ જીવને સમજાયો નથી’ અનંતકાળમાં અનંતવાર સાંભળ્યાં છતાં પણ સમજમાં નથી આવ્યો. ‘તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે...’ જુઓ ! શું લખ્યું ? કેમ સમજાશું નથી ? કારણકે અભિપ્રાયમાં સ્વચ્છંદ રાખીને સાંભળ્યું છે. ‘જ્ઞાનીપુરુષ’ ભલે ને ના પાડે ! આપણે તો જે કિયા કરવી હો તે જ કરીશું ! પૂજા પહેલાં કરશું, પછી સ્વાધ્યાય કરશું ! ( એવું ભાવમાં રાખીને સાંભળ્યું.) આપણે ત્યાં પણ કેટલાંક કરે છે ને ! પહેલા પૂજા પછી સ્વાધ્યાય ! અને સ્વાધ્યાય ચાલતો હોય તે જ સમયે પૂજા (પણ ચાલતી હોય છે) !

ગુરુદેવશ્રી તો ઠપકો આપતા હતા. (કહેતાં હતાં) કે આને તો શુભમાવ કરવાની પણ સમજણ નથી, તો જ્ઞાન તો ચાંથી થશે? ચો શુભમાવ ઉચ્ચકોટિનો છે અને ચો કરવો જોઈએ? એ પણ એને જ્ઞાનમાં - સમજણમાં નથી આવ્યું!

(અહીં કહે છે, એવું થવામાં) ‘સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો.’ જેનો સ્વચ્છંદ મંદ થયો છે તેને ચાર પ્રકારની પ્રતિબદ્ધતા છે. લોકસંબંધી એટલે સમાજ સંબંધીત, સ્વજન-કુટુંબ સંબંધી, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ-વિકલ્પરૂપ (બંધન) - એ જે પ્રકારના પ્રતિબંધ છે, એ બંધનને દૂર કરવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે, તેનો આ ઉપરથી તમે વિચાર કરો. ‘અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો.’ લલ્લુજીને કહે છે કે, ચાર પ્રકારના પ્રતિબંધ છોડવાનો વિચાર કરજો અને એ વિચાર કરતાં કાંઈ પૂછવા યોગ્ય જરૂરિયાત લાગે, આવશ્યકતા લાગે તો અમને પૂછજો.

‘અને એ માર્ગ જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશો.’ (ઉપશમ) એટલે સમ્યકૃદર્શન થશે, થશે અને થશે જ. ‘ઉપશમ મળે અને જેની આજાનું આરાધન કરીએ એવાં પુરુષનો ખોજ રાખજો.’ અહીં (જો કોઈ) સત્પુરુષ ન હોય તો તેની ખોજમાં રહેજો, એવો એક સંકેત કર્યો છે. કારણકે માની લ્યો કોઈને ખબર તો પડી કે, સત્પુરુષના ચરણમાં રહેવું જોઈએ પણ સત્પુરુષ હોય તો ચરણમાં રહીએ ને! (તો) એની ખોજ કરવી પડે છે.

‘બાકી બીજા બધાં સાધન પછી કરવા યોગ્ય છે.’ અર્થાત્ એક પણ સાધન પહેલાં ન કરવું, બાકી બધાં પાછળ રાખ્યાં છે. ‘આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય.’ બીજો કોઈ માર્ગ છે નહીં, તેમ છતાં પણ કોઈ તર્ક ઉઠે તો કહી દેજો. તમને (તેનો જવાબ) આપી દેશું. એમ કહીને લલ્લુજીસ્વામીને આ પત્ર લખ્યો છે. (સમય સમાપ્ત થયો છે).



‘શ્રીમદ્ રાજચંદ્ર’

પત્રાંક - ૨૦૦

મુંબઈ, માહ સુદ, ૧૯૪૭  
વચનાવલી

૧. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્તસુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.

૨. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.

૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક-લજજાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુભંધી કષાયનું મૂળ છે.

૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણો છચ્છવી, તેણો જ્ઞાનીની છચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની છચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.

૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની છચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.

૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસર્ટ તનો ત્યાગ કરી તેની ભર્ત તમાં જોડાય.

૭. જોકે જ્ઞાની ભર્ત છચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણામતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભર્ત ત અવશ્ય કર્તવ્ય છે એમ

સત્પુરુષોએ કહ્યું છે.

૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.

૯. ધર્મદેવજીએ અદ્ભુતું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો.

૧૦. પરીક્ષિત રાજાએ શુક્રદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.

૧૧. અનંતકાળ સુધી જીવ નિજ છંટે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.

૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.

૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી.

૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.

ઇતિ શિવમ्



પ્રવચન - ૪  
**‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક-૨૦૦**

તા. ૦૮/૦૧/૧૯૯૮ - કલકતા

---

---

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત. પત્રાંક - ૨૦૦. વચનાવલીમાં સંતનો અદ્ભુત માર્ગ પ્રકાશ્યો છે. ચૌદ વચનો લખ્યાં છે.

‘જીવ પોતાને ભૂલી ગયો છે,...’ જીવ પોતાને ભૂલી ગયો છે, એટલે કે પોતાના મૂળ સ્વરૂપને ભૂલેલો છે કે મારું મૂળ સ્વરૂપ શું છે ? મારી જે પણ વર્તમાન અવસ્થા છે અને તેની સાથે જેટલાં-જેટલાં, જેવાં-જેવાં સંબંધ છે, તેવો-તેવો હું મારો અનુભવ કરું છું. તે મારું મૂળ સ્વરૂપ નથી. કારણકે કેટલાંક કાળ પહેલા તેવું નહોતું અને અમુક કાળ પછી એવું નહીં રહે. આ એક વચ્ચે Periodical પરિસ્થિતિ છે, તે (મારું) મૂળ સ્વરૂપ નથી. પરંતુ મૂળ સ્વરૂપનું અભાન હોવાથી અથવા તે વિષયમાં પોતે - સ્વયં બેભાન હોવાથી, વર્તમાન પરિસ્થિતિ ને જ પોતાનું કાયમી સ્વરૂપ માનીને જ જીવ સંસારમાં પ્રવૃત્તિ કરે છે. ‘...અને તેથી સત્તસુખનો તેને વિયોગ છે;’ તેથી તેને સાચા સુખનો વિયોગ છે, આભિક સુખનો વિયોગ છે.

સંસારના જે સુખ છે તે સત્તસુખ નથી, સાચું સુખ નથી. કારણકે તેમાં અનેક પ્રકારની આકુળતા છે, બાધાસહિત છે, અપૂર્ણ છે અને અલ્યકાલિન છે. તે સાચું સુખ નથી. સાચું સુખ શાશ્વત હોય છે, બાધા રહિત હોય છે અને તેમાં સર્વાશે આકુળતાનો અભાવ હોય છે.

એવું સુખ શા માટે (પ્રાપ્ત) નથી ? કારણકે પોતાનું મૂળ સ્વરૂપ અનંત સુખનું ધામ છે, તેમાં અનંત સુખનું નિધાન ભર્યું છે તેને તે ભૂલી ગયો છે. તેથી (સંસારનું) જે Artificial (કૃત્રિમ) સુખ છે, કેવું છે (તે સુખ) ? Artificial છે, તેને જ તે સાચું સુખ માની તેની પાછળ તેને મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે. આ વાત ‘(એમ) સર્વ ધર્મ સમ્મત’ (અર્થાત્) તે કથન સર્વ ધર્મ સમ્મત છે. જેટલાં પણ આસ્તિ ય દર્શન છે તે બધાં આ વાતનો સ્વીકાર કરે છે.

કોઈ આસ્તિ ય દર્શન સાંસારિક સુખને સાચું સુખ નથી કહેતા. આધ્યાત્મિક સુખને જ, આત્મિક સુખને જ સુખ કહે છે.

‘પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.’ આ બીજું વચન છે. આમ પોતાને ભૂલી જવું તે જ અજ્ઞાનનું સ્વરૂપ છે. પોતાના મૂળ સ્વરૂપના જ્ઞાનનો અભાવ, તેને કહે છે ‘અજ્ઞાન.’ ‘અ’ એટલે નહીં, જ્ઞાન ન હોવું. જ્ઞાનનો અભાવ હોવો. પોતાના સ્વરૂપનું જ જ્ઞાન નથી, તેને જ અજ્ઞાન કહે છે. આવા અજ્ઞાનનો નાશ આત્મજ્ઞાન થતાં, આત્માનો સાક્ષાત્કાર થતાં પ્રાપ્ત થાય છે. એવા અજ્ઞાનનો નાશ થાય છે એમ નિઃશંક માનવું. કારણકે તે તો સીધી-સાદી વાત થઈ ગઈ કે જે સ્વરૂપનું અજ્ઞાન હતું, તેનું જ્ઞાન થયું તો અજ્ઞાનનો નાશ થયો. તેમાં કોઈ શંકાને અવકાશ નથી. કોઈ શંકાનો અવકાશ નથી. કોઈ Scope નથી.

હવે કહે છે કે, એ પ્રશ્ન અહીં થઈ શકે છે કે, આવું આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય ? અને અજ્ઞાનનો નાશ કેવી રીતે થાય ? અને અજ્ઞાનનો નાશ થાય તેવાં જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ? તેનો ઉત્તર પોતે જ આખ્યો છે. ફૃપણુદેવની પદ્ધતિ એવી છે કે, જ્યાં જેવો પ્રશ્ન ઉઠે, તેનો ઉત્તર વગર પૂછ્યે જ લખો દે છે. તેટલા તેઓશ્રી સમર્થ હતા, અહીં એવું જ લખવું જોઈએ કારણકે એવો પ્રશ્ન ઉઠવો અહીં સંભવિત છે.

‘જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, જ્તાં જીવ લોકલજાછિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુભંધી કખાયનું મૂળ છે.’ આ ગ્રીજું વચન છે. શું કીધું ? કે આવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ, જે આત્મજ્ઞાની હોય તેની પાસેથી થવી જોઈએ, તે સ્વાભાવિકરૂપે સમજાય છે. તેમાં કોઈ વિશેષ બુદ્ધિમાની આવશ્યક નથી. જેમકે, આપણાને શરીરમાં ચાંચપણ દુખાવો થાય છે, આપણે નથી જાણતાં હોતા કે આ દુખાવો ચા રોગને કારણો છે ? કેમ થયો છે ? અને કેવી રીતે મટશે ? તે કાંઈ આપણે જાણતા નથી. અને ગમાર હોય તેને ઘણી ઓછી બુદ્ધિ હોય, તે પણ દુખાવો થતાં ડોક્ટર પાસે જશે, વૈદ પાસે જશે. કારણકે તે વિષયમાં - Medical Science ના વિષયમાં તે Expert હોય છે, તજજ્ઞ હોય છે. જે વિષયમાં જે તજજ્ઞ હોય તેની પાસે જ જવું જોઈએ, આ વાત તો ગમારને પણ સમજમાં આવે છે. આપણે તો વિશેષ બુદ્ધિમાન જીવ છીએ.

તેવા ગમાર નથી અને કોઈ (આપણાને) ગમાર કહે તો એ વાતને સ્વીકારવા પણ આપણે તૈયાર નથી. આપણા કારોબારમાં બુદ્ધિ લડાવીએ છીએ. લડાવીએ છીએ કે નથી લડાવતાં ? આ તો સ્વાભાવિક સમજમાં આવે તેવી વાત છે. તો પણ આપણે આત્મજ્ઞાની પાસે જતાં નથી, અને લોકલજ્જાનિટ કારણે અજ્ઞાનીનો આશ્રય છોડતાં નથી. લોકો શું કહેશે ? તમે ત્યાં જાવ છો ? આપણાં સંપ્રદાયમાં મહારાજ છે, ત્યાગી છે, શાસ્ત્ર પણ વાંચે છે, શાસ્ત્રના જ્ઞાની પણ છે. પરંતુ આત્મજ્ઞાની છે કે નહીં ? તેની ખબર નથી.

મનુષ્ય કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લ્યે છે. ચાર ગતિમાં સાંપ્રદાયિક વ્યવસ્થા એક મનુષ્યગતિમાં જ છે. પશુ-પક્ષી-તિર્યંગગતિમાં નથી. દેવલોકમાં પણ કોઈ સંપ્રદાય નથી. નરકલોકમાં પણ કોઈ સંપ્રદાય નથી. મનુષ્ય કોઈને કોઈ ધાર્મિક સંપ્રદાય કે કુળમાં જન્મ લ્યે છે. જે સંપ્રદાયમાં તે જન્મ લ્યે છે, તે જ અનુસાર તેનું પૂર્વકર્મ હોય છે. એટલેકે પૂર્વના ભાવ હતા. પૂર્વકર્મ હોવા - બંધાવા એનો અર્થ કે પૂર્વના ભાવ હતાં. તે અભિપ્રાયને કારણે તેને તે ગતિ, તે કુળ મળ્યાં છે. જૈનોને જૈન કુળ મળ્યું. તેનું કારણ તેણે ચાંક ને ચાંક ઓઘસંજ્ઞાએ પણ જૈન ધર્મની અનુમોદના કરી છે. (તેથી) જૈન કુળ મળ્યું છે. અને અન્ય મતિઓએ જે-જે સંપ્રદાયમાં તેણે જન્મ લીધો તેવી બુદ્ધિ તેની પહેલાં થઈ હતી. તેનો તેવો અભિપ્રાય હતો. તે પ્રકારની વાત તેણે સમૃત કરી હતી. એમ વાત હતી. તેનો તે જ સંપ્રદાયમાં પ્રારબ્ધનો યોગ થયો અને ત્યાં જન્મ લીધો. એ રીતે કર્મનુસારિણી મતિ અને ગતિનો સંબંધ છે.

હવે, જે પણ સંપ્રદાયમાં જવ જન્મ લ્યે છે, તેને તે વાતને છોડી, પોતાના સંપ્રદાયને છોડી, અથવા સંપ્રદાયના રૂઢિ - રિવાજ, માન્યતા, શ્રદ્ધા છોડી અન્ય જગ્યાએ જવામાં તકલીફ થાય છે, મુશ્કેલી પડે છે. કારણકે તેના સંપ્રદાયવાળા તેને રોકે છે કે, તમે આમ કેમ કરો છો ? આપણાં સંપ્રદાયમાં પણ ત્યાગી લોકો છે, જ્ઞાની છે, બધું છે. આપણાં સંપ્રદાયમાં શું ખામી છે ? કે તમે આ છોડી બીજે જાવ છો ? વળી, સંપ્રદાયમાં જે લોકો હોય છે તે સગા-સંબંધી વગરે હોય છે. તે સંબંધ ચાંક તૂટી ન જાય (એવો ભય રહે છે.) આપણાં સંબંધમાં કોઈ વ્યવહારિક સંબંધ હોય છે, તો કોઈ વ્યાપારિક સંબંધ હોય છે, સમાજની સાથે કાંઈને કાંઈ સંબંધ તો હોય જ છે. કારણ ઓળખાણ -

પીણાણમાં એ બધું બનતું હોય છે. તેમાં કોઈ તિરાડ ન પડે, તેમાં કોઈ ભેટ-ભાવ ન થઈ જાય, કલેશ ન થઈ જાય, આપણાં સંબંધ બગડે નહીં. એવા ઘણાં પ્રકારની હિંમત હારી જવાની પરિસ્થિતિ એટલે કે ભય ઉત્પન્ન થાય છે. બીજું એ કે આપણો જે સમાજ - સંપ્રદાય છે તેમાં આપણી આબરું હોય છે. બીજાં તો આપણને જાણતાં પણ નથી હોતા. જે ઓળખાણ - પીણાણવાળા હોય તે જ જાણતાં હોય છે. તેઓની વચ્ચે જ આપણી છજીત, આબરું, કીર્તિ હોય છે. તેનું શું ? આપણી કિંમત ચાલી જશે, આપણી છજીત ચાલી જશે. - તેવા ભયથી પણ લોકલજા હોય છે કે. તે લોકોની શરમ રાખવી જોઈએ, કાંઈ કહે તો તેની વાત માનવી જોઈએ, એમ કરીને જીવ, (સાંપ્રદાયિક વ્યાચી ત) આત્મજ્ઞાની ન હોવા છતાં, તેવા અજ્ઞાનીઓનો સંગ છોડતો નથી, સંગતિ છોડતો નથી.

ચારેક-કચારેક તો એવું બને છે કે, જ્ઞાનીનો પણ સંગ કરે અને અજ્ઞાનીનો પણ કરે. જ્ઞાનીને પણ સાંભળે અને સંપ્રદાયમાં જે જ્ઞાની નથી તેને પણ સાંભળવા જાય. કેમ ? (કારણકે) લોક-લજા આડી આવે છે. લોકો ગણ-ગણ કરી માથું ભરાબ કરી દે તો ચાલોને ! ચાલો જઈ આવીએ, આપણું શું જાય છે ? એ રીતે પણ લોકો જાય છે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! ત્યાં શું સ્વચ્છંદ થાય છે કે મને ખબર છે કે મારે શું ગ્રહણ કરવાનું છે ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, ટીક છે. એમ કહેશે કે આપણે ગ્રહણ કરવા જેવું નહીં હોય તે નહીં કરીએ અને ગ્રહણ કરવા લાયક હશે તે કરીશું. પરંતુ એવું શા માટે કરે છે ? ન ગ્રહણ કરવા લાયકને ગ્રહણ નહીં કરવાનો પરિશ્રમ ઉઠાવવો પડે એવું શા માટે કરવું ? એ લોક-લજા આદિ કરણે જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. અને તે સામાન્ય અપરાધ નથી. શું લઘું છે કૃપાળુદેવે ? કે આ જ અનંતાનુંબંધી કષાયનું મૂળ છે કે જે અનંતાનુંબંધી કષાય જીવને ચારગતિમાં પરિભ્રમણનું કારણ છે. તેનું મૂળ શું છે ? કે જ્ઞાનીનો આશ્રય કરવો નહીં અને અજ્ઞાનીનો આશ્રય છોડવો નહીં. આવી જે પરિસ્થિતિ રહી છે તેમાં અનંતાનુંબંધી કષાય પાંગરી જશે. મૂળ છે ને ? જાડ મૂળમાંથી તો પાંગરે છે. અને તે જ ચારગતિમાં પરિભ્રમણ કરાવશે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! અમે જિનમતમાં આવ્યા. પૂર્વ કંઈક અનુમોદનાને

કારણે જિનમતમાં આવી ગયા અને જિનમતના દેવ-શાસ્ત્ર-ગુરુને અમે માનીએ છીએ, પછી મારો ચો દોષ રહી ગયો ?

પૂજ્ય ભાઈશ્રી :- પરંતુ બીજાને પણ માનો છો ! (કેટલાંક) તો કુદેવને પડો માનવા લાગી જાય છે.

મુમુક્ષુ :- કુદેવને ન માનીએ માત્ર જિનેન્દ્રદેવને જ માનીએ તો શું દોષ રહી ગયો ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, પછી તમે અજ્ઞાનીનો આશ્રય કરો છો કે કેમ ? દેવ-ગુરુ-શાસ્ત્ર એમ કહે છે કે અજ્ઞાનીનો આશ્રય કરો ?

મુમુક્ષુ :- એનો અર્થ કે પરીક્ષા કરવી જરૂરી છે ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, દેવ-ગુરુ-શાસ્ત્ર તો કહે છે કે, જ્ઞાનીનો આશ્રય કરો, જ્ઞાનીનો સંગ કરો. આપણે તેમની આજ્ઞામાં ચાલવું છે. છતાં પણ આપણે લોક-લજ્જાવશ (અજ્ઞાનીનો આશ્રય) જો નથી છોડી શકતા તો આપણું જે ચારગતિનું પરિભ્રમણ છે; જેમાં અનંત જન્મના દુઃખ, અનંત મરણના દુઃખ; અનંત પ્રકારનાં રોગનું, શરીરની પીડાનું, રોગ સિવાય Accident થી પડો પીડા થાય છે; અને અનેક પ્રકારનાં Tensionનાં દુઃખ, તણાવના દુઃખો થતાં રહે છે. આ ભયંકર પરિભ્રમણ છે. જ્યાં સુધી આ પરિભ્રમણની ભયંકરતા ભાસતી નથી, લાગતી નથી, ટેખાતી નથી, ત્યાં સુધી જીવ તેને છોડવાનો દઢ નિર્ધાર નથી કરી શકતો. જો તે દુઃખ સ્પષ્ટપણે સમજમાં આવે તો કોઈપણ કિંમતે તેને છોડવાનો વિચાર આવ્યા વગર રહેશે નહીં, કે મારે આવું દુઃખ કોઈપણ કિંમતે ન જોઈએ. 'At any cost' મારે આ મટાડવું છે. એવો નિર્ધાર કર્યા વગર તે નહીં રહે. કેમ ? (કારણકે) આ અનંત જન્મ-મરણનો Problem છે, તે સૌથી મોટો Problem છે. વિશ્વમાં અનાથી મોટી કોઈ સમસ્યા છે જ નહીં. તેથી જે લોકો વિચારશીલ છે, બુદ્ધિમાન છે, તે તો નાના-મોટા Problems ને છોડી સૌથી મોટા Problem ને જ મટાડશે. નાની-મોટી વાતમાં રોકાવું અને મોટા નુકસાનને થવા દેવું, આવવા દેવું અમાં કોઈ બુદ્ધિમાની નથી.

ગુરુદેવશ્રી એક રૂ ના વેપારીનો દ્વારાંત આપતા. એક રૂ નો વેપારી હતો. ગામડામાંથી ખેડૂત પાસેથી રૂ ની ખરીદી કરી તે મીલમાં - જિન માં વેચતો હતો. તેનું ધ્યાન ચાં રહેતું હતું ? કે એનાં જે બારદાન હોય તેમાં થોડું રૂ ચોંટી જતું હતું અને બારદાન મફતમાં આપી દેવા પડતા હતા. જેટલું

રૂ નું વજન થાય તેટલાં જ પૈસા મળે. એટલે જો ૧૦૦, ૨૦૦ ગ્રામ ઓમાંથી વીણીને આપણે જેને પૂમડાં કહીએ છીએ, તેનાથી બારદાનનું વજન પણ વધી જતું જે ૧ ક્રીલોનું હોય તે ૧= ૨૫૦ ક્રીલો થઈ જતું હતું તેથી એટલા પૈસા પણ ઓછા મળે અને એટલું રૂ પણ મફતમાં જાય અને પૈસા પણ કપાય જાય. Double નુકસાન થઈ જતું. તેનું ધ્યાન ત્યાં રહેતું હતું. તે હમેંશા શું કરતો ? કે (બારદાન) ખાલી હોય તેનું રૂ ભેગું કરવા લાગી જાય. તેમાં એટલું ધ્યાન આપે કે બજારમાં રૂના ભાવમાં ચઢાવ-ઉતાર થાય તેની ઉપર ધ્યાન ન રહે ? વેપારીનું ધ્યાન તો બજાર ઉપર હોવું જોઈએ કે, ભાવ કેમ વધે છે ? કેમ ઘટે છે ? અને સારામાં સારા ભાવે વેચવું. કારણકે મોટું લાભ-નુકસાન તો ત્યાં છે. ૨૦૦ ગ્રામ રૂ માં શું મોટી વાત છે ? કેટલું નુકસાન આવે ? પણ તે પૂમડાં વિષાવામાં રહી જાય છે અને ભાવનું નુકસાન મોટું ખાય છે. તો બીજા વેપારી શું કહેશે ? કે મૂર્ખ છે મૂર્ખ ! ધ્યાન ચાં આપવું જોઈએ. તેનું તેને ભાન નથી, તો દેવાળું કાઢશે. શું થશે ? દેવાળું નીકળશે. એ રીતે જીવ પરિભ્રમણની સમસ્યાને ન સમજે અને સંસારની નાની-મોટી અનુકૂળતામાં જ પોતાના સમય અને શર્ત તનો બર્ચ કરી ધ્યે, તો તે સૌથી મોટી મૂર્ખતા ગણાય અને તેથી કરીને ચારગતિના દુઃખ ભોગવવા પડશે. આ તો કુદરતની વ્યવસ્થા છે.

આ પરિભ્રમણનું મૂળ શું છે ? અનંતાનુંધી કખાય. અને તેનું બીજ યાં રહેલું છે ? કે આત્મજ્ઞાનીની ખોજ નહીં કરતાં સંપ્રદાયના અજ્ઞાની ગુરુઓના આશ્રયમાં રહી જવું. જુઓ ! કેટલી સ્પષ્ટ વાત કરી છે ? ત્યાં (સંપ્રદાયમાં) પણ કંઈક છે. તે લોકો ત્યાગી તો છે, તપ તો કરે છે, ઉપવાસ કરે છે, પ્રત કરે છે, પંચમહાત્રતની પ્રતિજ્ઞા લીધી છે, તેની પણ કંઈક કિંમત તો હોવી જ જોઈએ. તેની બુદ્ધિ કર્મનુસારીણી છે જે કર્મનું અનુસરણ કરી જે સંપ્રદાયમાં આવ્યો છે, ત્યાં જ ઓધસંજ્ઞાથી લાગી પડશે. સ્વતંત્રપણે વિચાર નહીં કરે કે શું યોગ્ય છે ? શું અયોગ્ય છે ? તેનો વિચાર નથી કરતો. બાકી આત્મજ્ઞાની વાત બધાં આસ્તિ યદર્શન કરે છે. છાએ દર્શનમાં આત્મજ્ઞાની, આત્મસુખની થોડી-થડી ચર્ચા ચાલી જ છે. કારણ તે બધાં નીકળ્યા છે તો જૈનમાંથી જ. માટે વાત તો ચાલી છે. વાત તો પ્રસિદ્ધ છે. પરંતુ સામાન્યબુદ્ધિમાં એ વાત સમજમાં આવવી જોઈએ કે, આત્મજ્ઞાનીથી

જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકશે, અન્યથી નહીં થઈ શકે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! આ બધું સાંભળવા છતાં જીવને બીજી તરફનું આકર્ષણ કેમ નથી છૂટતું ?

પૂજ્ય ભાઈશ્રી :- ઓધસંજ્ઞાને કારણે અને લોક-લજ્જા આદિ કારણોને લીધે (આકર્ષણ નથી છૂટતું). લોકલજ્જામાં કુટુંબપ્રતિબંધ પણ આવી જાય છે. લોકસંજ્ઞા તો આવે જ છે, લોકપ્રતિબંધ - સમાજપ્રતિબંધ તો હોય જ છે, (સાથે-સાથે) કુટુંબ પ્રતિબંધ પણ આવી જશે. કુટુંબમાં પણ બીજા લોકો એમ કહેશે કે તમે આપણાં સંપ્રદાયને છોડી બીજે-બીજે કેમ જાવ છો ? ત્યાં પણ બધું છે અને આપણે ત્યાં કઈ ખામી છે ? તે વાત શરૂ-શરૂમાં તે સમજાવી શકતો નથી. જે ચર્ચા થાય તેમાં Argument નથી આપી શકતો. કારણ તે વિષયમાં પૂરી સમજણ નથી હોતી. ત્યારે આમ જ અમૂલ્ય મનુષ્યભવ, કે જે મનુષ્યભવમાં પરિભ્રમણના નાશના કારણની આપણે પ્રાપ્તિ કરી શકીએ, તેવો અમૂલ્ય મનુષ્યભવ ખોઈ દેવાનો પ્રસંગ આવે છે. એવી વાત બને છે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! આમાં આપે જે અજ્ઞાનીના આશ્રયની વાત કરી, (એમાં) અજ્ઞાનીનો સંગ એ વસ્તુ જુદી છે અને અજ્ઞાનીનો આશ્રય એ વસ્તુ જુદી છે ને ? એનો સંગ હજી કદાચ કોઈ વખત થાય.

પૂજ્ય ભાઈશ્રી :- હા, સંગ તો પ્રારબ્ધવશાત્ સંયોગ થઈ જશે. પરંતુ તે સંયોગ થવામાં તેની વાતને માનવી, તેનો ધાર્મિકગુરુના રૂપમાં સ્વીકાર કરવો, તે તેનો આશ્રયભાવ છે. તેની વાત માનવી, ગુરુ સમજ વાત માનવી, તે આશ્રયભાવ છે અને તે આશ્રયભાવથી ચારગતિનો સંસાર ભો થવાનો છે, એમ કહે છે.

મુમુક્ષુ :- જ્યાં સુધી જ્ઞાનીનો સંયોગ નહીં થાય, ત્યાં સુધી અજ્ઞાનીના સંયોગમાં આવશે, ત્યારે જો તેને આત્મકલ્યાણ કરવાની ભાવના હશે તો આશ્રયમાં તે નહીં જાય.

પૂજ્ય ભાઈશ્રી :- વિવેક કરશે તો (આશ્રયમાં) નહીં જાય. અહીં વિવેકની જરૂર છે કે, તેની પાસે આત્મજ્ઞાન નથી તો ઢીક છે, સંજોગ વશાત્ મળવાનું થઈ ગયું. પણ આપણાને તેની વાતમાં શ્રદ્ધા - વિશ્વાસ નથી. એવો વિવેક થાય તો કોઈ આપત્તિ નથી. સંયોગ થવાથી ડરવાની જરૂર નથી. પણ વિવેકને મુખ્ય કરવાનો છે, તે વાત છે. તો જીવ તેના આશ્રયમાં કે આજ્ઞામાં નહીં

રહે અને આગળ જતાં સંપ્રદાયને છોડી દેશે. આગળ જતાં કહેવાતા સંપ્રદાયને તે છોડી દેશે. કારણકે તે આપણો સાચો સંપ્રદાય નથી. તે તો કહેવાતો છે. કારણકે આજે અહીંયા જન્મ લીધો તો કાલે ત્યાં જન્મ લેશે. સંપ્રદાય તો બદલાતો રહેશે. આ જીવ ચારેક મુસલમાન પણ થયો છે, ચારેક ખિસ્તી પણ થયો છે, ચારેક જૈન થયો છે, ચારેક વૈશ્વ થયો છે. કોઈ સંપ્રદાય બાકી નથી રહ્યો. અજ્ઞાનના અનંત પ્રકાર છે, બધાં પ્રકારના ભાવો કરી ચૂક્યો છે, અને બધાં પ્રકારના ફળ પણ ભોગવી ચૂંચો છે. આ બધું થઈ ચૂંચું છે. હવે તો વિવેક - પરમ વિવેક કરવાની વાત રહી અને વિવેક કરી જ્ઞાનીના આશ્રયમાં જાય તો તેનું પરિભ્રમણ છૂટી જાય છે. કારણકે એક આત્મજ્ઞાન જ સંસારના સર્વ દુઃખ, સર્વ કલેશ અને બધાં પ્રકારના અજ્ઞાનના નાશનું કારણ છે.

તેથી આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાનીની પાસે જ જવું જોઈએ, અને આપણો (સંસારમાં) એવું જ કરીએ છીએ. Heart-pain થાય તો આપણો ઓર્થોપેડીક-સર્જન પાસે નથી જતાં અને હાડકું ભાંગો તો આપણો કાર્ડીયોલોજ્સ્ટ પાસે નથી જતાં. આ તો સ્વાભાવિક સમજાય તેવી વાત છે. તેમાં ન સમજમાં આવે એવી કર્દ વાત છે ?! સમજમાં ન આવે એવી કર્દ વાત છે ? આમાં એવી તો કોઈ વાત દેખાતી નથી. અલ્યુબુદ્ધિમાન - ગમાર હોય તેને પણ એટલું તો સમજમાં આવે છે. જ્યારે આપણો તો બુદ્ધિજ્ઞાળી છીએ.

**મુમુક્ષુ :- ભાઈશ્રી ! જ્ઞાની છે કે નહીં એ વાતનો નિશ્ચય કરવો જરૂરી છે ?**

**પૂજ્ય ભાઈશ્રી :- હા, જરૂરી છે, અવશ્ય જરૂરી છે. નિશ્ચય કરવો (એટલું જ નહીં) પરીક્ષા કરીને નિશ્ચય કરવો. એવી વાત છે. એમ જ ન માની લેવું, કોઈ કહે તેનું માની ન લેવું. કારણ કોઈના જ્ઞાનથી આપણે કામ નથી કરવું, આપણાં પોતાના જ્ઞાનથી કામ કરવું છે. તે જ્ઞાનીને અજ્ઞાની કહે કે અજ્ઞાનીને જ્ઞાની કહે, કોઈ કાંઈપણ કહે આપણે તો આપણાં જ્ઞાનથી બધો નિશ્ચય કરવાનો છે અને તે જ આપણને કામમાં આવવાનો છે. બીજાનું જ્ઞાન આપણને કામમાં આવવાનું નથી.**

**મુમુક્ષુ :- ભાઈશ્રી ! પરીક્ષા કરવાની જે યોગ્યતા હોય, તે જ્યાં સુધી પરિભ્રમણની વેદના નહીં આવે, તે પહેલાં પ્રાપ્ત થાય ખરી ?**

પૂજ્ય ભાઈશ્રી :- સૌથી પહેલાં તો એ વાત છે કે, પરિભ્રમણથી ધૂટવું છે કે નથી ધૂટવું ? આ તો Scientific process છે. પરિભ્રમણથી છોડાવવાની જે વાત કરશે તેની વાત સમજમાં આવી જ જશે. જેને ધૂટવું છે તેને એ વાત સમજમાં આવી જ જશે. બાકી તો બધાં કહેશે કે આનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો, આ છોડી દો, પેલું છોડી દો અને આમ પૂજા કરો, ભર્ત ત કરો, દાન કરો, આ કરો, તે કરો, યાત્રા કરો, તપ કરો તો તમને પુષ્યબંધ થશે અને પુષ્યબંધથી તમને સંસારના સારા-સારા સુખ મળશે. (પણ) એવા સુખની પાછળ કેટલી મોટી દુઃખની ખાણ છે તે વાત તો કહેનાર પણ નથી જાણતા હોતા તો સાંભળનાર જાણે પણ કચાંથી ? માનો કે દેવલોકનો દેવ થઈ ગયો તો ત્યાંથી પછી એકેન્દ્રિયમાં જશે, આ વાત તો તે લોકો જાણતા નથી. જ્ઞાની કહેશે કે આવા પુષ્યનું કોઈ મૂલ્ય આત્મકલ્યાણના માર્ગમાં છે જ નહીં. એ વાત કોણ કહેશે ? જ્ઞાની કહેશે. અજ્ઞાની પુષ્યનું ઉપાર્જન કરવાની વાત કરશે, જ્યારે જ્ઞાની સંસાર પરિભ્રમણ નાશ કરવાની વાત કરશે. બસ ! આ વાતથી સમજાય જશે કે કોણ શું વાત કરે છે ? એ વાત સમજાઈ જશે. જેની દુકાનમાં જે માલ હોય તે જ વેચશે ને ? શાકભાજવાળાની માર્કિટમાં હીરાનો હાર ચાંથી મળશે ? તેની દુકાનમાં તે છે જ નહીં. એ તો જવેરીમાં દુકાનમાં હોય છે. શાકમાર્કિટમાં મળનારી ચીજ નથી. ત્યાં તો શાકભાજ જ મળશે.

મુમુક્ષુ : - જેની પાત્રતા હશે અને રૂપિયા લઈને જશે તેને જ મળશે.

પૂજ્ય ભાઈશ્રી : - જેને હીરાનો હાર ખરીદવો છે તેને તેટલા પૈસા લઈને જવું પડશે. જ્યારે શાકભાજ તો ૨૫-૫૦ રૂપિયામાં પણ મળી જશે. હીરાનો હાર કાઈ ૨૫-૫૦ રૂપિયામાં નથી મળતો. તેથી તેને માટે યોગ્યતા જોઈએ. અને યોગ્યતા જરૂરિયાત લાગવાથી પ્રાપ્ત થાય છે. યોગ્યતા વિના જ્ઞાનપ્રાપ્તિ નથી. સિદ્ધાંત એમ છે કે, યોગ્યતા વિના જ્ઞાનપ્રાપ્તિ નથી થતી અને યોગ્યતા જરૂરિયાત લાગ્યા વગર પ્રાપ્ત થતી નથી. જરૂરિયાત હોવી જોઈએ. નહીંતર મનુષ્ય છે માટે કોઈ પ્રકારે ધર્મ તો કરશે, પરંતુ અજ્ઞાનીનો આશ્રય નહીં છોડે અને તે જ અનંતાનુંધી કખાય કે જે પરિભ્રમણનું કારણ છે, તેનું મૂળ તો તે જ છે.

મુમુક્ષુ : - ભાઈશ્રી ! અને તેમાં પણ જ્ઞાનીની પ્રત્યક્ષતા મોજૂદ છે ત્યાં

સુધીમાં કામ કરી લીધું તો કરી લીધું, નહીંતર તે જ Group પાછળથી સંપ્રદાયમાં ફેરવાય જાય છે.

પૂજ્ય ભાઈશ્રી :- હા, તે જ્ઞાનીના નામથી સંપ્રદાય બની જશે. એ વાત બની જશે. અમે કાનજ્ઞસ્વામીવાળા, અમે શ્રીમદ્ રાજચંદ્રજ્ઞવાળા, એ રીતે ‘વાળા.. વાળા’ થઈ જશે. એ લોકો કહેશે અમે સ્થાનકવાસીવાળા, અમે મૂર્તિપૂજકવાળા, અમે દિગમ્બરવાળા, એ બધાં ‘વાળા.. વાળા’ થઈ જશે. જ્ઞાની કહે છે હું મતમાં નથી, ગણ્યમાં નથી, વાડામાં નથી, હું સંપ્રદાયમાં નથી, હું આત્મામાં છું. મારો માર્ગ તો, મારો માર્ગ એટલે જિનમાર્ગ, તો માત્ર આત્મકલ્યાણ કરવાનો છે. તેમાં કોઈ સંપ્રદાયનું બંધન નથી હોતું.

ભગવાન મહાવીરસ્વામીએ તે વાત સિદ્ધ કરી બતાડી કે જુઓ ! હું સંપ્રદાયમાં નથી માનતો. મેં તો વેદાંતીઓના ગુરુ જે હન્દ્રભૂતિ હતાં, તેને ગૌતમસ્વામી બનાવી તેમને ગણધર બનાવ્યા. જૈનોની લાઈન લાગેલી હતી. સમવસરણમાં લાખો જૈન બેઠા હતાં. મહાવીરસ્વામીના સંપ્રદાયમાં સાધુ પણ ઘણાં હતાં, સાધ્વીજ પણ હતાં, શ્રાવક હતાં; પરંતુ કોઈને ગણધરપદ ન આયું. તે Seniority પ્રમાણે નથી મળતું, તે તો Merit પ્રમાણે મળે છે. તેમાં Merit કામમાં આવે છે. ભગવાનના જ્ઞાનમાં દેખાયું કે તેઓ સૌથી વિશેષ પાત્ર છે. અને તેઓ આવશે તો કામ થશે. એટલે કે અમારો ઉપદેશ ચાલશે. તેઓ નહીં આવે તો અમારો ઉપદેશ નહીં ચાલે.

૬૬ દિવસ સુધી ભગવાનની વાણી ખરી નહીં. પછી હન્દ્રને વિકલ્પ આવ્યો. અવધિજ્ઞાનમાં જોયું કે વાત શું છે ? આવું ચારેય બને નહીં કે, તીર્થકર સમવસરણમાં બિરાજમાન હોય અને તેમની વાણી ખરે નહીં ! એક દિવસમાં ચાર ચાર ચાલે છે, (એની બદલે) એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ-એમ થતાં ૬૫-૬૬ દિવસ નીકળી ગયા ! પછી તેને વિકલ્પ આવ્યો કે, આમાં વાત કંઈક ગંભીર છે. તેમણે જોયું કે, સમવસરણમાં ભગવાનની વાણીનું જે સર છે, કક્ષા છે, તેને જીલવાં માટે અહીં કોઈ લાયક છે જ નહીં. કોઈ એટલું પાત્રતાવાન ન દેખાયું કે જેને ગણધરપદ મળી શકે. પછી તેમણે ઉપયોગ લંબાવ્યો અને જોયું કે અરે ! તે મનુષ્ય તો હજારો શિખોનો ગુરુ બનીને બેઠો છે, અહીંયા ચાંથી આવશે ? અજ્ઞાનદશામાં જેને ગુરુપદ પ્રાપ્ત થાય તે માનના ઘોડા પરથી ઉત્તરતો નથી. બધાં તેને ગુરુ માનીને

માન-સન્માન દે છે. તેમણે યું ત બનાવી (અને તેમની પાસે જઈને કહ્યું) ‘મહારાજ ! તમે તો મોટા જ્ઞાની છો, પરંતુ મારો એક પ્રશ્ન છે, કૃપા કરી તેનું સમાધાન કરી આપો’ એ પ્રશ્ન એવો કર્યો કે તેનું સમાધાન તેઓ ન આપી શક્યા. તેમણે કહ્યું કે હું તારા જેવા મામૂલી માણસ સાથે વાત નથી કરતો. આજકાલના ડૉક્ટરો એવું જ કરતા હોય છે, કંઈક પૂછીએ તો કહી દે કે તમારી સમજમાં નહીં આવે. અમે જે લખીએ છીએ, અમે જે કરીએ છીએ, તે બરાબર કરીએ છીએ. તમે ઉખલ નહીં કરો, કોઈ સ્પષ્ટીકરણ નહીં આપે. કારણ તેમાં તેનું અધૂરું જ્ઞાન છે એમ તેની પોલ ખૂલી જાય. તેઓ સમાધાન નહીં આપે. તે જ રીતે એમનું જ્ઞાન અધૂરું હતું. (એટલે કહી દીધું) ‘હું તારી સાથે વાત કરવા નથી માંગતો, તારા ગુરુ કોણ છે ? તેને બોલાવ ! તેની સાથે ચર્ચા કરીશ.’ (ઇન્ડ્રાએ) કહ્યું ‘મહારાજ ! મારા ગુરુ તો અહીં નહીં આવી શકે, આપ પધારો તો હું વાતચીતનો પ્રસંગ ગોઠવી દઉં.’ એમને શંકા તો થઈ ગઈ હતી કે આમના ગુરુ કોઈ સમર્થ હશે, જીવું તો જોઈએ, પાત્રતા હતી ને ! એટલે તેમને એવા ભાવ જ ચાલ્યાં. (ઇન્ડ્રભૂતિને લઈ) આવ્યાં સમવસરણમાં, બસ ! વાત પૂરી થઈ ગઈ. તીર્થકરદેવનો અતિશય હોય છે - પ્રભાવ હોય છે તેની અંદરની આખી દુનિયા બદલાય ગઈ. બધાં પરિણામ પલટવા લાગ્યાં. (પાત્રતા હોય તો) એવું જ થાય છે.

આ એક બહુ જ મહત્વપૂર્ણ વાત કરી છે કે, જીવ મનુષ્ય છે તે આ પ્રકારની ભૂલ પ્રાયઃ કરે છે. પોતાના સંપ્રદાયમાંથી નીકળી નથી શકતો અને સંસારના પરિણામથી છૂટી પણ નથી શકતો.

ચોથો બોલ “જ્ઞાનની પ્રાપ્તિ જેણો છચ્છવી, તેણો જ્ઞાનીની છચ્છાએ વર્તવું એમ જિનાગમાછિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની છચ્છાએ પ્રવર્તતાં અનાચિ કાળથી રખજ્યો.” આ ચોથું વચ્ચનામૃત છે. શું કહે છે ? કે, ‘જ્ઞાનની પ્રાપ્તિ જેણો છચ્છવી...’ (અર્થાતું) આત્મજ્ઞાનની પ્રાપ્તિ જેણો કરવી છે, તેની જરૂરિયાત લાગી છે, તેણો જ્ઞાનીની છચ્છા એટલે જ્ઞાનીની આજ્ઞા, તે પ્રમાણે જ ચાલવું જોઈએ. આ વાત સર્વ શાસ્ત્રોમાં કહી છે. આજ્ઞાકારિતા વિના તેમના ઉપદેશની અસર નથી થતી. આજ્ઞાકારિતામાં આવવું જોઈએ. અહીં છચ્છાનો અર્થ થાય છે ‘આજ્ઞા’. તેમની જે આજ્ઞા છે તે જ પ્રમાણે પોતે ચાલવું જોઈએ. ચાલવું જોઈએ એટલે અનુસરણ કરવું જોઈએ, અમલીકરણ કરવું જોઈએ. તેઓ કહે કે, આમ

કરો તો તેમ કરવું તેની એક હદ છે કે, દિવસના ૧૨ વાગે ગરમીના દિવસોમાં જો તેઓ એમ કહે કે આ તો અમાસની રાત છે અને આ સૂર્ય નથી, તને દેખાય છે તે ચંદ્ર પણ નથી, આ તો અમાસની અંધારી રાત છે. કારણકે અમાસની રાતે સૂર્ય-ચંદ્ર કાંઈ આકાશમાં હોતા નથી. (એટલી હદે) સ્વીકાર કરવાની તૈયારી હોવી જોઈએ. થોડી આવી વાત છે. પરીક્ષા કરીને નક્કી કરવું. નક્કી કર્યા પછી વિકલ્પ ન ઉઠાવવો. તેમની આજાની સામે વિકલ્પ ન ઉઠાવવો. એવી વાત છે. સમૃત કરતાં પહેલા પૂરી પરીક્ષા કરી લેવો. પછી પાંકું થઈ જાય કે (આમને) આત્મજ્ઞાન છે અને પરિભ્રમણથી ધૂટવાની પરિસ્થિતિ અહીંયા જ છે, તો પછી તેમની જે પણ આજા હોય, શિરોધાર્ય કરવી જોઈએ. કારણકે એમાં પણ કોઈ રહસ્ય હોય છે. જે વાત સામાન્યબુદ્ધિમાં નથી આવતી, તે વાત કોઈ વિશેષ બુદ્ધિમાન કરતા હોય ત્યારે જરૂર તેની પાછળ કોઈને કોઈ રહસ્ય હોય છે. એટલું મૂલ્યાંકન શરૂઆતથી જ હોવું જોઈએ. એવી સમજણ જો નહીં હોય, તો કચારેક શંકા પડ્યા વિના રહેશે નહીં અને શંકા થશે તો ભી ત ધૂટી જશે, આજાકારિતા ધૂટી જશે.

‘પોતાની છચ્છાઓ પ્રવર્તતા અનાદિકાળથી રખડયો.’ ધર્મ-સાધન તેઓ કહે, તે કરવાં. એમની આજાનો અર્થ શું છે ? કે, ધર્મ-સાધન કરવાનો વિષય તેમની પાસે છે બીજી તો કોઈ વાત છે નહીં. સંસારની લેવા-દેવાની કોઈ વાત તો એમાં છે નહીં. જે વાત છે તે તો (એટલી જ છે કે) ધર્મ-સાધન કેવી રીતે કરવું ? તેઓ કહે તેમ કરવું. પોતાની છચ્છા અનુસાર ન કરવું. પોતાની છચ્છા અનુસાર કરતાં તો પરિભ્રમણ ચાલુ રહ્યું છે અને તેને જ જાનીઓએ સ્વચ્છંદ કહ્યો છે. સ્વચ્છંદથી કાંઈ ન કરવું. સ્વચ્છંદ એટલે પોતાની મનમાની કરવી, પોતાની છચ્છા અનુસાર ધર્મ-સાધન કરવાં. આ સ્વચ્છંદ પરિભ્રમણનું કારણ છે.

પરિભ્રમણના બે કારણો બતાવ્યાં. એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સમાજ-પ્રતિબંધ, કુટુંબ-પ્રતિબંધ, શરીર-પ્રતિબંધ અને સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધ આ બધાં પરિભ્રમણના કારણો છે અને સ્વચ્છંદ તો સૌથી મોટો દોષ છે. સ્વચ્છંદમાં કેટલાંય મોટાં-મોટાં દોષોનો ગર્ભ રહેલો છે. બધાં મોટાં-મોટાં સ્વચ્છંદને કારણે જન્મ પામશે. સ્વચ્છંદથી તો દૂર જ રહેવું. પોતાની મતિ અનુસાર ધર્મ-સાધન કરવામાં સ્વચ્છંદ જેવો મોટો દોષ છે, એ ઓછા લોકો

જાણો છે. એ લોકો એમ સમજે છે કે, આપણે કંઈ પાપ થોડું કરીએ છીએ ? ધર્મ-સાધન કરીએ છીએ ને ! વ્રત કરીએ છીએ, ત્યાગ કરીએ છીએ, તપ કરીએ છીએ, દયા-દાન કરીએ છીએ, પૂજા-ભર્ત કરીએ છીએ, એમાં શું ખરાબ છે ? એમાં સ્વચ્છંદ દેખાતો નથી, એટલો મોટો દોષ છે. પરિભ્રમણના કારણોમાં તે સૌથી મોટો દોષ છે. જ્ઞાનીઓએ તેની મનાઈ કરી છે.

વૈદ્ય લોકો એમ જાણો છે અને કહે છે કે, તું આ પ્રકારની મિઠાઈ ખાધાં પછી પાણી નહીં પીતો. મારો એક Cousin-brother છે, તેને ટાઈફોડ થયો હતો. પહેલાના જમાનામાં એલોપેથીનું એટલું બધું ચલણ ગામડામાં તો નહોતું. અમારે ત્યાં એક વૈદ્ય આવતા હતા. ૮૦ વર્ષના વૃદ્ધ હતા. બહુ જાળકાર માણસ હતાં. નાડીવૈદ્ય હતાં. ૮૦ વર્ષ બધાં દાંતથી તેઓ શેરડી ખાતા હતાં, બરાબર ચાવી શકતા હતા. અમારે ત્યાં આવતા તો અમારે ત્યાં જમતા નહીં. પોતાની જાતે રસોઈ બનાવી ખાતા હતા. તો (મારા ભાઈને) તાવ ઉત્તરતો નહોતો. એકધારો તાવ જેને ઘણો વખત રહે તેને ટાઈફોડ કહે છે. જેને આપણે ‘મુદ્દીયો તાવ’ કહીએ છીએ. તે ઘણાં સમય પછી ઉત્તરે છે. આમણે કહું બોલો વૈદ્યજી શું છે ? વૈદ્ય નાડ જોઈને કહું કે ૧૫ દિવસ પહેલા આ છોકરાએ સુખડી ખાધી છે. તેના ઉપર પાણી પીધું છે અને પછી એ બહુ જ દોડચો છે. બહુ જ દોડાદોડી કરી છે. તે સુખડી એના આંતરડામાં ચોંટી ગઈ છે. પાકી નથી. પાકીને મળ વાટે નીકળી જવી જોઈએ. તે પાકી નથી, તે મળ પા ચો નથી માટે ગરમીથી જ પાકશે. એની માટે તાવ આવવો જરૂરી છે. તાવ વગર તે પાકશે નહીં. જો તેનો તાવ ઉતારશું તો ખોટું થશે. તેથી તેને ૨૧ દિવસ સુધી આ તાવ રહેવાનો છે. ૨૧ દિવસ પછી એની મેળે તાવ ઉતરી જશે. તેનો મળ નીકળી જશે અને તે ચાલવા માંડશે. તેને ખાવા-પીવાનું દેવાનું નથી. મગનું પાણી વગેરે જે કંઈ કહું છે તે આપવાનું છે. સાંભળનારે વિચાર્યુ કે, હા વાત તો સાચી છે. ૧૫ દિવસ પહેલા આપણે ત્યાં સુખડી બની હતી. અને ઘરમાં સુખડી બને તો છોકરાઓ તો ખાય જ ખાય. જ્યારે મીઠાઈ બને ત્યારે છોકરાઓ તો ચોક્કસ ખાય જ અને ખાધી છે એ વાત સાચી છે. અને છોકરાઓ તો ભાગા-દોડી કરતા હોય છે માટે તે વાત પણ પૂરે-પૂરી સંભવિત છે. એ રીતે નાડના ધબકારા ઉપરથી પેટમાં શું ચીજ પડી છે તે બતાડી હે છે.

Point (મુદ્રા) શું છે ? નાડીના ધબકારીથી પેટમાં શું ચીજ પડી છે તે બતાડી શકે છે, એવા તજજ્ઞ હોય છે. તેવી રીતે આ જ્ઞાની જે હોય તેઓ, આ સામાન્ય ધાર્મિક પ્રવૃત્તિ છે, જે સંપ્રદાય અનુસાર લોકો કરે છે, સામાયિક, પ્રતિકમણ, જેને ત્યાં જે ચાલતું હોય તે, એમાં શું ખરાબી છે ? અને પરિભ્રમણનો કેવો રોગ થાય છે ? તે જ્ઞાની બતાવે છે. સામાન્યબુદ્ધિથી જોતાં એમાં કોઈ દોષ પકડાતો નથી કે આ પરિભ્રમણનું કારણ થઈ શકે છે. પરંતુ તે જ્ઞાની બતાવે છે કે, જો ! તું પોતાની મતિ-કલ્પનાથી ધર્મ-સાધન કરે છે તે તારો સ્વચ્છંદ છે અને તે જ પરિભ્રમણ કરાવશે. તને એમાં કાંઈ દોષ દેખાતો નથી, પરંતુ સંસારમાં સ્વચ્છંદ જેવો કોઈ મોટો દોષ છે જ નહીં. એવું થઈ જાય છે.

મુમુક્ષુ :—ભાઈશ્રી ! સાંસારિક કાર્યોમાં સ્વચ્છંદ કર્દ રીતે થાય છે ? ધર્મ-સાધન છોડીને સાંસારિક કાર્યોમાં કર્દ રીતે સ્વચ્છંદ થાય છે ?

પૂજ્ય ભાઈશ્રી :- એમાં તીવ્ર વિષય-કખાયના પરિણામ કરવા, એ સ્વચ્છંદ છે. ખચકાટ વગર તીવ્ર રસથી પરિણામ થાય તે સ્વચ્છંદ છે અને ધાર્મિક ક્ષેત્રમાં જ્ઞાનીની આજાનુસાર (ધર્મ-સાધન) ન કરતાં સંપ્રદાયબુદ્ધિએ પોતાની મનમાની કરવી તે સ્વચ્છંદ છે. બજે સ્વચ્છંદ પરિભ્રમણના કારણ છે.

આ સ્વચ્છંદનું પ્રકરણ ધાણું મોટું છે. અને આ વિષયમાં ‘પ્રયોજન સિદ્ધિ’ પુસ્તકમાં થોડી - ધાડી વાતો લીધી છે. દર્શનમોહનું અને અનંતાનુંધી કખાયનું પણ મુખ્યપણે તે (સ્વચ્છંદ) બંધન કરાવે છે. તેથી આ વિષયમાં પૂરે-પૂરી તપાસ કરી સ્વચ્છંદ છોડવો જોઈએ. અને પૂરી તપાસ કરવાનો મોકો ન મળે તો જ્ઞાનીની આજામાં ચાલવું છે, એટલો સંક્ષેપ પરિણામી જાય તો તે જીવ Safe-guard થઈ જાય છે. આ તેનો Short-cut છે. દર્શનમોહ ઘટાડવાનો, પાત્રતા પ્રાપ્ત કરવાનો આ Short-cut છે. તેથી બધાં જ્ઞાનીઓએ પોતાની મુમુક્ષુની ભૂમિકામાં આ જ રસ્તો ગ્રહણ કર્યો છે. બધાંયે આ રસ્તો ગ્રહણ કર્યો છે. તેનું આ જ કારણ છે.

એ રીતે આ ચાર વચનામૃત પૂરા થયાં. આગળના વચનામૃત આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. સમય થયો છે.

પ્રવચન - ૫  
‘શ્રીમદ્ રાજયંત્ર’ પત્રાંક-૨૦૦  
તા. ૦૮/૦૧/૧૯૮૮ - કલકત્તા

---

---

(શ્રીમદ્ રાજયંત્ર) - પત્રાંક - ૨૦૦ - વચનાવલી. ચાર વચન થઈ ગયા છે. ચોથા વચનમાં એ વાત લીધી છે કે, ‘જ્ઞાનની પ્રાપ્તિ જેણે હચ્છવી...’ એટલેકે જે એવું હચ્છે કે મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય - એવી જેને આવશ્યકતા પણ લાગી છે. ‘તેણે જ્ઞાનીની હચ્છાએ વર્તવું...’ - એટલે જ્ઞાની જે અમલીકરણ કરવાનું કહે, તેનું પોતે અમલીકરણ કરવું જોઈએ. વાત તો સંક્ષેપમાં બે Stage ની જ છે. એક તો સમજણાની અને બીજી સમજેલી વાતનું અમલીકરણ કરવું. એનાથી વિશેષ કોઈ લાંબી - ચૌડી વાત એમાં નથી. કેટલાંયને તો આ વાત સમજમાં નથી આવતી. પૂર્વના વિપરીત સંસ્કારના બળને કારણે આ વાત સમજવામાં પણ મુશ્કેલી પડે છે. તેમ છતાં એવા જીવને પણ જો જિજ્ઞાસા થાય, ભાવના થાય, સમજવાની મહેનત કરે તો સમજ શકે છે. ભલે થોડું વહેલું-મોહું થાય પણ સમજ શકે છે. જ્યારે સરળ પરિણામી તો સીધું જ સમજ શકે છે. કારણકે આત્મકલ્યાણની વાત છે. એમાં ન સમજાય એવી કોઈ વાત નથી.

એ રીતે જે વાત સમજમાં આવી, એ વાતને અત્યારે પોતાના પરિણામનમાં લાગુ કરવી, તે જ અનુસાર પરિણામ થઈ જાય એવો પ્રયાસ કરવો, પુરુષાર્થમાં જોડાવું, તો આ એક એવું કાર્ય છે કે, જેનો પુરુષાર્થ કરતા સફળતા પ્રાપ્ત થાય જ છે. કારણકે જીવ પોતાના અવગુણ - દોષને મટાડવાં હચ્છે છે, કે જે દુઃખના કારણ છે. અને સુખી થવા માટે સદ્ગુણની પ્રાપ્તિ હચ્છે છે. તેનો Main criteria તો એટલો જ છે. જે પોતાના દોષ કાઢવા માંગે છે તેના દોષ નિરાધાર થઈ જાય છે. દોષ તો ત્યાં સુધી ચાલુ રહે છે અથવા પાંગરે છે કે જ્યાં સુધી આત્મા પોતે તેમાં રસ લ્યે છે, રુચિ કરે છે અને પોતે તેને આધાર આપે છે, ત્યારે તે દોષ ટકે છે અને પાંગરે પણ છે. પરંતુ જેને

દોષ કાઢવાં જ છે અને અંતરંગથી નિર્દોષ થવાની ભાવના થઈ, તેના દોષને આત્માનો આધાર નહીં મળે. આત્મા તો તેનો નિર્ષેધ કરતો રહેશે. તેનો ખેદ તેને વર્તશે. પછી કોના આધારે તે ટકશે ? તે નિરાધાર થઈ જાય છે અને છેવટે મટી જાય છે. તેથી આ કાર્યમાં, આ માર્ગમાં જે પ્રવૃત્તિ કરે છે, પુરુષાર્થ કરે છે, તેને નિયમથી સફળતા મળે જ છે. ન મળે તે વાત જ નથી.

સંસારના કાર્યોમાં તો પ્રારબ્ધ પ્રમાણે સફળતા મળે છે. (કાંઈ) પુરુષાર્થને વશાત્ સફળતા નથી મળતી. પ્રારબ્ધવશાત્ મળે છે. તમે એક ચીજ ખરીદી, પછી તેના ભાવ વધી ગયા. તો ભાવ વધારવા તમારા હાથની વાત છે જ નહીં. અને તમે એક ચીજ ખરીદી અને તેના ભાવ ઘટ્ટી ગયા. તો તમે સ્થિર રાખવા માગો તો સ્થિર રહે નહીં. એમાં તો જેવું પ્રારબ્ધ હોય તેમ જ બને છે. તેમાં કોઈ આપણા અધિકારનો વિષય નથી રહેતો અરે ! છોકરો સ્કુલમાં ભણે છે તેમાં સારા-સારા છોકરા પણ Fail થાય છે ! તેનું પ્રારબ્ધ જ એવું હોય છે. મહેનત કરે છે, પરિશ્રમ કરે છે તો પણ Fail થાય છે. એ રીતે સંસારના કાર્યોમાં બધી પ્રારબ્ધની વાત છે.

મોક્ષમાર્ગમાં તો, જે પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે જ છે. આ વાત ગેરંટેડ છે. કૃપાળુદેવે કહ્યું ને ? કે મોક્ષ મારી પાસેથી લેજે ! એવી ગેરંટી ચારે આપે છે ? બીજાના મોક્ષની ગેરંટી ચારે આપી ? કે જ્યારે તેમણે જેમ કહ્યું તેમ કર્યું, (એટલેકે) સર્વ ભાવ સત્પુરુષને અર્પણ કરી વર્તવાનું થયું. અહીં તે જ વાત છે. જ્ઞાનીની ઇચ્છા અનુસાર ચાલવાનું થાય, તો કોઈ વાત મુશ્કેલ નથી. તેનો મોક્ષ થઈ જ જશે. પોતાને પણ ઘ્યાલ આવી જાય કે મારો મોક્ષ તો હવે થઈ જ જશે, કારણકે તેને બધાં પ્રતિબંધ છોડવા પડે છે. જ્ઞાનીની આજ્ઞામાં ચાલવા જતાં બધાં પ્રતિબંધ તેને છોડવા પડે છે; અને ન છોડે તો જ્ઞાની પૂછે છે કે, કેમ પ્રતિબંધમાં ભા છો ? અમે કહીએ છીએ કે તું (પ્રતિબંધ) છોડી હે અને એમની આજ્ઞામાં ચાલનાર તો છોડી છે અને પોતાને પણ પોતાની સામે મુદ્દ ત દેખાય છે. જ્ઞાનીને તો ખબર છે કે, તે મોક્ષ લેવાં આવવાનો તો છે નહીં - પછી આપણે ગેરંટી દેવામાં શું જાય છે ? એનો મોક્ષ તો એની પાસે આવી જ ગયો. તેને પોતાને જ ખબર પડી ગઈ. અરે ! ચારેક તો એવું કહે કે મને મોક્ષની જરૂરિયાત

નથી. સત્પુરુષ મળી ગયા ને ! તો હવે મોક્ષની પણ મને જરૂર નથી. પછી તે કોઈ Demand કરવા તો આવવાનો નથી.

‘પોતાની છચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખજ્યો.’ જે પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ સ્વચ્છંદ અને પ્રતિબંધ છે. અહીં સુધી કાલે ચાલ્યું હતું.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! જેમકે કોઈ જીવ દીક્ષા લ્યે છે, તો પ્રતિબંધ તોડે છે પરંતુ સ્વચ્છંદ નથી છોડતો ?

પૂજ્ય ભાઈશ્રી :- પ્રતિબંધ તોડે જ છે, એવું કાંઈ નથી. કોઈ-કોઈને જંગલમાં જઈને પણ ઘર સાંભરે છે.

મુમુક્ષુ :- જેમકે કોઈ જીવ દ્રવ્યલિંગી થાય છે. તે શું કમથી નથી ચાલ્યો ?

પૂજ્ય ભાઈશ્રી :- કમથી ન ચાલ્યો, તેણે સ્વચ્છંદ કર્યો. તેમાં તો પ્રતિબંધ ન તો તૂટયો છે કે ન તો તૂટશે. ક્ષણિક વૈરાગ્ય આવશે.

મુમુક્ષુ :- જેમકે દ્રવ્યલિંગીને પણ શું પ્રતિબંધ નથી તૂટયો ?

પૂજ્ય ભાઈશ્રી :- નહીં, દ્રવ્યલિંગીને કોઈ ફાયદો થયો જ નથી. એક Percent પણ ફાયદો નથી થયો. પ્રવચનસારમાં અમૃતચંદ્રાચાર્યને દ્રવ્યલિંગી મુનિને સંસારતત્ત્વ કહ્યું છે. (શું કહ્યું છે ?) સંસાર તત્ત્વ કહ્યું છે. વળી પૂરી નિવૃત્તિ લઈને જંગલમાં રહે છે છતાં ગુરુદેવ કહેતાં હતાં કે, તે એક Percent પણ નિવૃત્ત થયો જ નથી. કેટલો ? એક Percent પણ નિવૃત્ત થયો નથી. એવું કહેતાં હતાં. એનો મતલબ શું ? તાત્ત્વિક વાત શું છે એમાં ? જેમકે એક દેડકો છે તે સમ્યક્કદર્શનને પ્રાપ્ત કરે છે અને એક દ્રવ્યલિંગી મુનિ સમ્યક્કદર્શનને પ્રાપ્ત કરતો નથી. પંચાચારનું પાલન કરે છે (તો પણ સમ્યક્કદર્શન પ્રાપ્ત કરતો નથી.)

મુમુક્ષુ :- દ્રવ્યલિંગી ઓટલે શું ?

પૂજ્ય ભાઈશ્રી :- મુનિ જેવું દ્રવ્યયિક, ભાવયિક નહીં. દ્રવ્ય એટલે શરીર અને શુભભાવ. કેવો (શુભભાવ) ? મુનિને લાયક. પંચમહાક્રત, સમીતિ-ગુપ્તિ, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પંચાચારનું પાલન કરે છે. પંચાસ્તકાયની ૧૭૨મી ગાથામાં એ બધી વાત આવે છે. તે દેવલોકમાં જાય છે. ત્યાંથી પછી પછડાઈને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. કારણકે મૂળમાં સ્વદ્રવ્યનો આશ્રય લીધો નથી અને પરદ્રવ્યનો આશ્રય છૂટયો નથી. આશ્રય કરવામાં બે જ દ્રવ્ય છે, એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય. તે

કાર્ય તો ન કર્યું અને એમ જ દીક્ષા આદિ લઈ લીધી. કમથી ન ચાલ્યાં માટે નિષ્ફળતા મળી. કમનું એટલું બધું મહત્વ છે. તેથી કૃપાળુદેવે ઈ નંબરનો પત્ર આ કમ ઉપર લખ્યો છે અને તે પણ મનસુખરામ સુરીરામ જેવાં પ્રભર વિદ્વાનને લખ્યો છે. આ કમની વાત બહુ જ મહત્વની છે. કારણ ધાર્મિક સંપ્રદાયમાં, બધાં જ ધાર્મિક સંપ્રદાયમાં, જૈન-જૈનેતર બંનેમાં લોકો કાંઈને કાંઈ કરતા જ હોય છે. (લોકો) ધર્મસાધન નથી કરતા એવી વાત થોડી છે ? પરંતુ કમને સમજતા નથી. દર્શનમોહને તોડવાની જે યોજના છે, તે યોજના સમજાણી નથી. અને જેમ મન ફાવે તેમ સ્વચ્છંદથી કરી લીધું તે કરી લીધું. તે બધું નુકસાનનું કારણ થઈ જાય છે.

મુમુક્ષુ :- દર્શનમોહ તો ચક્કાળુહની રચના જેવો છે. અને તોડીને બહાર નીકળવાનો કમ સિવાય કોઈ માર્ગ નથી.

પૂજ્ય ભાઈશ્રી :- એમ જ છે. બીજો કોઈ રસ્તો જ નથી. બીજો કોઈ ઉપાય નથી. મૂળમાંથી દર્શનમોહને ઉખેડીને ફેંકવો, એની યોજના છે કે ફરીને ગે નહીં.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! આ દ્રવ્યલિંગ અને ભાવલિંગનું આટલું બધું વિખૂટાપણું હોય છે ? એટલે આપણે દ્રવ્યલિંગી જે છે એને એક ટકો પણ નથી આપ્યો, તો એટલું બધું જ્યારે કરે છે તો એનો ભાવલિંગ કોઈ અંદરમાં હોય જ નહીં ?

પૂજ્ય ભાઈશ્રી :- શુભ ભાવ હોય. શુભભાવની પકડ હોય. શુભભાવની અને બાધ દ્વિષિથી બાધ ત્યાગની પકડ બહુ હોય. બાધ દ્વિષિ હોવાથી શુભભાવ અને તદ્દ અનુસાર થતા બાધ ત્યાગ, એની પકડ બહુ હોય. એવું હોય છે. આ Line આખી જુદી જ છે. આ અંતરની Line છે. બહારની Line નથી. એટલે ભૂલ એ ભૂલ છે. અમારે અંગેજમાં Second standard માં એક કવિતા આવતી હતી. “For want of a nail, the battle was lost” આખી લડાઈ એક ઘોડાના નાળની ખામીને લઈને હારી ગયો. હવે થયું શું ? કે જે ઘોડા ઉપર બેસીને એ Soldier કે મુખ્ય માણસ લડતો હતો, એ ઘોડાની નાળની ખીલી નીકળી ગઈ હતી. એટલે નાળ છે એ એને ચાલવામાં બીજા પગમાં ભરાતો હતો અને આડો આવતો હતો. એટલે એ ચાલ નહોતો પકડી શકતો અને ઘોડો વ્યૂહ પ્રમાણે ચાલી નહોતો શકતો. એણે જે વ્યૂહથી લડવું જોઈએ

એ લડી નહોતો શકતો. એટલે એક ખીલાને કારણે એ નાળની મુશ્કેલી થઈ, નાળને કારણે ઘોડાની ચાલની મુશ્કેલી થઈ, ઘોડાની ચાલને કારણે આખો વ્યૂહ Fail ગયો ! અને લડાઈ હારી ગયો માણસ. All for want of a nail - એક ખીલાને કારણે The battle was lost. એ કવિતામાં એક એક કિરીમાં એણે આખી Sequence લીધી છે. કે એણો શું ખોયું ? આમાં શું ખોયું ? આમાં શું ખોયું ? આમાં શું ખોયું ? તે દિવસે તો મુખપાઠે હતી તો મોઢે ફડ્ફડાટ બોલતા હતાં. પણ આખી લડાઈ હારી જવાનું કારણ બને છે. એમ આ સંસારને જીતવો છે અને સંસારને જીતનારા જિન થયા, જિનેશર થયા. (જેની શરૂઆત યથાર્થ નથી) એ લડાઈ હારી જાય છે. ખામી એક શરૂઆતની છે કે તમે શરૂઆત ચાંથી કરી ?

હું તમને કહું, અમારે સોનગઢમાં તત્વજ્ઞાનનો વિષય ખૂબ ચર્ચાય છે. બધા શાસ્ત્રના અભ્યાસી લોકો, વર્તમાન જે અધ્યાત્મિક શાસ્ત્રો છે એ બધાં સારી રીતે વાંચેલા. આપસમાં ખૂબ ચર્ચાઓ કરે. આપસમાં અત્યારે ચર્ચા કર્યા પછી Problem શું ભો થયો છે ? કેમકે ખાનગીમાં કોઈક-કોઈક અભ્યાસી લોકો (અમારી પાસે) આવે (અને કહે) કે ભાઈ ! આ બધું સમજાય છે, આપણે રોજ ચર્ચા કરીયે છીએ, કાંઈ અનું ફળ આવતું નથી ! અને સમ્યક્દર્શનની એટલી બધી ચર્ચા (કરે) ! મિથ્યાદર્શન અને સમ્યક્દર્શન ઉપર ગુરુદેવે ૪૫ વર્ષ સુધી વ્યાખ્યાનો આપ્યા. એ પોતે બધા શાસ્ત્રોમાંથી એ Topic ઉપર આવે. મિથ્યાદર્શન ટાળો ને સમ્યક્દર્શન પ્રાપ્ત કરો. એટલે એની ખૂબ સૂક્ષ્મ ચર્ચાઓ કરે. આપણે બધું કરીએ છીએ, સમજ્ઞાએ છીએ, કાંઈ આપણું ચાલતું નથી, તો એક Problem એ ભો થયો છે કે, શરૂઆત ચાંથી કરવી ? પ્રશ્ન શું આવે છે સામે ? શરૂઆત ચાંથી કરવી ? આ વસ્તુની ખામી દેખાય છે એ વસ્તુ સમજાતી નથી. એમ કહે કે, બધું સમજાય છે. પણ ( ચાંથી, કેવી રીતે) શરૂઆત કરવી એ નથી સમજાતું, તો બધું ચાં સમજાણું ? ખરેખર તો શરૂઆત કરવી એ જ નથી સમજાણું, એટલે કાંઈ નથી સમજાણું. અને સારા-સારા વિદ્વાનોની આ હાલત છે. Top level ના વિદ્વાનો જેને કહીએ (એની આ હાલત છે). પછી બીજા તો અંદર પેટામાં આવી ગયા. Top level ના વિદ્વાનોની આ હાલત છે. એ વિદ્વાનોને પ્રશ્ન પૂછો કે, શરૂઆત ચાંથી કરવી ? તો એ ગેંગફેઝ થઈ જાય ! કેમકે એનો જ એ Problem હોય છે.

આવી હાલત થાય છે.

એટલે કૃપાળુદેવે તો બહુ મોટી વાત ખોલી નાખો છે. એમણે જે ૮૬ અને ૧૯૫૪ પત્રમાં વિષય મૂં યો કે માર્ગની જેને છયા થઈ છે એણે બધાં વિકલ્પો મૂકી દઈને, ધર્મ-સાધનના બધાં વિકલ્પો મૂકી દઈને, આ એક નીચે લખેલું વા ય છે તે વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે. “આ વા યમાં અનંત અર્થ સમાયેલો છે.” હવે એ કેવી રીતે (છે) એ સમજવું મુશ્કેલ છે કે આની અંદર એક વા યમાં અનંત અર્થ કેવી રીતે સમાજો હોય ! એટલે એ બધું સત્સંગ વગર કાંઈ સમજાય નહીં. એના ઉપર સત્સંગ ચાલે, એ જ વિષય ઉપર ડી વિચારણા ચાલે, તો જ સમજાય કે આ બધું શું કહેવા માગે છે ? નહીંતર આમાં બહુ મોટો Problem છે.

આ જીવ પણ ભૂતકાળના અનંતકાળમાં અંગપૂર્વધારી થઈ ગયો છે, અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી ચાલ્યો જાય, અને તપ કરે તો લભ્યાઓ પ્રગટ થાય. એ લભ્યથી શાસ્ત્રના ઉકેલ કરે ! (પણ) મૂળ વાત રહી ગઈ. For Want of a nail, the battle was lost એવું છે.

એટલે જગતમાં Consultation ની જ મોટી કિંમત છે. આ જે ૫,૦૦૦ કરોડ, ૧૦,૦૦૦ કરોડના જે Industry plant નાખેલા હોય છે, એનો જે Economist હોય છે, એનો સૌથી વધારેમાં વધારે Charge હોય છે. Technical side નો એટલો Charge નથી હોતો. Technical advice પણ એણે લેવી પડે. પણ Economical advice નો સૌથી વધારેમાં વધારે Charge હોય છે. એ એને એવું સમજવી શકે છે કે તમારું Production એક દિવસ late થશે, તો તમને આટલા અબજનું નુકસાન થશે. કેટલું સમજાવે ? (માત્ર) આટલા કરોડનું નહીં. તો એક કલાક મોટું થાય તો કેટલું (નુકસાન થાય) ? એનું નામ Economy. એટલે જે એ સંભાળે છે, એ એની પાછળ રાત-દિવસ હોય છે. એક દિવસ પણ અમારું Production late નહીં થવું જોઈએ. અને Perfect આવવું જોઈએ. એનો Perfection manager જુદ્ધો, બધી જ Branch ના Manager જુદાં, બધાંની સાથે સમજ કરીને પછી Decision લે. તો એની કિંમત કેટલી ? એમ આ ચીજની બહુ કિંમત છે. નહીંતર તો આની અંદર ભલભલા અટવાય છે. અને આપણે પણ અનંતકાળ કાઢ્યો છે કે નથી કાઢ્યો ? આપણો કોઈ ઉત્પત્તિનો કાળ-સમય તો છે નહીં. અનંતકાળથી સંસારમાં ફરીએ છીએ - રખડીએ છીએ,

ધર્મ પણ કરીએ છીએ, પણ અનંતકાળ ચાલ્યો ગયો આમને આમ ! તો એવું રહી ગયું શું ? આ એક જ સમજવાનું છે. ફૃપાળુદેવે બહુ સરસ વાત (કરી કે) તું જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના માર્ગ ચાલ. જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના માર્ગ ચાલ. તું અજ્ઞાણ્યો છો ભૂલો પડી જઈશ, અને અજ્ઞાણ્યો ભૂલો પડે એ તો સ્વાભાવિક છે. સાથે જ્ઞાનીતો હોય તો એને ચાંચ ભૂલો પડવા દે નહીં. એણે બધું જોયું છે. રસ્તો જોયો છે. સીધી વાત છે.

સોભાગ્યભાઈ તરી ગયા એનું કારણ એ છે. નહીંતર એ તો સાવ ગૃહીત - મિથ્યાત્વમાં પડવા હતા. એમને તો ઇશ્વરકર્તા, હરિ ને બીજું ને ત્રીજું કંઈક હતું. ત્યાંથી બહાર કાઢવા. કેવી રીતે એ નીકળ્યા ? (ફૃપાળુદેવે) એના માટે એક જ વિશેષપણ વાપર્ય કે, “જ્ઞાનીના માર્ગ ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય આજે તેમની ગેરહાજરીમાં પણ અમને સાંભરે છે.” એ જીવનો શું નિશ્ચય હતો ? કે જ્ઞાનીની આજ્ઞા એટલે જ્ઞાનીની આજ્ઞા. એમાં મારે કાંઈ ફેરફાર નહીં કરવાનો. એ કહે એ જ બરાબર, એ કહે એ જ બરાબર. એટલો વિશ્વાસ એમને પહેલેથી ઉત્પન્ન થઈ ગયેલો. અને પરમેશ્વરબુદ્ધિમાં એ વિશ્વાસ આવી જાય છે. જેમ પરમેશ્વરમાં શંકા કરવાનું કારણ નથી, એમ જ્ઞાનીમાં પરમેશ્વરબુદ્ધિ થઈ કે પછી એને એની જ આજ્ઞામાં એ કહે એ પ્રમાણે ચાલવું. અને કોઈપણ ભોગે ચાલવું. ગમે તે વિટંબણા આવે, ગમે તે વાત સહન કરવાનો પ્રસંગ આવે, એ (સહન) કરીને (પણ) આ જ કરવું. એ એક જ Point ઉપર એ તરી ગયા ! છેલ્લા દિવસોમાં સિદ્ધપદનું Reservation લઈ લીધું ! નહીંતર તો મરણ-પથારીએ હતા. ૮-૮ મહિનાથી તાવ તરતો નહોતો. વૃદ્ધાવસ્થા થઈ ગઈ હતી. શરીર સાવ નબળું પડી ગયું હતું. અશ ત થઈ ગયેલું. પણ આત્માનો પુરુષાર્થ સથ ત થઈ ગયો. શરીર નબળું પડી ગયેલું અને આત્માનો પુરુષાર્થ શરીર તવાન - જોરદાર આવી ગયો. હવે તો કેવળજ્ઞાન લઈ લઈ (એમ) કહે. હવે તો કેવળજ્ઞાન લઈ લઈ, કહે. એવું જોર આવ્યું ! ખાટલે સૂતા-સૂતા એવી વાતો કરવા મંડયા. ભૂલી ગયા કે શરીર માંદું છે અને હવે નજીકમાં મૃત્યુ છે. એ બધું ભૂલી ગયા. મોટી કમાણી કરી લીધી ! એમણે અનંતભવની અનંતકાળની કમાણી કરી લીધી. બહુ મોટી વાત છે !

હવે પાંચમું વચનામૃત છે. ‘જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.’ જ્યાં

સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છા અનુસાર, પરોક્ષ જ્ઞાની ન લીધી, કેમકે પરોક્ષમાં તો જિનેશ્વરદેવ પણ છે અને એમની આજ્ઞાઓ શાસ્ત્રમાં લખી છે. પ્રત્યક્ષ જ્ઞાની લેવાનું કારણ શું છે? આપણે Medical science નો વિચાર કરીએ તો, એક રોગ ઉપર બહુ માણસ Expert થઈ ગયા પછી એના ઉપર પુસ્તકો લાયે. એકદમ Higher degree ઓ લીધી હોય, ખૂબ Expert થયા પછી એના ઉપર એનું પુસ્તક લખાયેલું હોય, અને એક General practitioner હોય, એટલું ન ભણ્યો હોય. એ પુસ્તક વાંચીને દવા કરવા જાય (તો) એ મરી જાય. એને (માટે) Doctor હાજર જોઈએ, કેમ? કે કોઈપણ વાત પૂરેપૂરી લખાવી મુશ્કેલ છે. એનું કારણ શું છે? કે એક રોગ થવાના જે કારણો છે, એ બધાંની Treatment જુદી-જુદી છે. એ રોગની સાથે બીજાં કેટલાક Complication છે, અને કેટલાં Complication હોય કે કોને થાય? એ બધું કંઈ પુસ્તકમાં આવે નહીં. પ્રત્યક્ષ Doctor હોય એ સમજે કે આ રોગ મુખ્ય છે પણ આટલા Complication સાથે છે. એટલે એ બધાંનું Co-ordination કરીને એને Treatment આપવી પડે. એ બધું પુસ્તકમાં કેવી રીતે આવે? અને એક જે દવા એણે સૂચવી હોય એ લાગુ ન પડે તો શું કરવું? પુસ્તક શું જવાબ દે? પુસ્તક એમ કહે કે આમાં આ દવા લેવાની, એ દવા લીધી અને લાગુ ન પડી, ત્યો! શું કરો હવે? કોને પૂછવું? પુસ્તક જવાબ દેશે? એટલે એની અંદર પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ, જોઈએ ને, જોઈએ જ.

રાષ્ટ્રપતિ કે Prime-minister ગંભીર રીતે બિમાર પડે, તો એને Hospitalize કરે છે. Hospital ને એના રાષ્ટ્રપતિ-ભવનમાં નથી લઈ જવાતી. એને પોતાને Hospital માં ખસેડવા પડે છે. કેમ? કે Hospital ની અંદર જે સેંકડો, હજારો Equipments હોય છે, એમાં ક્યા Equipment ની ચારે જરૂર પડે, એનો કોઈ નિયમ નથી. એટલે એ રીતે જ આખી Hospital તૈયાર થયેલી હોય છે. અને એનું અડધી-અડધી કલાકે, કલાકે-કલાકે, Reading લઈને Bulletin બહાર પાડે છે. એ કલાકે-કલાકે એના તજજો સંભાળી શકે એવી વ્યવસ્થા Hospital માં હોય છે. એ તજજોની ચારેક Conference ભરવી પડે. ૪-૫ જગ્યા જે Treatment કરતા હોય અને દવા લાગુ ન પડતી હોય, Treatment લાગુ ન પડતી હોય તો એ લોકોને આપસમાં સલાહ કરવા બેસવું પડે છે. એની Conference ભરવી પડે છે. પરોક્ષ પુસ્તક એમાં શું કામ આવે? આવા

Case ની અંદર પુસ્તક શું કામ આવે ?

એમ આ ભવરોગ છે, એ અનાદિનો Chronic છે અને ભયંકર છે. ચાર ગતિમાં રખડાવે છે. એના માટે પણ Under strict Medical Supervision માં જેમ પેલાને સાજો કરવો પડે છે, એમ આને જ્ઞાનીની આજ્ઞામાં રહેવું પડે છે, અને અને વાતે-વાતે જરૂર પડે છે. આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. ઓલો કહે, મને આમ થઈ ગયું, આમ થઈ ગયું. મારે કરવું શું ? દરેકના Case જુદાં-જુદાં, દરેકના ભૂતકાળ જુદાં-જુદાં, દરેકની યોગ્યતા જુદી-જુદી, અયોગ્યતા જુદી-જુદી, એટલે કૃપાળુદેવે ૪૬૬માં લખ્યું, કે કોઈ એમ માને કે યોગ કે, ધ્યાન કે હત્યાદિ કોઈને કોઈ ડિયાથી કલ્યાણ કોઈ કરવા જાય તો એમ થઈ શકે નહીં. જીવનું કલ્યાણ થવું એ જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે. એવું વા ય નીચે લખ્યું છે. એને ખબર છે કે આને રોગની અંદર શું ગરબડ છે ? અને ઓચિંતી ગરબડ થાય તો એને કેવી રીતે ઠીક કરવો ? Family - Doctor શું કરવા છે ? અદ્ધી રાતે તકલીફ થઈ, (તો) શું કરે ? શું કરે એ ? Doctor વગર શું કરે એ ? એટલે ‘જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની છથાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.’ ત્યાં સુધી અજ્ઞાનનો નાશ થવો એ સંભવિત છે જ નહીં. આ Full and final વાત એમણે કરી છે.

હવે કહે છે કે, ‘જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે...’ આજ્ઞામાં કોણ ચાલી શકે ? માત્ર વિકલ્પ કરવાની વાત નથી. હવે અહીંયા એની કેટલી તૈયારી હોય, એ વાત કરે છે. કે ‘જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ...’ એક જ નિષ્ઠા હોય કે બસ ! આત્મ-કલ્યાણ સિવાય મારે જીવનમાં હવે બીજુ કાંઈ કરવાનું રહેતું નથી. આ એક જ કામ કરવું છે. અનંતકાળમાં અનંતવાર બધું થઈ ગયું. પુષ્યના ફળ પણ બધાં ભોગવી લીધા અને પાપના ફળ પણ બધાં ભોગવી લીધા. બધાં પ્રકારના પુષ્ય અને બધાં પ્રકારના પાપ, ભોગવી લીધા. હવે કાંઈ બાકી નથી રહ્યું એટલે જ્ઞાની તો એમ જુઓ છે કે, ‘સકળ જગત છે અંદરવત’ આ તો બધું હવે અંહું ખાવાનું છે, પૂરું ખવાઈ ગયું છે. ‘અથવા સ્વખ સમાન.’ સ્વખાની સુખડી ભૂખ ભાંગે નહીં. એમાં કોઈ તૃપ્તિ થવાની નથી. જગતના પદાર્થો મળે એથી કોઈ તૃપ્તિ થવાની નથી.

એટલે ‘એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસ્તિ તનો ત્યાગ કરી તેની ભ્રત્યાં જોડાય.’ તન, મન, ધન આપીને નહીં, એ ઘણાં આપે છે એટલે કહું છું. નહીં તો ઓધસંજ્ઞાએ ઘણાંએ ઘણું આપ્યું. તન, મન, ધન બધું આપી હે. તનથી ૨૪ કલાક સેવા કરે. મનમાં, એ કહે એ પ્રમાણે શાસ્ત્ર વાંચે, અર્થ સમજે, બીજું-ગીજું કરે, અને ધન બધું આપી હે - એમ નહીં. તન, મન અને ધનની ‘આસ્તિ તનો ત્યાગ’ કરવાની વાત છે. તન, મન, ધનનો ત્યાગ કરવાની વાત નથી. વાત સાઈ લાગે પણ અંદર વાત શું છે ? તારા પરિણામમાં Attachment કેટલું છે ? તારા શરીર પ્રત્યે (કેટલું Attachment છે ?) મન એટલે તારા મનના પરિણામ કાખૂં બહાર જાય છે. એ કેવી રીતે છે ? એનું અવલોકન કરીને ઠીક કરવા પડે, અને ધન પ્રત્યે હજુ તારી આસ્તિ ત કેટલી છે ? આસ્તિ ત એટલે પોતાપણું.

(કોઈપણ પરપદાર્થમાં) સુખનો નિશ્ચય હોય છે. (જ્યારે) એ સુખનો નિશ્ચય તોડે, બદલે ત્યારે એ આસ્તિ ત મટે. સુખનો નિશ્ચય એમને એમ રહે અને આસ્તિ ત મટી જાય, એવું કાંઈ બને નહીં અને આસ્તિ ત મટ્યા વિના તન, મન, ધન અર્પણ કરી હે, એનો કાંઈ અર્થ નથી. અર્પણ કરી હે તો (પણ) એનો અર્થ નથી. ન કરે એનો સવાલ નથી. પણ કરી હે તો (પણ) એનો કાંઈ અર્થ નથી. એટલે જ્ઞાની છે એ આસ્તિ ત છોડાવે છે, એનો નિશ્ચય બદલાવે છે. તારો નિશ્ચય ખોટો છે, આ તારો Mis-concept છે. અને એ અનંત દુઃખનું કારણ છે. બીજું કોઈ કારણ નથી. પર-પદાર્થમાં સુખ છે, એવો જેનો ભૂલભરેલો નિશ્ચય છે એ આજે નહીં ને કાલે, કતલખાનાં માંડશે. શું કરશે ? Slaughter-house ચલાવશે. કેમકે જે Slaughter-house ચલાવે છે, કતલખાનાં ચલાવે છે, એ આ એક જ પરિણામ ઉપર ચાલે છે. આનાથી મને જે પૈસા મળે છે. એનાથી હું સુખી થાઉં છું. એનાથી હું સુખી છું, મારું કુટુંબ સુખી છે. આ બધું છે, માટે એનાથી સુખ છે. એની આસ્તિ ત કોઈ રીતે તૂટે નહીં અને એનું સમર્પણ એ સમર્પણ કાંઈ છે નહીં. નિશ્ચય બદલીને આસ્તિ ત તૂટે, પછી જે સમર્પણ થાય તે સાચું. એ પહેલાનું સમર્પણ એ કાંઈ ખરેખર સમર્પણ નથી.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! આ સુખનો નિશ્ચય કેવી રીતે છૂટે ?

પૂજ્ય ભાઈશ્રી :- નિશ્ચય બદલવો પડે છે. સ્વરૂપનો નિશ્ચય થાય તો

સ્વરૂપમાં સુખ છે તેનો નિશ્ચય થાય. ૧૦૮ પત્ર ચાલ્યો કે નહીં? સુખ અંદરમાં છે, બહારમાં ચાંચ નથી.

મુમુક્ષુ :- આ આસટિ ત તૂટી છે તેનો Test શું છે? સંયોગ-વિયોગ કોઈમાં પોતાને પરિણામમાં ફરક ન પડે એ એનો Test છે?

પૂજ્ય ભાઈશ્રી :- હા, (ફરક) ન પડે. એ તો બહુ Practical વાત છે. તમને બીજા ઉપર કોઈ આસટિ ત નથી તો કોઈ ભરી જાય છે તો પણ કાંઈ લાગે છે? એક Paper માં આવ્યું કે એક છોકરો Gutter માં પડી ગયો. શું થશે તમને? તમારો છોકરો હોય તો શું થાય? કેમ? કારણકે આસટિ ત છે એમાં, ત્યાં મારાપણું છે. તે જ વાત છે. તે ન સમજાય એવી વાત નથી. એમાં લાગે જ નહીં કાંઈ. કાંઈ પણ થઈ જાયને, લાગે જ નહીં, લાગે તો સમજવું કે આસટિ ત છે. સીધી વાત છે.

મુમુક્ષુ :- આસટિ ત રાખીને દાન અને ત્યાગ થઈ શકે?

પૂજ્ય ભાઈશ્રી :- હા, લોકો ત્યાગ કરે છે. લાખો-કરોડો રૂપિયાનું દાન આપે છે, અને પૈસાની આસટિ ત એટલી ને એટલી જ રહે છે. અરે! ઘણાં લોકો તો એવું કહે છે કે, વધારે કમાવો અને વધારે દાન આપો! એવું પણ ચાલે છે. જેને સમજ નથી તે તો ગમે તેમ ચાલશે, તે જ વાત લખી છે.

‘જ્ઞાનીની આજાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસટિ તનો ત્યાગ કરી તેની ભર્તિ તમાં જોડાય.’ ભર્તિ ત છે તે જ્ઞાની પ્રત્યેની આસટિ ત છે અને જો તન, મન, ધન પ્રત્યેની આસટિ ત છે, તો જ્ઞાનીની પ્રત્યે ભર્તિ ત હોય એમ બને નહીં. કેમ? કે આસટિ ત બે વિરુદ્ધ પદાર્થમાં ન હોય શકે. તન, મન, ધનમાં પણ આસટિ ત હોય અને જ્ઞાનીમાં પણ ભર્તિ ત હોય, બે વાત ન બની શકે. જ્ઞાની પ્રત્યે ભર્તિ ત - આસટિ ત હોય તો સંસારના તન, મન, ધન ઉપર આસટિ ત રહેતી નથી.

મુમુક્ષુ :- એમાં વિશ્વાસ છે જ નહીં!

પૂજ્ય ભાઈશ્રી :- (આસટિ ત) ધૂટી જાશે, તે બધેથી ઉદાસીનતામાં આવી જ જાય. કેમ? કે આંગળી સીધી રહેતી હોય તો વાંકી નથી રહેતી, વાંકી રહેતી હોય તો સીધી નથી રહેતી. બે અવસ્થા સાથે કેવી રીતે રહે? કંપદું સંકુલેલું પણ રહે અને ખુલેલું રહે, બે વાત કેવી રીતે બને? ઘડી પાડેલું

એ ઘડી પાટેલું, ખુલ્લું એ ખુલ્લું. એકસાથે બે અવસ્થા કેવી રીતે રહે ? એમ, એક બાજુ જે જૂકી ગયો - તન-મન-ધનમાં જૂકી ગયો, એ જ્ઞાની પ્રત્યે જૂકી શકે નહીં. જ્ઞાની પ્રત્યે જૂ યો એ તન-મન-ધનમાં જુકવાનો નહીં. એક જ અવસ્થા છે. આસ્તિ ત કં આ બાજુની થાય, અં આસ્તિ ત આ બાજુની થાય.

**મુમુક્ષુ :-** ૬૦૮ પત્રમાં લીધું ને, એકનિષ્ઠા અને અપૂર્વ ભર્ત ત આવી નથી.

**પૂજ્ય ભાઈશ્રી :-** હા, આખી નથી એટલે સત્સંગ નિષ્ફળ ગયો. એ સત્સંગ નિષ્ફળ થવાનું મુખ્ય કારણ લીધું છે. એમાં ચારે કારણ સમાઈ ગયા. પૂર્વગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ બધાં કારણ સમાઈ ગયા. કેમકે અથવા કરીને વાત લીધી કે, અથવા જ્ઞાનીમાં એકનિષ્ઠાએ અપૂર્વ ભર્ત ત આવી નથી એટલે સત્સંગની સફળતા થઈ નથી. કેમકે એ ઉપદેશ ચડે જ નહીં. આખી જિંદગી સાંભળે તો એ ઉપદેશ ચડે નહીં. કેમકે એની પ્રીતિ, ભર્ત ત, આસ્તિ ત બધી સંસારની છે. ઓલો ઉપદેશ ચાંથી ચડવાનો હતો !

આ વાત થોડી મંથન કરીને, તો વિચાર કરીને, પોતાના પરિણામો સાથે મીઠવણી કરીને, ગમે તેમ કરીને ઠીક કરવી પડે. જો ત્યાં ફેરફાર ન થાય તો મૂળમાં ફેરફાર થયો નથી. પછી બાકી બધું કરે એ “છાર પર લીપણું તેહ જાણો” આનંદધનજીએ ગાયું ને ? ‘છાર પર લીપણું,’ છાર એટલે શું ? રાખ. રાખનો મોટો ઢગલો હોય, દ હંચનો થર હોય એના ઉપર ગાર લીપે, એ રહે ? ન રહે. એ ગાર રહેવાની જ નથી. પહેલા Flooring માં ગાર કરતાં, એ બધું સાફ કરીને, Dust ન રહેવા દે. બરાબર સાફ કરીને પછી એના ઉપર ગાર કરે. નહીંતર તડીયા પડવા માંડે. તરત જ, નીચે ધૂળ હોય એટલે સુકાય એટલે તડીયા પડવા માંડે. નહીંતર એ Flooring સાથે ચોંટી જાય. મહેનત નકામી જાય એવું કરવું અને એવું ઘણું કરવું એનો કાંઈ અર્થ નથી. થોડું પણ સાર્થક થાય એવું કરવું જરૂરી છે. એટલે એ જ્ઞાનીની ભર્ત તમાં જોડાઈ જાય, એ બસે પડખાં એક વા ચમાં પોતે સાથે લીધા છે. આ બાજુની આસ્તિ તનો ત્યાગ થાય અને અહીંયા જોડાય. ત્યાંથી આસ્તિ ત મટે અને અહીંયા આસ્તિ ત થાય. બસ !

‘જોકે જ્ઞાની ભર્ત ત છચ્છતા નથી...’ જ્ઞાનીને કોઈની ભર્ત ત જરૂર નથી, અને જરૂર હોય તો એ જ્ઞાની નથી. એમ છે. જ્ઞાની છચ્છા કરતા નથી, કેમ ?

કે કોઈ ભી ત કરે છે તો એ સમજે છે કે એ એના કારણથી કરે છે. એને પોતાને લાભ થાય એટલા માટે કરે છે. મારા માટેનો કોઈ સવાલ ભો થતો નથી.

‘જોકે જ્ઞાની ભી ત ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને...’ કોને? મોક્ષનો અભિલાષી જે મુમુક્ષુ છે, એની વાત છે. એને પણ.. જે મોક્ષનો અભિલાષી નથી, એની તો વાત જવા દો. ‘...પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણામતો નથી...’ એનો ઉપદેશ છે એ પરિણામ પામતો નથી. એટલેકે એની અસર આવતી નથી. જે તન, મન, ધનની આસં તની પરિણાતિ થઈ ગઈ છે. એ ઉપદેશની અસર થવામાં ત્યાં આડી આવે છે. ઉપદેશ સંભળાય છે. ઉપદેશનો જીવ યથાશં ત વિચાર પણ કરે છે, પણ આત્મા ઉપર જે એની અસર આવવી જોઈએ, એ અસર નહીં આવવામાં એક આંદું આવનાર કોઈ કારણ હોય, આડશ હોય, અવરોધ હોય, તો એ અવરોધ છે પોતાના જ તન-મન-ધનની આસં તના પરિણામનો - એ અવરોધ છે. એટલે મોક્ષાભિલાષીને એ ભી ત ક્યારે થાય છે? તે આસં ત તૂટે ત્યારે. એ મોક્ષાભિલાષીને એમ કર્યા વિના ઉપદેશ પરિણામતો નથી, ઉપદેશની અસર થતી નથી. જેમ કોઈ બહેરા કાને, બહેરો સાંભળવા બેસે તો શબ્દો એના કાનના પડદેથી અથડાઈને Rebound થઈને પાણી ચાલ્યા જાય છે, અંદર સંભળાતું નથી, એમ (અહીંયા ઉપદેશની) અસર નથી પહોંચતી. જીવને ઉપદેશની અસર થતી નથી, ‘...અને મનન તથા નિદિધ્યાસનાટિનો હેતુ થતો નથી...’ એ ઉપદેશ અંદર પરિણામ્યો ન હોય, તો એનું મનન કરે, અને એને Visualize કરે, નિદિધ્યાસન કરે એટલે Visualize કરે, એ બધાં Stage તો ચાંથી આવવાના હતા! એમ પણ થતું નથી. એટલે જેને પરિણામન થાય એને મનન અને નિદિધ્યાસન ચાલે છે, એમ કહેવું છે.

‘માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભી ત અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહું છે.’ માટે મુમુક્ષુઓએ જ્ઞાનીની ભી ત અવશ્ય કરવી જોઈએ, એમ સત્પુરુષોએ જે કહું છે, એ યથાર્થ પ્રકારે આ છે કે તન-મન-ધનની આસં ત છોડીને અથવા છોડવાનો પ્રયત્ન કરીને પણ ભી ત કરવી જોઈએ.

ભી ત શું છે? ભી ત છે એ પૂજ્યબુદ્ધ છે અથવા ઉપકારબુદ્ધ છે કે મારા હિતનું નિભિત છે તેથી મને ઉપકારી છે. એમ કરીને એને

ઉપકારબુદ્ધિઅથી બહુમાન આવે છે અને એ બહુમાનને ભર્ત કહેવામાં આવે છે. એ રીતે ભર્ત તનું સ્વરૂપ છે.

મુમુક્ષુ :- અથી વિનય આવે ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો શું છે ? સર્વાધિક છે ને ? (જ્ઞાનીપુરુષ પ્રત્યે) સર્વાધિક ભાવ આવે. તન-મન-ધનની આસર્ત ત ધૂટી ત્યારે એને એનાથી અધિક ભાવ આવ્યો ને ? એટલે ભર્ત ત છે એ પૂજ્યબુદ્ધિથી, ઉપકારબુદ્ધિથી, સર્વાધિકપણે ઉત્પત્ત થતો ભાવ છે. એને બધું જ ગૌણ થઈ જાય, તન-મન-ધનમાં બધું આવી ગયું. બધું જ ગૌણ થઈ જાય, એમ. ભલે જ્ઞાની ઇચ્છતા નથી તોપણ મોક્ષાભિલાષીને તો એ સ્થિતિ, એ દશા થયા વિના પોતાના આત્મા ઉપર અસર આવવાની નથી એને પોતાને કાંઈ લાભ થવાનો નથી.

એટલે જ્ઞાનીની ભર્ત એ નિમિત્ત પરક વચન છે. જ્ઞાની નિમિત્ત છે ને ? એટલે એ નિમિત્ત પરક વચન છે. વાય તો નિમિત્ત પરક છે. પણ એની અંદર સમજાવવું છે - ઉપાદાનની વિશેષતા. ઉપાદાનમાં એવી યોગ્યતાવાળા પરિણામ થયા વિના, એના ઉપાદાનને લાભ નહીં થાય. નિમિત્ત પરક વાત છે એટલે નિમિત્તની પ્રધાનતા છે, અવું નથી.

અમારે ત્યાં તો આ બધી વાતો આવે ત્યારે તર્ક ઠેઠે. ફૂપાળુદેવ ઉપર વજન એટલું બધું નહીં, જેટલું હોવું જોઈએ એટલું. આમ માને ખરા બધાં, પણ એટલું બધું વજન નહીં એને એટલું બધું સમજતા પણ નથી. ફૂપાળુદેવના વચનોમાં જે ડાણ છે (એને) એટલું બધું નથી સમજતા. એટલું બધું વજન ન આવે એટલે એમ આમાંથી તર્ક ઠાવે, કે આમાં નિમિત્ત-પ્રધાનતા ન થઈ જાય ? આમાં નિમિત્તાધિનપણું ન આવી જાય ? શાસ્ત્રમાં તો ઉપાદાનની મુખ્યતા કરવાની આજ્ઞા છે, આમ છે, આમ છે. એવી બધી ચર્ચાઓ ચાલે. એટલે એ ઉપાદાનવાળાને એની રીતે કાન પકડાવવો પડે કે, આ નિમિત્ત - પરક વાત છે, પણ વાત તો ઉપાદાનની જ કરી છે. ઉપદેશ પરિણમશે કોને ? ઉપાદાનને. તો એની ઉપાદાનની યોગ્યતા એવી થયા વિના, એનું કામ નહીં થાય. એટલે મૂળ વાત ઉપાદાનની છે.

નિમિત્ત-ઉપાદાનમાં દૃષ્ટિ ફેરે લોકોને વાત નથી સમજતી. જુઓ ! ચશ્મા વગર દેખાતું નથી. જે લોકોને ચશ્માના નંબર છે. એને શું છે ? જોવામાં ચશ્મા નિમિત્ત છે. તો કહે જુઓ ! મારા ચશ્મા હું કાહું તો મને બરાબર

નથી દેખાતું. તમારા કાઢો તો તમને પણ બરાબર નહીં દેખાય. તમે કહો છો કે નિમિત્તનું આમાં શું સ્થાન છે ? પણ ભાઈ ! એ ચશ્માનો નંબર તમારા આંખના કષ્યોપશમના નંબરને બતાવે છે. કોને બતાવે છે ? તમારી આંખની જોવાની યોગ્યતા કેવી છે ? એમ ચશ્મા બતાવે છે. પણ તમે ચશ્માની ઉપર ભાર મૂકો છો. Doctor આંખ ઉપર ભાર મૂકે છે કે એની આંખની અંદર શું યોગ્યતા છે ? હવે ઉપાદાનને જોવું કે નિમિત્તને જોવું ? એ તો જોવાની નજર ઉપર વાત છે. તારી આંખ એવી નબળી છે એ એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. પછી તમે ચશ્માનો આધાર લ્યો છો, પણ મૂળમાં તમારી આંખ નબળી છે, એ જુઓ ને ! ઉપાદાનનો ઘ્યાલ ન કરે અને એકલા નિમિત્ત ઉપર વજન આવે તો એને એમ થાય કે નિમિત્ત વગર ન ચાલે. આંખને ઠીક કરો, કોઈ ચશ્માની જરૂર નહીં પડે. નિમિત્ત-ઉપાદાનની બહુ ચર્ચાઓ ચાલી છે, અને એટલી બધી ચર્ચાઓ ચાલી છે કે જેને છેડો ન આવે. બેય બાજુની એટલી દલીલો છે. આપણે તો એક જ દાખલો લીધો - ચશ્માનો. બહુ દલીલો છે.

એક દોલતરામજી થઈ ગયા. એમણે એના ઉપર ઘણાં દોહા લખ્યા છે. નિમિત્તવાળા કહે છે કે ભાઈ ! નિમિત્ત ને ઉપાદાન બંને જોઈએ. બે પૈડા વગર રથ ચાલતો નથી. રથ તો બે પૈડાથી ચાલે છે. માટે નિમિત્ત અને ઉપાદાન બંને જોઈએ. ઉપાદાનવાળો કહે છે કે જુઓ ! સૂર્યનો રથ એક પૈડે ચાલે છે. સૂર્યનો રથ એક પૈડે ચાલે છે. 'રવિકા યહી સ્વભાવ' 'એક ચકસે રથ ચલે, રવિકા યહી સ્વભાવ' એવું છે. એમાં તો બહુ વિવાદ ચાલ્યો છે. ઉપાદાન-નિમિત્તનો એટલો બધો વિવાદ ચાલ્યો છે અને લોકોએ એવો એ વિષયને ગુંચવી નાખ્યો છે કે પછી એમાંને એમાંથી નીકળી શકે નહીં !

**મુમુક્ષુ :-** મૂળ વાત એક બાજુ પડી રહી.

**પૂજ્ય ભાઈશ્રી :-** મૂળ વાત જ પડી રહી. આમાંથી મારે આત્મ-કલ્યાણ કેવી રીતે કરવું ? એ વાત એક કોર પડી રહી. એટલે એ આત્મકલ્યાણ કેવી રીતે કરવું, એની મુખ્યતામાં જીવ આવે, એ આ વિવાદની અંદર ફસાય નહીં. વિવાદની અંદર કોણ ન ફસાય ? એકનિષ્ઠાએ આત્મકલ્યાણ કરવાની બુદ્ધિ હોય એને વાંધો નથી આવતો. નહીંતર બંને બાજુની એટલી બધી દલીલો છે કે માણસનું માથું ખરાબ થઈ જાય અને મૂળ વાત ભૂલી જાય.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! જેને પ્રયોજનની પડ હોય એ બંને વાતનો ઉપયોગ કરી લે કે અત્યારે ઉપાદાનની મુખ્યતા છે તો ઉપાદાનથી કામ લેવું, પછી નિભિતથી લેવું.

પૂજ્ય ભાઈશ્રી :- હા, બરાબર છે. એ તો શું છે કે નિભિતની મુખ્યતા કરીને પોતાના પુરુષાર્થને છોડે નહીં. અને જ્યાં એને દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ મળો, ત્યાં એને ઉપાદાનમાં ભર્ત જાગીને પોતાનું આત્મકલ્યાણ કરવાનું ચૂકે નહીં. કેમકે એ તો પોતાના આત્મકલ્યાણવશ ભર્ત ત આવી છે. એમને એમ ચાં ભર્ત ત આવી છે ? ભર્ત ત કરવા ખાતર કે રાગ કરવા ખાતર, વર્ત ત રાગ કરવા માટે કોઈ ભર્ત ત નથી. ખરેખર તો જેને ગુણ પ્રગટ થયા છે, એવી વર્ત તનું બહુમાન તે ગુણોનું બહુમાન છે - વર્ત તનું બહુમાન નથી. તે ગુણોનું બહુમાન છે. એટલે પંચ પરમેષ્ઠિપદમાં “શામો અરિહંતાણમ્” લીધું છે. ‘શામો આદિનાથાય’ એવું નથી લીધું કે, ચાલો ! આદિનાથ ભગવાનને નમસ્કાર કરો. કેમકે કોઈ આદિનાથ છે નહીં. અનંતા તીર્થકરો થયા, એમાં પહેલા તીર્થકર થયા, એવું કાંઈ છે નહીં. કોઈ પહેલા તીર્થકર નથી. આ ચોવીસીમાં ઘભદેવ ભગવાન - આદિનાથ છે. એવી અનંતી ચોવીસી થઈ. એમાં કઈ પહેલી ચોવીસી અને ચા પહેલા તીર્થકર ? એ (કાંઈ) નથી. એ રીતે એનું ગણિત જ નથી. અને સિદ્ધાલયમાં કોઈ પહેલા સિદ્ધ તરીકે ગયા નથી કે પહેલા સિદ્ધશીલા ખાલી હતી, અને એક દિવસ કોઈ પહેલા સિદ્ધ થઈને ત્યાં બિરાજમાન થયા (એવું નથી). ત્યાં સર્વકાળે અનંતા સિદ્ધો છે. અનંતકાળ પહેલા સર્વકાળે પણ ત્યાં અનંતા સિદ્ધો છે, ૨-૪-૫ નહીં (જો એવું હોય) તો-તો પહેલા સિદ્ધ કોણ આવ્યાં ? એ નક્કી થાય. અનંતા સિદ્ધો છે. એવી વાત છે. મગજ નાનું પડે, વાત એવી મોટી છે કે એમાં મગજ નાનું પડે.

એટલે પંચ પરમેષ્ઠિપદમાં “શામો અરિહંતાણં” એમ વાત લીધી છે. જેણે અંદરના દુશ્મનોને - દ્યોષરુપી દુશ્મનોને હણી નાખ્યા, એટલેકે જેણે ગુણ પ્રગટ કર્યા. આત્માના સર્વગુણ પ્રગટ કર્યા એમને હું નમસ્કાર કરું છું. ગુણ પ્રધાનતા જ છે. એમ ભર્ત તમાં પણ ગુણ પ્રધાનતા છે અને જેને ગુણનો મહિમા આવે એને ગુણ પ્રગટે. ગુણનો મહિમા હોય તે ગુણ પ્રગટાવી શકે. પૈસાનો મહિમા હોય એ પૈસા રણે, અને જેને પડી ન હોય એ કાંઈ પ્રયત્ન

કરે નહીં (અને એમ થાય) જાવા દો ને હવે, એમાં શું છે ? એમ બને. જેને જેનો કિંમત હોય અને એ બાજુનો પુરુષાર્થ ચાલે. એટલે ભી ત એવો વિષય છે એ ગુણનો મહિમા છે.

**મુમુક્ષુ :- ભાઈશ્રી ! કૃપાળુદેવે કહ્યું ‘ઉપાદાનનું નામ લઈ. એ જે તજે નિમિત્ત.’**

**પૂજ્ય ભાઈશ્રી :-** ‘પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત,’ ઉપાદાનના બહાને અને નિમિત્તનો મહિમા ન આવે. બહાનું પકડીને ઓણે છળ પકડ્યો. એ ઓણે છળ પકડ્યો અને નિમિત્ત પ્રત્યે જે અને ભી ત થવી જોઈએ, એ જો ન થાય, એ કોઈ દિવસ અની સિદ્ધ થાય નહીં. જીવ ભ્રાંતિમાં પડ્યો છે. એ તો બહુ ઢી- ઢી વાતો અભાણો (કરી છે).

**મુમુક્ષુ :- ખરેખર તો નિમિત્તનો જે સાચો વિવેક કરે અને જ ઉપાદાનનો વિવેક જાગૃત થાય.**

**પૂજ્ય ભાઈશ્રી :-** (અમાં) ખરેખર ઉપાદાનનો જ વિવેક છે. નિમિત્તનો વિવેક છે એ Indirectly ઉપાદાનનો જ વિવેક છે. એમ જ છે. એ વાત ગુરુદેવે કરી છે કે જે આ નિમિત્તનો વિવેક છે, તે જ ઉપાદાનનો વિવેક છે. અહીંયા પણ કોઈ નિષેધ કરે છે તે ઉપાદાનને પણ સમજ્યો નથી અને નિમિત્તને પણ સમજ્યો નથી, એવી રીતે કહ્યું છે. આત્મ-સિદ્ધિના બહુ સરસ અર્થ કર્યા છે. વ્યાખ્યાનો ચાત્યા છે. અત્યાર સુધીમાં ‘આત્મસિદ્ધ શાસ્ત્ર’ ઉપરના વ્યાખ્યાનોની ૬૦-૭૦ હજાર નકલ છપાઈ ગઈ છે. ૮-૮ Re-edition થઈ છે. એટલું બધું લોકોને અભાંથી મળે છે. (એ) વ્યાખ્યાનોનું હજુ હિન્દી નથી થયું. હિન્દી થાય તો હિન્દીભાષી ક્ષેત્રમાં કૃપાળુદેવનો બહુ સારો પ્રચાર થાય અવું છે. અહીં સુધી રાખીએ.



પ્રવચન - ૬

**‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક-૨૦૦**

તા. ૧૦/૦૧/૧૯૮૮ - કલકત્તા

---

---

(શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - પત્રાંક ૨૦૦.) ૧૪માંથી ૭ વચનો થયા છે. ૮ મું વચન છે. ૨૦૧ પત્રમાં એમણે લખ્યું છે કે (સોભાગભાઈના પુત્ર) ભણિભાઈ માટે આ વચનાવલી અમે મોકલી છે. એમાં અમે સંતનો અદ્વિતીય માર્ગ પ્રકાશ્યો છે. જો કોઈ મુમુક્ષુ એક જ વૃત્તિએ, એક જ વૃત્તિએ એટલે માત્ર આત્મ-કલ્યાણના હેતુથી, અનું આરાધન કરશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે એટલે સત્પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. એટલા વચનો એમણે આ વચનાવલી માટે ૨૦૧ પત્રમાં લખ્યા છે.

સંક્ષેપમાં લઈએ તો, જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે તેથી એને સુખની પ્રાપ્તિ નથી થઈ. હમેંશા એને દુઃખ ભોગવવું પડ્યું છે. પોતાને ભૂલી જવા રૂપ અજ્ઞાન છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી અજ્ઞાનનો નાશ થાય છે, એમ કહ્યું છે; પણ એ જ્ઞાનની પ્રાપ્તિ જેણે કરવી હોય એણે જ્ઞાનીની હચ્છાએ, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય, એ સહેજે સમજાય એવી વાત છે. પણ જ્ઞાની સંપ્રદાયમાં માનતા નથી અને બધાં જીવ સંપ્રદાયવાસી હોય છે. પોતાનો સંપ્રદાય છોડી શકતા નથી. એમાં મુખ્યપણે લોકલજ્જા અથવા સમાજ-પ્રતિબંધ આડો આવે છે, (એને એમ થાય છે) કે લોકો શું કહેશે ? આપણે આપણો સંપ્રદાય છોડી દઈશું તો લોકો આપણી ચર્ચા કરશે. આપણી આબરૂ ઓછી થશે અને આપણા સગા-સંબંધીઓ બધાં સંપ્રદાયમાં છે. એની સાથેના સંબંધોમાં પણ કચાંક ખામી પહોંચશે. એકબીજાનો જે સ્નેહ છે એમાં કંઈક ફરક પડી જશે. એવા અનેક કારણોથી જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એટલેકે જે સંપ્રદાયના ગુરુ છે, આત્મજ્ઞાન જેને નથી, એમનો આશ્રય છોડતો નથી અને એ અનંતાનુંબંધી કખાયનું મૂળ છે. એ

વાત એમણે ત્રીજા વચનામૃતમાં લીધી છે.

અનંતાનુંબંધી કખાયનું મૂળ એટલે પરિભ્રમણનું મૂળ. હવે સંપ્રદાયના ગુરુ પાસે જવું, એ વ્રત - ઉપવાસ કરાવે, તો એમાં આપણને નુકસાન શું ? આમાં ચુ મોટું આપણે પાપ કરીએ છીએ, કે જેથી એ પરિભ્રમણનું મૂળ કહેવામાં આવે છે ? જુઓ ! આ વાત જીવને સમજાતી નથી એટલે બહુ Lightly - હળવાશથી લઈ લે છે. (એ એમ માને છે કે) આપણે જ્ઞાની પાસે પણ જવું અને આપણે સંપ્રદાયમાં પણ જવું. બંને જીવાએ જવું. એમાં આપણને વાંધો શું છે ? નુકસાન શું છે ? પણ કૃપાળુદેવે ધ્યાન ખેંચ્યું છે કે જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ એને પરિભ્રમણ(નું કારણ છે). અનંતાનુંબંધી કખાયનું મૂળ તો ત્યાં છે.

એટલે એણે જ્ઞાની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ હચ્છવી હોય તો એકનિષ્ઠાએ જ્ઞાનીના સત્ત્વસંગને અને એના આશ્રયને આરાધવો જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જેણે હચ્છવી, તેણે જ્ઞાનીની હચ્છાએ વર્તવું એમ જિનાગમ આદિ સર્વ શાસ્ત્રો કહે છે. પોતાની હચ્છાએ વર્તતા અનાદિ કાળથી રખડયો છે. પોતાની હચ્છાએ કહો કે સ્વચ્છંદ કહો. સ્વચ્છંદ ધર્મ-સાધન કરીને, પોતે (પોતાની) હચ્છા પ્રમાણે ધર્મ-સાધન કરીને અનાદિથી રખડયો છે. રખડવાનું કારણ કુટુંબ-પરિવાર, એ પછી લીધું. પહેલા આ લીધું. આ વચનાવતીમાં એવી બીજી વાત નથી લીધી. ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રમાં જે ભૂલ કરે છે એ એને સત્ત્વધર્મમાં, સન્માર્ગમાં, જિનમાર્ગમાં, જ્ઞાનીના માર્ગમાં ચડવા દેતું નથી. એના ઉપર ધ્યાન ખેંચ્યું છે.

કરીથી (લઈએ). એમ નથી કહ્યું કે તું વેપાર-ધંધો કરે છો અને ગૃહસ્થાશ્રમમાં છો માટે તને ચાર ગતિનું પરિભ્રમણ થશે, એમ નથી કહ્યું. અહીંયા તો એમ કહ્યું કે તું તારી મેળે ધર્મ-સાધન કરે છો, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, જ્ઞાનીના આશ્રયમાં આવતો નથી, માટે તને પરિભ્રમણ થાય છે. રખડપક્કી એટલા માટે રહી છે, એમ કહે છે. કેમકે જે માર્ગ નથી એને માર્ગ માને છે. ઉપાય નથી એને ઉપાય માને છે - એ ગૃહીત-મિથ્યાત્વ છે. એટલે તીવ્ર અજ્ઞાન છે.

જીવને વિષય કખાયનો દોષ દેખાય છે. કોઈ કોધ કરે, કોઈ ચોરી કરે, કોઈ જુગાર રમે, કોઈ દારુ પીએ, તો એ દેખાય છે પણ અજ્ઞાનનો દોષ નથી દેખાતો. અજ્ઞાનનો અપરાધ કેટલો મોટો છે એ નથી દેખાતો. હવે જીવનું

જે પરિણમન છે એ જીવના પરિણમનમાં Leading part જ્ઞાનનો છે. જ્ઞાન ધું પડે તો બધાં ધું ચાલે. જેમ નેતા ભૂલ કરે તો એને અનુસરનારા બધાં ભૂલ કરે. એમ જ્ઞાનનો પરિણમનની અંદર Leading part છે. એ જ્ઞાન Leader છે. જ્ઞાન ગોથું ખાય એટલે બધાંથી ગુણો ઉલટા ચાલવા મંડે અને જીવને નુકસાન પહોંચે.

એટલે એમ કહે છે કે અજ્ઞાન છોડવા માટે અજ્ઞાનીનો આશ્રય છોડવો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનીનો આશ્રય કરવો જોઈએ. આ વાત સહેજે સમજાય એવી છે. છતાં જીવ લોકલજજા આદિ કારણોથી એવો ફેરફાર નથી કરી શકતો ત્યાં સુધી એ સ્વચ્છાંદર્થી રખડે છે અને પોતાની છચ્છા પ્રમાણે ધર્મ-સાધન કરીને રખડે છે. એમણે બે વાત લીધી. એટલે પાંચમાં (વચનામૃતમાં) એ કહ્યું કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની છચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ - અજ્ઞાનનો નાશ થવો સંભવતો નથી. આ સ્પષ્ટ વાત છે કે પ્રત્યક્ષ જ્ઞાની અને એની આજ્ઞાએ વર્તવું, એ સિવાય અજ્ઞાનનો નાશ થવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી. એવું નથી કે શાસ્ત્ર વાંચે એટલે અજ્ઞાનનો નાશ થઈ જાય. અજ્ઞાનનો નાશ થવા માટે તો જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું એ એક જ એનો ઉપાય છે.

**મુમુક્ષુ :- ભાઈશ્રી ! આ પ્રત્યક્ષ (જ્ઞાની) ઉપર જે વજન મૂં ચું છે એનું જરાક (સ્પષ્ટીકરણ કરશો).**

**પૂજ્ય ભાઈશ્રી :- હા, એનું કરણ છે કે પરોક્ષ આજ્ઞાઓ તો શાસ્ત્રમાં છે. શાસ્ત્રો પણ જ્ઞાનીઓએ લખેલા છે અને પરોક્ષ આજ્ઞાઓ તો શાસ્ત્રોમાં છે. એ છેલ્લે કહેશે. બારમાં (વચનામૃતમાં) જુઓ ! ‘શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે...’ બારમાં વચનમાં છે. ‘અને તે જીવને અધિકારી થવા માટે કહી છે...’ એટલે પાત્ર થવા માટે કહી છે. પણ ‘...મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.’ એ વાત એમણે જુદી પાડી છે. નહીંતર કોઈ કોઈ જીવો એવો પણ સંતોષ લે છે, કે જે મહાજ્ઞાની છે એવા આચાર્યોના શાસ્ત્રો વિદ્યમાન છે એ આપણે વાંચીએ છીએ, તો પછી આપણને એનાથી જરૂર આત્મ-કલ્યાણ થઈ જવું જોઈએ. પણ એ પરોક્ષ આજ્ઞા છે. એ આત્મ-કલ્યાણના હેતુથી વંચાય તો પાત્રતા જરૂર પ્રગટે, પણ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવો હોય તો એ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા વિના મોક્ષમાર્ગમાં પ્રવેશ નથી થતો. અથવા**

પ્રત્યક્ષ જ્ઞાનીના આશ્રય વિના (મોક્ષમાર્ગમાં પ્રવેશ) નથી થતો તો એનું શું કારણ ?

અહીંયા પ્રશ્ન ઠવો જોઈએ કે એનું કારણ શું ? એવું શું છે એમાં ? કયું રહેસ્ય છે ? કચો ભેદ છે ? શાસ્ત્રમાં પણ જ્ઞાનીઓ લખી ગયા છે અને એ કોઈ મોટા મોટા જ્ઞાનીઓ લખી ગયા છે. પ્રત્યક્ષ જ્ઞાની તો આચાર્યોથી નાના જ્ઞાની પણ હોઈ શકે. જેમકે કૃપાળુદેવ ગૃહસ્થ હતા અને આચાર્યો તો ત્યારી હતા. છહો-સાતમાં ગુણસ્થાનવર્તી હતા. કૃપાળુદેવ ચોથા ગુણસ્થાનવર્તી હતા. પ્રત્યક્ષ (જ્ઞાની) ઉપર કેમ આટલું વજન મૂકે છે ? (એનું કારણ એ છે) કે આત્મજ્ઞાન મેળવવા માટેની કેટલીક જે Practical side છે, એ શાસ્ત્રમાં - લખાણમાં આવવી સંભવિત નથી. એટલે એમણે એમ કંબું કે જિનાગમ આદિ શાસ્ત્રો પણ એમ કહે છે કે જ્ઞાનીની છચ્છાએ વર્તવું. પ્રત્યક્ષ જ્ઞાનીની છચ્છાએ વર્તવું એવી આજ્ઞા શાસ્ત્ર પણ કરે છે. શાસ્ત્રો એથી વિરુદ્ધ વાત નથી કરતાં.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! પરોક્ષ જ્ઞાની જે થઈ ગયા, એમની છચ્છાએ કેવી રીતે ચાલવું ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, (તેઓ) નથી તો તેમની છચ્છા ચાં રહી ?

મુમુક્ષુ :- ભાઈશ્રી ! એક જગ્યાએ એવું વાંચ્યું હતું કે પરોક્ષને પ્રત્યક્ષ તરીકે માનવું.

પૂજ્ય ભાઈશ્રી :- એ વાત દેખત રીતે તો બરાબર નથી લાગતી. પરોક્ષ છે એ પરોક્ષ છે અને પ્રત્યક્ષ છે એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો કોઈ Alternative આ જગતમાં નથી. પ્રત્યક્ષનો (કોઈ) Alternative નથી. એનો એક બહુ મોટો સમર્થ દૃષ્ટાંત એ છે કે, આપણા વિશ્વમાં જે મહાસત્તા છે, જેમકે અમેરિકાના President છે, રશ્યાના President છે, બ્રિટનના President છે, એ લોકો Communication ના સાધનનો ઉપયોગ કરીને, એકબીજાના સંપર્કમાં રહીને કંઈપણ નિર્ણય લઈ શકે (છે), એમાં પ્રત્યક્ષ Meeting કરવાની શું જરૂર ? જમાનો Terrorist (ત્રાસવાદ) નો છે. અમેરિકાના President ને ભર બજારમાં પણ મારી શકાય છે, ખૂન કરી શકાય છે (જેમકે) કેનેડીને માર્યો. એટલે ઘર-બહાર નીકળવું એને જોખમ છે, છતાં એને ઘર-બહાર નહીં, દેશ-બહાર નીકળીને પણ Meeting કરવી પડે છે. પ્રત્યક્ષ Meeting કરવાનું શું કારણ ? અત્યારે એટલા બધાં Communication ના સાધન છે કે Screen ઉપર તમે

એકબીજા Meeting કરી શકો છો, પડદા ઉપર એકબીજાને બોલાવીને સામે-સામે વાતચીત કરી શકો છો. એ પણ પરોક્ષ છે - એ પણ પ્રત્યક્ષ નથી. તો એવું શું છે ? કે પ્રત્યક્ષમાં જે સમજાય છે તે પરોક્ષમાં નથી સમજાતું, એવું કાંઈક છે ખરું અને એ Practical knowledge છે. આ તો સ્થૂળ દૃષ્ટાંત છે.

જ્ઞાનીની પ્રત્યક્ષતાનો સિદ્ધાંત છે એ બહુ સૂક્ષ્મ છે. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો એની પરિણાતિ તમને જોવા મળે છે. શાસ્ત્રમાં પરિણાતિ જોવા નથી મળતી. શાસ્ત્રમાં શબ્દો અને શબ્દોનું વાચ્ય સમજવાનું રહે છે. પ્રત્યક્ષ કાંઈ દેખાતું નથી. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનીમાં જ્ઞાનીની પરિણાતિ - જગૃત ચૈતન્યની ચેષ્ટા તમને જોવા મળે છે. આત્મ-જગૃતિ શું ? આત્મજ્ઞાન શું ? આત્માનો અનુભવ શું ? એ વાત છે એ સૌથી વધુમાં વધુ રહસ્યમય વિષય છે, Top secret (છે), અધ્યાત્મની એક Top secret છે. એનો કોઈ Alternative નથી અને એ પરિણાતિ(ભાં) જે આત્મરસ છે તે (બીજાના) આત્મરસને ઉત્પન્ન કરે છે. કોઈપણ તીવ્ર રસ છે એ બીજાના રસને ઉત્પન્ન કરે જ. જ્યાં ખુશખુશાલ વાતાવરણ હોય ત્યાં બધાં હસતા હોય. કોઈ મરી ગયું હોય અને જ્યાં શોકાન્વિત વાતાવરણ હોય ત્યાં નવો માણસ જાય તો એ રોવા મંડે. ત્યાં એ હસી ન શકે. કેમકે ત્યાં એ જાતનો રસ બધાંના ચહેરા ઉપર વર્તે છે; એવી રીતે જ્ઞાનીને જે આત્મરસ છે, એ આત્મરસ પ્રગટ થાય છે. એમના સાનિધ્યમાં એમના વચ્ચનોથી, એમના હાવબાવથી એ જોવા મળે છે. એનો કોઈ Alternative નથી અને એનાથી જે જ્ઞાન પ્રાપ્તિ છે અથવા એના નિમિત્તે જે પરિણામનની ઉત્પત્તિ છે, એ જે પ્રસંગ છે, એ પ્રસંગ એ (પ્રત્યક્ષતા) વગર બની શકે એવી સંભવિતતા નથી. જ્ઞાનીને જ્ઞાનવેદન છે અને એ જ્ઞાનવેદનની ઉત્પત્તિ એ જ્ઞાનવેદન જોનારને થાય છે. એ સિવાય જ્ઞાનવેદનની ઉત્પત્તિ નથી થતી. (સ્વયંની અંદરમાં ચાલતું જ્ઞાનવેદન) જોવા મળતું નથી, ઢંકાયેલું છે. જ્ઞાન જ્ઞાનને વેદ છે એ વિષય અંદરમાં માલૂમ પડતો નથી. એના માટે એ પ્રત્યક્ષ સત્સંગ ઘણો જરૂરી છે. આ તો Top level ની વાત થઈ.

હવે એના નીચેના સ્તરની વાત લઈએ તો જીવ ડગલેને પગલે ભૂલ કરે છે. હવે એને જો પ્રત્યક્ષ જોગ હોય (અને) એ પોતાની વાત કરે તો એનો ઉકેલ આવે. ડોક્ટર પાસે જાય ને એમ કહે કે મને અહીંથા દુઃખે

છે તો એના ઉપાય થાય, પણ ચાં દુઃખે છે એ બતાવે નહીં તો શું થાય ? અને એ દવા કેવી રીતે કરે ? જો દર્દી દર્દ ન બતાવે તો ડોક્ટર એનો ઇલાજ કેવી રીતે કરે ? તો એ તો પ્રત્યક્ષ વગર થાય નહીં. એટલા માટે જેને દર્દ થયું છે એને Medical books વાંચવી, એ સલાહ ભરેલી વાત નથી, ઉહાપણ ભરેલી વાત નથી. એણે સીધી Medical store માં જઈને ફાવે એવી દવા લઈ લેવી, એ પણ સલાહ ભરેલી વાત નથી. એણે Doctor પાસે જઈને Doctor ના Prescription પ્રમાણે દવા લેવી, એ જરૂરી છે. જો Doctor જ ન હોય તો ઉપરની બે વસ્તુ કામમાં નહીં આવી - ન દવા કામમાં આવે, ન ચોપડી કામમાં આવે. એવી વાત છે. એટલે શાસ્ત્રો પણ એ જ કહે છે કે પ્રત્યક્ષ જ્ઞાનીના આશ્રયમાં તું જા, તો જ તારો નિવેડો આવે એવું છે. બીજી કોઈ રીતે નિવેડો ન આવે, એવી આ પરિસ્થિતિ છે. કેમકે Practical knowledge નું શું ? શાસ્ત્રોમાં બધું Theoretical knowledge છે. બધી Theory - વ્યાખ્યા છે. એની અંદર Practical knowledge છે એ આવતું નથી, લખી શકતું નથી. જે વાત એ પોતે કરે છે. અને એટલા માટે શાસ્ત્રોએ પણ, સર્વ જિનાગમ આદિ શાસ્ત્રોએ આ વાત કરી છે. એ આ વાત કહે છે, એમ એમણે કીધું. શાસ્ત્રોની સાક્ષી પણ મૂકી છે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! કૃપાળુટેવે એક જગ્યાએ લખ્યું છે ને ? કે તું માને ચડી ગયો હોય તો પ્રત્યક્ષ જ્ઞાની વગર કોણ દેખાડે, કે આ તારું માન અહીંયા છે ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, એટલે દાખલા તરીકે (એમ લઈ શકાય), બુદ્ધિશાળી માણસ હોય, ક્ષયોપશમ જ્ઞાન સારું હોય અને શાસ્ત્ર વાંચતા વાંચતા એને કેટલીક વાતો વધારે સમજાય. એ જે બધી નવી વાતો સમજાડી અનું માન ચડે, તો શાસ્ત્ર કેવી રીતે એને એમ કહે કે મને વાંચતા - મારું જ વાંચન કરતાં-કરતાં તને માન ચડી ગયું છે, એનો દોષ તારે કાઢવો જોઈએ. એ શાસ્ત્ર કેવી રીતે કહેશે ? (અને) જ્ઞાનીને તો તરત ઘ્યાલમાં આવે છે કે આ શું ભાવથી વાત કરે છે ? આ મને સમજાય છે, એવી રીતે આ વાત કરે છે. આ તો એણે પહેલાં કાઢવું પડશે, કે મને સમજાય છે, એ વાત તું પહેલા મૂકી દે. પહેલાં જિજ્ઞાસામાં આવ. એટલે કેટલીક વાતો એવી છે કે પ્રત્યક્ષ જ્ઞાની વિના એમાં સુધારો થવો સંભવિત નથી અને બીજી રીતે

જીવ આડે રસ્તે ચડી જાય, એવી પૂરી શ યતા રહેલી છે. એટલે ભાર દઈને કચું છે કે, ‘જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની (ઇચ્છાએ, એટલે) આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.’ એ સિદ્ધાંત ગ્રણે કાળે અફર છે. પાંચમાં વચનમાં એમણે બહુ સિદ્ધાંતિક વાત કરી છે.

(આગળ કહે છે) જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવાની તૈયારી કોની? કોણ યોગ્ય છે ? કે ‘જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસ્તિ તનો ત્યાગ કરી તેની ભર્તી તમાં જોડાય.’ તન, મન, ધનનો ત્યાગ કરીને નહીં. એમ નથી કહેતા કે તું ઘર, વેપાર, ધંધો છોડી દે અને જ્ઞાનીની ભર્તી તમાં જોડા ! એમ નથી કહેતાં. એની ‘આસ્તિ ત’ છોડી (દેવાની વાત કરી છે). સંયોગ, સંયોગની જગ્યાએ રહેવા દે એમાં જે તને મારાપણાથી પ્રેમ છે, રાગ છે, એ મૂકવાની વાત છે. મારાપણું મૂકવાની વાત છે, સ્વામિત્વબુદ્ધિ, ધણીપણું મૂકવાની વાત છે. પ્રારબ્ધયોગે જે કાંઈ સંયોગ (મળ્યા) છે, એને પ્રારબ્ધે તને Manager તરીકે Appointment આપી છે એમ ગણી લે. You have to well manage. બીજું કાંઈ નહીં. Manager હોય એ સારી રીતે Manage કરે, પણ Manager હોય એ ધણી થાય નહીં.

એ રીતે તું આસ્તિ તનો, મારાપણાનો, સ્વામીપણાનો ત્યાગ કરીને ભર્તી તમાં જોડા ! કોરી ભર્તી તમાં જોડાવાનું (એમ) પણ નહીં. ‘ભાઈ ! હું તો જ્ઞાનીના ગુણ ગાયા કરું છું, મને એમના ગુણના ગીતો ગાવા બહુ ગમે છે, માટે હું ગાઉં છું.’ એમ નહીં. પાછી તન, મન, ધનની આસ્તિ ત એમને એમ રાખું છું. એ પ્રકારે નહીં. (આ) Conditional વાત છે. જ્ઞાનીની ભર્તી તમાં જોડાવા માટેની શરતી વાત છે, Conditional વાત છે.

એ રીતે વાતને એમણે મૂકી છે, કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે છે. નહીંતર (જીવ) જ્ઞાનીનો સંગ કરી શકે છે, જ્ઞાનીની ભર્તી ત ગાઈ શકે છે, ગીત ગાઈ શકે છે પણ આજ્ઞાનું આરાધન કરી શકતો નથી. કેમકે જ્ઞાની પ્રતિબંધ છોડાવે છે. જ્ઞાનીની આજ્ઞા ભવભ્રમણમાં રખડવા માટે આડો પ્રતિબંધ છે. રોકે છે એને (કે) તને ભવભ્રમણ નહીં કરવા દઈએ. એવી વાત એમણે બીજા પત્રમાં લીધી છે - (પત્રાંક - ૫૧૧) કે જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવા માટેનો પ્રતિબંધ છે. (આજ્ઞા) અવરોધ કરે છે. તને ભવભ્રમણમાં નહીં જવા દે. તું ભવભ્રમણમાં ચાંથી જાય છે ? કે તન, મન, ધન આદિ જે કાંઈ

સંયોગ છે, એના ઉપરની જે તારી સ્વામિત્વપણાથી પકડ છે, એ તને પરિભ્રમણ કરાવે છે. પોતાપણું થશે ત્યાં તને કર્તાપણું થશે, ભો તાપણું થશે, આધારબુદ્ધિ આવશે, બધું થઈ જશે અને એ જ પરિભ્રણનું કારણ છે.

**મુમુક્ષુ :- ભાઈશ્રી ! સ્વામીત્વપણું છોડવાનું કેવી રીતે થાય ?**

**પૂજ્ય ભાઈશ્રી :-** બહુ સીધી સાઠી વાત છે, કે જ્યાં પોતે નથી અને જ્યાં પોતાની સત્તા ચાલતી નથી ત્યાં સ્વામીત્વપણું કરવું, એ તો દેખત ભૂલ છે. પોતાની હ્યાતીની મર્યાદા પોતાના દ્વય-ગુણ-પર્યાયમાં સમાપ્ત થાય છે. આથી (આગળ) પોતાની કોઈ હ્યાતી નહીં હોવાથી (પોતાની) સત્તા નથી. સત્તા નથી એટલે કાંઈ ચાલે એવું છે નહીં. આ એક સ્પષ્ટ વસ્તુસ્થિતિ છે. હવે જ્યાં પોતાની સત્તા નથી, ત્યાં પોતાની સત્તા ભોગવવી, એ દેખીતો અપરાધ છે. આપણે જ લ્યોને ! પાડોશીના ઘરમાં આપણે સત્તા ચલાવો જોઈએ, ચાલે છે ? (પાડોશી) હળવેક દઈને કહે કે, ભાઈ ! ‘તમે માથું મારો નહીં. અમારા ઘરમાં તમે માથું નહીં મારો.’ એ કહે કે ‘પણ હું તમારા હિતની વાત કરું છું.’ તો એ કહે ‘બધી વાત સાચી પણ તમે તમારી મર્યાદામાં રહીને વાત કરો. સત્તા ચલાવવાની વાત નહીં કરો.’ આ જીવ શું કરે છે ? કે જે સ્વતંત્ર પદાર્થો છે - બીજા જીવો અને બીજા પરમાણુઓ, એ જગતના સ્વતંત્ર પદાર્થો છે. એના ઉપર પોતાની સત્તા, પોતાનો અધિકાર જમાવવા માંગો છે અને જ્યારે ન જામે, ત્યારે એમાં અને કખાય થાય છે. (અને સત્તા) નથી જમવાની એ વાત નક્કી છે. અનંતકાળથી અનંતજીવોએ પર પદાર્થો ઉપર Control કરવા માટે અનંતો પુરુખાર્થ યો છે, છતાં એક પરમાણુ કે એક જીવ ઉપર કોઈ દિવસ કોઈની સત્તા ચાલી નથી. એટલે જે વસ્તુ અશ ય છે એને શ ય કરવા મથે છે એટલે એ પોતે દુઃખી થાય છે. દુઃખી થવાનું કારણ જ એ છે.

પરદેશમાં આ Multi-millionaire માણસો છે. એ બેચેન શું કરવા છે ? કે ઓઝે જે કાંઈ એના (સંયોગોમાં) રસ લીધો છે, પર-પદાર્થ ઉપર સ્વામીત્વ કરવાનો જે રસ લીધો છે, ઓઝે આત્માનો જે શાંત સ્વભાવ છે એમાં Disturbance ઓઝે પોતે જ ભો કર્યો છે. Disturbance તો પોતે જ ભું કર્યું છે. પણ એને એ વિજ્ઞાનની ખબર નથી કે આ મારી શાંતિનું Disturbance ઓઝે કર્યું ? મારી પાસે બધું છે છતાં મને ચેન નથી પડતું. (જ્ઞાની કહે છે) નથી પડવાનું.

આ બધું મારું છે - (એ માન્યતા) એ જ તારી શાંતિને Disturb કરે છે. Disturbance તો એ જ કરે છે. તારા જ પરિણામ કરે છે. વસ્તુ વસ્તુમાં પડી છે અને તારી હોત તો તારી સાથે રહેત. પણ શરીરનો એક પરમાણુ કે બીજા સંયોગનો એક પરમાણુ કે બીજો કોઈ જીવ સાથે તો રહેતો નથી. અમુક કાળ સુધી સંયોગ છે, એનો વિયોગ થઈ જાય છે. કોઈ સાથે રહેતું નથી. એટલે એ સાથે રહેવાની મહેનત કરવી એ જ વર્થ છે ને ખોટી છે. ઠીક છે, કુદરતી વ્યવસ્થા છે ને જે સંયોગ થયો તે થયો. એ સંયોગોની વચ્ચે મારાપણું રાખીને રહેવું કે મારાપણું છોડીને રહેવું, એ પોતાની સમજણ ઉપર આધાર (રાખે) છે. બીજું કાંઈ નથી.

સુખી દુઃખી થવામાં સમજણ અને આણસમજણનો જ Problem છે. સમજણથી સુખી થાય અને આણસમજણથી દુઃખી થાય. જ્ઞાનીઓ પણ એ સંયોગોમાં રહે છે. તીર્થકર જેવા જ્ઞાની ચકવર્તી હતા. શાંતિનાથ, કુંઘુનાથ, અરનાથ - ત્રણ ચકવર્તી થયા. બાર ચકવર્તીમાંથી ત્રણ તો એ હતા. દેવલોકના ઇન્દ્ર જ્ઞાની છે. સૌધર્મ ઈન્દ્ર એકાવતારી છે. એ હેવી વૈભવની વચ્ચે રહે છે. પણ મારાપણું છોડીને રહે છે એટલે એને એ કાંઈ તકલીફ નથી. પરિભ્રમણ થવાની તકલીફ નથી.

સંયોગ તો સંયોગ છે. (સંયોગમાંથી) મારાપણું છોડતાં એનો રસ છૂટે છે. તકલીફ જીવને અહીંયા છે. અંદરની જે તકલીફ છે એ અહીંયા છે, કે મારાપણાને લઈને જે રસ છે, એ રસ મીઠો લાગે છે. એટલે જીવ એને છોડી શકતો નથી. પણ એનું ફળ એને ખબર નથી. આ મીઠું જેર છે, આ રસ લઈએ છીએ એ મીઠું જેર છે અને એનું ફળ બહુ ખરાબ છે, એ જીવને ખબર નથી, એટલે Instant એને જે સારું લાગે છે એને એ મૂકી શકતો નથી.

અમારે એક સગા હતા. નાની ઊંમરમાં - ઉટ વર્ષની ઊંમરે ગળાનું Cancer થઈ ગયું, ગળાનું Cancer થવામાં શું થયું ? કે (પોતે) Chain-smoker હતા અને ચા ના પણ એટલા જ બંધાળી હતા. અઝીણના ડોડવાની ચા પીવા જાય. આખા દિવસમાં ૮,૧૦,૧૨ Cup પીવા જોઈએ. ત્યાં એક જગ્યાએ એવી ચા મળે છે. અંદર અઝીણના ડોડવા નામે એટલે એને થોડુંક Toxification થાય અને એ એને જ છચ્છે. આખો દિવસ બીડી ને ચા. ન ખાય તો ચાલે, પણ બીડી ને ચા જોઈએ. નાની ઊંમરે Cancer થયું અને એને એટલી બધી

તવપ લાગે ! Doctor કહે કે, ‘બીડી પીધી તો મરી ગયા સમજ લેજો.’ તો (આ ભાઈ) સંડાસમાં જઈને બીડી પી આવે ! વાસ આવે એટલે બૈરાને ખબર પડી જાય. (બૈરા કહે) ‘બીડી પીધી પાઇછી તમે ?’ તો ‘(ભાઈ કહે) પણ મારાથી રહેવાતું નથી, શું કરવું ?’ તેની સ્ત્રી કહે, ‘હવે આ Doctor ના પાડે છે.’ તો કહે ‘હવે પાંચમની છઠ ચાં થવાની છે !’ શું કહે ? ‘હું પાંચમે મરવાનો છું, તો છઠને દિવસે ચાં મરવાનો છું ! હું તો પાંચમે મરી જ જવાનો છું. મને બીડી પીવા ધ્યો !’ સંસારમાં આવી હાલત જીવની પોતાપણાના રસની છે. કાલે (આ પોતાપણાનું) ભયંકર પરિણામ આવશે એ નથી જોતો ! આજે મને રસ આવે છે ને આમાં, (એમ માનીને) એ રસ લઈ લે છે. કેમકે એ પ્રકારનું Toxification એને થયેલું છે. અનંતકાળથી - અનાદિકાળથી મારાપણું કરી... કરી... કરીને તો રખડયો છે. હવે એ છોડવું જરા આકરું પડે છે. (એટલે અહીંયા કહે છે) ‘એકનિષ્ઠાએ...’ જુઓ ! છહા (વચનમાં) એ લીધું. (જ્ઞાનીની આજ્ઞાનાનું) એકનિષ્ઠાએ આરાધન કરે તો જ ધૂટી શકે, નહીં તો ન ધૂટી શકે. એટલું બળવાનપણું પહેલેથી જ આવવું જોઈએ.

અમારે રસ્તામાં જ ચર્ચા થઈ હતી. પરિભ્રમણથી ધૂટવાની તીવ્ર ભાવના વેદનાથી વ્ય ત થાય છે. શેનાથી ? પરિભ્રમણની ચિંતના અને વેદનાથી વ્ય ત થાય છે. એ (વેદના) જ્યાં સુધી જીવને નથી આવતી ત્યાં સુધી ખરેખર પરિભ્રમણથી ધૂટવાનો જે પુરુષાર્થ છે અને ઉપાય છે એ જીવ કરતો નથી. એટલે કૃપાળુદેવે એ વાત લખી નાખી કે ભૂતકાળે, વર્તમાને કે ભવિષ્યમાં કોઈને આ વિના માર્ગ સૂઝે એવું નથી. ધૂટવાનો જે માર્ગ છે, મુજૂર તનો માર્ગ છે એ (સૂઝે એવું નથી). (પરિભ્રમણની વેદના ન આવે ત્યાં) સુધી માર્ગની દિશા પણ સૂઝે એવું નથી અને એ થયા પછી શું કરવું તે સમજાય છે. એ થયા પહેલા શું કરવું ? એ (જીવે) નક્કી કરી નાખ્યું છે. જીવ સ્વચ્છંદથી - પોતાની મનમાની રીતે (નક્કી કરી નાખ્યું છે) કે આ કરવું ને આ ન કરવું, આ કરવું ને આ ન કરવું.

(પરિભ્રમણની વેદના નથી આવતી) એનું બીજું પડખું સ્પષ્ટ કરીએ તો જીવને પરિભ્રમણ વહાલું છે. જીવને પરિભ્રમણ હજી વહાલું છે. (અને) વહાલું છે તો પરિભ્રમણ કર્યા કરશે. (આ) એક વિષય ઉપર બે પત્રો લખ્યા છે - ૮૬મો પત્ર અને ૧૮૫મો પત્ર. જેને મૃત્યુથી ધૂટવાનો ઉપાય છચ્છવો છે,

જેને છચ્છા છે, માર્ગની જેને છચ્છા છે, એણે બધાં (ધર્મ)સાધનના વિકલ્યો મૂકી દઈને, પહેલા આ કરવું જોઈએ. તમારે સઘળાએ એ શોધવાનું છે, કે કોઈ રીતે (આ પાયો નાખવો ?)

તમારે સઘળાએ એ જ શોધવાનું છે, એમ લખ્યું છે કે નહીં ? પોસ્ટકાર્ડ લખ્યું છે (તેમાં) એક એક વા ચ તોળી-તોળીને લખ્યું છે. એક-એક વા ચ તોળી તોળીને લખ્યું છે. એની બહુ મોટી કિંમત છે. એનું સ્થાન સમજાય, યથાસ્થાને એ વાત આવે તો એની બહુ મોટી કિંમત છે. એ સિવાય કોઈ જીવ મુ ત થયો જ નથી. એમણે પણ પોતાના અનુભવથી જ લખ્યું છે અને બધાં જ્ઞાનીઓનો અનુભવ જોઈએ તો એ જ જોવામાં આવે છે. કોઈ એના વગર જ્ઞાની થયા હોય એવું છે નહીં. એટલે પાયાની વાત એમણે જે કરી છે એ અનુભવ સિદ્ધ છે. અનુભવથી સિદ્ધ થયેલી વાત છે.

એ (પરિભ્રમણથી છૂટવાની વેદના) ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે. જ્યાં મારાપણું છે એ મોણું પડી જાય છે. પહેલે જ તબક્કે મારાપણું મોણું પડી જાય છે કે, આ (સંયોગો) પરિભ્રમણના નિમિત્તો છે. જેમાં હું રસ લઉં છું, જેની મને આસ્તિ ત છે, એ પરિભ્રમણના નિમિત્તો છે. ઉપાદાનમાં મારો ભાવ છે. નિમિત્તો ભલે નિમિત્તોની જગ્યાએ હો, મારે અંદરથી ફરી જવું જોઈએ. પોતે Turn લેવાનો છે.

પછી કોઈને વિકલ્ય આવે કે આ જ્ઞાનીની ભર્ત તમાં જોડવાની વાત કરે છે, અને (પોતે) પાછા જ્ઞાની થઈને વાત કરે છે. એટલે વાત થોડી બીજ રીતે ન ફંટાય, એટલે સ્પષ્ટીકરણ કરે છે કે, ‘એક જ્ઞાની ભર્ત ત છચ્છતા નથી...’ છચ્છતા નથી એટલા માટે (લખ્યું છે) કે એને કોઈ જરૂરત છે એ વાતની, એમ નથી. કોઈ પોતાની ભર્ત ત કરે, એવી જરૂરત જ્ઞાનીને નથી. કેમકે એ તો વીતરાગ માર્ગ જઈ રહ્યા છે. એને કોઈની અપેક્ષા હોય નહીં અને અપેક્ષા હોય તે જ્ઞાની હોય નહીં. એટલે એ અપેક્ષા છોડવાનો પુરુષાર્થ તો મુમુક્ષુની ભૂમિકામાં કરે છે, પછી જ્ઞાની થાય છે. કોઈપણ અપેક્ષા એ દુઃખનું કારણ છે. કેમકે અપેક્ષા બીજા પદાર્થ પ્રત્યેની છે, એનું પરિણમન સાવ સ્વતંત્ર છે. સો એ સો ટકા સ્વતંત્ર છે. એની અપેક્ષા રાખવી એ આ જીવની મોટી ભૂલ છે. એ એની રીતે પરિણમશે તું તારામાં રહે, તો તારા ખજાને શું ખોટ છે ?

મુમુક્ષુ :- ભી તમાં આવે છે, ‘તું કિણ બાતે અધૂરા’ ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, ‘પ્રભુ ! તુમ સબ બાતે પૂરા..’ ‘પરકી આશ કહાં કરે પ્રીતમ ! તું કિણ બાતે અધૂરા...’ તું તો કોઈ વાતે અધૂરો નથી. તારામાં બેહદ આનંદ છે. તારામાં સુખ-શાંતિ બેહદ છે અને આ સિવાય તો તને કાંઈ પ્રયોજન નથી. એ તારામાં ભર્યું છે પણ એના બેભાનપણાને લઈને જીવ સુખ-શાંતિ અને આનંદ માટે પરની અપેક્ષા રાખે છે. (પરંતુ) સુખ મળવાને બદલે દુઃખની પ્રાપ્તિ થાય છે. આમ છે.

એટલે એમ કહ્યું કે ‘જોકે જ્ઞાની ભી ત ઇચ્છિતા નથી, પરંતુ મોક્ષાભિવાધીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી...’ જ્ઞાનીની ભી તમાં ઉપદેશ પરિણમવાની યોગ્યતાની પ્રાપ્તિ છે. યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ ક્યાંય નથી. યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ નથી. કેમકે જ્ઞાનની વાતો તો પ્રસિદ્ધ છે. પણ યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ નથી. એટલે જીવે પોતા તરફ જોવું પડે છે કે મારી યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિની છે કે નહીં ? અને (મારી યોગ્યતા હોય) તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે ભલે મોક્ષનો અભિવાધી જીવ હોય તોપણ, જ્ઞાનીની ભી ત કર્યા વિના અને જ્ઞાનીનો ઉપદેશ પરિણમે નહીં. એમ છે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! આપે હું કે પરિભ્રમણની વેદના એ Start થયા પછી જ મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય ?

પૂજ્ય ભાઈશ્રી :- પછી જ મોક્ષના માર્ગની દિશાનું અલ્ય ભાન આવે, હજુ તો એ પહેલા તો અલ્ય ભાન પણ ન આવે, એવાં શબ્દ એમણે વાપર્યા છે. જ્યાં સુધી જીવ પરિભ્રમણની ચિંતના અને વેદનામાં આવે નહીં અને એના ઉપાય માટે જૂરે નહીં, ત્યાં સુધી માર્ગની દિશાનું અલ્ય ભાન પણ થવું સંભવતું નથી, આવા શબ્દો છે. કેમ (એમ છે) ? (કેમકે) અને ખરેખર છૂટવું છે એ વાત ત્યારે જ પાકી થાય છે. ત્યાં સુધી પાકી નથી થતી. આપણે નથી કહેતા ભાઈ ? કે વાતો કોઈ ગમે એટલી કરે પણ ખરો વખત આવે ત્યારે ખબર પડે. ખરો પ્રસંગ ભો થાય ત્યારે ખબર પડે કે ભાઈ યાં ભો છે.

અમારે એક વખત એવો પ્રસંગ બન્યો. (એમ વિચાર કર્યો) કે, આપણે મુંબઈમાં એક મંદિર કરીએ, ચાં ? મુંબઈમાં. મુંબઈમાં જો મંદિર કરવું હોય તો ઓછામાં ઓછા ૬૦, ૭૦ લાખનું બજેટ છે એ. કેટલું ? ૬૦, ૭૦ લાખનું

ઓછામાં ઓછું બજેટ છે. Construction આપણે ૧૫ લાખનું ગણીએ, પણ ત્યાં જમીનના ભાવ એવા છે કે ૫૦ લાખ આસપાસ તો જમીનની અંદર જોઈએ. (એમણે કહ્યું) અરે ! થઈ જાય. એમાં શું ? એ તો થઈ જાય કહે. મને એમ થયું, માણસ બહુ હોશીલા લાગે છે, કાંઈક Source હશે. એમની પોતાની પરિસ્થિતિ નહોતી દેખાતી, પણ કાંઈક Source સારો એવો હશે. (એમણે કહ્યું) એમાં શું ? એ તો થઈ જાય. અને ગુરુદેવનું નામ મોટું, (એટલે) ગુરુદેવની કૃપાથી થઈ જાય, (એમ) કહે. એક ૧૦, ૨૦ હજાર બાકી રહી ગયા, એમના પોતે બોલેલા, એ પૈસા આવવા મુશ્કેલ થયા હતા. આડા-અવળા ખર્ચા કરે પણ એ ૧૦, ૨૦ હજાર આપવાની વાત ન થાય. એમ માણસની ખબર ક્યારે પડે ? કે પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે. કે માણસ બોલે છે શું ? એ ભાવ બતાવે છે શું ? અને ખરે વખતે એ શું કરી શકે છે ? એ વગર ખબર ન પડે.

એમ અહોંયા પરિભ્રમણથી ધૂટવું છે, પરિભ્રમણથી ધૂટવું છે, જનમ-મરણ જોઈતા નથી, બધી વાત સાચી. અને માટે (તારે) જે જગ્યાએ આવવું જોઈએ, એ જગ્યાએ ન આવે ત્યાં સુધી એ વાત સ્વીકારી શકાય એવી નથી. એટલા માટે એ પત્ર (પત્રાંક - ૧૮૫) એમણે લખ્યો છે કે માર્ગની દિશાનું અલ્ય પણ ભાન ન થાય. કેમકે (એ) અંતર સૂર્જનો વિષય છે. (ત્યાં સુધી) સૂર્જ જ ન આવે કે મારા ક્યા પરિણામ અહિતકારક છે ? મારા ક્યા પરિણામ હિતકારક છે ? એની જે સૂર્જ આવવી જોઈએ, એ મતિજ્ઞાનની નિર્મળતા જે છે, એ નિર્મળતા આ વેદના અને ઝૂરણા વિના આવતી નથી.

બીજી રીતે વિચારીએ તો, પરિણમનની અંદર અભિપ્રાયનો Role બહુ મોટો છે. આ જીવનો સંસારની ઉપાદેયતાનો અને ઉપાસનાનો અભિપ્રાય અનાદિનો ગાઢ - અવગાઢ થયેલો છે. તેથી એ અભિપ્રાય બદલ્યા વિના જીવે જે જે ધર્મ-સાધન કર્યા, એમાં સંસાર ફળ્યો. કૃંયાં મોક્ષ ન આવ્યો. એ અભિપ્રાય પહેલો વહેલો બદલાય છે. - આ વેદનાના કાળમાં. આંતરીમાથી એને એ વાત ઠ છે કે હવે કોઈ ભોગે સંસાર ન જોઈએ, ત્યારે જ એ અભિપ્રાય બદલાય છે કે હવે મારે મોક્ષને જ ઉપાસવો છે. એ જ મારી ઉપાદેયતા છે. એક મોક્ષને માટે જ પ્રયત્ન કરવો. (કૃપાળુદેવે) ૨૫૪ (પત્ર) માં શું લીધું ? મોહાસું તથી મુંજાઈને એક મોક્ષને માટે જ પુરુષાર્થ અને પ્રયત્ન - પ્રયાસ

કરનારો હોય તે મુમુક્ષુ છે. એટલે એવા મોક્ષાભિલાષીનું અમણે સ્વરૂપ લીધું છે. એ સ્વરૂપ (માં) જ્યાં સુધી પોતે ન આવે, ત્યાં સુધી ખરેખર એને સંસાર મૂકવો છે અને મોક્ષ જોઈએ છે, એ વાત પાકી થતી નથી.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! પરિભ્રમણ કોનું થાય છે ?

પૂજ્ય ભાઈશ્રી :- જીવનું.

મુમુક્ષુ :- તો હજી જીવે તો જીવને જાણ્યો નથી ત્યાં એને એની વેદના કેવી રીતે થાય ?

પૂજ્ય ભાઈશ્રી :- જીવે જીવને જાણ્યો નથી પણ દુઃખ તો ભોગવે છે ને ? દુઃખ તો ભોગવે છે કે નહીં ? દુઃખનો અનુભવ છે કે નહીં ? તો અહીંથાં પરિભ્રમણથી મું ત થવું એટલે દુઃખથી મું ત થવું. પરિભ્રમણના દુઃખોથી મું ત થવું છે. પરિભ્રમણના દુઃખો પ્રત્યક્ષ છે. પોતાને પણ રોગ થાય છે. પોતાને પણ મૃત્યુ આવવાનું છે. બીજા તિર્યંગ જીવો તો નજર સામે દેખાય છે. નરકગતિ નથી દેખાતી પણ તિર્યંગગતિ તો સારી રીતે દેખાય છે. એકેન્દ્રિય જીવો, બે-એન્દ્રિય જીવો કેવી રીતે સબડે છે ! અમે હમણાં એક ફૂતરું જોયું, ગલુંદિયું હશે મહિના-બે મહિનાનું. આમ ઉહુંકારો કરીને પડવું હતું. જ્યાં આમ નીચે જોયું, તો પીઠ ઉપર આવવું મોટું કાણું પડવું હતું ને અંદર છયળો ખદબદ્ધતી હતી ! સરો થયેલો. એને તો કાંઈ ડૉક્ટરની દવા (કરવાની) કોઈ પરિસ્થિતિ નથી. આપણને તો થોડુંક થાય તો આપણે એનો ઈલાજ કરીએ છીએ. એ કોની પાસે જાય ? આવવું મોટું કાણું પડી ગયું હતું ! અંદર મોટી મોટી, આવડી આવડી છયળો ખદબદ્ધતી હતી ! છયળો ખાય એને, અંદરની માટીને ખાય. હવે આ બધાં દુઃખો નજર સામે તો જોવા મળે છે. છતાં (વધારે) જોવા હોય તો એકાદી Hospital માં ચક્કર મારી આવવું. મનુષ્યગતિના દુઃખો જોવા હોય તો Hospital માં એક ચક્કર મારો તો ખબર પડે કે લોકો કેવા કેવા રોગથી પીડાય છે. તિર્યંગો કેવી રીતે પીડાય છે. એક ફૂતરો છે, ભૂખ લાગે છે, ૫-૨૫ ઘરે ફરે તો એને પેટ પૂરતું ખાવા મળતું નથી. કોઈ વ્યવસ્થા નથી એની પાસે કે સાંજે શું ખાઈશ ? સવારે શું ખાઈશ ? ચારે શું ખાઈશ ? આ પરિસ્થિતિ કેમ થઈ ? એ પણ જીવ છે. હું પણ જીવ છું. એની એ સ્થિત શું કરવા થઈ ? કારણ વગર કોઈ કાર્ય નથી અને નજર સામે વસ્તુસ્થિતિ છે અને જો જીવને દુઃખથી છૂટવું છે એનો અર્થ જ એમકે પરિભ્રમણથી છૂટવું

૭.

એટલે એમાં જીવનું સ્વરૂપ પહેલાં જણાય તો પરિભ્રમણની વેદના આવે ઓવું નથી. પરિભ્રમણની વેદના આવે તો જીવનું જે નિર્મળ સ્વરૂપ છે, એ જ્ઞાન નિર્મળ થઈને જાણો. કારણકે જીવનું મૂળ સ્વરૂપ નિર્મળ છે - મહિન નથી અને એ નિર્મળ સ્વરૂપ નિર્મળ નિર્મળતા અપેક્ષિત છે. એ મતિશુત્રજ્ઞાનની (વર્તમાનમાં) નિર્મળતા નથી અનાદિનું મેલું છે. એ મેલપ કાઢવા માટે ચા પ્રકારનો Chemical જોઈએ ? કેવો Detergent જોઈએ ? એ વાત ફૂપાળુંદેવે પોતાના અનુભવથી કહી છે. કે તું સૌથી પહેલાં આ જગ્યાએ આવ. આ તને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તારો અભિપ્રાય નહીં બદલાય. તારો જ્ઞાનની નિર્મળતા નહીં આવે. તને સૂજ નહીં આવે, કે શું કરવું અને શું ન કરવું ? (આ વેદના આવે) ત્યાર પછી શું કરવું તે સમજાય છે, એમ લીધું છે.

એટલે બહુ વ્યવસ્થિત વાત કરી છે. આખી યોજના અનુભવ-સિદ્ધ (અને) બહુ વ્યવસ્થિત છે. એ તો તમે હજારો શાસ્ત્રો વાંચો, તોપણ આ યોજના ન સમજાય એવી યોજના એમણે ખુલ્લી કરીને મૂકી છે. એ એમનો બહુ મોટો ઉપકાર છે. જ્ઞાનીઓ ઘણાં થયા છે. ઘણી વાતો કરી ગયા છે પણ મુમુક્ષુની ભૂમિકામાંથી અનંતકાળથી જીવ બહાર નથી નીકળ્યો. અનંતકાળ એમાં કાઢ્યો છે. જ્ઞાનદશામાં અનંતકાળ નથી જવાનો. આત્મજ્ઞાન થયું પછી તો અસંખ્ય સમયમાં મુજબ ત છે. ભલે દેવલોકમાં જાઓ તોપણ તે અસંખ્ય સમય છે, અનંતકાળ નથી. જે અનંતકાળ જાય છે એ, એ પહેલાં જાય છે, જ્ઞાનપ્રાપ્તિ પહેલાં જાય છે અને એમાં જીવ બહુ ગોથા ખાય છે. મોક્ષમાર્ગ તો ચૌદ ગુણસ્થાન(પર્યત) વ્યવસ્થિત છે, ખુલ્લો છે. પહેલાં ચોથું ગુણસ્થાન આવે પછી પાંચમું આવે, પછી છહું-સાતમું આવે. આવી રીતે મોક્ષમાર્ગનું આરોહણ તો થઈ શકે છે. એ વાત બહુ વ્યવસ્થિત (રીતે) શાસ્ત્રમાં છે. મુમુક્ષુની ભૂમિકામાં મોક્ષમાર્ગ સુધી પહોંચવાની વ્યવસ્થા બનાવવી, કહેવી એ તો ઘણાં અંતરશોધનનો વિષય છે. ઘણાં અનુભવનો વિષય છે અને એ એમણે બહુ અનુભવથી - ઘણાં ભવનાં અનુભવ પછી એ વાતને નિચોડ કાઢીને મૂકી છે. એમને એમ નથી (કહી). પોતાને જાતિસ્મરણ હતું અને ઘણાં ભવનાં અનુભવથી એ વાતને એમણે મૂકી છે અને એ પણ અહીં Outline છે. Underline માં

તો એક એક Stage ની અંદર જીવ કર્યાં ચાં ભૂલ કરે, એ તો પ્રત્યક્ષ જ્ઞાની વગર માર્ગદર્શન મળે અનું નથી. એ વેદનામાં હું કેમ નથી આવતો ? બધાંનાં જુદાં જુદાં કારણો, બધાંનો ભૂતકાળ જુદો, બધાંનો ઈતિહાસ જુદો, બધાંની વર્તમાન યોગ્યતા જુદી. એને કેવી રીતે, કર્યાં સુધી લઈ આવવો, પહેલા એકડો કઈ રીતે ઘૂંટાવવો ? એ પણ એને સત્તસંગ વગર, પ્રત્યક્ષ જ્ઞાની વગર સમજાય અનું નથી. આ પરિસ્થિતિ છે અને ત્યાર પછી પણ એક-એક ભૂમિકાની અંદર જીવ કર્યાં ગોથું ખાય એ કહેવું મુશ્કેલ છે. એમાં પણ એને પ્રત્યક્ષ યોગ બહુ જરૂરી પડે છે.

જેમ ગંભીર દર્દમાં Under strict medical supervision treatment લેવી પડે એવો આ વિષય છે. એ તો એક શરીર રોગથી મું ત થવું છે. આ તો અનંતકાળના ભવરોગથી મું ત થવું છે. એટલો મોટો ગંભીર રોગ છે. Chronic થયેલો (રોગ છે). એટલે એમણે બહુ વજન આપ્યું છે. પ્રત્યક્ષ જ્ઞાની ઉપર જે વજન આપ્યું છે એની પાછળ પણ એમનો અનુભવ છે. પોતે પણ (મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે ભૂતકાળમાં) તનતોડ મહેનત કરી ચૂકેલા છે અને Fail ગયેલા છે, પછી કોઈ જ્ઞાનીપુરુષ મળ્યા છે અને પોતે સહજ માત્રમાં મોક્ષમાર્ગમાં પ્રવેશ કરી શક્યા છે. એ વાતનો એમણે ૧૯૪ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેથી અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. જુઓ ! ૧૯૪ (પત્ર) વ્યો. પાછળ જ છે નજીકમાં. ૨૫૮ પાને.

‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના...’ હવે અચળ પ્રેમની વ્યાખ્યા શું છે, ખબર છે ? બધાં કામ એકકોર મૂકીને જે ભાવ થાય, એનું નામ પ્રેમ છે. બધાં કામ એકકોર મૂકીને. ‘અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના...’ એ સમ્યક્પ્રતીતિ આવતાં ભર્ત ત થાય છે. એટલે પરમેશ્વરબુદ્ધિએ, ઉપકારબુદ્ધિએ એને પૂજ્યબુદ્ધિ આવ્યા વિના ‘સત્ત્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણો સેવ્યાં છે તેની દર્શાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી...’ એમને પણ કોઈ જ્ઞાનીપુરુષ મળ્યા છે અને જ્ઞાનપ્રાપ્તિ ભૂતકાળમાં થઈ છે. એ પહેલાં એમણે પણ જ્યાં ત્યાં બહુ માથા માર્યા છે. થોડી મહેનત નથી કરી. (એટલે) ધણાં ભવનાં અનુભવથી એમણે આ વાત મૂકી છે. ‘જ્ઞાનપ્રાપ્તિ એથી અમને

થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે' (અનાગતકાળે એટલે) ભવિષ્યમાં પણ. અને 'સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવાં જતાં એ જ છે. અને જે કોઈપણ પ્રાણી છૂટવા છચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.' આ માર્ગ આરાધ્યો નથી તો શું કર્યું છે? કે જીવે સ્વચ્છંદરૂપી અંધત્વને સેવું છે. (આ સ્વચ્છંદને સેવે છે) ત્યાં સુધી એ માર્ગનું એને દર્શન થતું નથી. જ્યાં સુધી મારી મેળે કરવું છે. મારી ઇચ્છા પ્રમાણે ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તનું છે ત્યાં સુધી સ્વચ્છંદરૂપી અંધત્વ છે અને એ અંધત્વ એને માર્ગને જોવા દેશે નહીં એને (માર્ગ) નહીં દેખાય. માટે 'અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે.' અવળે માર્ગ ચાલ્યો છે એટલે વેપાર-ધંધા કર્યા છે એમ નહીં. 'જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે...;' અને અવળે માર્ગ ચાલ્યો છે. એમ કહે છે. 'તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે એમે પ્રથમ જ જણાવું છે.

'સૂયગંગસૂત્રમાં ઘભદેવજી ભગવાને જ્યાં અહ્વાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગ ચાલવાં છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે.' એટલે એમણે શું કીધું? કે આ કાળની ચોવીસીના પહેલાં તીર્થકરે પણ આ જ માર્ગ બતાવ્યો હતો, આ જ રસ્તો ચીંધ્યો હતો. એમ કહે છે.

'હે આયુષ્યમનો! આ જીવે સર્વ કર્યું છે.' શું એક નથી કર્યું? 'એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચ્ચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.' મુનિઓનું સામાયિક (એટલે) અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં આ સામાયિક છે. ઓલુસામાયિક લઈને બેસે, એ સામાયિક નથી (એમ) કહે છે. આ સામાયિક છે અને હવે છેલ્લાં કેવળીની વાત (કરે છે). પહેલાં કેવળી ઘભદેવ ભગવાન થયા. એ પહેલાં કોઈ કેવળી નથી થયા. એણે આ ઉપદેશ કર્યો. છેલ્લાં કેવળી કોડા થયાં?

મહાવીરસ્વામી પછી જે છેલ્લા કેવળી થયા એ ‘સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણો દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણો આમ અમને કહ્યું છે :- ‘ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.’

‘એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે...’ એટલે પહેલાં ને છેલ્લાં કેવળીના વચ્ચેના બધા કેવળી લઈ લેવા, ‘અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.’ લક્ષ એટલે Intention - એ જ હરાદો છે. હવે શાસ્ત્રના આશયને અને હરાદાને ન સમજે (તો) એ શાસ્ત્રને શું વાંચ્યાં ! શાસ્ત્ર વાંચ્યા અને એના આશય અને હરાદા ન સમજ્યાં. ત્યારે કૃપાળુદેવ તો એવા સમર્થ પુરુષ હતા કે શાસ્ત્ર વાંચે એટલે એનો આશય પહેલાં તારવી લે. અમણે જે જે શાસ્ત્રો વાંચ્યા (છે) એ સેંકડો શાસ્ત્રોનો આશય એમણે તારવીને વાત લખી છે કે સર્વ શાસ્ત્રનો આશય તો આ જ છે. લક્ષ તો આ છે. લોકો બીજી રીતે સમજે છે.

‘આણાએ ધર્મો આણાએ તવો।’ એ પછી પોતે આચારંગસૂત્રનું સૂત્ર મૂં હું ‘સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે.’ (લક્ષ છે) એટલે આશય છે. ‘એ લક્ષ જીવને સમજયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે...’ પોતાની મેળે પોતાની મનમાની રીતે ચાલતું એ એક જ અને નડે છે. ‘અને જેણો સ્વચ્છંદને મંદ કર્યો છે, એવાં પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગ જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશો.’ (ઉપશમ) એટલે ઉપશમ સમ્યક્દર્શન થશે. ‘ઉપશમ મળે અને જેની આજાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો.’ આ Total પાછો ત્યાં લાવીને મૂકી દીધો.

‘બાકી બીજા બધાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશો નહીં. વિકલ્પથી લાગે તો જણાવશો કે કંઈ યોગ્ય હોય તે જણાવાય.’

મુમુક્ષુ :- ઉપશમ ગમે ત્યાંથી મળશે એટલે શું ?

પૂજ્ય ભાઈશ્રી :- એટલે ઉપશમ સમ્યક્દર્શન. મિથ્યાત્વનો ઉપશમ ગમે

ત્યાંથી થશે. જો આ રીતે તમે કરશો તો જરૂર તમને ઉપશમ મળશે. એટલે મિથ્યાત્વનો ઉપશમ થઈને (સમ્યકુદૂર્ધન થશે). કેમકે અનાદિ મિથ્યાદૃષ્ટિને સર્વથી પહેલાં ઉપશમ સમ્યકુદૂર્ધન થાય છે; પછી ક્ષયોપશમ કે ક્ષાયિકમાં આવે. સોથી પહેલાં ઉપશમ સમ્યકુદૂર્ધન થાય. એનું કારણ એ છે કે મિથ્યાત્વની જે પ્રકૃતિ છે અને જીવનો જે મિથ્યાત્વભાવ છે એ એટલો બધો બળવાન છે, એટલો બધો બળવાન છે કે એની જે બળવતરતા છે, એ પહેલાં દબાય છે. કોઈ જીવ પહેલા નાશ નથી કરી શકતો. કોઈ જીવ એનો નાશ ન કરી શકે. (પહેલાં) એ દબાય. (એ) દબાય ચારે? (કે) જોર નબળું પડે ત્યારે. નબળો હોય એ દબાય. સબળો દબાય નહીં. આ તો એટલો બધો સબળો છે કે પહેલાં એને નબળો કરવો પડે છે અને એને નબળો કરવાની યોજના - તે કૃપાળુદેવની મુમુક્ષુતાની ભૂમિકાનો આખો વિષય છે. (મિથ્યાત્વને) મોળું કરીને, પહેલાં મિથ્યાત્વને માંદો પાડે. નબળો કરી નાખે પછી ઉપશમમાં આવે અને એના મુખ્ય ઉપાયમાં એમણે આ સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ લીધો છે. આખો જે (મુમુક્ષુતા) આરોહણ કરું છે, એમાં સર્વથી વધારે એમણે સત્પુરુષના યોગ ઉપર વજન દીધું છે. રૂપૈઘમાં પત્રમાં - સ્વચ્છંદ પ્રાય: દબાયા પછી મોક્ષમાર્ગને પહોંચવામાં, દોષરૂપી આડા આવતાં જે ત્રણ કારણો રહે છે, એમાં એમણે મુખ્ય કારણ લીધું છે - 'સત્પુરુષનાં પ્રેમ-વિનયની ઓછિપ.' એટલે સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ આવે છે ત્યારે પરમ વિનય આવે છે. એમાં ખામી - ઓછિપ હોય છે ત્યાં સુધી પદાર્થ-નિર્ણય (ન થાય). (અને એ પહેલાં) જે બીજું કારણ છે - જગતના સુખની અલ્ય પણ સુખેચ્છા એ મટટું નથી અને એ આવ્યાથી (પ્રથમ જે કથાં તે) બંને મટે છે. એ ત્રણમાં પણ (સત્પુરુષના વિનયની) વાત લીધી છે. એવો પત્ર છે.

એટલે (કૃપાળુદેવે) બહુ વ્યવસ્થિત અનુભવસિદ્ધ વાતો કરી છે અને એ રીતે એમણે એ વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે. એટલે કોઈ એવી રીતે ખોટો સંતોષ પકડે કે પરોક્ષને આપણે પ્રત્યક્ષ માનીને ચાલીએ, તો એથી કાંઈ કામ (થાય નહીં). પોતાની ભૂલ થાય તો કોણ બતાવે એને? ભૂલને કોણ બતાવે? એટલે એના ઉપર એક વિચાર ચાલેલો, કે કૃપાળુદેવને કે કોઈપણ જ્ઞાનીને, પ્રત્યક્ષ માનવા હોય તો એમના ઉપદેશને પ્રત્યક્ષ કરવો. એમના વચ્ચનો વાંચીએ, (ત્યારે એ રીતે વાંચવા કે) 'મને આ કહી રહ્યા છે, મારી સામે બેસીને મને'

કહી રહ્યા છે. આ મારા માટે લખ્યું છે, હજારો માણસોએ ભલે વાંચ્યું હોય, લાખો માણસોએ ભલે વાંચ્યું હોય (પરંતુ) મારા માટે જ (આ) લખાણું છે.' એમ અંદરમાં એ વાત ચોટી જાય. તો એણે એ ઉપદેશને પ્રત્યક્ષવત્ત કરીને અંગીકાર કર્યો (એમ કહેવાય). પણ એ પુરુષ પ્રત્યક્ષ નથી તો એનાં વિયોગની વેદના તને આવવી જોઈએ. તારા સ્વજનના વિયોગની વેદના આવે છે કે નથી આવતી ? જ્યારે સ્વજનનો વિયોગ થાય (છે) તો વેદના આવે છે કે નહીં ? અરે ! એક છોકરીને ગામમાં ને ગામમાં વળાવે તો (પણ) રોવા માંડે છે ! કાલ સવારે દીકરી-જમાઈને જમવા બોલાવશે. પણ તોય એને વળાવતી વખતે માણસ એકદમ રડી પડે છે. (તો પછી) પરોક્ષને પ્રત્યક્ષ કરીને સંતોષ માનવાનો સવાલ ચાં છે ? (પણ) એની વેદના આવવી જોઈએ. જો એની વેદના આવે, તો અત્યારે તને (કદાચિત્ત) સત્પુરુષ નહીં મળે, તો મરીને તું એનાં ચરણમાં સીધો પહોંચીશ, ત્યાં જ તારી ઉત્પત્તિ થશે. જો તને વિયોગ સાલ્યો હશે તો (એમના ચરણમાં જઈ શકીશ) પણ વિયોગ નહીં સાલતો હોય તો શું કામનું ? તો તને સંતોષ છે. કાંઈ વાંધો નથી. ભલે એ જતાં રહ્યા, મારે શું વાંધો છે ? એનો ઉપદેશ તો છે જ ને. એમ ન હોય. પ્રત્યક્ષ (નથી તો તેનો) વિયોગ (સાલવો) જોઈએ, એની વેદના આવવી જોઈએ અને ઉપદેશને પ્રત્યક્ષ કરીને ગ્રહણ કરવો જોઈએ, અંગીકાર કરવો જોઈએ. એવો પ્રકાર હોય તો તે યથાર્થ છે. નહીંતર તો ખોટો સંતોષ માનવા જેવું થઈ જાય. અહીં સુધી રાખીએ.



પ્રવચન - ૭  
**‘શ્રીમદ્ રાજયંત્ર’ પત્રાંક-૨૦૦**

તા. ૨૪/૦૮/૧૯૮૮ - ભાવનગર

---

---

(શ્રીમદ્ રાજયંત્ર વચનામૃત પત્રાંક - ૨૦૦ ચાલે છે.) આઠમું વચનામૃત ચાલે છે. ‘આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.’ અર્થાત્ કોઈપણ શાસ્ત્ર આ વાતથી વિરુદ્ધ વાત નહીં કરે. બધાં શાસ્ત્રોએ એવું માન્ય કર્યું છે કે, (માર્ગ) તો આવો જ હોવો જોઈએ. તો જ મુમુક્ષુને - મોક્ષાભિલાખીને કોઈક અંશે ફાયદો થઈ શકે છે.

આગળ કહે છે, ‘ ષભદેવજીએ અદ્ધારું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યા હતો.’ આ વાત કેમ લખી ? કારણકે એક કોડા-કોડી સાગર પહેલાં ભરતક્ષેત્રમાં જૈનધર્મનો પ્રારંભ થયો. તે વખતે ભગવાને વાત અહીંથી જ શરૂ કરેલી. આ વાત કોઈ નવી પાછળથી થયેલી છે, એમ નથી. આમ જોઈએ તો અનંતકાળથી એ જ વાત ચાલી આવે છે. પરંતુ અનંતકાળનો ઇતિહાસ મળતો નથી. ચોવીસ તીર્થકરનો ઇતિહાસ મળે છે. જેમાં પ્રથમ તીર્થકર શ્રી ષભદેવજી છે. ષભદેવ ભગવાન એક કોડા-કોડી સાગર પહેલાં ચતુર્થ કાળના પ્રારંભમાં થઈ ગયા. ચોથો આરો એક કોડા-કોડી સાગરનો હોય છે. એની પહેલાં આ ક્ષેત્રમાં જૈન ધર્મ નહોતો. યુગલીયાનું ક્ષેત્ર હતું. ધર્મ જ નહોતો. કર્મભૂમિ ન હતી (અને) ધર્મભૂમિ પણ નહોતી. આ ભરતક્ષેત્ર માત્ર ભોગભૂમિ હતી. (આ ચોવીસી) પહેલાં અનંત ચોવીસી થઈ ચૂકી છે. પરંતુ જ્યારે આ ચોવીસીમાં ધર્મ શરૂ થયો ત્યારે ષભદેવ ભગવાને પણ આ જ વાત કરી હતી કે, જો જ્ઞાનપ્રાપ્તિ કરવી હોય તો તે જ્ઞાની દ્વારા થશે અને તે માટે એકનિષ્ઠા, તન-મન-ધનકી આસં તનો ત્યાગ અને જ્ઞાની પ્રત્યે અત્યંત ભં ત ઉત્પત્ત થયાં વિના કોઈને જ્ઞાનપ્રાપ્તિ થઈ નથી. અને થતી પણ નથી. તેથી ભગવાને પણ અહીંથી જ વાત શરૂ કરેલી.

(હવે ૧૦ મું વચન છે.) ‘પરીક્ષિત રાજાને શુક્રદેવજીએ એ જ ઉપદેશ

કર્યો છે.’ આ પાછલાં સમયની વાત છે. પરીક્ષિત રાજા અને શુકદેવજીનો જે જમાનો હતો તે સમયે પણ આ જ ઉપદેશ ચાલ્યો હતો. એટલેકે ઉપદેશ પદ્ધતિમાં પણ કોઈ ફેરફાર નથી થયો. કારણકે માર્ગમાં (મોક્ષમાર્ગમાં) ફેરફાર હોતો નથી. ત્રણેય કાળ (મોક્ષનો માર્ગ) એક જ હોય છે.

મુમુક્ષુ :- મનની આસં તનો ત્યાગ એટલે શું ?

પૂજ્ય ભાઈશ્રી :- (મનની આસં તનો ત્યાગ એટલે) મનમાં જે છચ્છાઓ થાય છે તે આસં તને કારણે થાય છે, આસં ત સુખબુદ્ધિને કારણે થાય છે અને મન છચ્છાઓ કરતું રહે છે. એક તો મન અને કહેવાય છે. બીજું મન અને પણ કહેવાય છે કે, જે જ્ઞાનનો ક્ષયોપશમભાવ છે તેની સાથે કામ કરે છે. કોઈમાં વિચારશી ત વધારે હોય છે. કોઈ મનમાં વધું સમજે છે, તો કોઈ ઓછું સમજે છે. (કોઈને) તેનો અહંકાર હોય છે કે, હું સમજું છું, હું જાણું છું, હું વધું જાણું છું. (અહીં કહે છે કે,) તેનો પણ ત્યાગ કરવો. આસં ત એટલે ખેંચાણ. શરીર પ્રત્યે, મન પ્રત્યે, ધન પ્રત્યે જે કાંઈ પરિણામોનું ખેંચાણ રહે છે, તે (પરિણામ) આત્મા પ્રત્યે જતાં નથી. આ જ્ઞાનપ્રાપ્તિ કરવાનું પ્રકરણ ચાલે છે. તો જેને જ્ઞાનપ્રાપ્તિ કરવી છે તેણે જ્ઞાનભંડાર એવો જે આત્મા છે તે પ્રત્યે જૂકવું પડશે. જો અહીં (આત્મા) તરફ નથી જૂકતો, તો ત્યાં (પરપદાર્થ પ્રત્યે) જૂકે છે. ત્યાં સુધી કામ નથી થતું.

(આગળ કહે છે). ‘અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.’ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એટલે શું ? કે જ્ઞાની જે રસ્તે ચાલે છે તે જ રસ્તો બતાવશે. તો તે જ રસ્તે ચાલવાનું છે. જ્ઞાની અંતર્મુહૂર્ત થાય છે. કેવી રીતે થાય છે ? અંતર્મુહૂર્ત થાય છે તો કેવી રીતે અંતર્મુહૂર્ત થવાય ? એ કોઈ કથનનો વિષય નથી. એ કોઈ વચનનો વિષય નથી. વચનના વિષયની હદ (મર્યાદા) ત્યાં પૂરી થાય છે કે, ‘અંતર્મુહૂર્ત થઈ જાવ !’ પરંતુ અંતર્મુહૂર્ત થવું કેવી રીતે ? એ એક બહુ જ મોટી સમસ્યા રહી છે અને તે અધ્યાત્મના વિષયમાં Top secret છે. એક બહુ જ રહસ્યમય ઘટના છે કે જે જોવાથી જ માલૂમ પડે છે. કારણકે તેને (દર્શાવવા માટે) વચન છે જ નહીં. એવો વચનાતીત વિષય છે, મનાતીત વિષય છે. અને આ (અંતર્મુહૂર્તના) જ્ઞાનીના પરિણામનમાં પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. કોને

દેખાય છે ? કે જેને તે પ્રકારની - તથારૂપ યોગ્યતા હોય છે, તેને દેખાય છે. બધાંને દેખાતી નથી. તે માટે યોગ્યતા પણ જોઈએ.

મુમુક્ષુ :- તથારૂપ યોગ્યતા કેવી હોય છે ?

પૂજ્ય ભાઈશ્રી :- ૬૭૪ પત્રનો વિષય તો આપણે અહીંયા ઘણો ચાલ્યો છે. દૃઢ મુમુક્ષુતા હોય, એટલે કે જીવનમાં શીંગ પૂર્ણ થવાનું (એટલે) પૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોય, અને પ્રાપ્ત ઉપદેશનું અમલીકરણ (તુરત જ થવા લાગે), તે જ વખતે (ઉપદેશનો અમલ કરે). ચારે ? ‘સાંભળતાં જ ચોંટ લાગે અને પ્રયાસ ચાલુ થઈ જાય.’ પૂજ્ય સોગાનીજા કથન (અનુસાર). એવી (ઉપદેશને) અવધારણ કરવાની યોગ્યતા હોય, પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની યોગ્યતા હોય, અંગીકાર કરવાની યોગ્યતા હોય, અમલીકરણ કરવાની યોગ્યતા હોય, તે ઉપરાંત જ્યારે અંતરાત્મવૃત્તિ જાગૃત થાય, ત્યારે જ અંતર્મુખ થવાના વિષયમાં જોવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે - યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. તે પહેલાં કોઈને થતી નથી. અટલી હણની યોગ્યતા હોવાથી તે જ્ઞાનીની અંતર્મુખ પરિણતિને જોવે છે, ત્યારે તેને પ્રથમ સમકિત થાય છે. જ્ઞાનીની ઓળખાણરૂપ (પ્રથમ સમકિત થાય છે). પછી સ્વરૂપની ઓળખાણમાં અનુભવાંશે પ્રતીતિ આવે છે ત્યારે બીજું સમકિત થાય છે. અને પછી નિર્વિકલ્પ સમ્યક્દર્શન થતાં જ વાસ્તવિક સમ્યક્દર્શન - પરમાર્થ સમ્યક્દર્શન જેને કહે છે, તે ગ્રીજું સમકિત (થાય છે). ત્યારે જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ આત્માનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે જ અંતરમાં રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર છે, તે જ ભગવાનના દર્શન છે. બાકી કોઈ ભગવાનના દર્શન છે જ નહીં.

(અહીંયા કહે છે) ‘અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે...’ સ્વચ્છંદ્ધી એટલે પોતાની મનમાની - પોતાની ઇચ્છાનુસાર કલ્પનાથી - વિચારથી ગ્રંથ વાંચીને કે પ્રવચન સાંભળીને પોતાની કલ્પનાએ અનંતકાળ સુધી પરિશ્રમ ભલે ને કરે ! (તો પણ) તેને જ્ઞાનપ્રાપ્તિ થતી નથી. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો જે આરાધક હોય છે, (તે વાત ઉપર) સૌથી વધારે વજન આપ્યું છે કે, મારે એકાંતે આજ્ઞામાં રહેવું છે, બીજી કોઈ વાત મારે ન જોઈએ. હું કાંઈ ન જાણું, હું કાંઈ સમજતો નથી. ચા વિષયમાં (કાંઈ નથી જાણતો) ? તો કહે, અંતર્મુખ થવાના વિષયમાં. બીજી જે જાણકારી છે તે જાણકારીનું કોઈ મૂલ્ય નથી. (જીવ) અંતર્મુખ થવાની (વિધિને) જાણો નહીં અને બીજી-

બીજુ જાણકારીનું અભિમાન કરે કે, હું જાણું છું, હું પણ સમજું છું, વાત આમ છે અને તેમ છે. એ રીતે અનંતકાળ સુધી પતો લાગવાનો નથી. અમે શરૂ-શરૂમાં જાણકારીના વિષયમાં કહેતા હતાં કે, જાણકારીવાળો શું કહે છે? કે મને ખબર છે, એ વાતની પણ ખબર છે. (કોઈ બીજુ વાત કરે) તો કહેશે એ વાતની પણ ખબર છે. એ રીતે બહુ જ બધી ખબર છે. ‘બहુત પતા હૈ ઉસીમે લાપતા હૈ’ શું છે. પોતે જ લાપતા છે. પતા હૈ, પતા હૈ અમાં પોતે જ લાપતા હોય છે. એવી વાત બને છે.

અહીંયા કહે છે કે, જ્ઞાનીની આજ્ઞામાં રહેવાવાળો અંતર્મુદ્દૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સમ્યક્દર્શન ન લીધું (કેવળજ્ઞાન લીધું છે). સમવસરણમાં એવાં જીવો પણ હોય છે (કે જેણે) મુનિદીક્ષા પહેલાં જ લઈ લીધી હોય અર્થાતું મિથ્યાત્વ અવસ્થામાં દ્રવ્યલિંગી થઈ જાય. શુદ્ધ દ્રવ્યલિંગી (હોય છે). શુદ્ધ એટલે શું? (બાબુ આચારમાં) કોઈ ભૂલ ન હોય. સમજણ અને કિયામાં કોઈ ભૂલ ન હોય. જિનો ત વ્યવહારનું શુદ્ધ પ્રતિપાલન હોય. કેવું પ્રતિપાલન હોય? શુદ્ધ પ્રતિપાલન હોય. એટલું તો પહેલાં જ થઈ ગયું હોય પરંતુ આજ્ઞામાં ન આવ્યા હોય. અને આજ્ઞામાં આવતાં જ સમ્યક્દર્શન, મુનિદશા અને કેવળજ્ઞાન બધું અંતર્મુદ્દૂર્તમાં (પ્રાપ્ત કરી લે છે). શું? સમ્યક્દર્શન, મુનિદશા અને કેવળજ્ઞાન બધું એક કલાકરમાં (પ્રાપ્ત) કરી શકે છે.

(હવે બારમું વચ્ચેન છે). ‘શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે...’ શાસ્ત્રમાં ઘડ્યો ઉપદેશ આવ્યો છે, તે બધો પરોક્ષ છે, લખનાર પ્રત્યક્ષ નથી. માટે સર્વ આજ્ઞાઓ પરોક્ષ છે. ‘અને તે જીવને અધિકારી થવા માટે કહી છે;...’ (અર્થાતું) પાત્રતામાં આવવા માટે તે (આજ્ઞાઓ) કામમાં આવે છે. પાત્રતા આવતાં, જો પાત્ર જીવને જ્ઞાની મળે છે તો જ્ઞાનપ્રાપ્તિ થઈ જાય છે. પાત્રતા વિના જ્ઞાની મળે તો પણ જ્ઞાનપ્રાપ્તિ થતી નથી. (તેથી) શાસ્ત્રમાં જે ઉપદેશ આવ્યો છે તે અધિકારી થવા માટે કહ્યો છે. તેનાથી પાત્રતા આવી શકે છે. (પરંતુ) મોક્ષમાર્ગમાં નથી આવી શકતો, પાત્રતા અવશ્ય આવી શકે છે.

‘મોક્ષ થવા માટે...’ અથવા જ્ઞાનપ્રાપ્તિ માટે ‘જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.’ તેમાં તો પ્રત્યક્ષ (જ્ઞાની) જ જોઈએ. તેમાં કારણ શું છે? કે ચારેય કોઈને જ્ઞાનીની ઓળખાજી થયા પહેલાં આત્માની ઓળખાજી થઈ નથી. અને ચારેય કોઈને આત્માની ઓળખાજી થયા પહેલાં આત્માનુભૂતિ

થઈ નથી, સમ્યકુર્દર્શન થયું નથી. આ તેનો કમ છે. જ્ઞાનીની ઓળખાણ પ્રત્યક્ષ જ્ઞાની વિના થતી નથી. કેમ એમ? કારણકે આ એક વ્યા તગત ઓળખાણ છે. તે વ્યા તની જ અનુપસ્થિતિમાં કેવી રીતે થઈ શકે? એ માટે તો પરિચય કરવો પડે. ઓળખાણની તો એક જ પ્રક્રિયા છે કે પરિચય થયાં વિના કોઈની ઓળખાણ થતી નથી. વગર પરિચય કોઈને કોઈની ઓળખાણ થઈ હોય, એવું બનતું નથી. જે જ્ઞાની મહાત્મા તીર્થકર ભૂતકાળમાં થઈ ગયા છે તેનો પરિચય કેવી રીતે કરશો? એ તો સંભવ નથી. તેથી ભૂતકાળમાં અનંત જ્ઞાની, અનંત તીર્થકર થઈ ગયા છે પરંતુ કોઈની ઓળખાણ થઈ શકે નહીં. તેથી ‘મોક્ષ થવા માટે..’ એટલે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે પણ ‘જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.’

બીજી વાત એ છે કે, જીવ ડગલે ને પગલે ભૂલ કરે છે, અને ડગલે ને પગલે ઢોકર ખાય છે. એવો અજાણ્યો રસ્તો છે માટે (પ્રત્યક્ષ જ્ઞાનીની) તેને બહુ જ જરૂર પડે છે. પ્રત્યક્ષ માર્ગદર્શનની બહુ જ જરૂર પડે છે. માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનાં આરાધન વિના કોઈને જ્ઞાનપ્રાપ્તિ થઈ શકતી નથી.

‘આ જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠી કહી..’: જેને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, તેને માટે આ જ્ઞાનપ્રાપ્તિની શ્રેષ્ઠી કહી. શ્રેષ્ઠી એટલે વર્ગ - પહેલાં આમ કરો, પછી આમ કરો, પછી આમ કરો (તેને શ્રેષ્ઠી કહે છે). ‘એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી.’ તે સિવાય કોઈ બીજા માર્ગ પરિભ્રમણ મટે - ચારગતિ ચોરાસી લાખ યોનિના જન્મ-મરણ મટે, (એવું) નથી બનતું. કોઈ બીજો માર્ગ - કોઈ બીજો ઉપાય આ વિશ્વમાં છે નહીં. જગતમાં ચાંચ છે નહીં. ‘એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ’ કૃપાળુદેવ તો કહે છે કે, જગતમાં બે જૈન હોતાં જ નથી. બે પ્રકારના જૈન નથી હોતાં. એક જ પ્રકારના (જૈન) હોય છે.

અત્યારે આપણે ત્યાં ઘણાં મત-મતાંતર થઈ ગયા અને જૈનોમાં પણ ઘણાં સંપ્રદાય થઈ ગયાં તે સારું નથી થયું. તે વાત ઉચિત નથી થઈ. તીર્થકરદેવનો તો એક જ માર્ગ છે અને (આ) એક જ માર્ગ ઉપર બધાંને ચાલવું પડશે, ત્યારે જ મોક્ષ થશે. તે સિવાય કોઈનો મોક્ષ થવાનો સવાલ જ નથી.

હવે જે વાત કરી છે તે મહત્વપૂર્ણ વાત કરી છે. ‘એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.’ એવું તે ચુ ગુપ્ત

તત્ત્વ છે ? કે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ અને આગળ જે છણ્ણા વચનમાં વાત કરી ને ! કે, પ્રત્યક્ષ જ્ઞાની પ્રત્યે એકનિષ્ઠાએ, તન-મન-ધનની આસં તનો ત્યાગ કરી, અત્યંત ભૂ તથી જો આજ્ઞામાં રહે તો તેને પ્રત્યક્ષ અમૃતની પ્રાપ્તિ થાય છે અને તે નિર્ભય થઈ જાય છે. જ્ઞાનીની ઉપસ્થિતિનો આ જે વિષય છે તે હમેશા-હમેશા જગતમાં ગુપ્ત રહ્યો છે. કેવો રહ્યો છે ? ગુપ્ત રહ્યો છે. એટલે માટે ગુપ્તો રહ્યો છે કેમકે, ગ્રંથ તો ઘણાં લોકો વાંચે છે. પરંતુ આ વિષયમાં ભૂલ કરી બસે છે. અને અનંતકાળમાં આ જ જગ્યાએ ભૂલ થઈ છે કે, પ્રત્યક્ષ (જ્ઞાનીનો) ફાયદો શું છે ? તે ખબર પડી નથી.

આ ગુપ્તતત્ત્વનું જે આરાધન કરે છે, એટલેકે જેને પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂરિયાત લાગી, પરિચય કર્યો અને ઓળખાણ કરી - આ વિષય હમેશા ગુપ્ત રહ્યો છે કે, જે (જ્ઞાનીપુરુષની) ઓળખાણથી સ્વરૂપની ઓળખાણ આવી શકે છે. સત્પુરુષની ઓળખાણ છે તે જ્ઞાનની પર્યાય છે ને ! ઓળખાણ જે થઈ તે જ્ઞાનની પર્યાય છે, તેના ગર્ભમાં બીજું સમકિત આવી ગયું. (બીજા સમકિતનો) જન્મ પછી થશે. મનુષ્ય પણ પહેલાં તો ગર્ભમાં આવે છે પછી જન્મ થાય છે ને ! તો સ્વરૂપની ઓળખાણ તો બીજું સમકિત છે, કે જે ત્રીજા પરમાર્થ સમ્યક્કર્ત્વનું અંગભૂત કારણ છે. તેનું ગર્ભમાં આવવું તે પ્રથમ સમકિતમાં બને છે. તેને (આત્મસિદ્ધિની) ૧૭મી ગાથામાં સમકિતનું પ્રત્યક્ષ કારણ કહ્યું છે. ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્ત્ત સદ્ગુરુ લક્ષ’ - તેમાં આજ્ઞાકારિતાનું વર્ણન કર્યું છે. ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્ત્ત સદ્ગુરુ લક્ષ’ એમાં આગ્રહ એટલે શું ? કે પોતાની સમજેલી વાતનો જીવને આગ્રહ હોય છે. પોતાના મતનો - પોતાના અભિપ્રાયનો આગ્રહ રહે છે. તે જ સ્વચ્છંદ છે. ‘સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.’ - તે પ્રત્યક્ષ સમ્યક્કર્દશન નું કારણ છે. જ્ઞાનીની નજરમાં પ્રત્યક્ષપણે સમ્યક્કર્દશનનું કારણ અહીં જોવામાં આવ્યું છે કે, અમને તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. હવે આ જીવનું સમ્યક્કર્દશન અમને પ્રત્યક્ષ દેખાય છે.

‘એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે...’ આ ગુપ્ત તત્ત્વ છે. ‘તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.’ તે આત્માના આનંદ અમૃતને પી ને અજર-અમર થઈ જ જશે. પછી તેને ફરી-ફરી મરવું નહીં પડે. ‘ધતિ શિવમ्’ એમ કહીને ‘ધતિ’ એટલે પત્ર પૂરો કર્યો છે. આ જે કલ્યાણકારી માંગલિક વાત છે, તેને અહીં એમે સમાપ્ત કરી. અહીં ૨૦૦ નંબરનો પત્ર પૂરો થાય છે.

ॐ

‘શ્રીમદ્ રાજયંત્ર’

પત્રાંક – ૫૧૧

મોહમ્મદી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦

ॐ

શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય,  
આપનો સવિગત કાગળ ૧, તથા પત્રું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં  
લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે.

જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન  
જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે  
છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં.  
જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે,  
કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ  
પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા  
તે ફરજ આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો  
પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; લટો આત્માર્થ વિસ્મરણપણે  
ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ  
ન થાય, અને લટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન  
થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વખે પણ આવતી  
નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગાંધો તો તેથી  
કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં  
ઇતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય

એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકણનાં બધાં માટાં સાધન, કલ્યિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કચા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજીવનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવની મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિર્વર્તવું શરૂ થાય છે.

(પત્રાંશ)



પ્રવચન - ૮  
**‘શ્રીમદ્ રાજચંદ્’ પત્રાંક-૫૧૧**

તા. ૨૫/૦૧/૧૯૮૮ - ભાવનગર

---

---

‘શ્રીમદ્ રાજચંદ્’ વચનામૃત. પત્રાંક ૫૧૧મો.

જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે.’ સાધન એટલે ધર્મ-સાધન, ધર્મ-કિયા. સાધનનો અર્થ (એ) થાય છે. ધર્મ પ્રાપ્તિના જે જે બાબ્ય સાધનો છે, એ જીવે પૂર્વ કાળે કર્યા છે - પણ પોતાની મતિ-કલ્યનાથી કર્યા છે, સ્વચ્છંદે કર્યા છે, મનમાની રીતે કર્યા છે. જ્યાં પોતાનું મન ન માને ત્યાં ન કરે અને એ વાતમાં અંદેશો એટલે શંકા (થતી નથી). એ વાતમાં શંકા જરા પણ લાગતી નથી. જે જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયા હોત તો (જીવને પરિભ્રમણ હોત નહીં).

(સ્પષ્ટ કરીએ તો) જ્ઞાનીપુરુષની આજ્ઞા મુમુક્ષુ માટે દર્શનમોહને કાપવાની છે. સીધી એક લીટીમાં વાત કરીએ તો આટલી છે અને એની યોજના અને એ સંબંધીનું સ્પષ્ટપણું એ જ્ઞાનીના લક્ષમાં હોય છે. યોજના તો કૃપાળુદેવ ૨૫૪ પત્રમાં - મુમુક્ષુતા આરોહણ કમમાં Registered કરીને ગયા છે. પણ ત્યાં ૨૫૪ માં (પત્રમાં) પરિભ્રમણની વેદનાનો વિષય નથી ચાલ્યો. એ (વિષય) ૮૬ અને ૧૮૫માં (પત્રમાં) ચાલ્યો અને પૂર્ણતાના લક્ષને એમણે ૧૨૮ ના પત્રમાં થોડું Elaborate કર્યું. (મુમુક્ષુનો) કેવો મક્કમ નિશ્ચય હોય છે ! મુમુક્ષુતા માટેનો કેટલો તાકાતવાળો નિશ્ચય હોય છે ! કે કોઈપણ પરિસ્થિતિ ભી થાય - At any cost (મારે) પરિભ્રમણથી છૂટવું છે એટલે છૂટવું જ છે. એમાં કોઈ, આનો ભોગ ન દેવાય એ વાત નથી. ગમે તે ચીજનો ભોગ દેવાય. એ વાત એમાં આવી ગઈ અને પરિભ્રમણની ચિંતનાના પત્રમાં (જે) Elaborate નહોતું કર્યું, એ એમણે ૧૨૮ માં પત્રમાં ૪ - Paragraph થી કર્યું છે કે, આ જે પૂર્ણતાના લક્ષનો નિર્ણય થાય છે અથવા આત્મ-કલ્યાણનો, એ આવી

વેદનાપૂર્વક થાય છે. એટલે દરેક Paragraph ના અંતે અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એટલે ચિંતના અને વૈરાગ્યનું Stage ૪-Paragraph માં લીધું અને ત જું Stage, જે ધૂટવું જ છે, પરિભ્રમણથી ધૂટવું જ છે એ (અના પછી) નીચે લીધું. એ વિષય ત્યાં સંક્ષેપ થઈ ગયો. ત્યાં (એ વિષય) પૂરો થયો પછી, એને ફરીને ૨૫૪ (પત્ર)માં એમણે Elaborate નથી કર્યો.

૨૫૪ (પત્ર)માં પછી ત્યાર પછીની વાત લીધી કે, જીવને દઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે મોહાસ્ય તથી મુંજાઈ અને એક 'મોક્ષ'ને વિષે જ યત્ન કરવો. એટલી વાત કરીને પછી પોતાના દોષો અપક્ષપાતપણે જોવા. પછી એમણે ત પ્રકારના દોષ (લીધા અને) એ બધી વાત કરી. એમણે એ યોજના તો વ્યવસ્થિત કરેલી છે. પોતે અનુભવસિદ્ધ વાત કરી છે અને દરેકને અનુભવ (એક સરખો હોવાથી) જેટલા જ્ઞાની થાય અને ઘ્યાલ આવી જાય કે બરાબર છે - જીવ આ કમે જ આગળ વધે છે. એ પોતાના પરિણામન સાથે Tally કરી લે છે.

એ (બધાં Stageમાં આવ્યા) પહેલાં Problem ભો થયો છે કે, પરિભ્રમણની ચિંતનાનો જે પ્રવેશ છે, એ પ્રવેશ જ ન થતો હોય તો શું કરવું ? આ જે Problem છે એ બહુ મોટો Problem છે. એટલા માટે બહુ મોટો Problem છે કે, જીવને દર્શનમોહ કેટલો બળવાન વર્તે છે, એ ખબર નથી હોતી. બહુભાગ જીવ એવી રીતે બફમમાં રહે છે કે, હું તો ઘણો સ્વાધ્યાય કરું છું, હું તો ઘણો સત્સંગ કરું છું, સત્સાસ્યો વાંચુ છું, અના વિચારો પણ મને આવે છે, - એટલે મારો દર્શનમોહ ઓછો હશે. (પણ) એવું નથી હોતું. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનું છું માટે મારો દર્શનમોહ ઓછો હશે, એવું નથી હોતું. રોજિંદા જીવનમાં દર્શનમોહને ખૂબ દઢ કરવામાં આવે છે. એક, કુટુંબ-પરિવાર વચ્ચે રહીને પોતાપણું કરીને, એક સંપત્તિ આદિમાં પોતાપણું કરીને અને એક ખાવા-પીવાના, ભોગ-ઉપભોગના પ્રસંગોમાં પણ સુખબુદ્ધિએ અને આધારબુદ્ધિએ જે દર્શનમોહને પોતે કાણો-કાણો, કાર્ય-કાર્ય ને પ્રસંગો-પ્રસંગો દઢ કરે છે એ પકડી શકતું નથી. મોટો અપરાધ છે એને પકડે નહીં, અને નબળો પાડે નહીં, તો પ્રવેશકાળ જ આવતો નથી.

એ સિવાય પણ દર્શનમોહ પ્રબળ થવાનું એક બીજું મોટું કારણ છે, -

‘પરલક્ષ’. હમણાં તો આપણે એના ઉપર ઘણો સ્વાધ્યાય આવી ગયો. (જીવને માર્ગ પ્રાપ્તિમાં) અવરોધક કારણો ચા ચા છે? એમાં પરલક્ષ છે એ પણ એક બહુ મોટો અપરાધ છે. જીવ સ્વલક્ષે સ્વાધ્યાય નથી કરતો (પરંતુ) પરલક્ષે કરે છે અને જ્યાં સામૂહિક સ્વાધ્યાય થતો હોય ત્યાં પણ એનું કંઈક ને કંઈક પરલક્ષ ચાલતું હોય છે, એ પકડાતું નથી અને સરવાળો આવીને એ ભો રહે છે કે (પોતે) ચિંતનામાં પ્રવેશ નથી કરી શકતો. એટલે એના માટે Individually દરેકનો Case જુદો જુદો છે એના માટેની કોઈ Fix યોજના નથી.

પરિભ્રમણની ચિંતનામાં આવ્યા પછી પદ્ધાર્થ નિર્ણય સુધીની યોજના Fix છે અને પદ્ધાર્થ નિર્ણય પછી તરત - અલ્યકાળમાં જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે. એટલે ચોથા ગુણસ્થાનનથી ચૌદ ગુણસ્થાન સુધી મોક્ષમાર્ગની યોજના Fix છે. અત્યાર સુધી તો બધાં સાધનાકાળમાં ચાર (ગુણસ્થાનનથી) ચૌદ ગુણસ્થાન સુધી જ સમજતા હતા. મુમુક્ષુતાના Stage અને મુમુક્ષુતા આરોહણ કમ (બાબતમાં) તો કોઈ આજે પણ ચર્ચા કરતું નથી. એ વિષય ચાંચ ચાલતો નથી. એટલે દર્શનમોહને મારવાનો વિષય ચાંચ ચાલતો નથી. ત્યારે ‘જ્ઞાનીનો માર્ગ’ એટલે શું? કે દર્શનમોહને મારે તે જ્ઞાનીનો માર્ગ. માર્ગ એટલે ઉપાય. દર્શનમોહને મારે તે જ્ઞાનીનો ઉપાય.

જ્ઞાનીનો માર્ગ એ તીર્થકરનો માર્ગ, અને તીર્થકરનો માર્ગ એ જ્ઞાનીનો માર્ગ. તીર્થકરના નામે ચાલે માટે તીર્થકરનો માર્ગ નહીં. એ તો બધાં જૈનના સંપ્રદાય ચાલે છે. ત્રણો ફીરકા અને જ ચાલે છે. કોઈ તીર્થકરનો માર્ગ ત્યાં નથી. ત્યાં બધે તમને વ્રત, પચ્ચાખાણ, ત્યાગ, ફલાણું, ઢીકણું (કરાવીને) ચારિત્રમોહ ઉપર જ (દોરવી જશે). દાન આપો, ત્યાગ કરો, વ્રત કરો, ફલાણું કરો, આટલું છોડો, આટલું છોડો, છેવટે આટલો ત્યાગ કરો. આ સિવિવાય કંઈ નથી. કેમકે ત્યાં ઉપદેશ આપનારા ત્યાગી થઈને બેઠા છે. એ પોતે જ ભૂલથી ત્યાગ કરીને બેઠા છે. એટલે એ ભૂલથી ત્યાગ કરાવશે, બીજું શું કરાવશે? આ પરિસ્થિતિ છે. એની પાસે પાછી જાણકારી પણ નથી. એ જાતનું જ્ઞાન પણ નથી કે એ તમને આપી શકે. એ બોધ આપી શકે એવું જ્ઞાન અમેની પાસે છે નહીં. એટલે જ્ઞાનીની આજ્ઞાનો અર્થ આ છે કે, દર્શનમોહને મારો. દર્શનમોહને મારી-મારીને નબળો પાડો. મરણતોલ મારીને એનો ઉપશમ કરી નાખો, અભાવ કરી નાખો; તો મોક્ષમાર્ગમાં પ્રવેશ કરી

શકો, પછી આગળનો રસ્તો સહેલો છે, સુગમ છે, અને એનો મોક્ષ પણ નિશ્ચિત જ છે. એટલે જ્ઞાનીની આજ્ઞાનો અર્થ આટલો જ છે કે, (દર્શનમોહને મારવો). (અત્યાર સુધી) જે-જે સાધન (જીવે) કર્યા છે એ દર્શનમોહને મારવા માટે કર્યા નથી.

ગુરુદુદેવે દ્રવ્યાનુયોગની પ્રધાનતાથી તત્ત્વજ્ઞાનનો ઉપદેશ ઘણો આપ્યો, અને શ્રદ્ધા પ્રધાનતાથી (પણ ઘણો ઉપદેશ આપ્યો). (કેમકે) એમનો સમ્યક્કદર્શનનો વિષય મુખ્ય હતો. એટલે દર્શનમોહનો અભાવ કરવાનો (ઉપદેશ મુખ્ય હતો). તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ માટે એની ચરમસીમાની વાત ત્યાં સુધી ચાલી, કે એક સમયની પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય ભિન્ન છે. ત્રિકાળી દ્રવ્ય શાશ્વત (છે), ત્રણે કણે એકરૂપ છે. એક સમયની પર્યાય બીજા સમયે (રહેતી) નથી. ચાહે તે કેવળજ્ઞાનની હોય કે સિદ્ધ-પરમાત્માની હોય, પર્યાય એક જ સમયની છે. માટે પર્યાયબુદ્ધિએ પર્યાયમાં પોતાપણું કરવું નહીં. આ એનો પરમાર્થ છે. પ્રવચનસારની ઈતમી ગાથા(માં એમ કહ્યું) ‘પર્યાયમુઢા: પરસમયા:।’ પર્યાયમૂઢ પર સમય છે - એ જૈન સમય નથી, અન્યમતનો સમય એટલે સંપ્રદાય છે - ધર્મ છે.

એક સમયની પર્યાયમાં પોતાપણું નથી કરવાનું અને ઘરે જઈને બૈરાછોકરાંમાં પોતાપણું કરવામાં કોઈને વિચાર સુધ્યાં ન આવે ! વિકલ્પ પણ ન ઠેકે હું શું કરું છું ! જ્ઞાનીની સ્થૂળતા કેટલી !! તમે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ સૂક્ષ્મબુદ્ધિથી કરો અને પરિણમનની સ્થૂળતા કેટલી બધી ! કે વાસીદામાં જ સાંબેલું જાય સીધું ! તમે આટલી સૂક્ષ્મ શુક્લધ્યાનની પર્યાયની ચર્ચા (કરો) ! ‘પરદ્રવ્યમ् પરમાવં હેયં ઇતિ।’ (કહો) ક્ષાયિકભાવને ‘નિયમસાર’ ની ૫૦મી ગાથા (માં હેય કહ્યો). ત્યાં સુધી ચર્ચા કરવામાં વાંધો નહીં, પણ કુટુંબ-પરિવાર અને રૂપિયાની બાજી સામે આવી (એટલે) ખલાસ ! ત્યાં પોતાપણું એટલી હંદે (કરે) કે પોતાને એટલો બધો અંધાપો આવેલો હોય છે કે, પોતાને ખબર નથી પડતી કે હું શું કરું છું ! આટલું બધું જ્ઞાન સ્થૂળ થઈ જાય છે, એને અજ્ઞાન કહેવાય છે. હવે એ (પોતે) શું માને છે ? કે હું જે શુક્લ (ધ્યાનની) - કેવળજ્ઞાનની પર્યાયને પરદ્રવ્ય માનું છું ને, માટે મારું જ્ઞાન સૂક્ષ્મ છે. પુણ્ય હેય છે, ક્ષયોપશમજ્ઞાન હેય છે અને ક્ષાયિકજ્ઞાન (પણ) હેય છે. ‘હેય ઇતિ’ (એમ) લખ્યું છે. (એને એમ લાગે કે) આપણું જ્ઞાન બહુ સૂક્ષ્મ ! અને ઘણાં

તો એમાં જ્ઞાની થઈ ગયા ! શરીરની વાત આવે, કુટુંબની વાત આવે, રૂપિયાની વાત (આવે તો ત્યાં) ગાઢ એકત્વ હોય ! ગાઢ પોતાપણું હોય ! એ સ્થળ અજ્ઞાન છે. બહુ જાડું થયેલું અજ્ઞાન છે. એટલે જ્ઞાનીની આજ્ઞાની વાત જ આખી જુદી છે.

મુમુક્ષુ :- સુરતમાં આપ પહેલી વખત આવ્યા હતા ત્યારે આજ્ઞા માટે આપે બે વાત કહી હતી કે, જ્ઞાનીના સમાચિતગત ઉપદેશમાંથી પોતાને લાગતું ખેંચી લેવું, એ પણ આજ્ઞા છે અને જો જ્ઞાની Personal આજ્ઞા આપે તો તે અદ્ભુત જ છે.

પૂજ્ય ભાઈશ્રી :- ખરી વાત છે અને એ દર્શનમોહ તોડવાની જ આજ્ઞા આપે. સમાચિતગત ઉપદેશમાંથી પણ એ જ તારવવાનું છે કે મારો મોહ અહીંથા કામ કરે છે. મારો મોહ અહીંથા કામ કરે છે, એ જ પકડવાનું છે. વાત તો એક જ છે. જ્ઞાનીની આજ્ઞા એક જ પ્રકારે છે.

‘જો એમ થયું હોત...’ એટલેકે જ્ઞાનીની આજ્ઞાએ સાધન કર્યા હોત, ‘તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં.’ ચારનો છુટકારો થઈ ગયો હોત. કેમ ? કે જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં ‘મોક્ષપાટણ’ સુલભ જ છે, અને (મોક્ષ પ્રાપ્તિ માટે) બહુ સમય જતો પણ નથી. ચૈતન્ય સ્વરૂપી આત્મા એવી અનંત ચમત્કારિક શરીર ત ધરાવે છે. ચમત્કાર પણ એનો અનંતો છે કે અનંતકાળનું અજ્ઞાન અને મિથ્યાત્વ જતાં બહુ અલ્યકાળ લાગે છે. બહુ અલ્યકાળમાં સિદ્ધિ થઈ જાય છે. અનંતકાળ આગળ થોડા ભવ તો કાંઈ નથી. એ તો સમુક્રમાં બિંદુ જેટલો એનો કાળ છે, એટલો બધો કાળનો મહાસાગર છે. એ તો અનાદિ અનંત છે. એમાં થોડાંક ભવ શું કહેવાય ? (જ્ઞાનીની આજ્ઞાની) લાઈને ચડયો હોય એને કાંઈ જાણ ભવ હોય નહીં.

આ કાળમાં કોઈ મુનિદશાએ પહોંચેને (તો) એ તો એકાવતારી જ હોય. પણ ફૃપણુંદેવ જેવા અને સોગાનીજી જેવા ચોથા ગુણસ્થાને એકાવતારી છે. તો પછી જીવ કેટલા અલ્યકાળમાં સિદ્ધિને પ્રાપ્ત થાય છે ! એનો પ્રગટ દૃષ્ટાંત છે. છતાં પણ કોઈને ૨-૪-૬-૮ ભવ હોય તો એ કાંઈ મોટી વાત નથી. એ કોઈ મોટી વાત નથી. પૂજ્ય સોગાનીજી સાહેબનો એ દૃષ્ટાંત છે કે, (માર્ગ પ્રાપ્તિમાં) બહુ ઓછો સમય લાગે છે - એનો એ પુરાવો છે. કોઈપણ જીવ માર્ગ ચેતે તો એને બહુ ઓછો કાળ લાગે, અને ઓછા કાળમાં કામ કરી

જાય એ તો એની સાબિતી છે.

(કોઈપણ ધર્મ સાધન જ્ઞાનીપુરુષની) આજ્ઞાથી થયાં હોય તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. ‘જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.....’ ભવ કોણ વધારે ? દર્શનમોહ. જ્ઞાનીપુરુષની આજ્ઞા એમાં આડી આવીને ભી રહે. - ‘નહીં, મોહ નહીં કરવા દઉ. મોહ નહીં કરવાનો.’ આગળ એક પત્ર આવશે કે જેણે સત્સંગને ઇચ્છાવો એણે કુટુંબ-પ્રતિબંધ ન ઇચ્છાવો. ૫૧૦માં ઉપર જ છે લ્યો ! એ જ પાના ઉપર વચ્ચેનો Paragraph છે ને ! એની છેલ્લી લીટી. ‘અનુત્પત્ત એવો આ જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિન્ત રહેવું....’ (ચિન્ત રહેવું) એટલે અભિપ્રાય રહેવો, ‘એ સૌ જીવની મૂઢ્યતા છે....’ કઠોર શબ્દ વાપર્યો છે. ‘એ સૌ જીવની મૂઢ્યતા છે....’ પણ આપણને અસર ન થાય તો શું કામ લાગે ? અરે ! મને મૂઢ કહે છે ને હું હજુ માનતો નથી. ! મૂઢ કહે છે તોપણ માનતો નથી. ‘અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી.’

એટલે પછી અમે એકવાર એવી રીતે લીધું હતું કે સત્સંગમાં બેસવું હોય તો કુટુંબ-પ્રતિબંધવાળાને (માટે) અહીંયા ‘No admission’નું Board છે. એને Admission નથી. જો કે અહીંયા એવું લખ્યું નથી, Board માર્યું નથી, પણ સમજ લેવાનું છે. એક (વાત થઈ). બીજું માનો કે છતાં પણ તમે આવીને બેસો છો, પણ અમે તમારું નામ સત્સંગીઓમાં Registered કરતાં નથી. Catalogue માં નથી લખતાં કે આ ભાઈ અમારા સત્સંગી છે, એ રીતે માન્ય નથી કરતાં. (અમે સમજાએ છીએ કે) ઠીક છે, આજે આવે છે (પણ) પાછા

ચારેક જતા રહેશે. અત્યારે (ભલે) આવતા હોય (પણ) પાછા ચારેક જતા રહેશે. એટલે એનો વિમો નથી ઉત્તારતાં. અનું Premium પણ નથી લેતા. એટલે શું ? કે ભલે તમે આવતા હોય પણ તમને Class માં બેસવા દઈએ છીએ એટલી અમારી ભલમનસાઈ છે. નહીં તો ઠાડીને કાઢી મૂકવા જોઈએ. ચાલો ! ઠો ! ભાગો અહીંથી કેમ કુટુંબ-પ્રતિબંધ કરો છો ? શું કરવા (કરો છો) ? કૃપાળુદેવ સત્સંગીને (કુટુંબમાં મોહ કરવાની) ના પાડે છે, આજ્ઞા ઉપર કેમ પગ મૂકો છો ? મૂઢ કહે છે તોપણ માનતા નથી !! સત્સંગની ઇચ્છાવાળાને આ હોય જ નહીં. આ રખાય જ નહીં. એટલે, બેસવા દે છે એમ સમજાને આપણે આવવાનું. બાકી કાં તો આપણો જતા રહીશું અને કાં

તો આપણને કાઢી મૂકશો. જો આપણે પ્રતિબંધ નહીં તોડીએ તો બેમાંથી એક સમજ લેવાનું. એવી ચર્ચા કરી હતી. એટલે વાત એવી છે કે જીવ ઘણાં મોહ દૃઢ કરે છે, બહુ જ મોહ દૃઢ કરે છે, અને એ મોહ જ્યાં સુધી હોય ત્યાં સુધી પરિભ્રમણની ચિંતના ન આવે. પછી આગળની કોઈ વાત થવાનો પ્રશ્ન રહેતો નથી.

‘જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી,...’ ‘અર્થ’ એટલે પ્રયોજન. અર્થ એટલે શબ્દાર્થ, ભાવાર્થ નહીં. (અહીંયા) અર્થ એટલે પ્રયોજન. કારણકે જેને (માત્ર) આત્માનું પ્રયોજન (છે). આત્માર્થ એટલે આત્મ-કલ્યાણનું પ્રયોજન (છે). (આત્માર્થ શબ્દમાં) સમાસ છે. વચ્ચે ‘કલ્યાણ’ શબ્દ સમાયેલો છે. (જ્ઞાનીપુરુષને) આત્મ-કલ્યાણના પ્રયોજન સિવાય બીજું કોઈ પ્રયોજન નથી.

‘અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે,...’ જ્ઞાની કેવાં છે ? કે જેણે આત્માર્થ સાધી માત્ર પ્રારબ્ધ પ્રમાણે જેનો દેહ છે. (જ્ઞાનીપુરુષ ભવિષ્યનું) Planning એટલે નથી કરતાં. (તેમના અભિપ્રાયમાં એમ છે કે) પ્રારબ્ધ પ્રમાણે શેષ આયુ ભોગવવાનું રહ્યું. જ્ઞાન થયા પછી શું ખબર પડે ? જે (આયુષ્ય) ભોગવાઈ ગયું એ તો ભોગવાઈ ગયું. એ પણ પ્રારબ્ધ પ્રમાણે જ ભોગવાણું છે, પણ તે દિવસે કર્તાબુદ્ધિ હતી એટલે ‘હું આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું, ચાલતું હતું.’ હવે તો ખબર પડી ગઈ કે જે ભોગવાણું એ (પણ) પ્રારબ્ધવશાત્ છે અને શેષ આયુ પણ પ્રારબ્ધવશાત્ જ ભોગવવાનું છે. પછી Planning કરવાનો સવાલ ચાં ભો થાય છે ? (હું પર પદાર્થમાં કાંઈ) કરી શકતો નથી. - એવું જેને જ્ઞાન છે એને Planning કરવાનો પ્રશ્ન ચાં રહ્યો ? અને જો Planning કરે તો ‘કરી શકું છું’ એ વાત આવીને ભી રહે છે, એ તો કર્તાબુદ્ધિ થઈ ગઈ. સીધી જ વાત છે.

‘પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા...’ ખાતી જ્ઞાનીપુરુષની આજ્ઞા ન લીધી. આત્માર્થ સાધીને પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા, એમ કહે છે. ‘તે ફ ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે;...’ તારું આત્મકલ્યાણ થાય - એ એક જ વાત છે. અમારે અહીંયા બીજી વાત નથી. બીજો વિષય અહીંયા નહીં ચાલે. એક જ વિષય ચાલે છે. તારું અકલ્યાણ ચાં થાય છે ? એ જો ! ને તારું કલ્યાણ ચાં થાય છે ?

એમ જો ! બે જ વાત છે. અસ્તિત અને નાસ્તિતથી જોઈ લે.

‘અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાડ્યો નથી;...’ આત્મ-કલ્યાણ કેવી રીતે થાય ? અની ભૂતકાળમાં કોઈ દિવસ ખબર પડી નથી. ‘ બધે આત્માર્થ વિસ્મરણાપણે ચાલ્યો આવ્યો છે.’ એમાં ભૂલો પડ્યો છે. તું ભૂલી ગયો છે. આત્માર્થ કેમ થાય ? એ જ ભૂલી ગયો છે.

મોટાભાગે જે તે સંપ્રદાયમાં જે તે જીવો ધર્મ-સાધન કરે છે. સૌથી મોટામાં મોટો દોષ ‘લોકસંજ્ઞા’નો ત્યાં કરી લે છે. (જીવ) લોકસંજ્ઞાએ ધર્મ કરે છે. જે લોકોમાં, જે સંપ્રદાયમાં, જે સમાજમાં, જે ટોળામાં હું જાઉ છું, ત્યાં મારું સ્થાન આ ! (એમ માની લે છે). એ સ્થાન (મેળવવા અને ટકાવવા) માટે પછી ગમે તે પ્રયત્ન કરે. ત્યાગ કરે, દાન કરે, જે કરે તે, કે જ્ઞાન કરે - એ બધું પછી લોકસંજ્ઞાએ જ કરે. લોકસંજ્ઞાએ કોઈ દિવસ ધર્મ થવાનો પ્રશ્ન જ નથી. લટાનો દર્શનમોહ તીવ્ર થાય. કૃપાળુદેવે તો અને ‘કાળકૂટ ઝેર’ જ કીધું છે. લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર કીધું છે.

‘તે પોતાની કલ્યાણ કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય,...’ પોતાની કલ્યાણાએ સાધન કરે એટલે આત્મકલ્યાણ થાય એવું કાંઈ બને નહીં. ‘અને

લદું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પત્ત થાય;..’ હું મારું આત્મ-કલ્યાણ કરું છું, કરું છું ને ! આટલું તો કરું છું ને ! આત્મકલ્યાણ માટે આટલું તો કરું છું ને ! (એ જાતનું અભિમાન થાય છે). એ જાતનું ‘દુષ્ટ અભિમાન’ કીધું, (માત્ર) અભિમાન ન કીધું.

મુમુક્ષુ :- અભિમાન તો બેસે છે પણ દુષ્ટ અભિમાન કેમ કહ્યું ?

પૂજ્ય ભાઈશ્રી :- (કેમકે આ અભિમાન) વધારે ખરાબ અભિમાન છે. બીજા અભિમાનથી તો કોઈક ઉત્તરાવે. ‘પૈસાવાળો છું, પૈસાવાળો છું’ એમ કરતો હોય તો કોઈ એમ કહે કે ‘હીવે, તારા કરતાં શેરમાથે સવાશેર ઘણાં બેઠાં છે, બેસ હીવે, કાંઈ નથી તારી પાસે.’ એમ કરીને કોઈક અને કાંઈક દેખાડી દે. (આ પ્રકારના અભિમાનમાંથી) તો ઉત્તારવો મુશ્કેલ પડે. બીજા (કોઈ) અભિમાન કરેને ! કોઈ કુળનું કરે, કોઈ શરીરબળનું કરે, કોઈ પૈસાના - ધનબળનું કરે, કોઈ રૂપબળનું કરે, કોઈને કોઈ (અભિમાન કરે) પણ બધાંયમાં અને શેરથી સવાશેર દેખાય. આમાં તો અને (એમ જ થાય કે) બસ ! હું, હું ધર્મ કરું છું, હું ધર્મ કરું છું. એમાંથી પાછો વાળવો અને બહુ મુશ્કેલ

પડે.

બીજા અભિમાનથી પાછા વાળવામાં શું કારણ છે ? કે એ બધાં સ્થૂળ પાપના પરિણામ છે અને આ પુષ્યના પરિણામ હોય છે. પાપમાં ફસાયેલો સહેલાઈથી નીકળે, પુષ્યમાં ફસાયેલો સહેલાઈથી ન નીકળે. (આ) બહુ છેતરામણી જગ્યા છે અને એથી વધારે ફસાય - ક્ષયોપશમ જ્ઞાનમાં. પરલક્ષી ક્ષયોપશમજ્ઞાનમાં ફસાજો હોય એને કાઢવો બહુ મુશ્કેલ, એને (બહાર કાઢવો) સૌથી વધારે મુશ્કેલ (છે). પાપવાળા કરતાં પુષ્યવાળાને કાઢવો મુશ્કેલ અને પુષ્યવાળા કરતાં ક્ષયોપશમ(જ્ઞાનમાં) - શાસ્ત્રજ્ઞાનમાં ચદેલાને કાઢવો મુશ્કેલ પડે. એવી ખરાબ પરિસ્થિતિ થાય છે. એટલે એને દુષ્ટ અભિમાન કીધું છે.

લટાનું દુષ્ટ અભિમાન ઉત્પત્ત થાય 'કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે.' (પરિભ્રમણના) બીજા બધાં (કારણો) ગૌણ છે. આ મુખ્ય હેતુ છે. અધર્મમાં ધર્મ માનવો, અકલ્યાણમાં કલ્યાણ માનવું, એ સંસારનો મુખ્ય હેતુ છે. તમે સંસારના પરિણામો કરો છો એ તો સંસારનો હેતુ છે જ. પણ (આ અભિમાન) એના કરતાં પણ વધારે (કારણભૂત) છે, એમ કહેવું છે. એટલે (આપણી) જવાબદારી વધે છે. ધર્મના ક્ષેત્રમાં આવેલાની જવાબદારી (વધે છે).

(કોઈક) ધ્યાનના રવાડે ચેતે છે. પછી (એ) યોગકેન્દ્રમાં જાય, ધ્યાનકેન્દ્રમાં જાય, ધ્યાન શિબિરોમાં જાય (એ) બીજી વાત છે અને અત્યારે તો આ બધાં કૃપાળુદેવના નામે આશ્રમો થાય છે, ત્યાં પણ ધ્યાન ચલાવવાનો એક કમ (રોજિંદા) કાર્યક્રમમાં ગોઠવી નાખે છે. આ બધાં ધા રવાડે ચઢવાના પ્રકારો છે. એટલે પછી શું થાય છે ? કે ધ્યાનમાં બેસે એટલે મનની અકાગ્રતા કેવી રીતે થાય ? (કે ધ્યાનમાં બેસે એટલે મનની ચંચળતા થોડી ઘટે છે). ચંચળતા ઘટચા પછી, અહીંયા થોડીક પરિસ્થિતિ નાજુક થાય છે. કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય; કોઈને કાંઈ દેખાય, (અને) કોઈને કાંઈ દેખાય. કોઈ કહે મને તેજના લીસોટા દેખાય છે ! કોઈ કહે મને કોઈ ચક્કર-ચક્કર-ચક્કર-તેજનું ચક્કર દેખાય છે ! કોઈ કહે મને બહુ જ શાંતિ લાગે છે ! કોઈ કહે મને આનંદનો અનુભવ આવે છે ! એમાં તો અનેક પ્રકાર ભજે છે.

(કૃપાળુદેવ આગળ લખે છે), જે વાત સ્વખ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્યાણથી સાક્ષાત્કાર જેવી ગણે... જુઓ ! ધ્યાનમાં સાક્ષાત્કાર થઈ ગયો, એમ એ લઈ લે. (માનસિક) શાંતિ થઈને આનંદ આવ્યો ને !

એટલે (એમ માની લે છે કે) મને આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો ! એ ધ્યાનમાં ચાંથી થાય ? કેમકે એણે અમુક વસ્તુ જોઈ છે, એને એ સાક્ષાત્કાર ગણે છે. અમુક પ્રકારનો ચિત્ર-વિચિત્ર અનુભવ થયો એને સાક્ષાત્કાર ગણે છે. તો કહે છે, એ તો સાચા ધ્યાનવાળાને સ્વખે (પણ) આવતું નથી ! ‘તે જીવ માત્ર અમસ્તી કલ્યાણથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે.’

‘તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં..’ અત્યાર સુધી તો એને આત્મજ્ઞાન સંબંધીની સૂજ નથી એટલે આંધળો જ છે. આ માર્ગ માટે તો આંધળો છે. અજાણ્યો કહો કે આંધળો કહો, એ તો એકસરખું જ છે. (અંધ થઈને) ચાલ્યો આવતાં છતાં, ‘પોતાની કલ્યાણએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય, એ સાવ સમજ શકાય એવો પ્રકાર છે.’ પોતાની કલ્યાણએ માની લે કે મારું કલ્યાણ થયું છે, મારું કલ્યાણ કરું છું અથવા તો કલ્યાણ થયું છે, વાતમાં કાંઈ માલ નથી.

‘એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન...’ (માઠાં સાધનમાં) બધું આવી ગયું. માઠાં સાધનમાં ત્યાગ, વ્રત, તપ, જ્ઞાન, ધ્યાન, દાન, બધું આવી ગયું. ‘જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલિપત સાધન...’ બે (સાધન) લીધાં. એક માઠાં સાધન કીધાં એ (બીજા) કલિપત સાધન કીધાં. પોતાની કલ્યાણએ કરેલાં છે તેથી કલિપત કીધાં અને (માઠાં સાધન એટલા માટે કહું કેમકે) એનું પરિભ્રમણ વધારનારા છે (અને) દર્શનમોહને દૃઢ કરાવનારાં છે. (દર્શનમોહ વધતાં) ગૃહીત મિથ્યાત્વમાં આવ્યો ને ? ગૃહીત મિથ્યાત્વમાં આવ્યો એટલે જ્યારે દર્શનમોહ તીવ્ર થાય ત્યારે અગૃહીતમાંથી ગૃહીત મિથ્યાત્વ થઈ જાય.

અગૃહીત મિથ્યાત્વ હોય ત્યાં જૈન કુળમાં જન્મયો હોય, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનતો હોય, તત્વજ્ઞાનનો બરાબર અભ્યાસ કરતો હોય, (ત્યાં સુધી) અગૃહીત મિથ્યાત્વમાં હોય. પછી એમાંથી આત્માને વિષે કલ્યાણ કરે કે આત્માને પ્રાપ્ત થવાના સાધનને વિષે કલ્યાણ કરે, ત્યારે ગૃહીત (મિથ્યાત્વમાં) આવી જાય. (બુદ્ધપૂર્વક) નવું (સાધન) ગ્રહણ કરી લીધું. એટલે એ માઠાં સાધન થયાં. ત્યાં મિથ્યાત્વ તીવ્ર થઈ ગયું.

‘માઠાં સાધન, કલિપત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી,...’ (અપૂર્વ એટલે) અત્યાર સુધી નહીં કરેલું એવું અપૂર્વજ્ઞાન (પ્રગટ

કર્યા) સિવાય બીજો કોઈ ઉપાય નથી. ‘અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પત્ત થવા સંભવ નથી;...’ અપૂર્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન, એમ લઈ લેવું. આત્મજ્ઞાન છે તે અપૂર્વજ્ઞાન છે. કોઈ દિવસ પ્રાપ્ત થયું નથી અને તે અપૂર્વજ્ઞાન ‘અપૂર્વ વિચાર વિના ઉત્પત્ત થવા સંભવ નથી,...’

અપૂર્વ વિચાર એટલે આત્મ-કલ્યાણ સંબંધીનો અપૂર્વ વિચાર. અને આપણે પ્રારંભની આત્મકલ્યાણની ભાવના કહીએ છીએ. આ વિષય થોડો વધારે છણાવટ કરવા જેવો લાગે છે. જે કોઈ (જીવો) ધાર્મિક ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે, એ બધાં આત્મકલ્યાણની ભાવનાથી જાણે કરીએ છીએ એમ માનતા હોય છે. બધાં (જીવોમાં) (જે) અન્ય હેતુથી કરતાં હોય અને આપણે એમાં અત્યારે નથી ગણતાં. બીજા હેતુથી પ્રવેશ કરીને બીજી પ્રવૃત્તિ કરતાં હોય એનું કામ નથી. પણ સામાન્ય રીતે બીજો હેતુ ન હોય અને (આ વિષયમાં) બરાબર માથું મારતા હોય કે આમાં શું કહે છે ? (એ) મારે બરાબર સમજવું છે. મારે (આત્મહિત) કરવું છે. મારે સમજવું છે, કરવું છે. એ (એમ) માને કે આપણે આત્મકલ્યાણની ભાવનાથી કરીએ છીએ. પણ એ ઉપરછલ્લી ભાવના એવી હોય છે કે અનાથી કાંઈ વળતું નથી. આ અપૂર્વ વિચાર એટલે અપૂર્વ આત્મકલ્યાણની ભાવનાથી આત્મકલ્યાણ માટે ઉત્પત્ત થયેલો વિચાર. એટલી વાત એની અંદર ગર્ભિત છે.

પૂજ્ય બહેનશ્રીની ભાષામાં કહીએ તો ‘અંતરથી ઉત્પત્ત થયેલી ભાવના.’ ઉપર-ઉપરથી નહીં. (આ જીવ) ઉપર-ઉપરથી ભાવના કરીને દ્રવ્યલિંગી સુધી જઈ આવ્યો. ઉપર ઉપરથી ભાવના કરી અને અગિયાર અંગ સુધી જઈ આવ્યો. બાધ્ય ક્ષયોપશમજ્ઞાન અને બાધ્ય ક્ષયોપશમચારિત્રમાં (આટલી હદ સુધી જઈ આવ્યો). બને ક્ષયોપશમ ભાવે થયું, (પરંતુ) અંતરની ભાવના નથી થઈ. આત્મજ્ઞાન માટે અપૂર્વ આત્મભાવના અને અપૂર્વ આત્મકલ્યાણનો નિર્ધાર (થવો ઘટે છે). વિચાર એટલે નિર્ધાર - નિર્ણય, કે (આત્મહિત) કરી જ લેવું છે. કોઈપણ ભોગે કરી લેવું છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ ચિંતનમાં નહીં આવે. એટલે અપૂર્વજ્ઞાન ઉત્પત્ત થવા માટે અપૂર્વ વિચાર જોઈએ.

‘અને તે અપૂર્વ વિચાર,...’ હવે પાછા મૂળ મુદ્દા ઉપર આવ્યા. ‘તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા ચા પ્રકારે જીવને પ્રાપ્ત થાય...’ કે બીજા કોઈ પ્રકારે ન થાય. અપૂર્વ પુરુષ એટલે જ્ઞાનીપુરુષ કહો, સત્પુરુષ

કહો, એના ‘આરાધન વિના...’ જોયું ? એના ‘સત્સંગ વિના’ શબ્દ અહીંયા ન વાપર્યો. કેમકે અહીંયા આજ્ઞા લેવી છે ને ! આજ્ઞાનું આરાધન કરવું છે. તમને Home-work આપ્યું એ તમે કરીને કેમ આવતા નથી ? ચોખ્ખી વાત છે. Home-work આપ્યું કે ‘ઘરે જઈને પરિવારમાં પોતાપણું કરવાનું નહીં.’ (તો પછી) શું કરવા થાય છે, ભાઈ ? ‘પરલક્ષ કરવાનું નહીં’ (તો) શું કરવા પરલક્ષ થાય છે ? Home-work આપ્યું એ કરીને આવો. એ કામ કર્યું એનું નામ ‘આરાધન.’ સાંભળ્યું એનું નામ આરાધન નહીં. વિચાર્યુ એનું નામ આરાધન નહીં. (જે કામ આપ્યું હતું) કામ કર્યું કે નહીં ? એ અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા ચા પ્રકારે જીવને પ્રાપ્ત થાય ? કે એમાં બીજા કોઈ પ્રકારે (પ્રાપ્તા) ન થાય.

‘એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે;..’ જુઓ ! સમ્યક્દર્શન ન લીધું અહીંયા, ‘સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.’ (એમ કહ્યું છે). જો એક (વાર) જ્ઞાનીપુરુષની આજ્ઞાના આરાધનમાં આવ (તો) તને અપૂર્વ વિચાર થશે. તને અપૂર્વજ્ઞાન થશે, અને તું સિદ્ધપદ સુધી પહોંચી જઈશ. આ જગતનું સર્વોત્કૃષ્ટ અને મોટામાં મોટું કામ છે, અને એ કામની ચર્ચા ચાલે છે. ભાજીમૂળાની ચર્ચા નથી ચાલતી કે ‘ચાલો (આજ્ઞાને આપણો) Lightly’ લઈ લ્યો. ટીક છે ! એ તો જ્ઞાની (છે એટલે) એમ (કહે). (અને) જ્ઞાની એમ બોલે. આપણો પ્રયત્ન કરતા રહીશું. કરીશું... કરતાં... કરતાં... વળી કાંઈક થઈ જશે.’ (પણ એમ) બિલકુલ નહીં (ચાલે). એની Sincerity (ગંભીરતા) એટલી જ આવવી જોઈએ. Most sincere થઈ જવું પડે.

અત્યારે (પોતે) મનુષ્યભવમાં છે એ (પરિસ્થિતિ) પર્વતની ટોચે ટીંગાઈ ગયો છે અને નીચે ખીંચ છે. હાથ ધૂટી જાય તો ખીંચમાં પડે. એવી ચારગતિની ખીંચ પડી છે (અને પોતે) ટીંગાયેલો છે. હવે એ ટીંગાયેલો છે, એ જો પુરુષાર્થ કરીને ઉપર ન ચઢી જાય તો નીચે જ પડવાનો છે. ચાં સુધી ટીંગાઈને રહેશે ? હાથ થાકી જવાના છે. ચાં સુધી ટીંગાઈને રહેવાનો છે ? હાથનું બળ મર્યાદિત છે. એ જેટલું બળ છે એ બળમાંથી ઉપર ચઢીને બહાર નીકળી ગયો તો નીકળી ગયો, નહીંતર ગયો ખીંચમાં ! ચારગતિના દુઃખો આમંત્રણ આપી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ૫૦-૬૦ (વર્ષ) વટાવ્યા હોય એને

બધાંયને તો નજીકના આમંત્રણ છે. ચારંગિતના દુઃખો આમંત્રણ મોકલી રહ્યાં છે. જો જીવ સમજ જાય તો સારી વાત છે – પાછો વળી જાય તો સારી વાત છે. (નહીંતર આયુષ્ય પૂરું થયા પછી) બહુ ભ્યાનક સ્થિતિ છે ! ભયંકર પરિભ્રમણમાં સપડાઈ જાય એવું મોટું તોફાન – Cyclone ચાલે છે. ચાંચ મરે ને ચાંચ જન્મે ! ચાંચ જન્મે ને ચાંચ મરે ! કાંઈ ઠેકાણાં નહીં કોઈનાં.

‘જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે...’ જુઓ ! આજ્ઞાની આરાધનની વાત જ્યારથી જીવ માનતો થાય છે, ત્યારથી. - એટલે આજ્ઞાને માનતો થયો ત્યારથી. ‘ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.’ નહીંતર ચારે ચો દોષ પર્યાયમાં ઉત્પત્ત થઈ જશે એનું પોતાને ભાન નહીં રહે. પાછળથી ખબર પડે એનો કોઈ અર્થ નથી. બીજા દોષનું સહેજે (ઉપશમવું શરૂ થાય છે). જીવ એક નિશ્ચયમાં આવી ગયો કે, મારે આજ્ઞાનું આરાધન કરવું જ છે અને આ ભૂમિકામાં દર્શનમોહને મારે ગમે તેમ કરીને મંદ કરવો જ છે, એટલે જ્યાં-જ્યાં પોતાનો દર્શનમોહ થતો હોય એને પકડવામાં એકદમ જાગૃત થઈ જાય, ચકોર થઈ જાય કે મારા ઘરમાં (પરિણામનમાં) આ બધા કૂતરાં - બિલાડાં (દોષો) પેસવા મંડયા ! હું ચોકીદાર તરીકે બેઠો દું ને ! (આમ) ન ચાલે. એટલે (દોષને - દર્શનમોહને) પકડતો થઈ જાય. બસ ! (આ એક નિશ્ચયમાં આવે એટલે) બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું સહેજે - સહેજે થવાનું. એક આજ્ઞાના આરાધનમાં આવે અને કામ શરૂ કરે એટલે આખું અંદરનું ભવન ફરી જવાનું ! અંદરનું ભવન જ ફરી જવાનું. નહીંતર શું થશે ? સ્વાધ્યાય સ્વાધ્યાયના કાળે (થતો રહેશે) અને બાકીની જિંદગી બીજા (જીવોની જેમ પૂરી થઈ જશે). બંનેને કાંઈ લેવા કે દેવા ! કાંઈ સંબંધ નહીં રહે. સ્વાધ્યાય અભરાઈએ ચડી જશે અને જિંદગી આમને આમ ચાલી જશે !

એટલે આ એક વાતને (તેઓ) સરવાળે ચાં લઈ ગયા છે ? કે (કોઈપણ ધર્મ સાધન) પોતાની મેળે - પોતાની કલ્પનાએ નહીં કરતાં, જ્ઞાનીની આજ્ઞાએ કરે. આ એક જ મુદ્દો છે. તો અપૂર્વ એવું આત્મજ્ઞાન થાય, અને એ જ સિદ્ધપદનો ઉપાય છે. બીજો કોઈ સિદ્ધપદનો ઉપાય નથી. આમ જોઈએ તો આટલી વાતમાં એમણે Total મારી દીધો છે. પત્રનો આખો સારાંશ આપી દીધો છે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! ૧૪૭ પત્રમાં એમ કહ્યું છે કે, આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગમાં ટકવું બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ અસુલભ છે. આમાં Continuation માં ‘એકતાન’ શબ્દ બેવાર આવતો હોય તો શું ?

પૂજ્ય ભાઈશ્રી :- આરાધવું (એટલે) એકતાન થઈને આરાધવું, એમ કહે છે. ત્યાં ૧૪૭ (પત્ર)માં કૃપાળુદેવને એમ કહેવું છે કે, આરાધવું એટલે એકતાન થઈને આરાધવું, એક લયે આરાધવું, એક નિષ્ઠાએ આરાધવું, એક લક્ષે આરાધવું અને પૂરી શરી તથી આરાધવું. એમને એમ ઉપર ઉપરથી જરાપણ ઢીલું મૂકીને નહીં. એમ (કહેવું છે).

હવે, (આજ્ઞામાં) એકતાન થવું અસુલભ છે, એનું શું કરશ ? કે બીજુ બાજું બધાં મોહના પ્રકારો ભા છે. સંસારના મોહના બધાં પ્રકારો એમને એમ ભા છે. હવે અહીંયા (આજ્ઞામાં) એકતાન થવું હોય તો ત્યાંથી ભા થઈ જવું પડે. એ મોહની Seat ખાલી કરવી જ પડે. એટલે એ અસુલભ છે. એણે (મોહની સામે) લડવું પડશે, અને એ વખતે અંદરમાં જે Friction (ઘર્ષણ) ચાલે છે, લડાઈ ચાલે છે, (એ) એક વખત સરખાઈની ચાલે છે. એમાં જીતી ગયો તો કાયમ માટે જીતી ગયો. નહીંતર અનંતકાળથી હારતો આવ્યો જ છે. એમ છે. એટલે અસુલભ છે. એક વખત (તો) લડવું પડે છે. પોતાનાને પોતાના મોહ સામે પોતાને લડવું પડે છે. કેમકે આ મોહે અનંત શરી તવાળા પોતાના પરમેશ્વરને દબાવી દીધો છે. એના ઉપર બેઠો છે - દબાવીને છાતી ઉપર બેઠો છે, હલવા દેતો નથી. અનંત શરી ત અંદર ભરી છે પણ છાતી ઉપર ચઢી બેઠો છે. એવી ખરાબ પરિસ્થિતિ છે. (એટલે) એને પાડવો અને નબળો પાડવો. એ વાત તો જરા પ્રયત્ન કરે (ત્યારે) એને ખ્યાલ આવે એવું છે કે જરાક વાત અધરી છે - કઠણ છે વાત ! પણ જેણે નિર્ધાર કર્યો છે કે કોઈપણ ભોગે કરવું છે એને એટલું બધું કઠણ નથી લાગતું અને લાગે તોપણ તે એક વખત એ જીતી જાય. કેમકે એનો નિર્ધાર બળવાન છે.

જુઓ ! ત્યાં ૧૨૮ માં (પત્રમાં) શું કીધું. ? ‘એવું દૃઢત્વ આત્મામાંથી પ્રકાશે છે.’ રાગમાંથી નથી પ્રકાશતું. આત્મકલ્યાણની ભાવના રાગથી કરી છે કે આત્મામાંથી કરી છે ? બસ ! આ જ સવાલ છે. આત્મામાંથી કરી છે, તો વાંધો નથી. એ આત્માનું સત્ત્વ છે. રાગથી કરી હોય તો ગયો

(સંસારમાં) ! એટલે આત્મામાંથી પ્રકાશે છે, એમ લઘું છે. અંતરથી કહો, આત્મામાંથી કહો, એક જ વાત છે. એ રીતે કામ થાય છે. વાત બહુ સ્પષ્ટ છે (કે) કામ સ્પષ્ટપણે થવું જોઈએ. જેવી વાત સ્પષ્ટ છે એવું જ કામ ચોખ્યું, સ્પષ્ટ થવું જોઈએ.

આપણા ઘરે એક કામવાળી રાખીએ. રોજ કપડાં મેલાં રાખે ને રોજ વાસણ એઠવાડવાળા રાખે. એટલે આપણે એને ૨-૪ વખત બતાવી દઈએ કે, ‘જો આમાં શું છે ? કપડાં એવાંને એવાં મેલાં છે. તે બોળીને કાઢી નાખ્યા લાગે છે ! મહેનત ૪ નથી કરી અને વાસણ કાંઈ (બરાબર) ઉટક્યા જ નથી. નહીંતર આ બધું જાય નહીં ? એઠવાડ એમને એમ ચોંટયો છે.’ (એમ) એકવાર કહો, બે વાર કહો, પાંચવાર કહો, સાતવાર, દસવાર કહો, પછી શું કરો ? કાઢી મૂકીવી પડે. શું થાય ? કામવાળીને રજા જ આપવી પડે ને. કામ કરીને ન આવે તો શું થાય ? આમાં (પણ) એવું છે. કામ એટલું જ ચોખ્યું કરવું જોઈએ. જેવી આજા છે તેવું જ એકદમ ચોખ્યું કામ થવું જોઈએ. થોડું વહેલું-મોડું થાય એનો વાંધો નહીં પણ Sincere attempt જોઈએ. એકદમ ગંત્ભીર પ્રયત્ન (થવો જોઈએ) પછી વાંધો નથી. અહીં સુધી રાખીએ.



મુમુક્ષુજીવના આત્મકલ્યાણની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. તે બાબતથી અજાણ હોવા છતાં આજાકારિતામાં રહેલ જીવ પડતો બચી જાય છે અને છેવટ પામી જાય છે.—આ જેને સમજાતું નથી, તે પ્રાય: સ્વચ્છાંદે ચડી જાય છે અને સન્માર્ગથી દૂર થઈ જાય છે.

— પૂજ્ય ભાઈશ્રી  
(અનુભવ સંજીવની - ૧૫૨૦)

ॐ

‘શ્રીમદ્ રાજચંદ્ર’

પત્રાંક - ૫૬૦

મુંબઈ, પોષ, ૧૯૫૧

ॐ

જો શાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે શાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. શાનીપુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય છે તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જ્ય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જ્ય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષ્મકાળને વિષે સત્સંગની સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ છચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્ય કાળમાં ફળીભૂત થાય.

શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે શાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે શાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન - પરિણામનો હેતુ થાય.

‘સમયસાર’માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.

શાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ

પ્રારંભપ્રતિબંધપણો હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદ્ય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેધો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વ-સંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂજુચાં કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદ્યમાં રહે, તો અલ્ય કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્તા, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાનો વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુખુષુળ્ઘનને દેખાતી નથી. આ પ્રકારે જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર કર્યારેક ચારેક વિશેષ ઉદ્ય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાનો સંભવ રહે છે. એ જ વિનંતિ.

આ. સ્વા. પ્રણામ.



પ્રવચન - ૮

‘શ્રીમદ્ રાજયંત્ર’ પત્રાંક-૫૬૦

તા. ૨૧/૦૨/૧૯૮૮ - ભાવનગર

---

---

(શ્રીમદ્ રાજયંત્ર વચનામૃત) પત્ર ૫૬૦મો છે.

‘જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણો-ક્ષણો આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ?’ શું કહે છે ? કે જો જીવ દૃઢપણે જ્ઞાનીપુરુષનો આશ્રય કરે, (તો) આશ્રય કરે એટલે શું ? કે દૃઢપણે આજ્ઞાંકિત રહેવાનો પુરુષાર્થ કરે. અનું નામ દૃઢાશ્રાય છે. (અમાં ભાવ એ રહે છે કે) એમની આજ્ઞાએ રહેવું છે. જરાપણ એમની આજ્ઞા બહાર જવું નથી અને એ આજ્ઞામાં રહેતાં મારે જે કઈ મૂકવું પડે તે મૂકવા હું તૈયાર દું.

જેમકે કોઈની પ્રકૃતિ ઉતાવળી હોય. (તો) એણે ધીરજ રાખવાની. ઉતાવળા નહીં થવાનું, તે પછી ગમે તે પરિસ્થિતિ સહન કરવા તૈયાર થાય, પણ ધીરજ જ રાખે. (એને એમ થાય કે) મને આજ્ઞા છે. ધીરજ રાખવી, શાંતિ રાખવી તે મને આજ્ઞા છે. આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી ન થાય. એમ જેટલી જેટલી પોતાને લાગુ પડે એવી વાત હોય, ભલે સીધું ન કીધું હોય ! સત્સંગમાં (સમઝીગત) વાત ચાલી હોય, સામૂહિક ઉપદેશમાં વાત ચાલી હોય, તોપણ પોતે એને આજ્ઞાપણે અવધારણ કરી લ્યે. (જો આ પ્રકારમાં આવે તો) સ્વરૂપમાં (માત્ર) સ્થિર ઉપયોગ (થાય એમ) નહીં (પરંતુ) મોક્ષ થવો સુલભ છે. એમ કહે છે. મોક્ષ થવો પણ સુલભ છે. કેમકે જ્ઞાનીની આજ્ઞા કોઈપણ સ્તરે જીવને અટકવા દે એમ નથી. તમામ પ્રકારની પર્યાય દર્શિનો નિષેધ છે.

કઈ પર્યાયમાં અહમ્ કરવો છે ? અહંકાર કઈ પર્યાયનો કરવો છે ? તારા સ્વરૂપ સામે જો ને ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પણ (જેની સામે) કાંઈ નથી. (સ્વરૂપ સામે કેવળજ્ઞાનની પર્યાય) અનંતમા ભાગે (છે).

એનો અર્થ શું ? એક ટકો કે એક ટકાના હજારમાં ભાગનો અર્થ શું ? અરે ! એક ટકાનો એક અબજમો ભાગ ન થયો. મૂળ સ્વરૂપના એક ટકાનો એક અબજમો ભાગ પણ નહીં, અનું નામ અનંતમાં ભાગે છે. વસ્તુ (સ્વરૂપ)-આત્મસ્વરૂપ - પરમાત્મસ્વરૂપ - પરમપદ એટલું મહાન છે કે કઈ પર્યાયનો તારે અહંકાર કરવો છે ? તારા સ્વરૂપ આગળ ડેવળજ્ઞાનની પર્યાયની આ હાલત છે તો બીજી વિકારી પર્યાય, અધૂરી પર્યાય, બુદ્ધિની પર્યાય, આવડતની પર્યાય, કઈ પર્યાયનો અહંકાર કરવો છે તારે ? કોઈ સ્થાન જ નથી. એવી દ્રવ્યદ્વારિ પ્રગટ કરવાની જ્ઞાનીપુરુષની આજા છે. કોઈ દોષમાં જ ભોરહેવા ન હે. કોઈ સરે કોઈ દોષમાં ભોરહેવા ન હે. ઉપદેશની શુંખલા જ એવી છે. તો મોક્ષપદ છેક સુધી સુલભ છે. પૂર્ણ શુદ્ધિ (જ્યાં સુધી) ન થાય ત્યાં સુધી દોષમાં રહેવા જ ન હે.

જો મોક્ષપદ સુલભ છે. ‘...તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ...’ મુનિદશામાં ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીનતા થાય. ‘...તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ?’ એ સુલભ હોય. એ પણ સુલભ દશા છે. એ તો નીચેની દશા છે. ઉપરની દશા સુલભ હોય તો નીચેની દશા કેમ સુલભ ન હોય ? હોય જ. એમાં પ્રશ્ન જ રહેતો નથી.

‘કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.’ ક્ષણે ક્ષણે ઉપયોગ સ્થિર થાય એ તો હજુ અસ્થિરતા બતાવે છે. એકધારી એકાગ્રતા રહે તે સ્થિરતા બતાવે છે અને એ સ્થિરતાના ફળ સ્વરૂપે મોક્ષપદની ઉત્પત્તિ છે. એટલે જ્ઞાનીપુરુષના આશ્રયે આત્માનું પરમ કલ્યાણ સુલભ છે, તો નીચેના સરના બધાં Stage છે એ તો સુલભ જ છે.

મુમુક્ષુ :- ભાઈશ્રી ! દઢ આશ્રયની પૂર્વ ભૂમિકામાં પરિણામનમાં શું હોવું જોઈએ ?

પૂજ્ય ભાઈશ્રી :- આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના (હોવી જોઈએ). આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના (એવી હોય) કે ઓમના દઢ આશ્રયે મારું પરમકલ્યાણ સહજમાત્રમાં સધાય તો મારે દઢ આશ્રયમાં રહેવું જ જોઈએ, એમાં બીજી વાત કઈ હોય શકે ?

લાઈસન્સ પદ્ધતિમાં લાઈસન્સ હોય એ જ અની ઈન્ડસ્ટ્રી કરી શકે એવું છે ને ? અને સરકાર લાઈસન્સ આપતી ન હોય. અરજી તો બધાં કરે કે

અમને લાઈસન્સ આપો. એને ખબર હોય કે સરકારની લાઈસન્સ આપવાની નીતિ (કેવી) છે ? વચ્ચમાં એમ હતું ને ? કે નવી કાર બનાવવાનું લાઈસન્સ નહોતું મળતું. એટલે ફીયાટ ગાડી દીકરી જન્મે ત્યારે નોંધાવે તો એના લગ્ન વખતે એને ડિલિવરી મળે. ફીયાટ ગાડીની આ દશા હતી. અને ડબલ - ત્રણ ગણા પૈસા ઓનમાં બોલાતા હતા. હવે, એવો Monopolized business હોય એવી ઇન્ડસ્ટ્રીજનું લાઈસન્સ મેળવવા માટે તમને મિનિસ્ટરે દિલ્હીમાં સામેથી બોલાવ્યા હોય; Signing authority જે પ્રધાન હોય એ મિનિસ્ટરને લાઈસન્સ ઉપર સહી કરવાની ઓથોરીટી હોય (છે). (એવામાં) તમને સામેથી તેનું આવી ગયું હોય, જ્યારે એની ઓફીસે જીવ ત્યારે એનો પટાવાળો સામે મળે, (એ એમ કહે) ‘બેસો હમણાં હું કહું પછી અંદર જવાનું છે’ અને એને પણ મોહું થતું હોય એને ખબર હોય કે તમારે આ ટાઈમે આવી જવાનું છે. પછી આ ટાઈમે તો હું એનોજ છું. ટાઈમ સાંકડો થઈ ગયો હોય (ત્યારે) શું કરે પટાવાળાને ? પટાવાળો જેમ રાજી થાય (એમ કરે). - મિનિસ્ટર નહીં, મિનિસ્ટરનો પટાવાળો રાજી થાય એવું બધું કરે કે નહીં ? (એ એમ કહે) આ લે ૫,૦૦૦, આ લે - ૫૦,૦૦૦ કેમકે એને (નવા કારખાનામાંથી) કરોડો કર્માવાના છે. એ સહી કરનારો ફેટ-ભંગીયો ખુરસી ઉપર બેઠો હોય. (તો પણ આજુજુ કરે). અત્યારે તો બેસાડી હે છે ને શીડ્યુઅલ કલાસને ! તો એને (પણ) સલામ કરીને બેસે (અને કહે) ‘સાહેબ ! મારા જેવું કાંઈ કામ હોય તો અડધી રાતે મને બોલાવી લેજો. મદ્રાસથી દિલ્હી આવતાં મને વાર નહીં લાગે’ શું કહે ? જ્યારે લાભ મોટો થવાનો હોય ત્યારે જીવ કેટલો ગરજવાન હોય છે ! (દબ્બાંત કહેવા પાછળા) આશય શું છે ? બહુ મોટો લાભ થવાનો હોય તો જીવને કેટલી ગરજ થાય છે ! મોટો શેરીયો હોય તોપણ પેલા ભંગીયાની સામે કૂતરાની જેમ પૂંછડી પટપટાવે. ગલુડીયું જેમ આમ પૂંછડી પટપટાવે ને ! એવી રીતે એ પૂંછડી પટપટાવે. જો કૂતરો હોય તો (એવું કરે). એને ગરજની એવી લાગણી હોય. પેલા કૂતરાને બટકું રોટલો નાખે ને કેમ પૂંછડી પટપટાવે, એમ લાઈસન્સનું બટકું રોટલો નાખે ત્યાં એવી રીતે જ પૂંછડી પટપટાવે. તો (પછી) જેના આશ્રયે કેવળજ્ઞાન પ્રગટે, જેની આજાએ કેવળજ્ઞાન પ્રગટે એની ગરજ કેટલી હોય ! આપણી પાસે કંઈ હિસાબ-કિતાબ ખરો કે નહીં ? એમ કહેવા માંગે છે.

આત્મકલ્યાણ શું ચીજ છે ? અને સહજમાત્રમાં સુગમપણે કેમ સધાય છે ? અને કેવી રીતે સધાય છે ? એ સમજણ પડે એટલે દઢ આશ્રય આવે, નહીંતર ન આવે. એને Total નહીં. Partly Surrender ship કહેવામાં આવે છે. કેવી ? Total Surrender ship - સંપૂર્ણ શરણાગતિ.

‘જ્ઞાનીપુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય...’ એટલે એ ભૂમિકામાં (જે જીવ) આવી ગયો (એને એમ થાય) કે મને કંઈ વાંધો નથી. ‘...તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે;...’ એને કોઈ સાધન અધરું લાગે જ નહીં. એને કોઈ વાત કઠણ લાગે જ નહીં ને ! ગમે એ પ્રયોગ આપે નહીં જ્ઞાની ! એની પરિસ્થિતિ જોઈ એનો પ્રયોગ આપે. એને કંઈ અધરું લાગે જ નહીં. કેમ ? કે મારું પરમકલ્યાણ થવાનો (ઉપાય) આ મને બતાવે છે. મારે તો એ જ જોવાનું છે. આમાં તો કંઈ છે જ નહીં. મારા માટે તો કોઈ વાત કઠણ છે જ નહીં. કોઈ વાત અધરી છે જ નહીં. ન થઈ શકે એ પ્રશ્ન જ નથી. એ જે કહે એ થાય જ.

મુમુક્ષુ :- જ્ઞાનીના આશ્રયે આવે તો પ્રકૃતિ દોષ પણ એને અડતાં નથી.

પૂજ્ય ભાઈશ્રી :- પ્રકૃતિનું સમર્પણ કરી નાભે. પ્રકૃતિ છે એ આત્મા છે. અજ્ઞાન દશામાં પ્રકૃતિ જ આત્મા છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એનો અર્થ શું ? કે પ્રાણ છોડી શકે (પણ) પ્રકૃતિ ન છોડી શકે. (એને એમ ભાવ થાય કે) ‘મરી જાઉ તો બહેતર છે, પણ એમ તો નહીં જ ચાલે.’ ‘મરી જાઉ તો બહેતર છે પણ એમ નહીં થવા દઉં’ - એમ કહે. એ પ્રકૃતિ બોલે છે. (એ) આત્મા સાથે વણાઈ ગયેલો ભાવ છે. (આજ્ઞાંકિત જીવ) એને પણ સહજમાત્રમાં ચપટી વગાડે એમ છોડી દે. મારે આજ્ઞા એટલે આજ્ઞા, વાત પૂરી થઈ ગઈ.

‘આજ્ઞા એ જ ધર્મ છે.’ એટલા માટે એ સૂત્ર છે. જૈન શાસનમાં એક સૂત્ર છે. ‘આજ્ઞાએ ધર્મો.’ આજ્ઞા એ જ ધર્મ છે. ‘આજ્ઞાએ ધર્મો.’ અને જેમ આકરી તપસ્યા છે, તો કહે, ‘આજ્ઞાએ તવો.’ આજ્ઞા એ જ મારા માટે તપશ્ચર્યા છે, બીજું કંઈ હું સમજું નહીં. બધાં લૌકિક દૃષ્ટાંતો ઘણાં એવા આવી ગયા છે. આ ગુરુ ગોવિંદસિંહનો દૃષ્ટાંત છે.

મુસલમાન બાદશાહો હિન્દુસ્તાનની વસ્તીને - બધાંને મુસલમાન બનાવતા હતા. એક હાથમાં કુરાન (રાખે) અને બીજા હાથમાં તલવાર (રાખે). કુરાન

હાથમાં લઈને (કહે) ‘મુસલમાન થા, નહીંતર તલવારથી ડોફું ઉડાડી દઈશ.’ (આ રીતે) હજારો માણસો મુસલમાન થઈ ગયા. જયપુરના રાજાની બહેન સાથે અકબર પરણ્યો. ક્ષત્રિયાણીની દીકરી મુસલમાનના ઘરમાં ગઈ. એ લોકો તો ઘણી સ્ત્રીઓ રાખે. ક્ષત્રિયોની દીકરીઓને - રાજાઓની બહેન-દીકરીઓને પરણાવી છે. આ તો ઇતિહાસ બોલે છે. રાજા માનસિંહની હોસ્પિટલ છે ને? સવાઈ માનસિંહની હોસ્પિટલ જે છે જયપુરની અંદર - એ માનસિંહની બહેન અકબરના ઘરે બેઠી. એ લોકોએ એટલા જુલમો કરેલા. ગુરુ ગોવિંદસિંહ માટે એમ કહેવાય છે કે જો પંજાબમાં ગુરુ ગોવિંદસિંહ ન થયા હોત તો ‘સુજાત હોત સબકી’ બધાં મુસલમાન જ હોત. હિન્દુસ્તાનમાં હિન્દુનો એક બચ્ચો પણ ન હોત. બધાં મુસલમાન હોત.

જેલમ નદી છે. એના કાંઠે આ બાજુ મોગલોનું સૈન્ય પડ્યું છે અને આ બાજુ મુહીભર શીખલોકો છે. ઓલા તો બહુ મોટું સૈન્ય લઈને આવે સવારમાં એ લોકો જો યુદ્ધ કરે તો આ બધાંને મુસલમાન થઈ જવું પડે. (ગુરુ ગોવિંદસિંહે) રાત્રે બાર વાગે બધાંને છાવણીમાં બોલાવ્યા (અને કહ્યું) માથું ઉતારીને આપે એવા કોણ છે? એ મને કહો. હું એમ કહું કે મારે તમારું માથું જોઈએ છે તો પોતાની તલવારથી કાપીને ચોટલી પકડીને (માથુ) આપી દે કે લ્યો આ મારું માથુ. એવા જેટલા હોય તેટલા અહીંયા રહે અને બાકીના બધાં અહીંથી ચાલ્યા જાય - આ સૈન્યમાં મારે ન જોઈએ. એવા થોડાક માણસો નીકળ્યા. - એટલે ૧૦૦-૨૦૦ માણસો નીકળ્યા કે તમે કહો તો અત્યારે માથુ આપવા - ઉતારી દેવા તૈયાર છીએ. (એટલે ગોવિંદસિંહે કહ્યું) ‘હવે વાંધો નહીં આવે. આટલાં બસ છે. અત્યારે ને અત્યારે તમે આ નદીમાં પડો, તરીને અવાજ કર્યા વિના સામે કાંઠે પહોંચ્યો જાવ. આ (મોગલ) લોકો સૂતા છે એના ઉપર તૂટી પડો.’ બધાંને કાપી નાખ્યા. ઘતા હતા (તે) ઘમાં જ બધાંને કાપી નાખ્યાં. એ મુસલમાન બાદશાહ લડાઈ હારી ગયો અને હિન્દુસ્તાન મુસલમાન થતું બચ્યું, એમ કહેવાય છે. દેશને માટે લોકોને માથું આપવાની તૈયારી થાય છે. તો અનંત જન્મ-મરણથી બચવા માટે અભિપ્રાયમાં કેટલી તૈયારી હોવી જોઈએ! આ વાત છે.

એટલે એમ કહે છે કે, ‘તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે;...’ જે સત્પુરુષો થયા એ પણ એ રીતે સત્પુરુષો થયા

છે. એ પણ કોઈ જ્ઞાનીના આશ્રયે સત્પુરુષો થયા છે અને એમના અનુભવથી એમણે આ અંડ નિશ્ચય કર્યો છે. આ સિદ્ધાંત - આ નિશ્ચય ખંડિત થાય તેવો નથી, એમ કહેવું છે.

‘તો પછી એમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જ્ય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જ્ય કેમ ન થઈ શકે ?’ જો (જ્ઞાનીપુરુષના) વચનનો દૃઢ આશ્રય હોય તો સવાલ જ રહેતો નથી. ગમે તે વૃત્તિનો જ્ય થઈ શકે છે. કોધ, માન, માયા, લોભ કોઈપણ હોય નહીં. (જ્ય) થઈ જ શકે છે - ન થવાનો પ્રશ્ન જ રહેતો નથી. (બીજું) કંઈ નહીં (જો) (પણ) તું એટલું જોને કે મને શું મળે છે ? હું મારી વૃત્તિ ઉપર કાપ મૂકું છું કે મારી વૃત્તિની પકડ છોડું છું, એની સામે મને શું મળે છે ? આટલું જ જોવાનું છે. જો મને મારું પરમેશ્વર પદ મળતું હોય તો આ (વૃત્તિઓને છોડવાની વાત તો) કંઈ નથી, જગતનો પદાર્થ તો કંઈ નથી અને કોઈપણ વૃત્તિ (હો-તે) બધી દુઃખદાયી છે. જે કોઈ સંસારિક વૃત્તિ છે એ તો બધી આકુળતાજનક અને દુઃખદાયી છે, મલિન છે. એનું સમર્પણ કરવામાં શું વાંધો (છે) ? વૃત્તિ - સંસારવૃત્તિ પોતે મલિન ભાવ છે. તો એ મલિનવૃત્તિનું સમર્પણ કરવામાં શું વાંધો (આવે) ? એમાં વળી શું એવું છે ? પકડી રાખવા જેવું (શું છે) ? કે જે પકડી રાખતા જીવને અધોગતિ થાય છે. સ્વલ્ખી યથાર્થ સમજણ આવે તો સાવ સુગમ વાત છે - તદ્દન સુગમ વાત છે.

‘આટલું સત્ય છે કે આ દુષ્મકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ....’ એવો (આ) કાળ છે. કાળ એટલે એવા હીન પરિણામવાળા જીવો છે કે જેનો સંગ કરવાથી પરિણામ બગડે, બગડે ને બગડે જ. એટલે સારી રીતે દૃઢતાથી આશ્રય હોવો જોઈએ.

મુમુક્ષુ :- આપ લાભની જે વાત કરો છો તે લાગતું નથી તો એમાં શું આડુ આવે છે ?

પૂજ્ય ભાઈશ્રી :- સ્વલ્ખી સમજણ નથી. નહીંતર ગળિત તો ચોખ્યું જ છે. એક મરણથી બચવા તમે શું ખર્ચો કરો ? કહો જોઈએ ! બધું આપી દઈએ. કોઈ એમ કહે કે આ સંજીવની જરી બુઝી છે. સુંધો એટલે મરો જ નહીં. ફ ત એકવાર એને સૂંધી લ્યોને એટલે તમને મૃત્યુ જ ન આવે. (તમને) અમરપટો મળી જાય, બોલો ! શું આપો એને ? તમે જે કહો તે (આપી

દઈએ) ! ‘શરીર સલામત તો પદ્ધતીયા બહુત.’ જે આપ્યું તે તો તમે ગમે ત્યાંથી ભું કરી લેશો. જીવતા રહેશો તો (કમાઈ લેશો).

મુમુક્ષુ :- ભાઈશ્રી ! સામે મૃત્યુ હોય ને ત્યારે એવો ડર લાગે છે. અત્યારે એ ડર પણ નથી લાગતો. સામે મૃત્યુ આવે અને એમ કહે કે, બોલ હવે તારે શું કરવું છે ? ત્યારે આ જીવ ડરે એવું લાગે છે. એ રીતનું લાગે છે.

પૂજ્ય ભાઈશ્રી :- એટલે એનો અર્થ શું છે ? કે આ માર્ગ જન્મ-મરણથી મું ત થવાનો માર્ગ છે, એવું સમજાયું નથી. જેમ એક ૫૦૦ રૂપિયાની નોટ છે. અત્યારે કરન્સીમાં વધારે ખોટી નોટ ૫૦૦ રૂપિયાની છે ને ? અને એક આંબાચોકની લારીમાં ૫૦૦ રૂપિયાની નોટો રૂપિયાની ૧૦ મળ. કેટલી (મળો) ? એક રૂપિયો આપો તો ખોટી છાપેલી ૫૦૦-૫૦૦ રૂપિયાની ૧૦ નોટ આપે. છોકરાઓને રમવા માટેની હોય છે ને ? એક રૂપિયાની ૧૦ (આવે). પણ એ નોટોની ખબર છે કે, એના ઉપર ૫૦૦ રૂપિયા લઘું છે, ગવર્મન્ટ ઓફ ઇન્ડિયા, ૫૦૦ રૂપિયા, I Promise to pay એ બધું લઘું છે. પણ તમને ખબર છે કે આ તો એક રૂપિયાની ૧૦ વાળી છે એટલે ૧૦ પૈસાની એક છે. નવાદસ પૈસાનું એક કાગળીયું છે. નવાદસ પૈસાનું કાગળીયું જ છે. એમ તમને તીર્થકરના વચ્ચેનો એવા લાગે છે. કેવા (લાગે છે) ? કાગળીયા જેવા (આ) કાગળીયું લઘું છે એમાં છે શું ?

ખરેખર સાચી વસ્તુ છે. ઓલી ખોટી વસ્તુ ખોટી દેખાય છે. આ સાચી વસ્તુ ખોટી દેખાય છે. આમ થાય છે. અને એનું કારણ પોતાનો વર્તમાન પરિસ્થિતિ ઉપરનો મોહ છે. વર્તમાન પરિસ્થિતિ ઉપરનો જે મોહ છે તે સાચું દેખાવા દેતો નથી. જ્ઞાનને ભ્રમિત કરે છે. બુદ્ધિમાં ભ્રમ ઉપજાવે છે. સુખ નથી ત્યાં સુખ દેખાય છે. આધાર મળવાનો નથી એનો આધાર દેખાય છે. જે પોતાનું નથી તે પોતાનું દેખાય છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું લાગે છે. જે કરી શકતો નથી એને એમ માને છે કે હું કરું છું. ભોગવી શકતો નથી એને એમ લાગે છે કે હું ભોગવું છું. બુદ્ધિના ભ્રમમાંથી આ બધાં ભાવો ઉત્પન્ન થયા. એટલે યથાર્થ સમજણ ઉપર બધો આધાર છે. (અને) એના માટે સત્સંગની સમીપતા લીધી.

યથાર્થ સમજણ ન આવે તો આ માર્ગનું મૂલ્ય નહીં આવે. કિંમત નહીં

આવે ત્યાં સુધી એનો મહિમા નહીં આવે. ત્યાં સુધી એની Sincerity નહીં આવે. આવું બનવાનું.

**મુમુક્ષુ :- યથાર્થ સમજણ કેવી રીતે આવે ?**

**પૂજ્ય ભાઈશ્રી :-** પોતાની જાતને Involve (શામિલ) કરવી જોઈએ. પોતાની જાતને બરાબર Involve કરવી જોઈએ. જગતમાં તિર્યંગતિ તો નજરે દેખાય છે. એ પણ જીવ છે અને હું પણ જીવ છું. એના દુઃખો નજર સામે નથી (દેખાતા) ? તિર્યંગતિના દુઃખો નજર સામે નથી ? મન વગરના પ્રાણીઓ છે. ચાર ઈન્ડ્રિય, ત્રણ ઈન્ડ્રિય, બે ઈન્ડ્રિય, એકેન્ડ્રિય જીવો (છે). કેમકે જ્યારે એને મન એટલે વિચાર શરી ત મળી; મનથી વિચાર કરે છે ને ? એમાં એંઝો યથાર્થ પ્રકારે સમજણ ન કરી. મન ગુમાવવાનો વારો આવ્યો. તે પ્રાણીઓ મનરહિત કેમ થયા ? કે મન મણ્યું ત્યારે પોતાના આત્મકલ્યાણની ઉપેક્ષા કરીને વર્ત્યો. એટલા માટે એ મનરહિત થઈ ગયા. આમ (પોતાની જાતને શામિલ કરવી) પડશે.

એટલે બાર ભાવના અને વીસ દોહરાનો વિષય ફરી ફરીને લેવો. જ્યાં સુધી પોતાના આત્મા ઉપર એ વાતની અસર ન થાય ત્યાં સુધી એ વિષયમાં જ વિચારો ચાલવા જોઈએ. વિષયાંતર નહીં કરવો. ઉપદેશની હજારો ગમે વાતો છે. મને કામની વાત કઈ છે ? મને કઈ વાતની અસર થતી નથી ? કેમ નથી થતી ? શું કરવા નથી થતી ? (એમ) પાછળ પડી જવું જોઈએ. પાછળ પડી જવું જોઈએ. પછી ન થાય એ નહીં બને.

‘આ દુષ્મકાળને વિષે સત્સંગની સમીપતા કે દઢ આશ્રય વિશોષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ;...’ જુઓ ! અસત્સંગથી તો બહુ દૂર રહેવાનું. જરાપણ અસત્સંગ ન ચાલે. એક તો મારું ઠેકાણું નથી. સત્સંગની અસર મને થતી નથી. થવી જોઈએ એના પ્રમાણમાં (અસર થતી નથી). અને અસત્સંગ સેવાય તો મારી હાલત શું થાય ? અસત્સંગ છે એ મોટો દુશ્મન જ દેખાવો જોઈએ. મોટો અજગર દેખાવો જોઈએ, એને એની બીક લાગે. અસત્સંગ ન જોઈએ, મારે અસત્સંગ ન જોઈએ.

‘તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ છચ્છા કરવી,...’ એટલે શું ? એમ લાગે ને ? કે ભાઈ આ કઠણ છે. આમ થવું કઠણ છે. મારા માટે આ કઠણ છે. આ પ્રયોગ મને કઠણ

(પડે) છે. તો એની પહેલી છચ્છા કરવી. જે પ્રયોગ કઠણ લાગે એની પહેલી છચ્છા કરવી. - એ તો પહેલું કરવું છે અને એ વગર મારો નિવેદો નહીં આવે. મારા પરિણામમાં ફેર નહીં પડે એટલે પોતાના જે પરિણામો જે રીતે

ધા ચાલતા હોય એની સામે બળવો કરવો એમ એનો અર્થ થયો. શું કરવું ? બળવો કરવો. આ પરિસ્થિતિ તો મારે તોડે જ ધૂટકો છે. મારે આ ભવ ગુમાવવો નથી. મને આ ભવ મારું આત્મકલ્યાણ કરવા માટે જ મળ્યો છે. બીજું કાંઈ કરવા માટે મળ્યો જ નથી. એમ લાગવું જોઈએ. નહીંતર મનુષ્ય આયુષ્ય છે તે પાણીના પરપોટા જેવું છે. કેવું છે ? Air bubble (જેવું છે) પાણીનો પરપોટો ક્યારે ફૂટી જાય એ કાંઈ કહેવાય નહીં. તેથી 'મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ છચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્ય કાળમાં ફળીભૂત થાય.' પછી કોઈ સાધન કરો (એટલે) તરત જ એનું ફળ આવે. કેમકે પછી તો પ્રયોગ પદ્ધતિ હાથમાં આવી જાય છે.

એક વખત કઠણમાં કઠણ પ્રયોગ કર્યા પછી તો બધાં પ્રયોગ સહેલા લાગવાના અને એનું ફળ પણ તરત મળવાનું - પ્રયોગનું ફળ તત્કાળ મળવાનું.

'શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા. સંસારપરિશીળા થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો....' શાસ્ત્રમાં જ્ઞાનીને અભિજ્ઞ પરિણામી કહ્યાં છે. હવે એને કાંઈ સંસાર લાંબો નથી. તો(પણ) એમણે પુરુષાર્થ તો કરવો જ - મુખ્ય જ રાખવો. સમ્યક્દર્શન થઈ ગયું એટલે હવે વાંધો નથી - એવું જ્ઞાનીપુરુષને હોતું નથી.

બહેનશ્રીએ તો બહુ સરસ વાત લીધી છે કે ચક્કવર્તિની પુણ્ય પ્રકૃતિનો જ્યારે ઉદ્ય આવે છે ત્યારે એને જે કાંઈ એના પુણ્યના યોગ અનુસાર બધાં સાધનો ભા થાય, એમાં એની આયુધશાળામાં ચક્કરણ ઉત્પત્ત થાય. જેવી એને ખબર પડે, આયુધશાળાનો જે સુપરિન્ટેન્ડેન્ટ હોય એ આવીને વાત કરે, 'મહારાજા ! મહાન ચક્કની ઉત્પત્તિ થઈ છે. દેવો આવીને આપી ગયા છે. આપને આ શુભ સમાચાર દેવા આવો છું.' એટલે એ ટાઢો થઈને બેસી ન રહે કે, હવે વાંધો નહીં, હવે ચક આવી ગયું ને હાથમાં ! હવે ગમે ત્યારે આપણે લડી લઈશું. એ જેવી ખબર પડે એટલે એ હુકમ છોડે, 'ચલો !

તૈયારી કરો બધાં, સેના તૈયાર થાય બધી ! આપણે બધાં હાલવા માંડો ! છ ખંડ જીતવા નીકળો.' એમ સમ્યકુદર્શનરૂપી સુદર્શન ચક્ર પ્રાપ્ત થાય. એટલે ઓ ભોક્ષ લેવા માટે નીકળી પડે. પગ વાળીને બેસી ન રહે. એ પુરુષાર્થ કર્યા વગર રહે નહીં. એનો પુરુષાર્થ ચાલે જ. બહેનશ્રીએ (આવો) એક દાખલો આખ્યો છે, સમ્યકુદર્શન થાય એટલે મુજિ તનો પુરુષાર્થ ઉપાડે. પહેલા મુનિદશાનો (પુરુષાર્થ) ઉપાડે. મુનિદશા પછી મુજિ તનો (પુરુષાર્થ) ઉપાડે. તો જ પૂર્ણતાનું લક્ષ ગણાય ને ! નહીંતર પૂર્ણતાનું લક્ષ યાં રહ્યું ? વચ્ચે અટકી જાય તો (પૂર્ણતાનું લક્ષ કર્યાં રહ્યું) ?

'શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન - પરિણામનો હેતુ થાય.' એ જ્ઞાનીનો પુરુષાર્થ જોઈને બીજા જીવો પણ પુરુષાર્થમાં લાગે. કે ઓહો ! એ પોતે આવો પુરુષાર્થ કરે છે, જ્ઞાની થઈને પુરુષાર્થ કરે છે ! આપણે પણ કરીએ. જરા પણ આમાં આણસ કામમાં ન આવે. આપણે તો જરા પણ એની અંદર બેદરકાર રહેવું કામ ન લાગે. એમ આત્મકલ્યાણ સાધે છે, એ બીજાને પણ આત્મકલ્યાણ સાધવામાં નિમિત્ત થાય છે. હેતુ એટલે નિમિત્ત થાય છે. એવો આ એક સ્વપર હિતકારક માર્ગ છે. પોતાનું અહિત કરે એ બીજાના અહિતમાં નિમિત્ત થાય છે. પોતાનું હિત સાધે તો બીજાના હિતમાં નિમિત્ત થાય છે. આવી જ કોઈ પરિસ્થિતિ છે. (અહીં સુધી રાખીએ).



ॐ

‘શ્રીમદ્ રાજચંદ્ર’

પત્રાંક - ૮૧૯

મુંબઈ, માર્ગશીર્ષ સુદ્ર ૫, રવિ, ૧૯૫૪

ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગ ચાલતાં  
મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકખાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે  
વિચારવાનને પોતાનું નિર્વિર્યપણું જોઈને ઘણો જ થાય છે, અને આત્માને  
વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં  
ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે  
વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા  
નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન  
આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત  
સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.



પ્રવચન - ૧૦

**‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક-૮૧૯**

તા. ૨૫/૦૮/૧૯૮૮૬ – ભાવનગર

---

---

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - પત્ર - ૮૧૯. અંબાલાલભાઈ ઉપર પત્ર લખેલો છે. અંબાલાલભાઈ ઘણાં વખતથી પરિચયમાં આવ્યા છે, ભી તવંત છે. મુમુક્ષુ દશાના વિષયમાં પોતાની વિશેષ દશા નહીં થતી હોય, (એટલે) એનો ખેદ વર્તતો હશે. લાંબા સમય સુધી વિકાસ ન થાય તો મુમુક્ષુને ખેદ થવાનો સંભવ છે. (કૃપાળુદેવને) ઉત્તમું વર્ષ (ચાલે છે). (એટલે એમના પરિચયમાં આવ્યાને) સાત-આઠ વર્ષ થઈ ગયા. ૨૭માં વર્ષ પરિચયમાં આવ્યા છે, એટલે આઠેક વર્ષ થઈ ગયા, ઘણો સમય ગયો એટલે પોતાની દશા વિષે ખેદ થતો હશે. એ સંબંધમાં માર્ગદર્શન આપ્યું છે.

‘ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગ ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.’ (આમ કહીને) પ્રેરણા કરી છે. ઉત્સાહથી, ઉમંગથી, વીર્યાલ્લાસથી. શૂરવીરપણું એટલે શું ? ઉલ્લાસથી, ઉલ્લાસિત વીર્યથી જ્ઞાનીને માર્ગ ચાલવું. (મુમુક્ષુને) ખેદ થાય પણ એટલો ખેદ ન કરવો જોઈએ કે, જેથી એકદમ Depression માં આવી જવાય. બિલકુલ ખેદ ન થાય એ પણ બરાબર નથી. પોતે દશામાં આગળ ન વધે અને બિલકુલ ખેદ ન થાય તો એ પણ યોગ્ય નથી. અને એટલો બધો ખેદ થાય, ઘણો ખેદ થાય કે એકદમ પોતે Depression માં આવી જાય અને પુરુષાર્થ ઉપાડવા માટે એવા અભિપ્રાયમાં આવી જાય કે, મારાથી કંઈ કામ નહીં થાય તો ? Depression માં આવી જાય ત્યારે શું થાય ? કે, હવે મારાથી કેમ કામ થશે ? હું કેવી રીતે આગળ વધીશ ? નહીં વધી શકું તો ? એવા અભિપ્રાયમાં આવી જાય. એ પ્રકાર પણ હોવો યોગ્ય નથી. એવો પ્રકાર પણ થવો યોગ્ય નથી.

કોઈને ખેદ થોડો થાય છે, કોઈને ઘણો થાય છે. ઠીક છે, એ તો થવો ઘટે છે. આગળ ન વધે તો થવો ઘટે છે. કોઈને થોડો થાય, કોઈને વધારે

પણ થાય. એનું કોઈ ધોરણ નથી. પણ એની નીચેની હદ એટલી છે કે, એવા અભિપ્રાયમાં ન આવી જાય કે, હવે મારાથી પુરુષાર્થ નહીં ઉપડે તો ? હું પુરુષાર્થ નથી કરી શકતો અને નહીં કરી શકું તો ? એવી પોતાને વિષે પોતાને શંકા પડી જાય, એટલી હદ ખેદ નહીં થવો જોઈએ. એટલે કેવળ ‘ખેદ નહીં કરતાં....’ (એટલે કે) એ ખેદ કર્યા જ કરે, એ ખેદ કર્યા જ કરે - પછી એ એક જાતનો એક પ્રકાર ચાલુ થઈ જાય, તો એમ નહીં (થવું જોઈએ).

‘...શૂરવીરપણું ગ્રહીને....’ એટલે ઉલ્લાસિત વીર્યથી ‘....જ્ઞાનીને માર્ગ ચાલતાં....’ જ્ઞાનીના માર્ગ એટલે શું ? કે, જ્ઞાની જે કમ બતાવે છે તે કમે ચાલતાં. એ જ્ઞાનીનો માર્ગ છે. ચૌદ ગુણસ્થાનમાં, ચતુર્થ ગુણસ્થાનથી મોક્ષમાર્ગ શરૂ થાય છે. એ વાત તો પ્રસિદ્ધ છે કે, કોઈને પ્રથમ ચૌદું ગુણસ્થાન આવે - (પણ) પાંચમું કે છહું - સાતમું કે ઉપરનું કોઈ ગુણસ્થાન ન આવે. પછી ઉપર-ઉપરના ગુણસ્થાને ચેડે, એ મોક્ષમાર્ગ તો નિયત છે. ત્રણેકાળે નિયત છે - ચોક્કસ (છે). જે કાંઈ વિટંબણા છે એ મુમુક્ષુની ભૂમિકામાં છે. ચોથા ગુણસ્થાને પોતાનું સ્વરૂપ જોયું - પ્રત્યક્ષપણે અનુભવ કર્યો અને અનુભવની પદ્ધતિ પણ પોતે અંગીકાર કરી લીધી. એટલે હવે નિજઘરથી અજાહયો નથી અને નિજઘરના રસ્તાથી પણ અજાહયો નથી. એટલે એને એટલી વિટંબણા નથી. પછી તો આત્મગુણ પ્રગટ થયા છે, શર્ત ત વધતી જાય છે. પણ જે કાંઈ તકલીફ છે, વિટંબણા છે, મૂંજવણ છે - એ મુમુક્ષુની ભૂમિકામાં છે. જ્ઞાનદશા પ્રગટ થયા પછી મોક્ષ થવામાં અનંતકાળ નથી લાગવાનો. પણ જ્ઞાનદશા પ્રાપ્ત થવા પહેલાં અનેક પ્રકારના વિધવિધ ધર્મસાધન કરવા છિતાં પણ અનંતકાળથી મોક્ષમાર્ગ પામ્યો નથી. એટલે જે કાંઈ તકલીફ છે, વિટંબણા છે - એ મુમુક્ષુને છે. ત્યારે મુમુક્ષુ માટે જ્ઞાનીઓએ માર્ગ નક્કી કર્યા છે. જે જ્ઞાનદશાને પામ્યા અને જે કમે કરીને પામ્યા એ નક્કી કર્યું છે.

વિષય થોડો વિસ્તારવાળો એટલા માટે થાય છે કે, મુમુક્ષુની યોગ્યતા અનેક પ્રકારની છે. મુમુક્ષુની યોગ્યતા એક પ્રકારની નથી - અનેક પ્રકારની છે. એટલે એ મુમુક્ષુ ચાં ભો છે ? ચાં રોકાણો છે ? કેવી રીતે રોકાણો છે ? શું ભૂલ કરે છે ? કેવી જાતની ભૂલ કરે છે ? અને એને કેવી રીતે આગળ લઈ જવો, એનું જ્ઞાન જ્ઞાનીપુરુષને હોય છે. એટલે અંધારામાંથી એ અજવાળે લઈ જાય છે. મુમુક્ષુજીવ અંધારામાં ભો છે એને એ અજવાળામાં

લઈ આવે છે.

આ જે યોગ અને ધ્યાનના પ્રયોગો કરે છે ને ? એમાં ઘણાંને ઉલટું પડી જાય છે તો કોઈ પાગલ થઈ જાય છે. અને જે રીતે કહેવામાં આવે એ રીતે જો બરાબર ન કરે અને કાંઈક પોતાની રીતે કરવા જાય તો ગડબડ થઈ જાય. એમ આમાં પણ એવું છે. એ જ્ઞાનીના માર્ગ ન ચાલે અને જરાક સ્વચ્છફંદે ચાલે એટલે ચાંયનો ચાંય નીકળી જાય. એવો વિષય છે.

૭૮૩ (પત્રમાં) સોભાગભાઈ માટે એમ લખ્યુંને, શ્રી સોભાગનો જ્ઞાનીના માર્ગ ચાલવાનો અદ્ભુત નિશ્ચય, ‘જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.’ એ પ્રકારની વિશિષ્ટ યોગ્યતા સોભાગભાઈમાં હતી, એની એમણે પ્રશંસા કરી છે. અને કોઈ મુમુક્ષુ એટલું મજબૂત રીતે જો પકડી રાખે કે, ‘હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી, મને તો જે આજ્ઞા મળે એ પ્રમાણે મારે ચાલવું છે, અને આજ્ઞા બહાર બિલકુલ જવું નથી.’ એવું જો મજબૂતપણે પકડી રાખે તો એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ સુધી સુગમતાએ પહોંચી શકાય છે. એ Safeguard થઈ જાય છે. જ્ઞાનીને કારણે એ સહીસવામત રીતે માર્ગ સુધી - માર્ગની પ્રાપ્તિ સુધી પહોંચી શકે છે.

મુમુક્ષુ :- આ એનો Base ઓણે નક્કી કરવો જોઈએ.

પૂજ્ય ભાઈશ્રી :- હા, આ પાયો હોવો જોઈએ.

‘....જ્ઞાનીને માર્ગ ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.’ અને પોતાની મેળે ચાલતાં અનંતકળથી રખડયો. કેમ રખડયો ? પોતાની મેળે ચાલતાં. એ (વાત) ૨૦૦ નંબરની વચ્ચનાવલીમાં લીધી છે. જુઓ ! ચૌદ વચ્ચનો છે ને એમાં ચોથા નંબરનું વચ્ચનામૃત છે.

‘જ્ઞાની પ્રાપ્તિ જેણે છચ્છવી, તેણે જ્ઞાનીની છચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે.’ હું કહું છું એમ નહીં, બધાં શાસ્ત્રો પણ એમ જ કહે છે. ‘પોતાની છચ્છાએ પ્રવર્તતાં અનાદિ કળથી રખડયો.’ આ ભૂલ કરી છે. Heart-disease - હૃદયરોગ થાય તો એનો જે Heart-specialist કહે એમ કરવું પડે ને ? કે એમાં પોતાનું ડહાપણ ચાલે ? કે, તમે આ લાલ ગોળી કેમ લખી દીધી ? મને પીળી ગોળી કેમ ન આપી ? Heart ની તો આટલી બધી દવા છે - મેં ચોપડી વાંચેલી છે. તમે આ જ દવા કેમ આપો છો ? બીજી કેમ આપતા નથી ? (ડોક્ટર કહેશે કે) એ તારું

કામ નથી.

અમારે એકવાર એવું થયું હતું. ગુરુદેવને Blood cancer હતું ને ! પછી એના (ડૉક્ટરને) Haematologist કહેવાય છે. Blood expert હોય એને Haematologist કહે છે. મુંબઈના એક મોટા Haematologist પણે ગયા હતા. બધાં પ્રશ્નોની Query લઈને ગયા હતા. ચાર-પાંચ જણાનું Delegation ગયું હતું. એટલે અમે બધાં પ્રશ્નો પૂછીતા હતા. ડૉક્ટર તો સમજે કે, (ગુરુદેવ એક) મહાપુરુષ છે એટલે આ મોટા-મોટા માણસો પણ ચાર-પાંચ જણા ભેગા થઈને આવ્યા છે. એમણે પ્રશ્નો જોયા એટલે શું કહ્યું ખબર છે ? ‘આ વિષય સમજતા મને ૧૫ વર્ષ લાગ્યા છે. કેટલા ? ૧૫ વર્ષ લાગ્યા છે ! તમે ૧૫ મિનિટમાં આ વાત સમજવા માગતા હો તો એ તમે સમજી નહીં શકો. ભલે તમે મને ગમે તેટલા પ્રશ્નો પૂછો. તમને કહ્યું કે, આ રોગ છે, એટલે એમાં મીનમેખ નથી. તમે ગમે એને પૂછી વળો.’ અમે મુંબઈના ત્રણેય મોટા Haematologist ને મળેલા. જે International Fame વાળા હતા એવા (ત્રણેયને મળેલા). એમાં એક Tata ના Haematologist હતા. Tata Blood cancer ની હોસ્પિટલના (હતા). અને બીજા બે General practitioner હતા. એક જસલોક (હોસ્પિટલના) હતા. અને એક General practitioner હતા. પોતાનું Clinic હતું. ત્રણેનો એક જ મત નીકળ્યો કે, આમ જ છે. પણ અમે થોડા ડા ઉત્તરવા માટે પૂછપરછ કરી એટલે એમણે કહ્યું કે, ‘ભાઈ ! આ તમારું કામ નથી. બહુ Technical subject છે. આમાં ઘણી વાતો વિચારવાની હોય છે. અમને ભણતા-ભણતા ૧૫ વર્ષ નીકળી ગયા અને તમને ૧૫ મિનિટમાં (કેવી રીતે સમજાવું) ? તમે આ વિષયના Layman ગણાઓ. કેવા ગણાઓ ? સાવ Layman ગણાઓ. તમારો આ વિષય નથી. તમને ૧૫ મિનિટમાં કાંઈ સમજાશે નહીં. એ સમજાવવું મારા માટે મુશ્કેલ છે. તમને હું એ બરાબર છે.’ (પણ) કરવું શું ? No drug - No treatment - cancer ની કોઈ Drug નથી, એની કોઈ Treatment નથી. પણ અમને કાંઈ સંતોષ થાતો નહોતો કે, ‘નહીં, સારું થવું જ જોઈએ, સારું કરવું જ જોઈએ.’

અમ આ એથી પણ વધારે સૂક્ષ્મ માર્ગ છે. જગતની વિદ્યાઓ જેવો સ્થૂળ માર્ગ નથી. જગતની વિદ્યાઓ જેવો આ સ્થૂળ માર્ગ નથી. આ ઘણો સૂક્ષ્મ માર્ગ છે. એટલા માટે જ્ઞાનીના માર્ગ ચાલવું એ જ એક સહીસલામત

ઉપાય છે. એમાં સમજે નહીં અને પોતાની મેળે કરવા જાય કે, ‘હું સમજું છું’ - તો એવી રીતે તો અનંતવાર કર્યું છે અને અનંતવાર રખડયો પણ છે અને (જ્ઞાનીના માર્ગો ચાલે) તો મોક્ષ સુધી પહોંચવું સુલભ છે. પછી તો સમ્યંદર્શન થઈ જાય, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય.

(અહીંચા કહે છે), ‘વિષયકખાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વિર્યપણું જોઈને ઘણો જ બેદ થાય છે, અને આત્માને વારંવાર નિંટે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વા ચનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો બેદ કરીને અટકી રહેતા નથી.’ શું કહ્યું ? કે, મુમુક્ષુછ્લવને પોતાના પરિણામ જ્યારે ઉત્તરી જાય; વિષયકખાયાદિ જોર કરી જાય એટલે શું થાય ? કે, ચારેક પોતાના પરિણામ ઉત્તરી જાય, ત્યારે ‘...પોતાનું નિર્વિર્યપણું...’ એટલે પોતાનો પુરુષાર્થ કામ ન કર્યો, પોતે હારી ગયો, ઉદ્યની સામે પોતે હારી ગયો, એ જોઈને ‘ઘણો જ બેદ થાય છે,...’ અને થાય એ સ્વાભાવિક છે. મુમુક્ષુને એવો બેદ થાય તે સ્વાભાવિક છે.

‘અને (પોતાના) આત્માને વારંવાર નિંટે છે,...’ કે, અરે.... આત્મા ! તારો પુરુષાર્થ કેમ આગળ વધતો નથી ? તું પુરુષાર્થમાં ટકી કેમ ન શ ચો ? તું પુરુષાર્થથી કેમ ટકી ન શ ચો ? તાંતું બળ કેમ ન ચાલ્યું ? ‘ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ,...’ (અર્થાત્) એને પોતા માટે (તિરસ્કાર) થઈ આવે છે અને તે શું કરે છે ? ‘ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વા ચનું અવલંબન ગ્રહણ કરી,...’ આવા ઉદ્ય પ્રસંગોમાં મહાન પુરુષો પોતાના આત્માના શ્રદ્ધા-જ્ઞાનના પુરુષાર્થમાંથી વિચલિત થયા નથી. અને પુરુષાર્થપ્રેરક એમના જે વચનો તેને ગ્રહણ કરે છે. વચનો માત્ર વાંચી લ્યે છે એમ નહીં, વચનો ગ્રહણ કરે છે. એટલે એની અસર આવે છે. આત્મા ઉપર એ વચનોની અસર આવે છે.

મુમુક્ષુ :- મહાન પુરુષોના વચનો કેવી રીતે ગ્રહણ કરવા ?

પૂજ્ય ભાઈશ્રી :- મહાન પુરુષોના વચનો એટલે એમના જે ઉપદેશ વા ચો છે, તેની પોતે અસર લે છે. એમનું ચારિત્ર જોવે છે, એમનું આચરણ જોવે છે અને એમજો એ વખતે જે પોતાનો પુરુષાર્થ ઝોરવ્યો, એ જોઈને પોતે

પણ એ સંબંધી અમના જે વચનો છે, એની અસર પોતાના આત્માને વિષે ગ્રહણ કરે છે. એટલે એને વચન ગ્રહણ કર્યા એમ કહેવામાં આવે છે.

‘આત્માને શૌર્ય ઉપજાવી...’ જુઓ ! ખેદ કરીને Depression માં ન આવ્યા. આત્માને શૌર્ય ઉપજાવી (એટલે) એમાં પુરુષાર્થનો ઉપાડ કર્યો. પોતે પુરુષાર્થનો ઉપાડ કરીને, ‘તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે...’ બરાબર અંદરમાં લડાઈ કરે છે, એમ કહે છે. અવિવેકમલ્લ અને વિવેકમલ્લ બગ્નેની લડાઈ ચાલે છે.

મુમુક્ષુ :- સાચો ખેદ હોય, સ્વાભાવિક ખેદ હોય તો શું એ પોતે એક લડાઈ નથી ?

પૂજ્ય ભાઈશ્રી :- હા, એ પણ એક લડાઈ છે.

મુમુક્ષુ :- ખેદની માત્રા આપણે કઈ ગણવી કે આ છેલ્લી હદની માત્રા છે ? થોડો ખેદ થાય એટલે માની લેવું કે આ છેલ્લી માત્રા આવી ગઈ ?

પૂજ્ય ભાઈશ્રી :- ના, એમ નથી. પોતાને માટે શંકા પડી જાય કે, હવે હું પુરુષાર્થ નહીં કરી શકું તો ? મારો પુરુષાર્થ જ નહીં ઉપડે તો ? એવી જો શંકા પડે, એટલી હદ સુધી ખેદ ન થવો જોઈએ. એટલે એ ચર્ચા આપણે પહેલા કરી. ખેદ ઘણો થાય એનો વાંધો નથી, થોડો થાય એનો વાંધો નથી પણ એ ખેદને અંતે પુરુષાર્થ ઉપડવો જોઈએ. ખેદને અંતે પુરુષાર્થહીન થાય, એ ખેદ બરાબર નથી. અંતે શું થવું જોઈએ ? પુરુષાર્થ ઉપડવો જોઈએ. કોઈ અભિપ્રાયમાં આવી જાય કે, ‘હવે મારાથી કાંઈ નહીં થઈ શકે. હું વારંવાર હારી જાઉ છું. મારાથી કાંઈ નહીં થઈ શકે.’ તો એ યથાર્થ ખેદ નથી. આની અંદર બે પ્રકાર બને છે. જેને ખેદ આવે છે એને બે પ્રકાર બને છે. હતાશા કે નિરાશામાં આવવું જોઈએ નહીં. ખેદ થાય, થવો જોઈએ, થવો ઘટે છે; ન થાય તો પણ બરાબર નથી અને એટલો થાય કે નિરાશામાં આવી જાય તોપણ એ બરાબર નથી.

મુમુક્ષુ :- અમારો પ્રાણ પ્રશ્ન તો ખેદ ન થવાનો છે.

પૂજ્ય ભાઈશ્રી :- આ તો વ્યા તગત પત્ર છે. અંબાલાલભાઈને ઘણો ખેદ થયો હશે અને કૃપાળુદેવને એવું લાગ્યું હશે કે, આ ચાંક નિરાશામાં આવી જાય નહીં. આ મુમુક્ષુ કાંઈક નિરાશામાં (આવી જાય નહીં). સાત-આડ વર્ષથી પોતે જે પ્રગતિ કરવા ધારી હોય અને એટલે પ્રગતિ ન કરી

શ ચો હોય, અને ખેદ થતો હોય તો એ નિરાશામાં ન આવી જાય, એટલે માટે અને પુરુષાર્થની પ્રેરણા આપે છે. એમ છે.

**મુમુક્ષુ :-** ખેદ ન થાય તો પ્રતિપક્ષમાં શું થાય ?

**પૂજ્ય ભાઈશ્રી :-** સ્વચ્છંદ થાય. ખેદ ન થાય તો સ્વચ્છંદ થાય. પ્રતિપક્ષમાં સ્વચ્છંદ (થાય).

**મુમુક્ષુ :-** અહીંયા હવે Balance ની વાત આવી ગઈ. ખેદ પણ થવો જોઈએ અને Depression માં નહીં આવવું, એ પણ એક સંતુલનની વાત આવી.

**પૂજ્ય ભાઈશ્રી :-** હા, એ તો દરેક કામમાં Balance તો રહેવું જ જોઈએ. આપણે રોજ ખાઈએ છીએ ને ! તો એમાં પણ Balance રાખવું પડે. વધારે પડતું ખાઈ જાઓ તોપણ અશર્ટ ત આવે અને ઓછું ખાઓ તોપણ અશર્ટ ત આવે. ખાવાથી શરીર ત મળે. શું કહેવાય છે ? માણસ અને ખાય તો શરીર ત રહે. પણ વધારે પડતું અને ખાય તોપણ અશર્ટ ત થાય અને અદ્ધુત પણ પૂરું ન ખાય તો પણ અશર્ટ ત આવે. બજે વાત છે. (એટલે) દરેક કામમાં Balance તો રાખવું જ પડે. એની બજે બાજુની Range હોય છે, એ Range ની વચ્ચે ચાલવું પડે. એનું નામ યથાર્થતા. એમ (વાત) છે. દરેક કામમાં એવું છે.

**મુમુક્ષુ :-** ‘અતિ હઠ કરીને’ શબ્દ પ્રયોગ કર્યો છે. એમાં મક્કમતા કહેવું છે ?

**પૂજ્ય ભાઈશ્રી :-** હા, મક્કમતાની વાત છે. એટલે અંદરની જે લડાઈ છે એમાં તો બરાબર જોર રાખવું, એમ કહે છે. એમાં હારી જવું નહીં. (આ તો) અંદરની લડાઈ છે. વિવેકમલ્લ અને અવિવેકમલ્લ બજે લડે છે. જે બળવાન હોય એ સામાને પછાડે. વિવેક બળવાન હોય તો અવિવેકને પછાડે. અવિવેક બળવાન હોય તો વિવેકને પછાડે. આમ છે.

**મુમુક્ષુ :-** હઠ એટલે જીદ નહીં.

**પૂજ્ય ભાઈશ્રી :-** નહીં, અહીંયા જીદની વાત નથી. હઠ કરીને એટલે જોર કરીને, પુરુષાર્થમાં આવીને.

જ્યાં સુધી તેને હઠાવે નહીં, પછાડે નહીં, ‘....ત્યાં સુધી નીચે મને બેસતા નથી...’ વાતને મૂકી દેતા નથી. ‘નીચે મને બેસતા નથી’ એટલે વાતને મૂકી દેતા નથી.

**મુમુક્ષુ :-** આવું સંતુલન સમજને સાચી રીતે કરવાનું છે, કૃત્રિમતાથી

નથી કરવાનું.

પૂજ્ય ભાઈશ્રી :- હા, સમજણપૂર્વક બરાબર વ્યવસ્થિત રીતે આગળ વધવાનું છે. આ માર્ગમાં સમજણપૂર્વક વ્યવસ્થિત રીતે આગળ વધવાનું છે. અને મુમુક્ષુને દરેક ભૂમિકામાં જે પ્રકારની પ્રકૃતિ હોય એ જોર કરી જાય છે. કોઈની પ્રકૃતિ હોય તો ગુરુસો થઈ જાય, માનની પ્રકૃતિ હોય તો માન થઈ જાય, માયાની પ્રકૃતિ હોય તો માયા થઈ જાય, લોભની પ્રકૃતિ હોય તો લોભ થઈ જાય. પ્રકૃતિ જોર કરે એ વખતે લડવું પડે. અની સામે લડવું પડે કે, હવે હું તારું ચાલવા દઈશ નહીં. હવે મારે માથે એવા કોઈ ઘણી છે ! અને અને લઈને મને બળ છે. એ (મારું) Backing છે. હવે હું તને જીતવા નહીં દઉં. અને હું હવે હારવાનો નથી.

મુમુક્ષુ :- પ્રેરણ પત્રમાં આ વાત લીધી છે.

પૂજ્ય ભાઈશ્રી :- પ્રેરણમાં જોઈએ. સોભાગભાઈ ઉપરનો પત્ર છે - પાનું - ૪૪૭ ‘જો શાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણો ક્ષણો આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠળા માર્ગ તે શાનીપુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? મોક્ષ મળતો હોય તો એમાં (તો) કાયમ સ્થિરતા (રહે) છે, તો પછી અલ્ય સ્થિરતા કેમ ન આવે ? ‘કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. શાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે;...’ જુઓ ! વાત કેવી સ્પષ્ટ લીધી છે ! પોતાના અનુભવની આ બધી વાતો લખી છે. ‘શાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન...’ (અર્થાત્) ધર્મના સર્વ સાધન ‘સુલભ થાય...’ (અટલે) સર્કણ થાય. ‘એવો અખંડ નિશ્ચય...’ (અટલે કે) એમાં કાંઈ ગડબડ નથી. ‘અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી એમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જ્ય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જ્ય કેમ ન થઈ શકે ?’ ગમે એવા પ્રકૃતિ જોર કરતી હોય (તોપણ તેને) જીતી શકાય છે. ચોક્કસપણે જીતી શકાય છે, એમ કહે છે.

એવા પ્રકાર બન્યા છે, એવા પ્રકાર બને છે કે, મુમુક્ષુનું આખુ જીવન બદલાઈ જાય ! તમે અને થોડા વર્ષ પહેલા જોયો હોય, થોડા વખત પહેલા જોયો હોય અને પછી ઓઝો જે પલટો ખાદો હોય અને દૃઢપણો શાનીની આજ્ઞાને

અનુસરતો થયો હોય (તો) પ્રકૃતિના ભૂક્કા બોલાવે ! અને ચાંક થોડી-ઘણી પછાડ ખાય તો વળી બેઠો થઈને જોર કરે. પણ પહેલામાં અને પછીમાં તો બદુ મોટો ફેર પડે. આખો માણસ જાણો ફરી ગયો ! આખો માણસ જ બદલાઈ ગયો હોય એવું લાગે !

મુમુક્ષુ :- દોડતો હોય એ કોઈવાર પડે તો એને માફ કરાય પણ જે દોડે જ નહીં એને કોઈ માફ કરે ?

પૂજ્ય ભાઈશ્રી :- એ તો છે. પુરુષાર્થ તો કરવો જ જોઈએ.

‘આટલું સત્ય છે કે આ દુષ્મકાળને વિશે સત્તસંગની સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ....’ આ કાળમાં બહારના અસત્તસંગ આદિની પરિસ્થિતિ એવી છે - એવી પરિસ્થિતિ છે કે એમાં સત્તસંગ વિશેષ જોઈએ અને દૃઢપણે આશ્રય કરવો જોઈએ. ‘અને અસત્તસંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ;....’ (અર્થાતુ) આધા જ રહેવું. અસત્તસંગના પ્રસંગોથી દૂર જ રહેવું.

‘તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ છચ્છા કરવી,...’ એટલું એને શૌર્ય આવવું જોઈએ, ઉલ્લાસ હોવો જોઈએ કે, ગમે તેવા ઉદ્યમમાં હું હવે હારવાનો નથી. ‘કે જેથી સર્વ સાધન અલ્ય કાળમાં ફણીભૂત થાય.’

‘શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો,...’ જ્ઞાનીએ પણ પુરુષાર્થ મુખ્ય રાખવો ! ‘કે જે બીજા જીવને પણ આત્મસાધન - પરિણામનો હેતુ થાય.’ એમનો પુરુષાર્થ જોઈને બીજા જીવને પણ પુરુષાર્થની પ્રેરણા મળે. શરૂઆતમાં એ વાત છે.

એટલે (અહીંયા ૮૧૮માં) એમ કહે છે, ‘ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી.’ એકલો ખેદ કરીને અટકી ન રહે. પુરુષાર્થ કર્યા વિના રહે નહીં. પુરુષાર્થ ચાલુ જ રાખે. ‘એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે.’ એટલે અહીંયા પુરુષાર્થની વૃત્તિ લેવી. ‘એ જ વૃત્તિ...’ એટલે પુરુષાર્થની વૃત્તિનું આલંબન આત્માર્થી જીવોએ લીધું છે. આત્માર્થી જીવો પુરુષાર્થ કરે છે.

આપણો ભાવનાનો વિષય ચાલે છે. ત્યારે ભાવનામાં અને રાગમાં ફેર શું ? અથવા ભાવના અને છચ્છામાં ફેર શું ? એ પ્રશ્ન આપણો ચર્ચાય છે.

જે પુરુષાર્થ સહિત હોય તે ભાવના (ઇ). પુરુષાર્થ વિના (માત્ર) વિકલ્પ આવે એ ભાવના નહીં, એ છચ્છા છે - વિકલ્પ છે, એમ લેવું. એટલે આત્માર્થી છે એણે તો પુરુષાર્થની વૃત્તિનું અવલંબન લીધું છે.

‘અને તેથી જ અંતે જ્ય પામ્યા છે.’ (અર્થાત્) પુરુષાર્થ કરે અને એનો વિજય ન થાય, એવું બનતું નથી. પુરુષાર્થ કરે એ જ્ય પામે, પામે ને પામે જ (એ) Guaranteed (વાત છે). ‘આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હદ્યમાં સ્થિર કરવા યોગ્ય છે.’ આ વાતને મુખ્ય કરવી અને મુખ્યતા રાખીને એને હદ્યમાં સ્થાન આપવું.

મુમુક્ષુ :- ૮૧૩ પત્ર પણ અંબાલાલભાઈને લખ્યો છે એમાં પણ આવી જ વાત છે.

પૂજ્ય ભાઈશ્રી :- હા, એ પણ અંબાલાલભાઈ ઉપરનો જ પત્ર છે. ‘ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંકમણ થઈ આવે છે,...’ વાસના એટલે અહીંયા સંસ્કાર (લેવા). ‘અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે;...’ ઉપરની ભૂમિકાઓમાં પણ એટલે મુમુક્ષુ આગળ વધ્યો હોય એની વાત કરે છે. સામાન્ય મુમુક્ષુની વાત નથી કરતા. કાંઈક આગળ વધી ગયો હોય, ઉપરની ભૂમિકાએ ચઢ્યો હોય, એવા મુમુક્ષુને પણ પૂર્વ સંસ્કારથી પછાડ ખાવાનો વારો આવે છે. ‘આકુળ-વ્યાકુળ કરી દે છે;...’ એટલે ઘણીવાર પછાડ ખાય જાય છે.

‘વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે;...’ હવે આગળ નહીં વધી શકાય, (એમ થાય). એવી પછાડ ખાય (કે એને એમ થઈ જાય કે), ‘માર્યા ! ભારે થઈ ગઈ ! આ જગ્યાએ કોધ નહોતો કરવો અને મારાથી ગુસ્સો થઈ ગયો’ અને એકદમ પરિણામ ઉતરી જાય. એકદમ પરિણામની (જે) Line મુમુક્ષુની ભૂમિકામાં ચાલતી હોય એ એક વખત Disturb થી જાય. શું થાય ? Disturb થઈ જાય. એવું બને છે, ઘણીવાર વાત નાની હોય, પણ પ્રકૃતિ જોર કરી જાય એટલે મોટી વાત થઈ જાય. એને નુકસાન મોટું થઈ જાય. નાની વાતમાં નુકસાન મોટું થઈ જાય અને એમ લાગો કે, હવે આગળ નહીં વધી શકાય.

‘અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે.’ વારંવાર પછાડ ખાય. વર્તમાન ભૂમિકામાં પણ સ્થિર રહી શકે નહીં. એવા અસંખ્ય

અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ સ્થિર બને છે,...’ એવા અસંખ્ય પરિણામ મુમુક્ષુની ઉપરની ભૂમિકામાં પણ બને છે. ‘તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્રયકારક નથી.’ એટલે નીચેની ભૂમિકામાં એમ બને (એ કંઈ આશ્રયકારક નથી). શુભેચ્છા એટલે શું ? કે, પોતાને ભાવના થઈ હોય કે, મારે આત્મકલ્યાણ કરી લેવું છે. પણ હજુ એટલો આગળ ન વધ્યો હોય. તો એને તો એવા અંતરાયના પરિણામ આવે એ સ્વાભાવિક છે. ઉદ્યમાં એ ખેંચાય જાય એ સ્વાભાવિક છે. એમ (કહેવું છે). એ કંઈ આશ્રયકારક નથી.

‘તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદસ્તિ કરવી અને શૂરવીરપણું રાખવું...’ એ જ વાત લીધી છે. ૮૧૩ પત્ર આસો વદ, ૭ લખ્યો છે અને ૮૧૮ માગસર સુદ, ૫ નો પત્ર છે. કારતક અને માગસર - એમ બે મહિનાના ગાળામાં એમના ઉપરના બે પત્રો છે. એ બનેમાં એક ૪ વિષય લીધો છે. ૮૧૪ અને ૮૧૬ પણ અંબાલાલભાઈ ઉપરના છે. પણ ૮૧૩ અને ૮૧૮ માં બનેમાં લગભગ વિષય સરખો છે. ૮૧૪ અને ૮૧૬માં જુદો જુદો વિષય લીધો છે. એટલી વાત છે.

‘તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્રયકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા...’ (અર્થાતું) એવા પરિણામ ચારેક થઈ જાય તો એનાથી ખેદ નહીં પામતા, ‘....આત્માર્થી જીવે પુરુષાર્થદસ્તિ કરવી....’ હવે (અહીંયા) ‘...ખેદ નહીં પામતા...’ એટલે શું ? નિરાશામાં નહીં આવતા, એમ લેવું છે. જરાય ખેદ ન થાય એવું તો બને નહીં. ખેદ તો થાય, થઈ આવે. પણ પાછો પુરુષાર્થ ઉપાડે તો એ ખેદ થયો એ યથાસ્થાને થયો. અને જો પુરુષાર્થ ન ઉપાડે તો એ યથાસ્થાને ખેદ થયો નથી. કાં તો પૂરતો નથી. થયો અને કાં તો વધુ પડતો થયો છે એમ છે. એ બને બરાબર નથી.

જુઓ ! માર્ગદર્શનની ચાં જરૂર પડે છે ? અહીંયા માર્ગદર્શનની જરૂર પડે છે. પોતાની મેળે એને ઘ્યાલ ન આવે કે, આમાં હવે શું ફરક પડયો, કેવી રીતે થયું ? કેવી રીતે ન થયું ? નિરાશ થઈ ગયો હોય (પણ) એને ઘ્યાલ ન આવે કે, હું કેમ નિરાશ થઈ જાઉં છું ? અને ખેદ થાય તોપણ પુરુષાર્થ ન ઉપડે તો એ ખેદ થયો શું કામનો ? અધૂરો થયો અથવા વધુ પડતો થયો - પણ પુરુષાર્થ કેમ ઉપડે ? એ એને જ્ઞાનીના સત્સંગ વગર

આગળ ચાલવું મુશ્કેલ પડે છે. એ આના જેવું છે કે, ડોક્ટરની દવા લે અને લાગુ ન પડે તો ફરીને જાવું પડે કે ન જાવું પડે ? (ત્યાં જઈને કહે કે) ‘સાહેબ ! તમે અઠવાડિયાનો Course આપ્યો હતો. દવા પૂરેપૂરી લેવાઈ ગઈ પણ મને હજુ કાંઈ ફાયદો નથી.’ ફરીને એણે ડોક્ટરને Consult કરવા જ પડે. એમાં બીજું શું કરે ? દવા લીધા પછી પણ જો ફાયદો ન થાય તો શું કરવું ? ફરીને જાવું પડે. (ડોક્ટરને એમ કહે) ‘તમે કાંઈક ફરીને વિચારો. આમાં કાંઈક રહી જાય છે. કાંઈક આમા રહી જાય છે. મારો Case સીધો સાદો નથી કે, તમારી દવા ખાઈને મટી જાય.’ પછી (ડોક્ટરે) બીજા સંભવિત Complication ચા- ચા હોય એ વાત વિચારીને ફરીને નવી Treatment શરૂ કરવી પડે. એવું આમા છે. Under strict medical supervision treatment લેવી પડે. હઠીલા રોગ હોય ત્યાં શું થાય ? એવા જે જલ્દી મટે નહીં એવા રોગ હોય, દુઃસાધ્ય જેને કહેવામાં આવે છે, કેવા ? દુઃસાધ્ય હોય - ત્યાં એને બધી બાજુથી પૂછે કે, તમે આવું કંઈક ખાઈ લીધું હતું ? શું-શું થયું ? મેં તમને કહ્યું હતું એ બધી પરેજની મર્યાદામાં રહ્યા છો ? કે કાંઈ ગડબડ કરી છે ? પછી એણે બધી ઉલટતપાસ પણ કરવી પડે.

**મુમુક્ષુ :-** એટલે આનો અર્થ તો એ થયો કે, જે Reaction આવ્યું એ Reaction માં ખેટનો દોષ નથી પણ ગુરુગમના અભાવનો દોષ છે.

**પૂજ્ય ભાઈશ્રી :-** હા, ઠીક વાત છે. એમાં શું છે કે જેમ (મુમુક્ષુ) ઉપરની ભૂમિકામાં જાય એમ માર્ગ સાંકડો થતો જાય છે. સાંકડો થતો જાય છે એટલે શું ? કે, કોઈવાર સામાન્ય દોષ પણ એને મોટું નુકસાન કરે. એને એમ થાય કે, આટલામાં શું ? પણ એમાં એવું નથી. એની આખી Line disturb થઈ જાય. (એટલે) ઓકદમ ઓઝો પરેજમાં ચાલવું પડે. જે જ્ઞાની કહે (એમ જ ચાલવું પડે). જરાય આધો પાછો પગ ન મૂકે. બરાબર Line ઉપર ચાલ્યો જાય તો વાંધો ન આવે. એનું નામ ગુરુગમ છે.

**મુમુક્ષુ :-** એમાં શું ? એને ખબર નથી કે એટલામાં શું છે ! કેટલો મોટો સ્વચ્છંદ થઈ જાય. અને દોષની અનુમોદના થઈ ગઈ, એ બીજી વાત.

**પૂજ્ય ભાઈશ્રી :-** હા, (એમાં) દોષની અનુમોદના થઈ જાય. અથવા જો દોષનો બચાવ થઈ ગયો તો અભિપ્રાયની ભૂલ થઈ ગઈ. જ્ઞાને દોષ નાનો છે પણ જો દોષનો બચાવ થઈ ગયો તો અભિપ્રાયની ભૂલ થઈ ગઈ.

એટલે એને ખેદ બરાબર થવો જોઈએ. કેમકે અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થયા. એટલે ખેદ તો થવો જોઈએ. પણ નિરાશા ન આવે એટલો પ્રકાર એને હોવો જોઈએ અને ખેદને અંતે પુરુષાર્થ ઉપડવો જોઈએ. પાછો બરાબર બેઠો થાય, બાંધો ચડાવીને આગળ ચાલે ! એમ છે.

(અહીં ૮૧૩ પત્રમાં આગળ કહે છે) ‘તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદ્વારા કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્વય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું...’ (એટલે) સત્સંગ આદિ (યોગનું અનુસંધાન કરવું). ‘સત્સાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને...’ હઠ કરીને એટલે જોર કરીને. ‘....પણ મનને સદ્ગિયારમાં પ્રવેશિત કરવું...’ પણ આદું-અવળું જાવા દેવું નહીં. ‘અને મનના દુરાત્મ્યપણાર્થી આકુળ-વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદ્ગિયારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે....’ જરૂર પ્રાપ્તિ થાય. ‘મનના દુરાત્મ્યપણાર્થી...’ એટલે આત્માર્થી દૂર જાય છે. એવી જે મનની પ્રવૃત્તિ છે એમાં વિશેષ આકુળ-વ્યાકુળ નહીં થતાં એટલે નિરાશામાં નહીં આવતા, ‘ધૈર્યથી સદ્ગિયારપંથે જવાનો...’ (અર્થાતું) આત્મકલ્યાણના વિચારે ધીરજપૂર્વક જવાનો પુરુષાર્થ કરતાં, ‘ઉદ્યમ...’ એટલે પુરુષાર્થ કરતાં જરૂર વિજય થાય છે અને ‘ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે....’

‘અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે.’ એવા જીવને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. જે Disturbance થયો હતો એ છુટી જાય છે. પાછા પરિણામ શાંત થઈને લાઈનસર આગળ વધવા માંડે છે. જે પ્રકૃતિ જોર કરી ગઈ ત્યારે વિક્ષેપ પડી ગયો. પોતાની Line માં વિક્ષેપ પડ્યો એમ કહો, અંતરાય પડ્યો એમ કહો (બધું એકાર્થ છે). એ પાછો ફરીને પુરુષાર્થ કરે ત્યારે અનુસંધાન થઈ જાય છે. બાળક છે એ ચાલતા શીખે તો બે-ચાર વખત પડવા પછી પણ ચાલવાનું બરાબર રાખે તો દોડતો થઈ જાય. પણ ડરી જાય કે, ‘હું પડી જાઉં છું એટલે હવે નહીં ચાલું.’ તો (શું થાય) ? તો ચાલતા ન શીખી શકે. એણે હોશથી પાછું ચાલવાનું શરૂ કરવું જોઈએ. ભલે પડે, સંભવ છે પડવાનો, પગમાં એટલી શરીર આવી નથી અને હજી એટલી Practice નથી તો પડશે. પણ એણે ઉત્સાહથી ચાલવાનું રાખવું જોઈએ. ‘યોગદ્વિષસમુચ્ચય્ય’ વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.’ જુઓ ! એ વખતે એને એ ગ્રંથની જરૂર છે .આ

હરિભદ્રાચાર્યનો ગ્રંથ છે. સારો અધ્યાત્મગ્રંથ છે. એટલે એમણે સત્તુશુતમાં 'યોગદાષ્ટિસમુચ્ચય'નું નામ આપ્યું છે. કેમકે અમુક મૂળ વાતો લીધી હોય અને આત્માર્થી થઈને એ વાતો લીધી હોય - એટલે અમુક ભૂમિકામાં એ બધી સારી વાતો આવે છે. એ એમને અનુપ્રેક્ષા એટલે એનો અભ્યાસ કરવા માટે - વારંવાર વાંચવા માટે ભલામણ કરી છે. અહીં સુધી રાખોએ.



જ્ઞાન, ધ્યાન, જ્યુ, તપ, આદિ કોઈપણ કિયા સંબંધી, જ્ઞાનીપુરુષનું માર્ગદર્શન આત્માર્થી જીવ માટે પરમફળનું કારણ છે. - તેમ નિશ્ચય હોવો યોગ્ય છે. - દૃઢ નિશ્ચય એવા પ્રકારનો હોવો યોગ્ય છે, કે જેથી જ્ઞાનીપુરુષનું વચન શીરોધાર્ય થવામાં પાછળથી પણ બુદ્ધિ મચક ખાય નહિ, લોકસંજ્ઞાએ પણ તે વચન ગૌણ થાય નહિ - શાસ્ત્ર સંજ્ઞાએ પણ તે વચન પ્રત્યે શિથિલપણું આવે નહિ, કદાચ લોકસંજ્ઞા કે શાસ્ત્રસંજ્ઞા સંબંધી વિકલ્પ થાય, તો તે નિશ્ચે ભાંતિ છે, - તેમ લક્ષમાં હોય, તેવી ધીરજથી જ્ઞાનીપુરુષના વચનરૂપ આજ્ઞા અવધારવા યોગ્ય છે. તેવી યોગ્યતા પ્રાપ્ત થયે, માર્ગનું રહસ્ય જ્ઞાનીપુરુષ થકી, પ્રાપ્ત થાય છે; જેનું ફળ - પરમફળ છે. એવો સત્તુપુરુષોનો પરમ નિશ્ચય છે.

- પૂજ્ય ભાઈશ્રી  
(અનુભવ સંજીવની - ૫૮૩)

# श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट

## उपलब्ध प्रकाशन (हिन्दी)

ग्रंथ का नाम एवं विवरण

मूल्य

०१	जिणसासणं सब्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन)	०८-००
०२	द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग - पूज्य श्री निहालचंद्रजी सोगानीजीके पत्र एवं तत्त्वचर्चा)	३०-००
०३	दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन)	०६-००
०४	दंसणमूलो धम्मो (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार)	०६-००
०५	निर्ग्राति दर्शनकी पगड़ंडी (ले. पूज्य भाईश्री शशीभाई)	१०-००
०६	परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीखामीके १००८ वचनामृत)	
०७	प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई)	०४-००
०८	मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीखामीके विविध प्रवचन)	०८-००
०९	विधि विज्ञान (विधि विषयक वचनामृतोंका संकलन)	१०-००
१०	सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक)	१५-००
११	तत्त्वानुशीलन (भाग १-२-३) (ले. पूज्य भाईश्री शशीभाई)	२०-००
१२	अनुभव प्रकाश (ले. दीपचंद्रजी कासलीवाल)	
१३	ज्ञानामृत (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत)	
१४	मुमुक्षुता आरोहण क्रम (श्रीमद् राजचंद्र पत्रांक-२५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)	
१५	सम्यग्दर्शनके सर्वोत्कृष्ट निवासभूत छ: पदोंका अमृत पत्र (श्रीमद् राजचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)	१८-००
१६	आत्मयोग (श्रीमद् राजचंद्र पत्रांक-५६९, ४९१, ६०१ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)	२०-००
१७	परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद् राजचंद्र पत्रांक-१९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)	२०-००
१८	अनुभव संजीवनी (पूज्य भाईश्री शशीभाई द्वारा लिखे गये वचनामृतोंका संकलन)	१५०-००
१९	धन्य आराधना (श्रीमद् राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर पूज्य भाईश्री शशीभाई द्वारा विवेचन)	
२०	सिद्धपदका सर्वश्रेष्ठ उपाय	२५.००
२१	कुटुम्ब प्रतिबंध	२५.००

# વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ

## ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી)

### ગ્રંથનું નામ તેમજ વિવરણ

		મૂલ્ય
૦૧	ગુરુગુણ સંભારણા (પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સુચિત્ર ગુરુભ્રાત) ત	૦૫-૦૦
૦૨	જિષાસાસણં સંવન (જાનીપુરુષ વિષયક વચનામૃતોનું સંકલન)	૦૮-૦૦
૦૩	દ્વાદ્શ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાયેદેવ વિરચિત)	૦૨-૦૦
૦૪	દ્વાદ્શાંતિપ્રકાશ ભાગ-૩ (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીની તત્ત્વચર્ચા)	૦૪-૦૦
૦૫	દસલક્ષ્ણા ધર્મ (ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો)	૦૬-૦૦
૦૬	ધન્ય આરાધના (શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દારા વિવેચન)	૧૦-૦૦
૦૭	નિર્ભાત દર્શનની કેરીએ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)	૧૦-૦૦
૦૮	પરમાત્મપ્રકાશ (શ્રીમદ્ યોગીન્નદેવ વિરચિત)	૧૫-૦૦
૦૯	પરમાગમસાર (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮ વચનામૃત)	૧૧-૨૫
૧૦	પ્રવચન નવનીત ભાગ-૧ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)	અનુપલબ્ધ
૧૧	પ્રવચન નવનીત ભાગ-૨ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)	૨૫-૦૦
૧૨	પ્રવચન નવનીત ભાગ-૩ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ નય ઉપર ખાસ પ્રવચનો)	૩૫-૦૦
૧૩	પ્રવચન નવનીત ભાગ-૪ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ શા તથો ઉપર ખાસ પ્રવચનો)	૩૫-૦૦
૧૪	પ્રવચન પ્રસાદ ભાગ-૧-૨ (પંચાંતિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો)	૬૫-૦૦
૧૫	પ્રયોજન સિદ્ધિ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)	૦૩-૦૦
૧૬	વિધિ વિજ્ઞાન (વિધિ વિષયક વચનામૃતોનું સંકલન)	૦૭-૦૦
૧૭	ભગવાન આત્મા (દ્વાદ્શાંતિ વિષયક વચનામૃતોનું સંકલન)	૦૭-૦૦
૧૮	પથ પ્રકાશ (માર્ગદર્શન વિષયક વચનામૃતોનું સંકલન)	૦૬-૦૦
૧૯	સમ્યક્ક્ષાનાટીપિકા (લે. શ્રી ધર્મદાસજી કુલ્લક)	૧૫-૦૦
૨૦	આધ્યાત્મિક પત્ર (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજના પત્રો)	૦૨-૦૦
૨૧	અધ્યાત્મ સંદેશ (પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો)	પ્રેસમાં
૨૨	જ્ઞાનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃતો)	૦૬-૦૦
૨૩	બીજું કાંઈ શોધ મા (પ્રત્યક્ષ સત્પુરુષ વિષયક વચનામૃતોનું સંકલન)	૦૬-૦૦
૨૪	મુમુક્ષુતા આરોહણ ક્રમ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૪૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)	૧૫-૦૦
૨૫	સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ નિવાસમૃત છ પદનો અમૃત પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૮૩ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)	૨૦-૦૦

---

૨૬	આત્મયોગ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૫૬૮, ૪૮૧, ૬૦૮ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)	૨૦.૦૦
૨૭	પરિષ્ઠમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૮૫, ૧૨૮ તથા ૨૬૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)	૨૦.૦૦
૨૮	અનુભવ સંજીવની (પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દારા લિખિત વચનામૃતોનું સંકલન)	૧૫૦.૦૦
૨૯	સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૮૪, ૨૦૦ ૫૧૧, ૫૬૦ તથા ૮૧૮ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)	૨૫.૦૦
૩૦	કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, ૫૨૮, ૫૩૭ તથા ૩૭૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)	૨૫.૦૦

**વીતરાગ સત્ત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટમે સે**  
**પ્રકાશિત હુઈ પુસ્તકોંકી પ્રત સંખ્યા**

૦૧	પ્રવચનસાર (ગુજરાતી)	૧૫૦૦
૦૨	પ્રવચનસાર (હિન્દી)	૪૨૦૦
૦૩	અંચારિતકાયસંગ્રહ (ગુજરાતી)	૧૦૦૦
૦૪	અંચારિતકાય સંગ્રહ (હિન્દી)	૨૫૦૦
૦૫	સમયસાર નાટક (હિન્દી)	૩૦૦૦
૦૬	અષ્ટપાહુડ (હિન્દી)	૨૦૦૦
૦૭	અનુભવ પ્રકાશ	૨૧૦૦
૦૮	પરમાત્મપ્રકાશ	૪૧૦૦
૦૯	સમયસાર કલશ ટીકા (હિન્દી)	૨૦૦૦
૧૦	આત્મઅવલોકન	૨૦૦૦
૧૧	સમાધિતંત્ર (ગુજરાતી)	૨૦૦૦
૧૨	બૃહદ દ્રવ્યસંગ્રહ (હિન્દી)	૩૦૦૦
૧૩	જ્ઞાનામૃત (ગુજરાતી)	૧૦,૦૦૦
૧૪	યોગસાર	૨૦૦૦
૧૫	અધ્યાત્મસંદેશ	૨૦૦૦
૧૬	પદ્મનંદીપંચવિશતી	૩૦૦૦
૧૭	સમયસાર	૩૧૦૦
૧૮	સમયસાર (હિન્દી)	૨૫૦૦
૧૯	અધ્યાત્મિક પત્રો (પૂજ્ય નિહાલચંદ્રજી સોગાની દ્વારા લિખિત)	૩૦૦૦
૨૦	દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ (ગુજરાતી)	૧૦,૦૦૦
૨૧	દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ (હિન્દી)	૬૬૦૦
૨૨	પુરુષાર્થસિદ્ધિપાય (ગુજરાતી)	૬૧૦૦
૨૩	ક્રમબદ્ધપર્યાય (ગુજરાતી)	૮૦૦૦
૨૪	અધ્યાત્મપરાગ (ગુજરાતી)	૩૦૦૦
૨૫	ધન્ય અવતાર (ગુજરાતી)	૩૭૦૦
૨૬	ધન્ય અવતાર (હિન્દી)	૮૦૦૦
૨૭	પરમામગસાર (ગુજરાતી)	૫૦૦૦
૨૮	પરમાગમસરા (હિન્દી)	૪૦૦૦
૨૯	વચનામૃત પ્રવચન ભાગ-૧-૨	૫૦૦૦
૩૦	નિર્માત દર્શનની કેડીએ (ગુજરાતી)	૪૫૦૦
૩૧	નિર્માત દર્શનકી પગડંડી (હિન્દી)	૭૦૦૦

---

૩૨	અનુભવ પ્રકાશ (હિન્દી)	૨૦૦૦
૩૩	ગુરુગુણ સંભારણા (ગુજરાતી)	૩૦૦૦
૩૪	જિણ સાસણાં સવં (ગુજરાતી)	૨૦૦૦
૩૫	જિણ સાસણાં સવં (હિન્દી)	૨૦૦૦
૩૬	દ્વાદશ અનુપ્રેક્ષા (ગુજરાતી)	૨૦૦૦
૩૭	દસ લક્ષણ ધર્મ (ગુજરાતી)	૨૦૦૦
૩૮	ધન્ય આરાધના (ગુજરાતી)	૧૦૦૦
૩૯	ધન્ય આરાધના (હિન્દી)	૧૫૦૦
૪૦	પ્રવચન નવનીત ભાગ-૧-૪	૫૮૫૦
૪૧	પ્રવચન પ્રસાદ ભાગ-૧-૨	૧૫૦૦
૪૨	પથ પ્રકાશ (ગુજરાતી)	૨૦૦૦
૪૩	પ્રયોજન સિદ્ધિ (ગુજરાતી)	૩૫૦૦
૪૪	પ્રયોજન સિદ્ધિ (હિન્દી)	૨૫૦૦
૪૫	વિધિ વિજ્ઞાન (ગુજરાતી)	૨૦૦૦
૪૬	વિધિ વિજ્ઞાન (હિન્દી)	૨૦૦૦
૪૭	ભગવાન આત્મા (ગુજરાતી)	૨૦૦૦
૪૮	સમ્યક્જ્ઞાનદીપિકા (ગુજરાતી)	૧૦૦૦
૪૯	સમ્યક્જ્ઞાનદીપિકા (હિન્દી)	૧૫૦૦
૫૦	તત્ત્વાનુશીલન (ગુજરાતી)	૪૦૦૦
૫૧	તત્ત્વાનુશીલન (હિન્દી)	૨૦૦૦
૫૨	બીજું કાંઈ શોધ મા (ગુજરાતી)	૪૦૦૦
૫૩	દૂસરા કૃષ ન ખોજ (હિન્દી)	૨૦૦૦
૫૪	મુમુક્ષુતા આરોહણ ક્રમ (ગુજરાતી)	૨૫૦૦
૫૫	મુમુક્ષુતા આરોહણ ક્રમ (હિન્દી)	૩૫૦૦
૫૬	અમૃત પત્ર (ગુજરાતી)	૨૦૦૦
૫૭	અમૃત પત્ર (હિન્દી)	૨૦૦૦
૫૮	પરિભ્રમણના પ્રત્યાખ્યાન (ગુજરાતી)	૧૫૦૦
૫૯	પરિભ્રમણને પ્રત્યાખ્યાન (હિન્દી)	૨૦૦૦
૬૦	આત્મયોગ (ગુજરાતી)	૧૫૦૦
૬૧	આત્મયોગ (હિન્દી)	૨૦૦૦
૬૨	અનુભવ સંજીવની (ગુજરાતી)	૧૦૦૦
૬૩	અનુભવ સંજીવની (હિન્દી)	૧૦૦૦
૬૪	જ્ઞાનામૃત (હિન્દી)	૧૫૦૦

## વાચકોની અંગત નોંધ માટે

## વાચકોની અંગત નોંધ માટે



## ચી. તાને સ્મારણંજલી

બહુ પુષ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભઈ તયુ ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભત / પ્રભુદ્વ પ્રવચનકાર) ના કુટુંબમાં તો તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૯ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શઠીભાઈ શેઠ (જેઓ આપણે ત્યાં બે

વખત રહેલાં અને તને તેઓશ્રીની ભઈ ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણાથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શર્ટ ત, શાંતતા અને સ્થિતથી છલકાતુ હતું, તારું વ્યા તત્ત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તો આત્મહિતના મહાપંથે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ય અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાચ્યો, શ્રીગુરુની આજ્ઞા ભઈ તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સધાને માટે દુઃખદ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદ્યાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દઢ કરાવી રહી છે. આજ્ઞા ભઈ તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હદ્યભીની સ્મરણાંજલી અર્પાએ છીએ.

તું અને અમો સૌ શીધ્ર વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુશિલા શાહ

ચિ. મેઘા શાહ

ડૉ. અતુલ શાહ  
બીજા શાહ

સમીર જવેરી

તથા પીયર - શ્રીસુર પક્ષનાં સર્વ સ્નેહિ / સ્વજનો.

(ચિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છ.)



## શી. તાને સ્મારણાંજલી

બહુ પુષ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભી તયુ ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજ સ્વામીના અનન્ય ભ ત પ્રભુદ્વ પ્રવચનકાર) ના કુટુંબમાં તે તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૬ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણો ત્યાં બે વખત રહેલાં અને તને તેઓશ્રીની ભી ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિયથી કેળવાયેલ તારી ધાર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણાથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શરી ત, શાંતતા અને સ્થિતથી છલકાતુ હતું, તારું વ્યા તત્ત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ત અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અષાધ્યાર્થ અંતને પાખ્યો, શ્રીગુરુની આજ્ઞા ભી તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુઃખદ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થ જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દૃઢ કરાવી રહી છે. આજ્ઞા ભી તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હદ્યભીની સ્મરણાંજલી અપીએ છીએ.

તું અને અમો સૌ શીંગ વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાતમ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુશિલા શાહ

ચિ. મેધા શાહ

સમીર જીવેરી

ડૉ. અતુલ શાહ  
બીજા શાહ

તથા પીયર - શ્રીસુર પક્ષનાં સર્વ સ્નોહિ / સ્વજનો.

(ચિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)



## શી. તાને સ્મરણાંજલી

બહુ પૂજ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુનો ભી તથું ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભ. ત / પ્રભુદ્વ પ્રવચનકાર) ના કુટુંબમાં તેં તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૯ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણે ત્યાં બે

વખત રહેલાં અને તને તેઓશ્રીની ભી ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધાર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શર્ટ ત, શાંતતા અને સિમતથી છલકાતું હતું, તારું વ્યાર્ત તત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી ધીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ય અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાચ્યો, શ્રીગુરુની આજ્ઞા ભી તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી ધીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુઃખદ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદ્યાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, દૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દૃઢ કરાવી રહી છે. આજ્ઞા ભી તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ વદ્યભીની સ્મરણાંજલી અપીએ છીએ.

તું અને અમો સૌ શીંગ વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુશિલા શાહ

ચિ. મેધા શાહ

ડૉ. અતુલ શાહ  
બનિના શાહ

સમીર જવેરી

તથા પીયર - શ્રદ્ધાર્થ પક્ષનાં સર્વ સ્નેહ / સ્વજનો.

(ચિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)



## શ્રી. તાને સ્મારણાંજલી

બહુ પુષ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસકાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભર્ત તથું ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજ સ્વામીના અનન્ય જ ત / પ્રબુદ્ધ પ્રવચનકાર) ના કુટુંબમાં તેં તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૬ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણો ત્યાં બે વખત રહેલાં અને તને તેઓશ્રીની ભર્ત ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધર્મિક અભિરૂચી, યુવાનીમાં ઉગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણાથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શર્ત ત, શાંતતા અને સિમતથી છલકાતુ હતું, તારું વ્યાચિ તત્ત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ઉગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાય્યો, શ્રીગુરુની આક્ષા ભર્ત તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાયું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુઃખ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદ્યાય અમને સંસારની અત્યંત ક્ષાણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા ઢઢ કરાવી રહી છે. આક્ષા ભર્ત તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હદ્યતનીની સ્મરણાંજલી અર્પાયે છીએ.

તું અને અમો સૌ શીધ વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુરિલા શાહ

ધિ. મેધા શાહ

સમીર જવેરી

ડૉ. અતુલ શાહ

બીજા શાહ

તથા પીયર - શ્રીસુર પક્ષનાં સર્વ સ્નોહિ / સ્વજનો.

(ધિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)



## શ્રી. તાને સ્મારકાંજલી

બહુ પુષ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભર્તિ તથું ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભર્ત / પ્રભુજી પ્રવચનકાર) ના કુટુંબમાં તો તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૭ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણે ત્યાં બે

વખત રહેલાં અને તને તેઓશ્રીની ભર્તિ ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણાથી પરિપ વ બન્ની. તારું જીવન મેત્રી, સમજ શર્ટ ત, શાંતતા અને સ્થિતથી છલકાતું હતું, તારું વ્યાર્ત તત્ત્વ પ્રેમ, પ્રસંગતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તો આત્મહિતના મહાંપણે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ય અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાછ્યો, શ્રીગુરુની આજ્ઞા ભર્તિ તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સધાને માટે દુઃખદ વિયોગ થઈ પડવો.

તારી કાયમી વિદ્યાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દઢ કરાવી રહી છે. આજ્ઞા ભર્તિ તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હદ્યભીની સ્મરણાંજલી અર્પાએ છીએ.

તું અને અમો સૌ શીધ્ર વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુશિલા શાહ

ચિ. મેઘા શાહ

ડૉ. અતુલ શાહ  
બીજા શાહ

સમીર જવેરી

તથા પીયર - શ્રીસુર પક્ષનાં સર્વ સ્નેહ / સ્વજનો.

(ચિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)



## શી. તાને સ્મારણાંજલી

બહુ પૂજ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસકાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભી તથું ત દાદ ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભ ત / પ્રભુજ્ઞ પ્રવચનકાર) ના કુટુંબમાં તે તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૬ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણો તાં બે વખત રહેલાં અને તને તેઓશ્રીની ભી ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધાર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણાથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શરી ત, શાંતતા અને સિમતથી છલકાતુ હતું, તારું વ્યા તત્ત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ત અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાય્યો, શ્રીગુરુની આજ્ઞા ભી તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જભકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુઃખદ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થ જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દૃઢ કરાવી રહી છે. આજ્ઞા ભી તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હદ્યભીની સ્મરણાંજલી અપીએ છીએ.

તું અને અમો સૌ શીંગ વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાતમ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુશિલા શાહ

વિ. મેધા શાહ

સમીર જવેરી

ડૉ. અતુલ શાહ

બીજા શાહ

તથા પીયર - શ્રીસુર પક્ષનાં સર્વ સ્નોહ / સ્વજનો.

(ચિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)



## ચી. તાને સ્મરણાંજલી

બહુ પૂજ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુનો ભી તથું ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભ. ત / પ્રભુદ્વ પ્રવચનકાર) ના કુટુંબમાં તેં તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૯ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણે ત્યાં બે

વખત રહેલાં અને તને તેઓશ્રીની ભી ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધાર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શર્ટ ત, શાંતતા અને સિમતથી છલકાતું હતું, તારું વ્યાર્ત તત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી ધીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ય અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાચ્યો, શ્રીગુરુની આજ્ઞા ભી તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી ધીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુઃખદ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદ્યાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, દૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દૃઢ કરાવી રહી છે. આજ્ઞા ભી તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ વદ્યભીની સ્મરણાંજલી અપીએ છીએ.

તું અને અમો સૌ શીંગ વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુશિલા શાહ

ચિ. મેધા શાહ

ડૉ. અતુલ શાહ  
બનિના શાહ

સમીર જવેરી

તથા પીયર - શ્રદ્ધાર્થ પક્ષનાં સર્વ સ્નેહ / સ્વજનો.

(ચિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)



## શ્રી. તાને સ્મારણાંજલી

બહુ પુષ્ય કેરા પુંજીથી સદ્ગર્મ સંસકાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભર્ત તથું ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ / પૂજ્ય ગુરુદેવશ્રી કાનજ સ્વામીના અનન્ય જ ત / પ્રબુદ્ધ પ્રવચનકાર) ના કુટુંબમાં તેં તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૭ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.

બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજસ્વામી, પૂજ્ય બેનશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણો ત્યાં બે વખત રહેલાં અને તને તેઓશ્રીની ભર્ત ત / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પૂજ્ય શ્રી રાકેશભાઈની પ્રેરણથી પરિપ વ બની. તારું જીવન મૈત્રી, સમજ શર્ત ત, શાંતતા અને સિમતથી છલકાતુ હતું, તારું વ્યાચિ તત્ત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌભ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ર અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્ય વયમાં અણધાર્યા અંતને પાય્યો, શ્રીગુરુની આક્ષા ભર્ત તમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં જબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાયું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુઃખ વિયોગ થઈ પડ્યો.

તારી કાયમી વિદ્યાય અમને સંસારની અત્યંત ક્ષાણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા ઢઢ કરાવી રહી છે. આક્ષા ભર્ત તની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હદ્યત્બીની સ્મરણાંજલી અર્પાયે છીએ.

તું અને અમો સૌ શીધ વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.

ડૉ. રાજેન્દ્ર પી. શાહ

સુરિલા શાહ

ધિ. મેધા શાહ

સમીર જવેરી

ડૉ. અતુલ શાહ

બીજા શાહ

તથા પીયર - શ્રીસુર પક્ષનાં સર્વ સ્નોહિ / સ્વજનો.

(ધિ. તાના સ્મરણાર્થ ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૦,૦૦૦/- પ્રાપ્ત થયા છે.)